



**MAHARAJA KRISHNAKUMARSINHJI BHAVNAGAR UNIVERSITY**  
(With effect from Academic Year: 2020-21)

**B.Com.**  
**SEMESTER – I**

**CORE COURSE:** Paper No. CC105

**Business Economics – I**

**SUBJECT CODE:** 23107

**Credits: 03**

<b>Marks:</b>	<b>100 Marks</b>
Semester End Examination:	70 Marks
Internal Evaluation:	30 Marks

<b>Unit</b>	<b>Detailed Syllabus</b>	<b>Marks</b>
1	<b>Basic Concepts and Definitions</b> Marshall, Robbins and Samuelsons' definitions of Economics. Positive and Normative Economics. Micro economics and Macro Economics. Utility, Goods and Services. Money and Wealth. Value and Price. Wealth and Welfare. Consumer surplus(Marshall's concept). Meaning of Demand and Supply. Supply and Stock.	18
2	<b>Demand Analysis and Consumer Behavior</b> Demand function-Law of Demand-Determinants of Demand. Elasticity of Demand and its types-price, income and cross elasticity. Types of Demand-Individual Demand and Market Demand, Industry Demand and Firm Demand, Demand for Consumer Goods and Demand for Producers Goods. Demand for Durable and Demand for Perishable Goods.	17
3	<b>Production, Cost and Revenue Analysis</b> Production and Production Function-Short run and Long run Production function(basic ideas only). Transformation Curve (Production Possibility Curve). Iso-Quants and Iso-Cost curves and equilibrium of a firm. Cost analysis-Various concepts of Cost-Total Fixed Cost, Total Variable Cost, Total Cost, Average Fixed Cost, Average Variable Cost, Average Cost and Marginal Cost Relationship between Average Cost and Marginal Cost Opportunity Cost. Basic concepts of Revenues-Total Revenue, Marginal Revenue and Average Revenue Relationship between Average Revenue and Marginal Revenue.	18
4	<b>Markets, Product Pricing &amp; Factor Pricing</b> Concept of Perfect Competition, Monopoly and Monopolistic Competition (Meaning and characteristics). Control of Monopoly. Price Discrimination and Dumping. Selling cost and its Impacts. Concepts of Duopoly and Oligopoly-Collusive Oligopoly- Kinky Demand Curve (Price Leadership Model with reference to Oligopoly).	17



**B.Com.**  
**SEMESTER - I**

**CORE COURSE: Paper No.CC105****Credit-03****Business Economics - I (ધ્યાનપૂર્વક અર્થશાસ્ત્ર - I)****SUBJECT CODE:23107**

Unit.	Detailed of syllabus	Marks
1	<p><b>Basic Concepts and Definitions</b> (મુજબુત ખ્યાલો અને વ્યાખ્યાઓ.)</p> <ul style="list-style-type: none"> <li>❖ અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ:- પાર્શ્વિક, રોવિન્સ, અને સેમયલસન.</li> <li>❖ વાલાપિક અને આદશેલકી અર્થશાસ્ત્ર.</li> <li>❖ એકમલકી અને સમગ્રલકી અર્થશાસ્ત્ર.</li> <li>❖ તૃણિકુલ, વરતુંઘો અને રોવાઓ, નાણું અને રંપાતે, મુદ્ય અને કિમત, રંપાતે અને કટવ્યાઓ.</li> <li>❖ ગ્રાહકનો અધિકસૌંધ (માર્કીંગ ખ્યાલ)</li> <li>❖ માગ અને પુરવણોની અર્થ - પુરવણો અને જચ્છી.</li> </ul>	18
2	<p><b>Demand Analysis and Consumer Behavior</b> (માંગ વિશ્લેષણ અને ગ્રાહકવર્તન)</p> <ul style="list-style-type: none"> <li>❖ માંગ વિધેય- માંગનો નિયમ- માંગના નિષ્ઠાયો (અસર કરતા પરિબળો)</li> <li>❖ માંગની મુલ્યસાપેક્ષતા, માંગની આવક સાપેક્ષતા, માંગની પ્રતિમુલ્ય સાપેક્ષતા.(અર્થ &amp; પ્રકારો)</li> <li>❖ માંગના પ્રકારો:- (વ્યક્તિગત માંગ &amp; બજારમાંગ, ઉંડોગ &amp; પેઢીની માંગ, વપરાશી વસ્તુઓની માંગ &amp; ઉત્પાદક વરતુંઘોની માંગ)</li> <li>❖ ટકાવ વસ્તુની માંગ અને બિન ટકાવ વસ્તુનોની માંગ.</li> </ul>	17
3	<p><b>Production, Cost and Revenue Analysis</b> (ઉત્પાદન, ખર્ચ અને આવક વિશ્લેષણ)</p> <ul style="list-style-type: none"> <li>❖ ઉત્પાદન અને ઉત્પાદન વિધેય- ટુકાગાળાનું અને લાંબાગાળાનું ઉત્પાદન વિધેય.</li> <li>❖ ઉત્પાદન શક્યતા રેખા.</li> <li>❖ સમ-ઉત્પાદન રેખા અને સમ-ખર્ચ રેખાઓ અને પેઢીની સમતુલ્ય.</li> <li>❖ ખર્ચ વિશ્લેષણ:- વિવિધ ખર્ચનો ખ્યાલો:- કુલ સ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચે સંબંધ, વૈકલ્પિક ખર્ચ.</li> <li>❖ આવકના ખ્યાલો: કુલ આવક, સીમાંત આવક, સરેરાશ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક વચ્ચેના સંબંધો.</li> </ul>	18
4	<p><b>Markets, Product Pricing &amp; Factor Pricing</b> (બજારો, ઉત્પાદન કિમત અને સાધન કિમત)</p> <ul style="list-style-type: none"> <li>❖ પુરુષ હરીકાઈ, ઇજારો, અને ઇજારાયુક્ત હારેકાય (અર્થ અને તથાઓ)</li> <li>❖ ઇજારા નિયંત્રણ, કિમત ક્રેડિટાબ અને લાદાણ. વૈચાળું ખર્ચ અને તેની અમરો.</li> <li>❖ પ્રિસ્ટાફ અને અલપ છસ્ટક ઇજારાનો ખ્યાલ, જોડાણ મોડેલ, ખાંચાવણી માંગ રેખા.</li> <li>❖ (અલપ છસ્ટક ઇજારાના સંદર્ભે કિમત નેતૃત્વ મોડેલ)</li> </ul>	17

# UNIT - 1

## Basic Concepts and Definitions (મુખ્યાલો અને વ્યાખ્યાઓ.)

- ❖ અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ:- માર્શિલ, રોડિન્સ, અને સેપ્યુલસન.
- ❖ વાસ્તવિક અને આદર્શલક્ષી અર્થશાસ્ત્ર.
- ❖ એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર.
- ❖ તુણ્ણુણ, વસ્તુઓ અને સેવાઓ, નાણું અને સંપત્તિ, મુલ્ય અને કિમત, સંપત્તિ અને કલ્યાણ.
- ❖ ગ્રાહકનો અધિકસંતોષ (માર્શિલનો મ્યાલ)
- ❖ માંગ અને પુરવઠોનો અર્થ - પુરવઠો અને જથ્થો.

# UNIT - 1

## મુળભૂત ખ્યાલો અને વ્યાખ્યાઓ.

પ - ૧ અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ:- માર્શિલ, રોબિન્સ, અને સેમ્યુલસન.

### 1. પ્રાસ્તાવિક

ડ. એ. 1776માં એડમ સિંહે સૌ પ્રથમ તેમજું પુસ્તક, "An Enquiry into the Nature and Causes of the Wealth of Nations" પરિચિત કરેલ ત્યારી અર્થશાસ્ત્રનો જન્ય થેલ ગણાય છે. તે પહેલાં ભારતમાં ચંદગુપ્ત મીર્યના સમયમાં "કીટિલ્યે" 'અર્થશાસ્ત્ર' નામજું પુસ્તક લખ્યું હતું. પરંતુ આ બંને પુસ્તકો મહદૂંગંગે રાજ્યશાસ્ત્રના રૂપે રંગાપેલા હતા. લગભગ એકાદ ધારમ સુધી એડમ સિંહે પ્રસિદ્ધ કરેલ ઉપરોક્ત પુસ્તક પણ મહદૂંગંગે "Political Economy"ના સ્વરૂપનું રહેલ. અલબાન્સ, 19મી સદીના શરૂઆતનાં વર્ષોમાં અર્થશાસ્ત્રને નવા પ્રકારનું સ્વરૂપ આપવા પ્રપત્તો થયેલા. 19મી સદીના અંત ભાગથી તેને વધુ વૈજ્ઞાનિક સ્વરૂપ આપવાનું શરૂ થેલ જોવા મળે છે. ગ્રીક લોકો અર્થશાસ્ત્રને ગૃહસંચાલનનું શાસ્ત્ર ગણતા હતા. તેઓના મંતવ્ય અનુસાર અર્થશાસ્ત્ર ધરમાં ગ્રામ ધોય તેવા નાબાંનોનો કરકસાયુક્ત ઉપયોગ કરવા સાથે સંબંધ પરાવે છે. ઠંડેનુંમાં પણ તે સમયના વાપારવાઈઓ અર્થશાસ્ત્રને નાલ્યું, કરવેચા, આર્ટારિક વાપાર-ઉદ્યોગોને અને વિદેશ વાપાર સાથે સંકળતા હતા. ત્યારબાદ ઠંડેનુંમાં અણાસી સહીના અંત ભાગમાં જીવોનિક કંઈ વઈ અને તેના પરિણામો અર્થતનાં જે ફેરફારો થયા તેને લીધે અર્થશાસ્ત્ર એક પદ્ધતિસરના શાસ્ત્ર તરીકે અને જ્ઞાનની સ્વતંત્ર શાખા તરીકે અસ્તિત્વમાં આવ્ય.

વર્તમાન સમયમાં હવે આપણાને 'અર્થશાસ્ત્ર'ની અનેક વ્યાખ્યાઓ જોવા મળે છે. આ બધી વ્યાખ્યાઓ આપણને અર્થશાસ્ત્રનું સાચું સ્વરૂપ સમજવામાં ઉપયોગી બની રહે છે. અલબાન્સ, આ બધી વ્યાખ્યાઓ જુદા જુદા અર્થશાસ્ત્રીઓને બિનન બિન દાસ્તિકોણી રજૂ કરેલ છે. તેથી એમ પણ કહી શકાય કે અર્થશાસ્ત્ર વ્યાખ્યાઓની જ્ઞાનમાં ફસાઈ ગયું છે. વર્તમાન સમયમાં દરેક વ્યક્તિની પ્રવૃત્તિઓ પાછળનો ઉદેશ તેમની જરૂરિયાતોને સંતોષવાન ધોય છે. આથી આ પ્રકારના હેતુથી યથી દરેક પ્રવૃત્તિ આર્થિક ગણાય છે. આ દાસ્તિકે અર્થશાસ્ત્ર ખાનવીની આ આર્થિક પ્રવૃત્તિઓનો પદ્ધતિસર અભ્યાસ કર્યું શાસ્ત્ર ગણાય છે.

ઉપરોક્ત ડાઇકલાના સંદર્ભમાં આપણે અહીં અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓની સમજૂદ્દી મેળવીએં.

### 2. અર્થશાસ્ત્રની જુદી જુદી વ્યાખ્યાઓ

૧ - માર્શિલની વ્યાખ્યા : -

૨ - રોબિન્સની વ્યાખ્યા : -

૩ - સેમ્યુલસનની વ્યાખ્યા : -

(2) આલ્કેડ માર્શિલ : અર્થશાસ્ત્રની કલ્યાણલક્ષી વ્યાખ્યા : ઉપરોક્ત વ્યાખ્યાની મર્યાદાના કારણે આલ્કેડ માર્શિલ ઈ. સ. 1890માં તેમના પુસ્તક Principles of Economicsમાં અર્થશાસ્ત્રની કલ્યાણલક્ષી વ્યાખ્યા આપી. તેમના મંત્રય અનુસાર, અર્થશાસ્ત્ર એ માનવીના સામાન્ય જીવનવ્યવહારનો અભ્યાસ કરે છે. તેમજે એ બાબત ઉપર ખાર મૂક્યો કે "અર્થશાસ્ત્ર એ સંપત્તિનું નહિ પરંતુ ભૌતિક કલ્યાણનું શાસ્ત્ર છે." સંપત્તિ એ તો કેવળ સાધન છે, સાથ્ય નહિ. વ્યક્તિનું અંતિમ સાધ્ય તો માનવકલ્યાણ છે. તેમજે એમ પણ રજૂઆત કરી કે અર્થશાસ્ત્ર એક બાજુ સંપત્તિનો અભ્યાસ કરે છે તો બીજી બાજુને તે માનવકલ્યાણના એક અગત્યાનો પણ અભ્યાસ કરે છે. તેના તથા પીશુ જેવા અર્થશાસ્ત્રનોને પણ આ કલ્યાણલક્ષી વ્યાખ્યાના પોતાનો સૂર પુરાવ્યો છે. આ વ્યાખ્યા લગભગ અડધી સઢી સુધી સ્વાક્ષર્ય બના રહી.

પ્રો. માર્શિલ સમયના સમસ્યાનો હતી. એક તો, ભૌતિક સંપત્તિ વધવા છતાં ગરીબાઈ ગા માટે વધે છે? અને બીજી સમસ્યા એ હતી કે શું ગ્રેનિઓર ઘરાડવી કે દૂર કરવી શક્ય નથી? તેમજે અર્થશાસ્ત્રને દુનાં હૂર કરવા માટેનું અને માનવજીવનનું હિત વધારવા માટેનું સાધન ગણ્ય અને કશું કે, "અર્થશાસ્ત્ર માનવીના સામાન્ય જીવનવ્યવહારનો અભ્યાસ કરે છે. માનવીના કલ્યાણના ભૌતિક સાધનો પ્રાપ્ત કરવાના અને તેના ઉપયોગ સાથે સેવી વધુ ગાડ રીતે સંકણાપેલા વ્યક્તિના તથા સમાજના કાર્યેને તે તપાસે છે." આમ માર્શિલની વ્યાખ્યા, 'Wealth' ના બદલે 'Welfare' પર વિશેષ ભાર મૂકે છે.

#### સમજૂતી :

(1) માર્શિલના મત મુજબ અર્થશાસ્ત્ર માનવીના સામાન્ય જીવન (જીવનવ્યવહાર)નો અભ્યાસ કરે છે. એટલે અર્થશાસ્ત્રનો પ્રધાન વિષય સંપત્તિ નહિ પરંતુ માનવી અને તેના કાર્યો એ અને બીજું એ કે અર્થશાસ્ત્ર માત્ર માનવીના જીવનના આર્થિક પાસાંને સ્પર્ધો છે. વ્યક્તિના જીવનમાં આર્થિક પાસાં ઉપરાંત અન્ય પાસાંનો પણ છે. જેમ કે, સામાજિક, ધાર્મિક અને રાજકીય. પરંતુ માર્શિલ આ અન્ય પાસાંનોને છોડી દે છે. તે કેવળ માનવીના જીવનના આર્થિક પાસાં પર જ ભાર મૂકે છે. આથી એ સ્પષ્ટ થાય છે કે અર્થશાસ્ત્રને આર્થિક પાસાં સિવાય માનવીના જીવનના અન્ય પાસાંનો સાથે કોઈ સંબંધ નથી. તો પછી આર્થિક પાસાંનોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થઈ શકે તે? દેખીતી રીતે જ એ સ્પષ્ટ થાય છે કે તેમાં વ્યક્તિનું કઈ રીતે આવક મેળવે છે અને તેનું કઈ રીતે તે પર્ય કરે છે? એ બાબતોનો સમાવેશ થાય છે.

(2). બીજું કે, આ વ્યાખ્યા આર્થિક કલ્યાણને જ સ્પર્ધો છે; અથવું તેમાં વ્યક્તિના જીવનમાં અન્ય અને સમગ્ર પાસાંનો સમાવેશ થતો નથી. એટલે કે તે સમગ્ર માનવકલ્યાણને સ્પર્શાત્મક વ્યાખ્યા નથી. (It includes only economic or material welfare). આથી જ આ વ્યાખ્યા કલ્યાણલક્ષી ગણાય છે. અર્થશાસ્ત્રની આવી કલ્યાણલક્ષી વ્યાખ્યા પીશુ, તેના અને જિવિષિષે પણ આપી છે :

**મૂલ્યાંકન :** પ્રો. માર્શિલની ઉપરોક્ત કલ્યાણલક્ષી વ્યાખ્યા પણ ટીકાથી પર નથી. આ વ્યાખ્યાની મુખ્ય મર્યાદાઓ નીચે મુજબ છે.

(1) ઉપર કશું તેમ આ વ્યાખ્યા મુજબ અર્થશાસ્ત્ર કલ્યાણ સાધવા માટેનાં ભૌતિક સાધનોની પ્રાપ્તિ અને તેના ઉપયોગ સાથે સંકણાપેલ બાબતોનો અભ્યાસ કરે છે. આ વિધાન સામે પ્રો. રોબિન્સ ઉગ્ર વિરોધ કરે છે. રોબિન્સના મંત્રય અનુસાર કલ્યાણ સાધવા માટેનાં ભૌતિક સાધનો જ માત્ર અર્થશાસ્ત્રના અભ્યાસમાં પ્રવેશી શકે નહિ. વાસ્તવમાં તો એવી પણી આર્થિક સેવાઓ પણ રહેલી છે કે જે માનવકલ્યાણ સાધવામાં ઉપયોગી બને છે. તેને માટે પણ નાશાં કે ડિમાન્ડ અને પેટન ચૂકવામાં આવે છે. જેમ કે, ડોક્ટરની સેવા કે સારપારી માનવકલ્યાણ વધે છે. આવી જ રીતે શિક્ષણની સેવા વગેરે. આ બીજી સેવા મેળવવા માટે પણ ડિમાન્ડ ચૂકવાય છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાંથી કઈ રીતે બાકાત રાખી શકાય? આ દિનિયો અર્થશાસ્ત્ર માત્ર ભૌતિક પ્રવૃત્તિઓ જ નહિ, પરંતુ અલોટિક પ્રવૃત્તિઓનો પણ અભ્યાસ કરે છે.

(2) બીજું કે, કેટલોક અભૌતિક પ્રવૃત્તિ પણ અર્થશાસ્ત્રનો એક ભાગ છે. તેનાથી માનવીનું ભૌતિક કલ્યાણ ન વધતું હોય તો પણ તે હાથ ધરવામાં આવે છે. દા. ત., સંગીતકારને ચુકવાતી રકમ. તેનાથી માનવીના ભૌતિક કલ્યાણમાં કોઈ વધારો થતો નથી તેમ છતાં તેને વેતન આપવામાં આવતું હોવાથી તે અર્થશાસ્ત્રના અભ્યાસકોર્ટમાં અવશ્ય પ્રવેશે છે.

(3) નીજું કે પ્રો. રોબિન્સનનો વિરોધ માત્ર ભૌતિક (material) શબ્દ સામે જ નથી. તેઓ તો 'કલ્યાણ' શબ્દનો પણ વિરોધ કરે છે. કેટલોક આર્થિક પ્રવૃત્તિઓથી સમાજના ભૌતિક કલ્યાણમાં કોઈ વધારો થતો ન હોય, પરંતુ જે અકલ્યાણકારી અને અહિતકર હોય તેવી વસ્તુઓ જેવી કે દારૂ, માદકપીણાં વગેરેનું પણ ઉત્પાદન થાય છે અને આવી પ્રવૃત્તિઓને પણ અર્થશાસ્ત્રના અભ્યાસકોર્ટમાંથી બાકાત ન રાખી રાકાય. આવી જ તેઓ આપદે એવા મંત્રથી પર આવે છે કે, અર્થશાસ્ત્રને ગમે તેની સામે સંબંધ હોય, પરંતુ ભૌતિક કલ્યાણના કારકો સાથે તો નથી. ૪.\*

(4) વળી અર્થશાસ્ત્રમાં જો કલ્યાણનો અભ્યાસ કરીએ તો આપણે એ બાબત પણ લક્ષમાં રાખવી પડે કે "શું હોય જોઈએ અને શું ન હોય જોઈએ?" આમ અહીં આપણે સારા-નરરસા, કલ્યાણ-અકલ્યાણ વગેરે બાબતો અંગે પણ અભિગ્રાય આપવો પડે. આથી પ્રો. રોબિન્સ માને છે કે, અર્થશાસ્ત્રને સાથ્યો પ્રત્યે તત્ત્વ રહેણું જોઈએ. એટલે કે તે અંગે કોઈ અભિગ્રાય ઉચ્ચારણો ન જોઈએ. અર્થશાસ્ત્રનું કાર્ય સંશોધન અને સમજૂતી આપવાનું છે. તેને કલ્યાણ સાથે કોઈ સંબંધ નથી અને તે માત્ર વાસ્તવિક વિજ્ઞાન છે.

(5) માર્શલની વાખ્યા અનુસાર, અર્થશાસ્ત્ર 'માનવીના સામાન્ય જીવનવ્યવહારના કાર્યોનો' અભ્યાસ કરે છે. આવી અતે એ પ્રક્રિયા પણ ઉદ્ભબે છે કે સામાન્ય જીવનવ્યવહારના કાર્યો એટલે શું? અને અસામાન્ય જીવનવ્યવહારના કાર્યો એટલે શું? આ બને પ્રકારનાં કાર્યો વચ્ચે તશીવત પાડવો મુશ્કેલ છે.

આ ઉપરાંત સામાન્ય જીવનવ્યવહારનાં કાર્યોનાં સામાજિક, આર્થિક અને ધાર્મિક કાર્યોનાં પણ સમાવેશ થઈ શકે. પરિણામે અર્થશાસ્ત્રનું કાર્યક્રમ ખૂલ જ વ્યાપક બની જાય. જો આમ થાય તો અર્થશાસ્ત્રનાં કાર્યક્રેતાનો વૈશાનિક દિશાએ અભ્યાસ કરવાનું અશક્ય બની જાય છે.

(6) આમ ઉપર જાર્ખાવેલા બધા મુદ્ઘાઓ લક્ષમાં લઈએ તો, આ વાખ્યામાં વૈશાનિક દિશાનિષ્ઠાનો અભાવ માલૂમ પડે છે. આર્થિક પ્રવૃત્તિના ઉદ્ભબ માટે કપાં પરિબળો જવાબદાર ગજાય તેની સમજૂતી આ વાખ્યા આપતી નથી. વળી માનવકલ્યાણના મુદ્ઘાને ધ્યાનમાં લઈએ તો અર્થશાસ્ત્ર નિષ્પત્ત કે તત્ત્વ પણ રહી શકતું નથી. તેમાં સારા-નરરસા, નેતિક-અનેતિક તેમજ કલ્યાણ અને અકલ્યાણનો વિચાર પણ કરવો પડે છે. તેથી તે વાસ્તવિક વિજ્ઞાન (Positive Science) રહેવાને બદલે આદર્શિકી વિજ્ઞાન (Normative Science) બની જાય છે.

આમ ઉપર મુજબ માર્શલના વાખ્યા ઘણા દિશાએ મર્યાદિત બની જાય છે તેથી તેનો પણ સ્વીકાર થઈ શકતો નથી.

(3) વાયોનલ રોબિન્સ : અર્થશાસ્ત્રની અછતલખી વાખ્યા : માર્ગદરિની ઉપરોક્ત વાખ્યાની કાર્યાની દૂર કરવા અને અર્થશાસ્ત્રનું સાચું સ્વરૂપ સમજવા માટે વાયોનલ રોબિન્સે ઠ. સ. 1932માં પોતાના પુસ્તક An Essay on the Nature and Significance of Economic Science માં અર્થશાસ્ત્રની અછતલખી વાખ્યા આપી.

રોબિન્સે આપેલી વાખ્યા નીચે મુજબ છે : "અર્થશાસ્ત્ર એ એક વિજ્ઞાન છે કે કે અમયાદિત જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગો પરાવતાં એવાં અછતપુક્ત સાધનોના સંદર્ભમાં માનવી કેવી રીતે વર્તે છે તેનો અવ્યાસ કરે છે." (Economics is the Science which studies human behaviour as a relationship between ends and scarce means which have alternative uses).

વાખ્યાની સમજૂતી : રોબિન્સની ઉપરોક્ત વાખ્યાનું વિશ્લેષણ કરીએ તો તેમણી મુખ્ય જગત મુદ્દાઓ નાભાર આવે છે : (1) માનવજરૂરિયાતો (2) અછતપુક્ત સાધનો અને (3) સાધનોના વૈકલ્પિક ઉપયોગ (ends, scarce means and their alternative uses). આ પ્રશ્ને પાસાંની સમજૂતી નીચે મુજબ આપી શકાય.

(1) અમયાદિત જરૂરિયાતો : માનવીની જરૂરિયાતો અમયાદિત છે. આ જરૂરિયાતો સંતોષવા માટે તેણે સતત પ્રવૃત્તિ કરવી પડે છે. પરંતુ આપણે અમુલ્યવે એ જીવે કે અમયાદિત જરૂરિયાતો માનવી એવી સાથે સંતોષી શકતો નથી. જો તે મયાદિત હોતું તો તેને કદાચ તે એક પણી એક એમ સંતોષી શકત. પરંતુ જરૂરિયાતોની એ લાક્ષણ્યકતા છે કે એક જરૂરિયાત સંતોષવામાં આવે તો તુરત બીજી જરૂરિયાત ઉદ્ભબવે છે. આમ અનેક જરૂરિયાતો જીવાથી માનવી તેને કદી સંતોષી શકતો નથી. આ તબક્કો ક્રયારેય પૂર્ણ થતો નથી. આમ જરૂરિયાતો અમયાદિત હોવાથી વ્યક્તિને વહું તીવ્ર જરૂરિયાતો અને ઓછી તીવ્ર જરૂરિયાતો વચ્ચે પસંદગી કરવી પડે છે. પરિણામે વ્યક્તિને સતત પ્રવૃત્તિમય છાવન ગળજું પડે છે. જો જરૂરિયાતો મયાદિત હોતું તો, આર્થિક પ્રવૃત્તિ કરવાની પ્રેરણાનો અંત આવી જાત. વળી એકની એક જરૂરિયાત પણ અમુક સમયવા અંતરે ફરી ઉદ્ભબવે છે. આમ જરૂરિયાતોનું યક્કા સતત ચાલ્યા જ કરે છે તેનો કદી અંત આવતો નથી.

(2) અછતપુક્ત સાધનો : ઉપર મુજબ માનવીની જરૂરિયાતો અમયાદિત છે. પરંતુ તેમને સંતોષવાના સાધનોની સાપેક્ષ અછત છે. બેંકિંગ, કુલું કે દેશ તેમજ ફુનિયાની જરૂરિયાતોના સંદર્ભમાં જોઈએ તો જોવાય છે કે આ જરૂરિયાતો સંતોષવા માટેના સાધનો માનવી પાસે મયાદિત છે. અને એ ચાદ ચાપતું જરૂરી છે કે સાધનોની અછત હંમેશાં જરૂરિયાતોના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે. અછત એટલે હોવી સંચાય કે ઓછું પ્રમાણ એવો અર્થ નથી. સાધનોની આ પ્રકારની સાપેક્ષ અછતને લીધી જ માનવીએ તેમનો તેવુંપૂર્વક કે કરકસરચ્છુક્ત ઉપયોગ કરવો પડે છે. જો સાધનો અમયાદિત પ્રમાણમાં ઉપલબ્ધ હોતો તો તેમના કરકસરચ્છુક્ત ઉપયોગની કોઈ સમયા જ ઉદ્ભબવત નાલિ. પ્રો. નિષ્ઠન કિન્નેનાન્ય શાન્દોમાં જ કહીએ તો, "If the means are not scarce, there is no problem at all; there is Nirvana".

અને એ પણ ચાદ ચાપતું જરૂરી છે કે કોઈ પણ નસ્તું પુરવણી ઓછો હોય તો તેનો એ અર્થ નથી કે તેની અછત છે. પરંતુ આહી માંગના સંદર્ભમાં તેનો વિચાર કરવો પડે છે. પ્રો. રોબિન્સ આ સંદર્ભે જોવાએ છે કે, "પરાબ ઠડા, ચારાં ઠડાના સંદર્ભમાં ઓછા હોવા છતાં તેની આર્થિક દર્દિને અછત જોવાય નાલિ." પરાબ ઠડાની માંગ હોતી નથી. આમ પરાબ ઠડા તેની માંગના સંદર્ભમાં અછતપત્વાનો નથી. આથી વિરુદ્ધ, અનાજરનું લાયો ટન ઉત્પાદન હોય તો પ્રથમ તે માંગના સંદર્ભમાં અછત હોયએ છે. આમ અછતનો વિચાર અને તેની માંગના સંદર્ભમાં સાપેક્ષ રીતે કરવામાં આવે છે.

(3) સાધનોનો વૈકલ્પિક ઉપયોગ : ઉપર જગ્યાવા મુજબ જરૂરિયાતો સંતોષવાનાં સાધનોની અછત છે તેમજ તે મર્યાદિત છે એટલું જ નહિ પરંતુ આ સાધનોના અનેક વૈકલ્પિક ઉપયોગો પણ થઈ શકે છે. દરેક ઉત્પાદનના સાધન દ્વારા જુદી જુદી ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થઈ શકે છે. આમ ઉત્પાદનના સાધનોનો વિવિધ ઉપયોગ થઈ શકે છે. દા. ત., ભૂમિ કે જમીન. તો તેમાં ખેતી થઈ શકે, તેના પર રહેણાંકનાં મકાન પણ બાંધી શકાય કે કરવાનું પણ સ્થાપી શકાય. મેઝાન જો તેમાં ખેતી કરવાનો નિર્ણય હે તો તેમાં કઈ વસ્તુનું વાંચેતર કે ઉત્પાદન કરવું તે બાબતમાં પણ તેણે પસંદગી કરી પડે. જેણ કે જો તે થઈ ઉગાડે તો મગજણીનું ઉત્પાદન જતું કરવું પડે. તેવી જ હોતે મુજી અને શ્રમનો વૈકલ્પિક ઉપયોગ કરી શકાય છે.

જો ઉત્પાદનનાં સાધનોનો એક જ ઉપયોગ થઈ શકતો હોતો તો તેના ઉપયોગ બાબત પસંદગી કરવાની સમસ્યા ઉદ્ભવત નહિ. પરંતુ હીકિતમાં ઉત્પાદનનાં સાધનોનો વૈકલ્પિક ઉપયોગ થઈ શકે છે. આશી ઉત્પાદનનાં કંધી સાધનને કયા ઉપયોગમાં કામે લગાડવું તે નક્કી કરવાની સમસ્યા ઉદ્ભવે છે. પરિણામે અર્થ આર્થિક પસંદગી કરવાનો પ્રશ્ન ઉદ્ભવે છે. આવી જ રીતે કોઈ એક દેશ મુલના તેપારી કરતો છોય તો તે ટેંબે પસંદ કરવાનું રહે છે કે તેમજો શરણસરંજામનું ઉત્પાદન કરવું કે તે સાધનોને વિકાસનાં કાર્યોમાં રોકવા. આવી જ રીતે વ્યક્તિએ ખર્ચ કરતી વખતે પણ એ પસંદ કરવું પડે છે કે તેણે પોતાની આવક કઈ વસ્તુની ખરીદી પાછળ વાપરવી.

આમ જુદા જુદા અગત્યાનુકમ ધરાવતી અમર્યાદિત જરૂરિયાતો સંતોષવા માટે વૈકલ્પિક ઉપયોગ ધરાવતાં મર્યાદિત કે સીમિત સાધનોનો ઉપયોગ કરવાનો હોય ત્યારે જે પસંદગીની સમસ્યા ઉદ્ભવે છે, તે સમસ્યા આર્થિક છે. અર્થશાસ્ત્ર આવી પસંદગીની કે આર્થિક સમસ્યાનો અભ્યાસ કરવું શાસ્ત્ર છે.

(4) અર્થશાસ્ત્ર સાધ્યો પ્રત્યે તત્ત્વ : અર્થશાસ્ત્ર આપદે પસંદગીની સમસ્યાનો અભ્યાસ કરે છે તેમ જગ્યાવીને ગ્રો. રોબિન્સે અર્થશાસ્ત્રની વાખ્યાનો "કલ્યાણલક્ષી" જોક દૂર કર્યો. રોબિન્સના મતે અર્થશાસ્ત્ર સાધ્યો પરતે તત્ત્વ છે અને કલ્યાણલક્ષી બાબતોનો અભ્યાસ તેના કાર્યક્રીત્યાં પ્રવેશતો નથી. દુંકમાં કરી કહીએ તો વ્યક્તિ કે સમાજે નક્કી કરેલાં સાધ્યો સારાં છે કે ખરાબ, ઘોય છે કે અયોય, નીતિમત્તાવાળાં છે કે અનીતિમત્ત છે તે નક્કી કરવાનું કે તેના વિશે અનિપ્રાય ઉચ્ચારવાનું કાર્ય અર્થશાસ્ત્રનું નથી. અર્થશાસ્ત્ર સાધ્યોની બાબતમાં તત્ત્વ છે. (Economics is neutral between ends) કલ્યાણ કે અકલ્યાણ, સારું કે ખરાબ વગેરે બાબતો વિશે અનિપ્રાયો ઉચ્ચારવાનું કાર્ય નીતિશાસ્ત્રનું છે. જો આ બધી બાબતોનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે તો તેનું કાર્યક્રીત વિશાળ બની જાય છે. અર્થશાસ્ત્રનું કાર્ય તો માન સંશોધન અને સમજૂતીનું છે. બલામજો કે દોષો દર્શાવવાનું નથી. તે હીકિતોને "As it is" ની દર્શિએ તપાસે છે. "What ought to be ?" હું હોય જોઈએ ? તે પ્રશ્ન તેનાં કાર્યક્રીતાની બધારનો છે.

મૂલ્યાંકન : ગ્રો. રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વાખ્યા વધુ તકસંગત અને વૈજ્ઞાનિક હોવા છતાં પણ તેની કેટલીક મર્યાદાઓ પણ છે અને આ વાખ્યાની પણ ટીકા કરવામાં આવી છે. તેની ટીકાના કેટલીક મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે :

(1) પસંદગીની સમસ્યા સાર્વત્રિક : રોભિન્સના મતે આપણે પસંદગીની જે સમસ્યા ઉદ્ભવે છે તે તો જીવનનાં દરેક કોત્રમાં ઉદ્ભવે છે. માત્ર તે આર્થિક પ્રવૃત્તિમાં જ જોવા મળતી નથી. આથી એ સમસ્યાને આર્થિક સમસ્યા કહી રીતે ગણાય ? જેમ કે યુવાનોએ પોતાના સમયનો ઉપયોગ કરી રીતે કરવો તે અંગે પસંદગી કરવી પડે છે. લગ્નસંબંધ જેવા સમાજિક પ્રસંગોમાં પક્ષ વ્યક્તિએ પસંદગી કરવી પડે છે. ટૂંકમાં કહીએ તો પસંદગીની સમસ્યા સાર્વત્રિક છે. અર્થાત જીવનનાં દરેક કોત્રમાં વ્યક્તિએ પસંદગીનો સામનો કરવો જ પડે છે. જો પસંદગીની આ સમસ્યા દરેક કોત્રમાં લાયું પાડીએ તો અર્થશાસ્ત્રનું કાર્યક્રમ ધર્ઘું વિશાળ અને અવૈજ્ઞાનિક બની જાય. પરિણામે અર્થશાસ્ત્રનો અભ્યાસ પદ્ધતિસર થઈ શકે નહિ. આથી રોભિન્સનો આ ખ્યાલ ખામીપુરક બની જાય છે.

(2) અછતનાં પાતાં પર વિશેષ ભાર : રોભિન્સની વ્યાખ્યામાં તે અછતનાં પાતાં પર વધુ લક્ષ આપે છે. આધુનિક યુગમાં અછતનો પ્રશ્ન કહી રીતે ઉકેલવો એ મુખ્ય સમસ્યા બની ગયેલ છે. પરંતુ વર્તમાન સમયમાં મોટા લાગના અર્થશાસ્ત્રનો વિકાસના અર્થશાસ્ત્ર પર વિશેષ ધ્યાન આપે છે. ટૂંકમાં આધુનિક અર્થશાસ્ત્ર અછતલક્ષી કરતાં વિકાસલક્ષી વિશેષ ગણાય છે.

(3) વિપુલતામાં પક્ષ આર્થિક સમસ્યા : રોભિન્સના મંતવ્ય અનુસાર જરૂરિયાતોના સંદર્ભમાં સાધનોની અછતનાં પરિણામે આર્થિક સમસ્યા ઉદ્ભવે છે. તેથી તેઓ અછતનાં પાતાં પર વિશેષ ભાર મૂકે છે. પરંતુ વલચારનાં આર્થિક સમસ્યા માત્ર સાધનોની અછતનાં પરિણામે જ ઉદ્ભવતી નથી. આ સમસ્યા છત કે વિપુલતાના સંજોગોમાં પક્ષ ઉદ્ભવે છે. ઉદાહરણ તરીકે મંદીના સમયમાં વસ્તુઓની માંગ કરતાં તેનો પુરવઠો વધુ છોય છે. આથી આ ડિસ્ટ્રિક્ટમાં અછતની સમસ્યા નહિ પરંતુ અતિઉત્પાદનની સમસ્યા ઉદ્ભવે છે. આમ, છત કે વિપુલતાના સંજોગોમાં પક્ષ આર્થિક સમસ્યા ઉદ્ભવે છે એ હકીકતને રોભિન્સની વ્યાખ્યામાં લેવામાં આવી નથી.

(4) નીરસ અને ડેસ્ટ્રિક્ટિન વ્યાખ્યા : રોભિન્સના મતે અર્થશાસ્ત્ર તટ્ટથ શાસ્ત્ર છે એટલે કે, અર્થશાસ્ત્રનો સંબંધ માત્ર સાધનો સાથે છે. સાધ્યોનો અભ્યાસ તેના કાર્યક્રમ બાબારનો છે. આમ કહેવા પાછળ રોભિન્સનો ડેસ્ટ્રિક્ટ અર્થશાસ્ત્રમાં 'કલ્યાણ' પરનો ગોડ દૂર કરવાનો છે. પરંતુ રોભિન્સના આ મંતવ્યની પક્ષ આકરી રીકા થઈ છે. અર્થશાસ્ત્રને વધુ પ્રમાણમાં વૈજ્ઞાનિક કે શાસ્ત્રીય બનાવવા જઈએ તો તેનો અભ્યાસ નીરસ અને ડેસ્ટ્રિક્ટિન બની જાય છે. આથી વિદુદ, આધુનિક અર્થશાસ્ત્રનો માને છે કે અર્થશાસ્ત્ર સાધ્યો પરત્યે તટ્ટથ રહી શકે નહિ. દેશમાં ગરીબાઈ હોય કે બેનીબાઈ હોય, આર્થિક અસમાનતા પ્રવૃત્તમાન હોય, ભાવવધારો હોય કે અતિવસ્તીની સમસ્યા હોય તો માત્ર તેમનાં કારણો શોધવાનું કે તેનું આર્થિક વિસ્થેપક્ષ જ કરવામાં આવે તે પૂર્તું નથી. આવા મહત્વના પ્રક્રો હલ કરવા કંપા ઉપાયો હાથ પરવા જોઈએ તે અંગે માર્ગદર્શન અને સૂચનો કરવાનું કાર્ય પક્ષ અર્થશાસ્ત્રને બાળવું જોઈએ. જો અર્થશાસ્ત્ર આવી સગરમાઝોના ઉકેલ માટે કોઈ ઉપાયો ન જતાવે તો તેના અભ્યાસનું વ્યવહારું મહત્વ નથી ? તેની ઉપયોગિતા હી ? મો. પીગુ આ સંદર્ભ સાચું જ જીવાએ છે કે, "માત્ર જીનની આશાને લીધે નહિ, પરંતુ કળની આશાને લીધે જ માનવીને કોઈ પક્ષ શાસ્ત્રના અભ્યાસમાં ખાસ રૂસ હોય છે." કેવળ જ્ઞાન પ્રાપ્તિના

હેતુથી આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરી શકીએ નહિ. આર્થિક સમસ્યાના ઉકેલો ન દર્શાવતું અર્થશાસ્ત્ર નકારાનું બની જાય છે.

(5) કલ્યાણના ખાલનો પરોક્ષ સ્વીકાર : રોઝિન્સે તેમની વાખ્યામાંથી 'કલ્યાણ' શબ્દ સામે ઉગ્ર વિરોધ કરી તેની આકર્ષી ટીકા કરેલ છે. પરંતુ રોઝિન્સની અર્થશાસ્ત્રની વાખ્યામાં પણ પરોક્ષ રીતે કલ્યાણનો ખાલ પ્રવેશી જાય છે. આ ખાલ પણ તેમાં અલિપ્રેત છે. રોઝિન્સની વાખ્યા મુજબ અર્થશાસ્ત્ર અછતયુક્ત કે મર્યાદિત સાધનોની અમર્યાદિત જરૂરિયાતો સંતોષવા માટે કેવી રીતે કાળવણી કરવી તેનો અભ્યાસ કરે છે. પરંતુ આ સાધનોની ફાળવણી વ્યક્તિને કે સમાજને વહુમાં વહુ સંતોષ મળે એટલે કે 'મહત્તમ કલ્યાણ' થાય તે રીતે થતી હોય છે એવી ધારકા તેની વાખ્યામાં અલિપ્રેત છે. આપ તેમણે આપેલી વાખ્યામાં પણ 'કલ્યાણ'નો પરોક્ષ સ્વીકાર થયેલો છે તેથી કહી શકાય.

(6) રોઝિન્સની અર્થશાસ્ત્રની વાખ્યામાં પણ કશું નવીન નથી : જિવરીજ અને ફેઝર જેવા અર્થશાસ્ત્રનો માને છે કે માર્શિલ ન જાણતા હોય તે તેવું કશું રોઝિન્સની વાખ્યામાં નથી. તેઓ માને છે કે રોઝિન્સની વાખ્યામાં પણ કશું નવીન નથી. અમર્યાદિત જરૂરિયાતો અને સાધનોની અછત અને તેમાંથી ઉદ્ભબવતો પરંદાનો પ્રશ્ન એ બધા ખાલો માર્શિલની વાખ્યામાં એક ચા બીજી રીતે સમાપ્યેલ છે જ. માર્શિલ જ્ઞાને છે કે, અર્થશાસ્ત્ર સંપત્તિ અને કલ્યાણના સંદર્ભમાં માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. અહીં 'સંપત્તિ' એ અમર્યાદિત જરૂરિયાતોના સંદર્ભમાં અછતયુક્ત સાધન છે. માનવકલ્યાણ ત્યારે જ મહત્તમ બની શકે જ્યારે અછતયુક્ત સાધનોની, અમર્યાદિત જરૂરિયાતો સંતોષવા માટે હોય પરંદાની કરવામાં આવે. આમ આ વાખ્યામાં પણ આ ખાલ પરોક્ષ રીતે સમાપ્યેલો છે.

(7) આર્થિક પ્રવૃત્તિના સામાજિક પાસાંની અવગણના : રોઝિન્સે આપેલ અર્થશાસ્ત્રની વાખ્યા આર્થિક પ્રવૃત્તિના સામાજિક પાસાંની ઉપેક્ષા કરે છે. વાસ્તવમાં અર્થશાસ્ત્ર પણ એક સામાજિક વિજ્ઞાન છે. આથી અર્થશાસ્ત્ર, સમાજના એક સભ્ય તરીકેની માનવીની આર્થિક પ્રવૃત્તિના અભ્યાસ સાથે સંકળાયેલું છે. અર્થશાસ્ત્ર પણ સમાજચી દૂર રહેતી હોય તેવી એકાડી વ્યક્તિના વર્તનના અભ્યાસ સાથે સંબંધ ધરાવતું નથી. સમાજ પર જેણી પ્રવૃત્તિની અસર પડતી ન હોય તેવી એકાડી વ્યક્તિના આર્થિક વર્તનનો અભ્યાસ કરવાથી સમાજને શો લાભ ? આ સંદર્ભ કેઠનીકોષ જ્ઞાને છે કે અર્થશાસ્ત્ર એ એક સામાજિક શાસ્ત્ર છે કે જે પોતાની જરૂરિયાતો સંતોષવા અછતયુક્ત સાધનોના સંદર્ભમાં માનવી કેવી રીતે વર્તે છે અને તેના આ પ્રકારના પ્રયાસો દ્વારા ઉદ્ભબવતી વિનિમયની કિયા સમાજમાં કેવા પ્રકારની પ્રતિક્રિયા સર્જે છે તેનો અભ્યાસ કરે છે.\*

(8) અર્થશાસ્ત્ર આર્થિક વિજ્ઞાન પણ છે : રોઝિન્સના મતે અર્થશાસ્ત્ર એ શુદ્ધ અને વાસ્તવિક વિજ્ઞાન છે. તેને માનવકલ્યાણ સાથે કથો સંબંધ નથી. અર્થાત્ તેની વાખ્યા માનવજીવનના નેતૃત્વ પાસાંની ઉપેક્ષા સેવે છે. આ રીતે રોઝિન્સના મંત્રત્વ અનુસાર તે અર્થશાસ્ત્રને કેવળ વાસ્તવિક વિજ્ઞાન જ ગણે છે. અર્થશાસ્ત્ર જો સામાજિક શાસ્ત્ર તરીકે માનવકલ્યાણમાં કોઈ ફળો આપતું ન હોય તો પણ તેનો અભ્યાસ નિરર્થક બની રહે છે.

પરંતુ વાસ્તવમાં અર્થશાસ્ત્ર આજે આર્થિકલાયી વિજ્ઞાન (Normative Science) ગણાય છે. અર્થશાસ્ત્રને સમાજ માટે શું લાભદારી છે તે અંગે નીતિવિષયક સૂચનો પણ કરવાનાં હોય છે જે સરકારને અંધ્રિક નીતિના ઘડતરમાં ઉપયોગી બની રહે છે. આમ પ્રો. પીગુના મંત્રી અનુસાર અર્થશાસ્ત્ર લાભદારી (Fruit-bearing) પણ હોય જોઈએ નહિ કે કેવળ શાનદારી (Light-bearing)

(9) સિદ્ધતાનું અર્થશાસ્ત્ર : છેલ્લે જોઈએ તો રોબિન્સની અર્થશાસ્ત્રની વાખ્યા રૂપોપે સિદ્ધતાના અર્થકારકનો નિર્દેશ કરે છે. આથી તે દર્શિએ પણ તે વાખ્યા અપૂર્વી ગણાય છે. રોબિન્સન સમગ્રપણે અછતના પ્રશ્નને સિદ્ધતાના દર્શિકોક્ષાથી જ જૂને છે. તે આપેલાં અછતનાં સાધનો અને આપેલી પરિસ્થિતિમાં જ જરૂરિયાતોનું વિશ્વેષણ કરે છે. તેનો અર્થ એ થાય છે કે સાધન અને સાધ બદલાતાં જ નથી. વર્તમાન પરિવર્તનશીલ પુરાગાં સાધનો અને સાધ બને બદલાતાં રહે છે. અર્થાતું અર્થતંત્રના વિકાસ સાથે સાધનોનું પ્રયાશ બદલી શકાય છે. આ દર્શિએ રોબિન્સની વિચારધારા સિદ્ધર વિશ્વેષણને વ્યાનમાં વે છે. આ દર્શિએ પણ તેની અર્થશાસ્ત્રની વાખ્યા ધર્ષી જ સંકુચિત બની જાય છે.

આમ ઉપર મુજબ સમગ્રપણે રોબિન્સના ખાલો તપાસતાં માલૂમ પડે છે કે તેણે આપેલી અર્થશાસ્ત્રની વાખ્યા પણ અનેક દર્શિએ મળ્યાદિત બની જાય છે.

આ હકીકતને વ્યાનમાં રાખીને જ પ્રો. સેમ્યુલ્સને અર્થશાસ્ત્રની વિકાસલક્ષી (Growth definition) વાખ્યા આપી છે. સેમ્યુલ્સનની વાખ્યાનો સાર એ છે કે તેઓ વર્તમાન અર્થકારકને ગતિશીલ ગણે છે અને તેમના જ શાન્દોભાં કરીએ તો, "It takes cognizance of the dynamic changes taking place both in the 'means' as well as the "ends" with the lapse of time". આથી સેમ્યુલ્સન દરા આપેલી અર્થશાસ્ત્રની વાખ્યાને વર્તમાન અર્થશાસ્ત્રનો વધુ સંતોષકારક ગણે છે.

આમ છતાં આપણે એ ભૂલંબું ન જોઈએ કે રોબિન્સની વાખ્યા ધર્ષી જ વૈશાળિક સ્વરૂપની અને તાર્કિક ગણવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ તેના વિચારણો એટલો પ્રબળ પ્રભાવ પડેલ છે કે તેના સમકાળીન વિચારકોએ તેને ધર્ષું સમર્થન આપેલ છે. વિશ્વેષણાત્મક દર્શિએ તેમણે આપેલી અર્થશાસ્ત્રની વાખ્યા તે દર્શિએ ધર્ષી જ ચાલિયાતી સાખિત થયેલ છે. આજે પણ તેની વાખ્યા વધુ સ્વીકાર્ય ગણાય છે.

## સેમ્યુલસન આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા :

'Economics is the study of how society uses scarce resources to produce valuable commodities and distribute them among different people.'

સમાજ કેવી રીતે પોતાનાં અધ્યત્વાળાં સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરેછે અને જુદા - જુદા લોકો વચ્ચે વહેંચે છે . તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે .

સેમ્યુલસન સમાજની પસંદગીઓ અને વહેંચણેના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપે છે . આમ અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ પરથી આ પ્રમાણેના મુદા મહત્વના બને છે :

- (1) અર્થશાસ્ત્રએ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે .
- (2) તે વાસ્તવદર્શી છે .
- (3) તેની અભ્યાસપદ્ધતિ વૈજ્ઞાનિક છે .

માટે તે સામાજિક વિજ્ઞાન છે .

## પ્ર - ૨ ધ્યાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ સમજાવો

### અથવા

વાસ્તવિક અને આદર્શલક્ષી અર્થશાસ્ત્ર.

#### ૭. ધ્યાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ :

ધ્યાકીય અર્થશાસ્ત્ર આર્થિક સિદ્ધાંત અને ધ્યાકીય વનધાર વગ્યેનું ગઠલ્યાન છે અને તેનો ઉકેશ સંચાલકો માટે નિર્ણયીકરણ તથા પૂર્વઆયોજનની પ્રક્રિયાને સરળ અને અસરકારક બનાવવાનો છે. અહીં આપણો એ તપાસીશું કે સંચાલકો જે આર્થિક સિદ્ધાંતની મદદ લે છે તેનું સ્વરૂપ કેવું છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે ધ્યાકીય અર્થશાસ્ત્રના સ્વરૂપ વિશે માહિતગાર વચ્ચાનું છે.

(૧) ધ્યાકીય અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે : વિજ્ઞાન એટલે પદ્ધતિસરનું જ્ઞાન. શ્રેષ્ઠિપદ વિજ્ઞાનમાં વિભિન્ન પરિબળો વગ્યેના કાર્યકારક્ષા સંબંધ પ્રસ્તાવિત કરવામાં આવે છે અને નિયમ કે સિદ્ધાંતના સ્વરૂપમાં તેની રજૂઆત કરવામાં આવે છે. દા.ત. માગના નિયમમાં અન્ય પરિબળો સ્થિર છે એવી ધારકા ડેટા ક્રિમત અને બજીઝરમાગ વગ્યે કાર્યકારક્ષા સંબંધ દર્શાવવામાં આવે છે. અલભત્ત નિયમો તારવવા માટે ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવામાં આવે છે. હકીકતો એકત્રિત કરવામાં આવે છે. વ્યવસ્થિત ફેને હકીકતોનું વગ્નિકરક્ષા કરવામાં આવે છે અને તાર્કિક પદ્ધતિઓ વડે હકીકતોનું વિશ્વેષજ્ઞ કરવામાં આવે છે.

આ દિશિએ ધ્યાકીય અર્થશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે એમ કહી શકાય. ધ્યાકીય અર્થશાસ્ત્ર ધ્યાકાદારી પેઢીઓના સંચાલનનું વિજ્ઞાન છે. ધ્યાકીય અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતો અને વિશ્વેષજ્ઞ પદ્ધતિઓનો ઉપયોગ કરીને સંચાલકો સામેની સમસ્યાઓનું પૃથક્કરક્ષા કરવામાં આવે છે અને આ સમસ્યાઓના ઉકેલો સૂચવવામાં આવે છે. આમ શુદ્ધ અર્થશાસ્ત્ર જેટલા અંશે નિજીન છે તેટલા અંશે ધ્યાકીય અર્થશાસ્ત્ર પણ વિજ્ઞાન છે એ સ્વીકારવું જોઈએ.

(૨) ધ્યાકીય અર્થશાસ્ત્ર એકમલકી અર્થશાસ્ત્ર છે : અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રશ્નોના અભ્યાસ માટે બે વિશ્વેષજ્ઞ પદ્ધતિઓ ઉપલબ્ધ છે : એકમલકી અર્થશાસ્ત્ર (Micro Economics) અને સુમગલકી અર્થશાસ્ત્ર (Macro Economics). એકમલકી અર્થશાસ્ત્રમાં કોઈએક ગ્રાહક, કોઈએક પેઢી, કોઈએક ઉદ્યોગ કે કોઈએક વસ્તુનો ભાવ વગેરે વાજીતગત એકમોનો અભ્યાસ કરવામાં આવે છે. વાજીતગત એકમોના વર્તનનું વિશ્વેષજ્ઞ કરીને

અર્થતંત્રના કોઈએક ભાગને લાગુ પડતો નિયમ તારવવામાં આવે છે. દા.ત., તટસ્થરેખા પદ્ધતિ વડે વ્યક્તિગત ગ્રાહકનાં વર્તનનું વિશ્વેષણ કરીને બજારમાગનો નિયમ મેળવવામાં આવ્યો છે. એકમલકી અર્થશાસ્ત્રને 'મૂલ્યનો સિદ્ધાંત' કે 'ભાવનિર્ધારણનું અર્થશાસ્ત્ર' પણ કહેવામાં આવે છે.

ધ્યાકીય અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે એકમલકી અર્થશાસ્ત્ર છે. એના અભ્યાસનો વિષય વ્યક્તિગત પેડી છે. ધ્યાકીય અર્થશાસ્ત્રમાં એકમલકી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, વિભાવનાઓ અને વિશ્વેષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. સંચાલકોને પેઢીની સમસ્યાઓની સ્પષ્ટ સમજ આપવામાં આવે છે અને પેઢીને ઉપલબ્ધ સાધનોની વિભિન્ન પ્રવૃત્તિઓ વચ્ચે કઈ રીતે વહેચણી કરવી કે જેથી મહત્વમની મેળવી શકાય એનું માર્ગદર્શન આપવામાં આવે છે. ધ્યાકીય અર્થશાસ્ત્રમાં એકમલકી અર્થશાસ્ત્રની જે વિભાવનાઓનો ઉપયોગ થાય છે તેમાં માગનો નિયમ. માગની સાપેક્ષતા, સીમાંતખર્ય અને સરેરાશ ખર્ય, પેઢીનું ઈદ કદ, મોટા પાયા પરના ઉત્પાદનના લાભ અને ગેરલાભ, વૈકલ્પિક ખર્ય, મૂડીસાધનનું વર્તમાન મૂલ્ય અને બજારનું માળપું ઉત્પેખનીય છે. ધ્યાકીય અર્થશાસ્ત્રમાં એકમલકી અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે તેમાં ઈજારામાં કિમતનિર્ધારણનો સિદ્ધાંત, કિમતબેદભાવ, અલ્યહક્સક ઈજારામાં ભાવનિર્ધારણ અંગેના વિભિન્ન મૌફેલ્સ, ઘટતી સીમાંત ઉત્પાદકતાનો નિયમ વગેરે ઉત્પેખનીય છે.

(૩) ધ્યાકીય અર્થશાસ્ત્ર વાસ્તવદર્શી વિજ્ઞાન કરતાં આદર્શલકી વિજ્ઞાન વહુ છે : વાસ્તવદર્શી વિજ્ઞાન વાસ્તવિકતાનું દર્શન કરાવે છે, આદર્શલકી વિજ્ઞાન આદશોની સ્થાપના કરે છે. વાસ્તવદર્શી વિજ્ઞાનને 'શું છે' સાથે નિરખત છે, આદર્શલકી વિજ્ઞાનને 'શું હોય જોઈએ' સાથે સંબંધ છે. વાસ્તવદર્શી વિજ્ઞાન તટસ્થ રહીને હકીકતોનું વિશ્વેષણ કરે છે અને એમની વચ્ચે કાર્યકારણ સંબંધ કેવો છે તે દર્શાવે છે. આદર્શલકી વિજ્ઞાન હકીકતો ઘોગ્ય છે કે અયોગ્ય એ અંગે નિર્ણયો આપે છે.

દા.ત., અર્થશાસ્ત્ર હુગાવાની સમસ્યાનું વિશ્વેષણ કરીને એનાં કારણો દર્શાવે છે ત્યારે વાસ્તવદર્શી વિજ્ઞાનની ભૂમિકા બજાવે છે અને હુગાવો અનિષ્ટ છે એવું મંતવ્ય આપાને હુગાવાની નાભૂટીના ઉપાયો સૂચવે છે, ત્યારે આદર્શલકી વિજ્ઞાનની ભૂમિકા અદા કરે છે.

ધ્યાકીય અર્થશાસ્ત્ર આદર્શલકી વિજ્ઞાન છે. તેનો ચોક્કસ ઉદ્દેશ છે. પેઢીની આર્થિક અને ટેકનિકલ કાર્યક્ષમતા સુધારવાનો તેનો ઉદ્દેશ છે. અને આ ઉદ્દેશની સિદ્ધિ માટે સંચાલક પેઢીનાં સાધનોના કઈ રીતે કાળવણી કરવી એ અંગે માર્ગદર્શન આપે છે. સંચાલકોએ કયા નિર્ણયો લેવા, કઈ રીતે પૂર્વ આપોજન કરવું, કઈ રીતે નિર્ણયોનો અમલ કરવો એ અંગે સૂચનો કરે છે.

અલબત્ત, એમ ન માની લેવું જોઈએ કે ધ્યાકીય અર્થશાસ્ત્ર માત્ર આદર્શલક્ષી વિજ્ઞાન છે. ધ્યાકીય અર્થશાસ્ત્ર વાસ્તવદર્શી વિજ્ઞાન પણ છે. ધ્યાકીય અર્થશાસ્ત્ર વાસ્તવદર્શી વિજ્ઞાન અને આદર્શલક્ષી વિજ્ઞાનનું સંભિશ્શેષ છે. ધ્યાકીય અર્થશાસ્ત્ર ધ્યાદારી પેડીને સ્પર્શતા પરિબળો વચ્ચેના વિષેયાત્મક સંબંધ અંગે વિધાનો રજૂ કરે છે ત્યારે તે વાસ્તવદર્શી વિજ્ઞાન છે અને નિર્ણયીકરણ તથા પૂર્વઆયોજનના પોરષોની પ્રસ્તાવના કરીને ઈષ્ટ સંચાલનનો આદર્શ રજૂ કરે છે ત્યારે તે આદર્શલક્ષી વિજ્ઞાન છે. ધ્યાકીય અર્થશાસ્ત્ર જ્ઞાનપ્રાપ્તિનું સાધન છે અને ફળપ્રાપ્તિનું સાધન પણ છે. પણ ફળપ્રાપ્તિના સાધન તરીકે ધ્યાકીય અર્થશાસ્ત્ર વહુ લોકપ્રિય બન્યું છે. ધ્યાકીય અર્થશાસ્ત્ર આજકાલ જડપથી વિકાસ પામી રહ્યું છે એનું કારણ જ એ છે કે તે ઉત્પાદન અને વેપાર કરતી પેડીઓમાં સંચાલનની કાર્યક્રમતા સુધ્યારીને રામાજને વહુ સુખસાગર પ્રદાન કરી શકે છે એવી આશા જન્યી છે.

(૪) ધ્યાકીય અર્થશાસ્ત્ર કણા પણ છે : કણા એટલે કાર્ય કરવાની સર્વોત્તમાં રીત. કણા પ્રશ્નોના ઉકેલની સર્વોત્તમ નીતિ કે પદ્ધતિ દર્શાવે છે. વિજ્ઞાનને સિદ્ધાંત સાથે સંબંધ છે જ્યારે કણાને વ્યવહાર સાથે સંબંધ છે. વિજ્ઞાન સમજૂતી આપે છે. કણા માર્ગ યોગી છે, ધ્યાકીય અર્થશાસ્ત્ર કણા છે. કારણ કે તે સંચાલકને પેડીનાં સાધનોનો સર્વોત્તમ ઉપયોગ કરી રીતે કરવો એનું માર્ગદર્શન આપે છે. અનેક વિકલ્પો પેડી કણો વિકલ્પ શ્રેષ્ઠ છે એનો સંચાલકોને સમજ આપે છે. અલબત્ત, ધ્યાકીય અર્થશાસ્ત્ર પેડીના સંચાલકોને પ્રશ્નોના તૈયાર ઉકેલ આપતું નથી. તે સંચાલકોને વિચારવાની વૈજ્ઞાનિક પદ્ધતિ આપે છે જેની મદદથી સંચાલકો સમસ્યાઓનો તલસ્પર્શી અભ્યાસ કરી શકે છે અને સાચા નિઝર્ખ પર આવી શકે છે. ધ્યાકીય અર્થશાસ્ત્રનું જ્ઞાન હોય તો ઉત્પાદકો વાસ્તવિક પરિસ્થિતિને ઘાનમાં લઈને જીતે સર્વોત્તમ ઉકેલ શોધી લે છે.

(૫) ધ્યાકીય અર્થશાસ્ત્ર સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની પણ મદદ લે છે : પેડીના સંચાલકોએ આર્થિક અને સામાજિક વાતાવરણના સંદર્ભમાં નિર્ણયો લેવાના હોય છે. આ વાતાવરણને સમગ્રલક્ષી કે બૃહદ પરિસ્થિતિ તરીકે વર્ણવી શકાય. તાજેતરમાં જે બૃહદ પરિસ્થિતિ પેડીઓ સામે પ્રવર્તમાન છે તેમાં (અ) મુક્ત અર્થતંત્રનું પ્રાધાન્ય છે. ભાવો, માંગ અને પુરવણાં પરિબળો દ્વારા નક્કી થાય છે. (બ) આર્થિક અને ટેકનિકલ કેને જડપથી પરિવર્તનો આવી રહ્યા છે અને (ક) અર્થતંત્રની કામગીરીમાં સરકારનો હસ્તક્ષેપ પણ નોંધપાત્ર છે. નાધ્યાકીય નીતિ, રાજકોણીય નીતિ, ઔદ્યોગિક નીતિ અને વિદેશ વેપાર સંબંધી નીતિ વગેરે દ્વારા સરકાર બજાર તંત્રને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. પેડીઓએ આ બધી મર્યાદાઓના આગખામાં રહીને કામ કરવાનું છે. પેડીના સંચાલકો બજારતંત્રની કામગીરીની ટેકનિકલ અને આર્થિક પરિવર્તનોની કે સરકારની પ્રવૃત્તિઓની અવગણણા કરી શકે નહીં.

#### ૫ - ૩ એકમલલી અર્થશાસ્ત્ર અને સમગ્રલલી અર્થશાસ્ત્ર :

અર્થશાસ્ત્ર વિષયના પાયા ખૂબ જ ઊડા છે. રાજશાહી સમયથી અર્થશાસ્ત્ર વિષય ચાલતો આવ્યો છે. કોટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ તે સમયના આર્થિક ઘણાલો રજૂ કરેલ છે. વર્તમાનના સમયમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે બે પદ્ધતિઓ છે.

(1) એકમલલી અર્થશાસ્ત્ર (Micro Economics)

(2) સમગ્રલલી અર્થશાસ્ત્ર (Macro Economics)

આ બંને વિશ્વેષજ્ઞ પદ્ધતિના નામનો સૌ પ્રથમ ઉપરોગ નોર્બેની ઓસમો પુનિવર્સિટીના પ્રાધ્યાપક રેઝનાર ફિચે 1933માં રજૂ કરેલ.

#### (1) એકમલલી અર્થશાસ્ત્ર :

એકમલલી અર્થશાસ્ત્ર એટલે વ્યક્તિલલી અર્થશાસ્ત્ર. એકમલલી પદ્ધતિને અંગ્રેજીમાં “Micro” શબ્દથી ઓળખવામાં આવે છે. Micro નો અર્થ સૂક્ષ્મ થાય છે. Micro શબ્દ ગ્રીક શબ્દમાંથી ઉત્તરી આવેલ છે. એકમલલી અર્થશાસ્ત્રમાં વ્યક્તિ, પેઢી, કુટુંબ, ઉદ્યોગ જેવાં આર્થિક ઘટકોનું વિશ્વેષજ્ઞ કરવામાં આવે છે. એકમલલી અર્થશાસ્ત્ર અર્થતંત્રના નાનકડા ભાગનો અભ્યાસ કરે છે. એકમલલી અર્થશાસ્ત્રની વાખ્યાઓ નીચે પ્રમાણે છે.

⇒ લેફ્ટટવીચ :

“એકમલલી અર્થશાસ્ત્રને ગ્રાહકો, સાપનના માલિકો, વેપારીઓ અને પેઢીઓ જેવા આર્થિક એકમોની આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંબંધ છે.”

⇒ મોરિસ ડોબ :

“એકમલલી અર્થશાસ્ત્ર અર્થતંત્રની સૂક્ષ્મ બાબતોનો અભ્યાસ કરે છે. જેમાં કુટુંબો, પેઢીઓ અને ઉદ્યોગો જેવા નાના, એકમોના આંતર સંબંધોને સમજાવવામાં આવે છે.”

⇒ એમ. એલ. શેઠ :

એકમલલી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની એવી શાખા છે જે વ્યક્તિ, કુટુંબ કે પેઢી જેવા વ્યક્તિગત આર્થિક એકમોનો અભ્યાસ કરે છે. તેમાં માત્ર એક એકમનો જ અભ્યાસ થાય છે. એકમોના સામૂહિકો નાથી.

એકમલલી અર્થશાસ્ત્રની ઉપરોક્ત વાખ્યાઓ ઉપરથી કહી શકાય કે તેમાં વ્યક્તિગત આર્થિક એકમોના વર્તનનો ઊડાશથી અભ્યાસ કરવામાં આવે છે. એકમલલી અર્થશાસ્ત્રમાં મુખ્ય બે ધારણાઓ મહત્વાની છે. (1) મુક્ત અર્થતંત્ર અને (2) પુરુરોજગારી મુક્ત અર્થતંત્ર એટલે સરકારનો અર્થતંત્રની પ્રવૃત્તિઓમાં કોઈ પણ ઉત્તેષ્ણે કે દખલગારીનો અભાવ અને અર્થતંત્રમાં ઉત્પાદનના બધા જ સાપનોને પૂર્ક રોજગારી મળી ગયેલ છે. એટલે કે બેકારીનો અભાવ.

❖ એકમલકી અર્થશાસ્ત્રનું કાર્યક્રમ :

એકમલકી અર્થશાસ્ત્રના કાર્યક્રમને ટૂંકમાં નીચે પ્રમાણે રજૂ કરી શકાય.

(1) ગ્રાહક અને વેપારીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ :

બજારમાં મુખ્ય બે પદકારો હોય છે. ગ્રાહક ખરીદનારા અને વેપારી (વેચનાર). આ પદકારો બજારમાં કેંઠું વર્તન કે વ્યવહાર કરશે તેનો અભ્યાસ એકમલકી અર્થશાસ્ત્ર કરે છે. વસ્તુઓની પ્રવર્ત્તિમાન કિંમતો ગ્રાહક કેટલી વસ્તુ ખરીદશે તેમજ વેપારી કેટલા પ્રમાણમાં વસ્તુ વેચવા તૈયાર છે તેનો અભ્યાસ કે જાણકારી એકમલકી અભ્યાસમાં થાય છે.

(2) પેઢી અને ઉદ્ઘોગોનું વલણ :

કોઈ પણ ઔદ્ઘોગિક પેઢી કે ગેક્ટમ કેટલી વસ્તુઓનું ઉત્પાદન કરશે, કેટલા ખર્ચ કરશે, ઉત્પન્ન કરેલ વસ્તુની કિંમત કેટલી રાખશે તેનો અભ્યાસ એકમલકી અર્થશાસ્ત્ર કરે છે. આ ઉપરાંત વેચાણની પદ્ધતિઓ કેવી રાખશે તેમજ નફો કે ખોટ જે કાંઈ પ્રાપ્ત થાય તેનો વિચાર એકમલકી અર્થશાસ્ત્ર કરે છે.

એક જ સરળી વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરતી પેઢીઓના સમૂહને ઉદ્ઘોગ કહેવામાં આવે છે. ઉદ્ઘોગને જૂથ અથવા સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદ્ઘોગ વસ્તુઓનું વેચાણ કરીને નફો વધારવા માટેની કોણિય કરે છે. જેનો એકમલકી અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે.

(3) ઉત્પાદનના સાધનોનું કિંમત નિર્ધારણ :

ઉત્પાદનના ચાર સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાઈને કુલ ઉત્પાદનમાં જે ફળો આપે છે, મદદ કરે છે. તેના બદલામાં તે સાધનોને વળતર મળે છે. જમીનના ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન અને નિયોજકને નફો મળે છે. જેનું નિર્ધારણ એકમલકી અર્થશાસ્ત્રમાં થાય છે.

❖ એકમલકી અર્થશાસ્ત્રનો ઉપયોગ/મહાત્વ :

આર્થિક વિશ્વેષણની આ એકમલકી અર્થશાસ્ત્રની પદ્ધતિના ઉપયોગો નીચે પ્રમાણે રજૂ કરી શકાય.

(1) અમૃક ચોક્કસ સમય અને પરિસ્થિતિમાં ગ્રાહક, ઉત્પાદક અને વેપારીના વર્તન કેંઠું હશે તેની માહિતી આપે છે. બીજા શબ્દોમાં

કહીએ તો માંગ અને પુરવણાના ફેરફારોના અભ્યાસમાં મદદરૂપ થાય છે.

- (2) ઉત્પાદનના સાધનોના માલિકને માર્ગદર્શન મળી રહે છે. કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરતું વગેરે નિર્ણયો લેવામાં ઉપયોગી થાય છે.
  - (3) ઉત્પાદનના સાધનોની કિમત નક્કી કરવામાં મદદરૂપ થાય છે. દા.ત. ભાડું, વેતન, વાજ, નફાનું મ્રાણ નક્કી કરવામાં ઉપયોગી છે.
  - (4) ઉત્પાદન કરેલ વસ્તુઓ કે સેવાઓને બજારમાં કેટલી કિમતે વેચવી તેની સમજજી આપે છે.
  - (5) સરકારને/રાજ્યને તેના સાધનોના કાર્યક્રમ ઉપયોગ કરવા માટે ઉપયોગી થાય છે.
  - (6) સામાજિક, આર્થિક કલ્યાણ વધારવા માટે કરવેરા નીતિ, જાહેર નીતિ, વેતન નીતિ, વગેરે બાબતોનો ઘડતરમાં ઉપયોગ થાય છે.
  - (7) મુક્ત અર્થતંત્રમાં ગ્રાહકો અને ઉત્પાદકોના વર્તન વિશેની આગામી તેમજ કેવા પ્રકારના આર્થિક નિર્ણયો લેવા તેનો અંદાજ મળી રહે છે.
- ❖ એકમલકી અર્થશાસ્ત્રની મર્યાદા :

એકમલકી અર્થશાસ્ત્રનું મહત્વ તો છે જ પણ તેમાં કેટલીક મર્યાદાઓ પણ જોવા મળેલ છે.

- (1) પૂર્ણ રોજગારીની અવાસ્તવિક ધારણા જે એક મહત્વની મર્યાદા છે. આ ધારણા અર્થતંત્રની જડતાનું સુચન કરે છે.
- (2) વર્તમાન સમયમાં કલ્યાણલકી રાજ્યની વિચારધારા મોટા ભાગના રાખ્યોએ સ્વીકારેલ છે. તેથી મુક્ત અર્થતંત્રની ધારણા પણ અધ્યોગ્ય છે. આર્થિક કેને સરકારનો મત્યક્રાંતિકાનો હોય છે.
- (3) કોઈ એક વ્યક્તિ, પેઢી કે ઉધોગના અભ્યાસ કે તારણ સમગ્ર સમાજની વ્યક્તિઓ માટે ઉપયોગી ન પણ બને. જેમ કે, બચત કરવી એ સારી બાબત છે. પણ તે વ્યક્તિગત રીતે સારી બાબત છે. પણ સમગ્ર સમાજની દૃષ્ટિએ તે એક દૂષકા છે. કેઈન્સના મતે તેઓ ખલનાયક છે. જો બચતો કરતાં વ્યક્તિઓ વધી જાય તો અસરકારક માંગ ઘટે છે અને મંદી આવે છે.

## \* સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર :

સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશ્વેષણ પદ્ધતિમાં કોઈ એક આર્થિક ઘટકનો નહિ પણ સમગ્ર અર્થતંત્રના બધા જ આર્થિક ઘટકોનો એક સાથે અભ્યાસ કરવામાં આવે છે. અર્થતંત્રની કુલ બચતો, કુલ મૂડીરોકાજા, કુલ આવક, કુલ ભાંગ, કુલ પુરવઠો, કુલ રોજગારી વગેરે બાબતોના સંબંધોની સમજૂતી સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સમજાવવામાં આવે છે. કેઈન્સના આગમન પછી આ વિશ્વેષણ પદ્ધતિનો ઉપયોગ વિસ્તૃત અને જરૂરી બન્યો છે. કેઈન્સનો આવક, રોજગારી તેમજ વાજનો સિદ્ધાંત સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું ઉદાહરણ છે. બૃહદ કે સમગ્રલક્ષીને માટે "Macro" અંગેઝ શબ્દનો ઉપયોગ થાય છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ નીચે મુજબ ૨૫ ગ્રામેલ છે.

## (1) ક્રેનેશ ઈ. બોલ્ડિંગ :

સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વ્યક્તિલક્ષી બાબતોનો નહિ પણ સમગ્રલક્ષી બાબતોનો અભ્યાસ કરે છે. જેમ કે, કોઈ એક વસ્તુની ક્રિમત નહિ પરંતુ સમગ્ર લાવસપાટી, તે જ રીતે કોઈ એક વ્યક્તિ કે પેઢીના આવક નહિ પણ સમગ્ર દેશની રાખ્યોથી આવકનો અભ્યાસ કરે છે.

## (2) પ્રા. એલન :

સમગ્ર આર્થિક ઘટકો વચ્ચેના સંબંધોનો બૃહદ્દ અભ્યાસ એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર.

## \* ગાર્ડનર ઓકલે :

"આર્થિક ઘટનાઓના દરેક પાસાંઓનો વિસ્તૃત અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કરે છે. આ માટે તેઓ એક ઉદાહરણ આપે છે કે જંગલમાં આવેલ વૃક્ષોનો અભ્યાસ એકબીજાથી સ્વતંત્ર જુદી જુદી કરવાને બદલે સમગ્ર જંગલોનો અભ્યાસ કરવો તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય."

## \* સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર :

સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં નીચેની બાબતોનો અભ્યાસ થાય છે.

## (1) આવક, રોજગારી અને ઉત્પાદનની સમતુલા :

અર્થતંત્રમાં આવક, રોજગારી અને ઉત્પાદનની સમતુલા અંગેનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે.

(2) વેપારચકનો અભ્યાસ :

અર્થતંત્રમાં કુલ ઉત્પાદન, કુલ માંગ વગેરેમાં ફેરફારો કેમ આવે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. તેજ કે મંદી જેવી આર્થિક અસ્થિરતા અંગેનો અભ્યાસ કરવામાં આવે છે.

(3) સામાન્ય ભાવસપાઈના ફેરફારોનો અભ્યાસ :

નાણાંકીય નીતિ તેમજ નાણાંના પુરવઠામાં થતા ફેરફારોની સામાન્ય ભાવસપાઈ ઉપર તેમજ અર્થતંત્રના અન્ય બોતો/વિભાગો પર થતી અસરોનું પૂછકરણ કરે છે.

(4) આર્થિક વિકાસ અને વૃદ્ધિનો અભ્યાસ :

અર્થતંત્રમાં શિક્ષણ, આરોગ્ય, બેંકિંગ વગેરેનો વિકાસ આર્થિક વિકાસમાં વધારો કરે છે. આવક અને ઉત્પાદન વૃદ્ધિમાં કેવા અને કેટલા ફેરફારો થયા તેનો અભ્યાસ થાય છે.

(5) જાહેર વિત વ્યવસ્થા અને કલ્યાણ :

દેશમાં ગ્રામ પંચાયતથી શરૂ કરીને કેન્દ્ર સરકાર સુધીની રાજ્ય વ્યવસ્થા ગોઠવાયેલ છે. આ દરેક સ્તરે આવક અને ખર્ચ અંગેના વલણોનો અભ્યાસ કરવામાં આવે છે. આર્થિક સ્થિરતા જળવાય તો કલ્યાણમાં વધારો થાય છે. આ તમામ બાબતોનો અભ્યાસ થાય છે.

❖ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ/ઉપયોગો :

- (1) અર્થતંત્રના વિકાસની દિશા નક્કી કરવામાં મદદરૂપ થાય છે. જેમ કે, ઔદ્યોગિક વિકાસ વધારવો છે કે કૃષિ વિકાસ.
- (2) સરકારની નીતિઓમાં કેવા ફેરફારો જરૂરી કે ઈચ્છનીય છે તે બાબત સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ પરથી જાણી શકાય છે.
- (3) વેપારચકના સમયે અર્થતંત્રને બંધાર લાવવા માટેનું માર્ગદર્શિન કે પ્રયોગો અંગેની જાણકારી મળી રહે છે.
- (4) લોક કલ્યાણ વધારવા તેમજ સામાજિક સલામતીના ઉપાયો મંગે સરકારને ઘોગ્ય પગલાંઓ અંગેનું માર્ગદર્શિન સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ પરથી મળી રહે છે.

❖ સમગ્રલક્ષી અર્થશાખાની મર્યાદાઓ :

(1) સામાન્યીકરણ અત્યંત જોખમી :

સમગ્રલક્ષી અર્થશાખાના સિદ્ધાંતો અને નિયમોની તારચુણી મોટા ભાગે વ્યક્તિગત એકમોના વર્તનાના આધારે થાય છે. આ પ્રકારનું સામાન્યીકરણ જોખમી છે. કેટલીક બાબતો એવી છે કે જે વ્યક્તિગત એકમ માટે આશીર્વાદરૂપ છે. જ્યારે સમગ્ર સમૂહ કે સમાજ માટે તે શાપરૂપ હોય છે. દા.ત. બચત એકાડ વ્યક્તિ કે એકમ માટે સારો ગુણ છે પણ તે સમગ્ર સમાજ માટે દુર્ગુણ છે.

(2) સમરૂપી એકમોના સમૂહનો અભ્યાસ ન થયો હોય તો નિરર્ધક સાધિત થાય છે :

આ પ્રકારની ટીકા બોલ્ડિંગ નામના અર્થશાલીએ કરી છે. તેમના મત પ્રમાણે સંયોજનમાં લેવાતા પદાર્થો કે વસ્તુઓ સુસંગત હોવી જોઈએ. વિપરીત સંયોજનોના ઘટકોના અભ્યાસ કરવાથી સમગ્રલક્ષી અર્થશાખાની મહત્વતા ઘટે છે.

(3) અમુક ખાલો કે વિગતોનું માપન મુશ્કેલ :

સમગ્રલક્ષી અર્થશાખાના સામાન્ય ભાવ સપાઠી, કુલ રોજગારી, કુલ આવક વગેરે બાબતોના માપન અંગે અર્થશાલીઓમાં મતભેદ પ્રવર્તે છે.

(4) સમગ્ર અર્થતંત્રની દર્શિએ જે કોઈ પ્રસંગ કે ઘટના બને છે તેની અસરો એકસરખી થતી નથી :

જેમ કે સામાન્ય ભાવસપાઠીમાં થયેલ વધારાની અસર સમાજના બધા વર્ગો ઉપર એકસરખી થતી નથી. અમુક વ્યક્તિઓને ફાયદો થાય છે. જ્યારે અમુક વ્યક્તિઓને નુકશાન થાય છે.

(5) સમગ્રલક્ષી વિશ્વેષણ પદ્ધતિનો ઉપયોગ વિવેકપૂર્વ કરવામાં ન આવે તો જોખમી બને છે :

જેમ કે, કોઈ એક જ સમયે ખેત પેદાશોના ભાવોમાં ઘટાડો થાય અને ઝૌધોળિક પેદાશોના ભાવમાં વધારો થાય ત્યારે સામાન્ય ભાવસપાઠી સિથર રહે છે પણ આવા સમયે કૃષિ વિકાસ વધે, એકૂઠોના હિતોનું રહણ થાય તે પ્રકારના સરકારે પગલાં લેવા જોઈએ.

❖ એકમલથી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તંત્રજ્ઞ :

એકમલથી અર્થશાસ્ત્ર	સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર
(1) વ્યક્તિગત બાળનો તેમજ વ્યક્તિગત એકમો/ઘટકોના વર્તનનો અભ્યાસ કરે છે.	(1) અર્થતંત્રમાં થતા સામૃહિક વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે.
(2) પેઢી, ઉધોળ કે એકમને મહત્વમની કેવી રીતે પ્રાપ્ત વરો તેનો અભ્યાસ ચાય છે.	(2) અર્થતંત્રમાં આવક, ઉત્પાદન, રોજગારીમાં કેવા કેરકારો થયા છે તેનો અભ્યાસ કરવામાં આવે છે.
(3) ઉત્પાદનના દરેક સાધનની સમતુલ્યનો જુદી જુદી અભ્યાસ ચાય છે.	(3) ઉત્પાદનના દરેક સાધનોની સમતુલ્યનો સાખ્યુદેણ અભ્યાસ ચાય છે. એટલે કે સમગ્ર અર્થતંત્રના સમતુલ્યનો અભ્યાસ ચાય છે.
(4) વ્યક્તિગત કે સાધન-ની સમતુલ્ય સમયના કોઈ એક નિષ્ઠાએ કેવી છે તેનો અભ્યાસ ચાય છે.	(4) અર્થતંત્રના સમતુલ્ય ગોક્કાસ સમયગાળા દરમિયાન જાણવા માટેનો અભ્યાસ ચાય છે. દા.ત. છ માસ, એક વર્ષ વગેરે ગોક્કાસ સમયગાળાનો નક્કી કરી તે અભ્યાસ ચાય છે.

❖ પરસ્પર પૂરક પદ્ધતિ :

એકમલથી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી તદેન જુદા તેમજ અસંગત છે તેવું માનવાની જરૂર નથી. આ બંને પદ્ધતિઓ એકબીજાની પૂરક પણ છે. કેટલીક વાર તો એક રીતે એકમલથી ગણાતી પદ્ધતિ બીજી રીતે સમગ્રલક્ષી પદ્ધતિ હોવાનું જર્યાય છે. આ બંને પદ્ધતિઓનું યોગ્ય રીતે સંયોજન કે સુધેળ કરવામાં ન આવે તો અર્થતંત્રની કામગીરીઓમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. તેજના સમગ્રગાળામાં પેઢી કે એકમને વસ્તુની ઊંચી કિંમત મળે છે જ્યારે મંદીમાં તેમને નીચી કિંમતોએ વસ્તુ વેચવી પડે છે. આમ, કોઈ એક એકમ કે પેઢી ઉત્પાદનના સાધનની કેટલી કિંમત ચૂકવશે તેમજ વસ્તુની કિંમત કેટલી રાખશે તેનો આધાર અર્થતંત્ર પર રહેલો છે. આપ, કોઈ એક વ્યક્તિ કે પેઢીના આર્થિક વર્તનનો અભ્યાસ કર્યા પછી સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અસર તેના પર પડે છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં ઉકેલવામાં આવતા મનો કે સમર્પણાં વ્યક્તિગત એકમોના સામૃહિક મધ્યલોના જ પરિણામ છે. સેમ્બુલસના મત પ્રમાણે એકમલથી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચે કોઈ બેદ નથી. આર્થિક વિશ્વેષણ માટેની આ બંને પદ્ધતિઓ સરળી મહત્વની છે. અર્થતંત્રમાં કુલ આવક વધી હોય તો પણ કેટલાક વર્ગના લોકોની આવક વધી પણ હોય. આ બંને વિશ્વેષણ પદ્ધતિઓ એક સાથે જ કાર્યરત બને છે. આર્થિક બાબતોને સમજવા માટે બંને પદ્ધતિઓ ઉપયોગી છે અને અર્થશાસ્ત્રમાં બંનેનું મહત્વ સરખ્યું છે.

૫ - ૪ તુટિગુણ, વસ્તુઓ અને સેવાઓ, નાણું અને સંપત્તિ, મુલ્ય અને કિમત, સંપત્તિ અને કલ્યાણ.

- ૧ તુટિગુણ,
- ૨ વસ્તુઓ અને સેવાઓ,
- ૩ નાણું અને સંપત્તિ,
- ૪ મુલ્ય અને કિમત,
- ૫ સંપત્તિ અને કલ્યાણ.

### તુટિગુણ :

તુટિગુણનો ખ્યાલ અર્થશાસ્ત્રમાં મહાવનો છે. સમગ્ર વિષમાં વ્યક્તિઓ જે આર્થિક પ્રવૃત્તિઓ કરે છે તેની પાછળનો મુખ્ય હેતુ વપરાશનો છે. જુદી જુદી ચીજવસ્તુઓ અને સેવાઓના વપરાશ દ્વારા વ્યક્તિઓને આનંદ કે સંતોષ પ્રાપ્ત થાય છે.

તુટિગુણ શબ્દ બે શબ્દનો બનેલો છે. “તુટિ”નો અર્થ સંતોષ થાય છે અને “ગુણ”નો અર્થ શક્તિ થાય છે.

### \* અર્થ :

સિલ્વર મેનના ભાત પ્રમાણે “વસ્તુઓ કે સેવાઓમાં રહેલો માનવ જરૂરિયાતોને સંતોષવાનો ગુણ એટલે તુટિગુણ.” તુટિગુણ એટલે સંતોષ. વ્યક્તિને જ્યારે કોઈ પણ સેવા કે વસ્તુઓના વપરાશમાંથી સંતોષ મળે છે ત્યારે તેને તુટિગુણ તરીકે ઓળખવામાં આવે છે.

તુટિગુણનો ખ્યાલ સાપેક્ષ છે. કારક્ષ કે તે વ્યક્તિ, સમય, સ્થળ તેમજ સંજ્ઞોગો બદલતા તુટિગુણ બદલાય છે. જેમ કે, પેન અને પુસ્તક શિક્ષિત વ્યક્તિ માટે મહાવની વસ્તુ છે. તેમાંથી અભજ વ્યક્તિને કોઈ આનંદ કે તુટિગુણ મળતો નથી.

### \* લક્ષણો :

- (1) તુટિગુણનો ખ્યાલ સાપેક્ષ તેમજ માનસિક છે.
- (2) તુટિગુણનું ચોક્કસ માપ કાઢતું મુશ્કેલ છે.

- (3) વસ્તુ કે સેવામાં રહેલી માનવ જરૂરિયાતોને સંતોષવાની શક્તિ તુટિગુણ છે.
- (4) જરૂરિયાતોના મહત્વમાં ફેરફાર થતાં તુટિગુણ ફેરફાર પામે છે.
- (5) તુટિગુણ એટલે આનંદ નહિ.
- (6) તુટિગુણ એટલે કલ્યાણ નહિ.
- (7) વસ્તુઓના ઉપયોગો અને વક્તિના જ્ઞાનમાં ફેરફાર થતા તુટિગુણમાં ફેરફાર થાય છે.

❖ તુટિગુણના પ્રકારો :

તુટિગુણના સ્વરૂપને આખારે તેના પ્રકારો નીચે પ્રમાણે જોવા મળે છે.

(1) સ્વરૂપલક્ષી તુટિગુણ :

કોઈ પણ કુદરતી પદાર્થ કે વસ્તુના કદ, આકાર કે સ્વરૂપમાં ફેરફાર કરવાથી તેના તુટિગુણમાં જે વધારો થાય છે તેને સ્વરૂપલક્ષી તુટિગુણ તરીકે ઓળખવામાં આવે છે. દા.ત., હુલાર માટીમાંથી માટલા બનાવે, હીઠે બનાવે, ફૂડા બનાવે તેમજ સુથાર લાકડામાંથી જે ફર્નિચર બનાવવાથી તુટિગુણમાં જે વધારો થાય છે તેને સ્વરૂપલક્ષી તુટિગુણ કહેવાય છે.

(2) સ્થળલક્ષી તુટિગુણ :

કોઈ પણ વસ્તુ કે પદાર્થને જ્યારે એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવામાં આવે ત્યારે તુટિગુણમાં જે ફેરફાર થાય છે તેને સ્થળલક્ષી તુટિગુણ કહેવાય છે. જેમ કે, નદી કે રણમાં રહેલી રેતીને શહેરોમાં મકાન બાંધકામ માટે લાવવામાં આવે ત્યારે તેમાં જે તુટિગુણ વધે છે તે સ્થળલક્ષી તુટિગુણ છે.

(3) સમયલક્ષી તુટિગુણ :

સમયમાં ફેરફાર થવાને કારણે તુટિગુણમાં જે ફેરફાર થાય છે તે સમયલક્ષી તુટિગુણ છે. સમયના પ્રવાહની સાથે આ તુટિગુણમાં ફેરફાર થાય છે. કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરીને જ્યારે તે ખૂબ જરૂરી ઢોપ ત્યારે તેની કિંમત વધુ મળે છે. દા.ત., ઈલેક્ટ્રિક પંખા કે એરક્લીશન જેવી વસ્તુમાંથી શિયાળા કરતાં ઉનાળાની ઝતુમાં વધારે તુટિગુણ મળે છે. તે જ રીતે શિયાળામાં ગરમ કપડાં કે ચોમાસામાં છતી કે રેઇનકોટથી તુટિગુણમાં જે વધારો થાય તે સમયલક્ષી તુટિગુણ છે.

#### (4) સેવાલક્ષી તુટિગુણ :

સેવાઓના ઉપયોગને લીધે વ્યક્તિની કેટલીક જરૂરિયાતો સંતોષાય છે, જેને સેવાલક્ષી તુટિગુણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રો. રેમન્ડના જ્ઞાનવ્યા પ્રમાણે અર્થતંત્રમાં સેવાઓ જેવી કે રસ્તા, વિજણી, પાણી વગેરે બાબતોનું પ્રમાણ વધવાને કારણે માનવ જરૂરિયાતો સંતોષાય છે. જે સેવાલક્ષી તુટિગુણ છે તે જ રીતે શિક્ષક, વકીલ, ડોક્ટર વગેરેની સેવાઓ દ્વારા પણ વ્યક્તિને તુટિગુણ મળે છે.

#### (5) પ્રાથમિક તુટિગુણ :

કુદરતે આપેલ કેટલાક પદાર્થો તેમજ વસ્તુઓ એવી છે કે જેનો માનવ સીધેસીધો ઉપયોગ કરીને પોતાની જરૂરિયાતો સંતોષી શકે છે. જેમ કે, જમીનમાંથી નીકળતા ખનીજ તત્ત્વો, ક્રોલસો, પેટ્રોલ, લોઝંડ વગેરે વસ્તુઓ ઉપયોગી છે. જે સંપૂર્ણ રીતે કુદરતને આભારી છે. આમ, પ્રાથમિક તુટિગુણને કુદરતી કે નૈસાર્જિક તુટિગુણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ, કોઈ પણ વસ્તુ, પદાર્થ કે સેવામાં કુદરતી રીતે જે તુટિગુણ જોવા મળે છે તે પ્રાથમિક તુટિગુણ છે.

#### (6) માલિકીપણાનો તુટિગુણ :

વસ્તુની માલિકી હક્કમાં ફેરફાર થવાને કારણે વસ્તુમાં રહેલા તુટિગુણમાં જે ફેરફાર થાય છે તેને માલિકીપણાનો તુટિગુણ કહેવાય છે. જેમ કે, વ્યક્તિ પહેલા ભાડાના મકાનમાં રહેતો હોય ત્યાર બાદ આર્થિક પરિસ્થિતિ સુધ્યતા તે જ મકાન ખરીદી લે છે ત્યારે તેના આનંદ અને તુટિગુણમાં વધારો થાય છે. આમ, કોઈ પણ વસ્તુ કે સાધનની માલિકી બદલાતા તુટિગુણ બદલાય છે.

#### (2) વસ્તુઓ અને સેવાઓ :

##### ❖ અર્થ :

અર્થશાસ્ત્રમાં વસ્તુ અને સેવાનો અર્થ જીમજવો જરૂરી છે. જે આ પ્રમાણે સમજાવી શકાય.

“જે કોઈ વસ્તુ કે પદાર્થમાં તુટિગુણ છે, તેનું બાહ્યસ્વરૂપ છે તેમજ વિનિમ્ય

પાત્રતા છે તેને વસ્તુ કહેવાય છે.” વસ્તુઓ ભૌતિક તેમજ દશ્યમાન હોય છે. વસ્તુઓને ચોક્કસ સ્વરૂપ, રંગ, આકાર હોય છે.

માનવીની ઠંકાઓ તેમજ જરૂરિયાતો માત્ર ભૌતિક વસ્તુઓથી સંતોષપાત્રી નથી. કેટલીકવાર સેવાઓ દ્વારા સંતોષવી પડે છે. જેને અભૌતિક વસ્તુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અભૌતિક વસ્તુઓને સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે. દા.ત., વકીલની સેવા, ડોક્ટરની સેવા, શિક્ષકની સેવા વગેરે અભૌતિક વસ્તુ (સેવાના) ઉદાહરણો છે. આ પ્રકારની સેવાઓમાં વિનિમય પાત્રતા છોતી નથી. વ્યક્તિના આંતરિક ગુજોનો કે ક્રીશલ્યનો વિનિમય થઈ શકે નથી.

#### ❖ વસ્તુના લક્ષણો :

- (1) વસ્તુમાંથી તુઢિગુણ મળતો હોય છે.
- (2) વસ્તુઓનું ચોક્કસ બાબત સ્વરૂપ હોય છે, ભૌતિક હોય છે.
- (3) વસ્તુઓમાં વિનિમય પાત્રતા હોય છે.

#### ❖ વસ્તુઓનું સ્વરૂપ/પ્રકાર :

વસ્તુઓના પ્રકાર કે સ્વરૂપ નીચે મુજબ જોવા મળે છે.

#### (1) આર્થિક વસ્તુઓ અને મુક્ત વસ્તુઓ/સર્વસુલભ વસ્તુઓ :

આર્થિક વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે જેને પ્રાપ્ત કરવા માટે કિમત ચૂકવવી પડે છે. આર્થિક વસ્તુમાં ત્રણ બાબતો રહેલી છે, તેમાંથી તુઢિગુણ મળે છે. તેનો વિનિમય થઈ શકે છે તેમજ આવી વસ્તુની અધિત હોય છે. દા.ત., અનાજ, કપડાં, રહેઠાણ, વાહન વગેરે આર્થિક વસ્તુઓ છે.

મુક્ત વસ્તુઓને સર્વસુલભ વસ્તુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે જે વસ્તુ સરળતાથી કોઈ પણ પ્રકારનો શ્રમ કર્યા વગર, તેની કિમત ચૂકવ્યા વગર પ્રાપ્ત થતી હોય તેને મુક્ત વસ્તુઓ કહેવાય છે. મુક્ત વસ્તુઓનું ઉપયોગિતા મૂલ્ય સૌથી વધુ હોય છે, પરંતુ તેનો જથ્યો વિશાળ હોય છે. તેનો માંગ કરતા પુરવઠો વધુ હોય છે. દા.ત., સૂર્યપ્રકાશ, હવા, પાણી વગેરે.

(2) નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ :

નાશવંત વસ્તુઓ એવી હોય છે કે જેનો એક વખત ઉપયોગ કે વપરાશ કર્યા પછી તેમાં રહેલો તુટ્ટિગુણ નાશ પામે છે. એટલે કે એક વાર ઉપયોગ કર્યા પછી તેમાં માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ રહેતો નથી. તેમજ આવી વસ્તુઓનો લાંબા સમય સુધી સંગ્રહ પણ કરી શકતો નથી. દા.ત., શક્કભાળ, દૂધની બનાવટે, ફળો, વગેરે.

જ્યારે વસ્તુઓનો એક કરતાં વધુ વખત ઉપયોગ કરવા છતાં તેમાં તુટ્ટિગુણ ટકી શકતો હોય તો તેને ટકાઉ વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. આવી વસ્તુઓનો સંગ્રહ લાંબા સમય સુધી થઈ શકે છે. દા.ત., યંત્રો, વાહન, મકાન વગેરે.

(3) દશ્ય વસ્તુઓ અને અદશ્ય વસ્તુઓ :

જે વસ્તુને જોઈ શકાય છે, સ્વર્ગ કરી શકાય છે, જેને ચોક્કસ કદ, સ્વરૂપ અને આકાર હોય છે તેને દશ્ય વસ્તુઓ કહે, છે. દશ્ય વસ્તુઓને ભૌતિક વસ્તુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી વસ્તુઓને બાબુ સ્વરૂપ હોય છે.

કેટલીક વસ્તુઓને આપણે જોઈ શકતા નથી પણ માત્ર તેનો અનુભવ કરી શકીએ છીએ. જેને અભૌતિક વસ્તુઓ કહી શકાય. માનવજીવનમાં અભૌતિક કે અદશ્ય (સેવાઓ) વસ્તુઓનું ખૂબ જ મહત્વ છે. દા.ત. ડોક્ટર કે વકીલની સેવાઓ, પેઢીની ગુડવીલ વગેરે અદશ્ય (અભૌતિક) વસ્તુઓ છે.

(4) અવેજા (હરીક) અને પૂરક વસ્તુઓ :

જે વસ્તુઓ વપરાશની દિશાએ એકબીજાની અવેજામાં ઉપયોગમાં લઈ શકતી હોય તેને અર્થશાસ્ત્રમાં અવેજા વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. દા.ત., ખાંડના બદલામાં ગોળ.

જ્યારે કોઈ એક વસ્તુ દ્વારા જરૂરિયાત સંતોષવા માટે બીજી વસ્તુનો પણ ઉપયોગ કરવો પડે છે ત્યારે તેને પૂરક વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. દા.ત. બોલપેન સાથે રીઝિલ, સ્કુટર કે બાઈક ચલાવવા માટે પેટ્રોલ.

(5) ઉત્પાદક વસ્તુઓ અને વપરાશી વસ્તુઓ :

જે શીજવસ્તુઓના વપરાશ કે ઉપયોગથી વિકિતની ઈચ્છા કે જરૂરિયાત

પ્રત્યક્ષ (સીધી) રીતે સંતોષાતી હોય તેને વપરાશી વસ્તુઓ (અંતિમ વસ્તુઓ) તરીકે ઓળખવામાં આવે છે. દા.ત., અનાજ, કાપડ વગેરે.

જે વસ્તુઓનો ઉપયોગ કે વપરાશ કરવાથી વ્યક્તિની જરૂરિયાતો પરોક્ષ રીતે સંતોષાતી હોય તો તેને ઉત્પાદક વસ્તુઓ અથવા મૂડી વિભયક વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. દા.ત., પંત્રો, મશીનરી, કારખાનાના મકાન.

વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુ વચ્ચેનો બેદ કે તફાવત જ્ઞાનવા માટે વસ્તુઓનો વપરાશ કેવી રીતે થાય છે તે જ્ઞાનું જરૂરી છે. જેમ કે, ધરમાં વપરાતો કોલસો વપરાશી વસ્તુ છે, જ્યારે કારખાનાની ભક્તીમાં વપરાતો હોય તો તે ઉત્પાદક વસ્તુ બને છે.

#### (6) ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ :

વસ્તુઓના માલિકી ઉક્કને ધ્યાનમાં રાખીને વસ્તુઓના આ બે પ્રકારો પાડવામાં આવેલ છે. જે વસ્તુઓ પર ખાનગી પેઢી, કંપની કે ક્રોઈ વ્યક્તિની માલિકી હોય તો તે ખાનગી વસ્તુઓ કહેવાય છે. મુનિસિપાલિટી, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તેમજ સ્થાનિક સ્વાયત્તતાની સંસ્થાનની માલિકી ડેણની વસ્તુને જાહેર વસ્તુઓ કહેવામાં આવે છે. જાહેર વસ્તુઓની માલિકી સામૃહિક હોય છે. દા.ત. બગીચા, રસ્તા, રેલવે વગેરે જાહેર વસ્તુઓ છે.

#### \* વસ્તુઓ અને સેવાઓ વચ્ચેનો તફાવત :

વસ્તુઓ	સેવાઓ
(1) વસ્તુઓ જોઈ શકાય છે. દશ્યમાન છે.	(1) સેવાઓ જોઈ શકતી નથી. અનુભવી શક્ય છે. અદ્દ્ય છે.
(2) વસ્તુઓને બાબુ સ્વરૂપ હોય છે. તેનો સર્વ કરી શકાય છે.	(2) સેવાએનું બાબુ સ્વરૂપ હોયનથી. તેનો સર્વ કરી શકતો નથી.
(3) વસ્તુઓનો સંગ્રહ કરી શકાય છે.	(3) સેવાઓનો સંગ્રહ કરી શકતો નથી.
(4) વસ્તુઓને ભૌતિક વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે.	(4) સેવાઓને અભૌતિક વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે.

#### (4) નાણું-સંપત્તિ અને કલ્યાણ :

પ્રાચીન સમયમાં સાટા પદ્ધતિથી વ્યવહારો થતા હતા. વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય થતો હતો. સમય જતાં વસ્તી વધતાં, જરૂરિયાતો વધતાં વસ્તુ વિનિમય પ્રથમાં મુશ્કેલીઓ વધતી ગઈ. મુશ્કેલીઓને ઘટાડવા માટે નાજીાંની શોધ થઈ. યંત્રવિજ્ઞાનના વિકાસમાં જેમ ચકની શોધ મહત્વની ગણાય તે જ રીતે અર્થશાલમાં નાજીાંની શોધ એ મહત્વની શોધ ગણાય છે.

#### ❖ નાણાંનો અર્થ :

નાણાંની વિવિધ વ્યાખ્યાઓ જુદા જુદા અર્થશાલીઓ દ્વારા રજૂ કરાઈ છે. જેમાંથી કેટલીક વ્યાખ્યાઓ રજૂ કરેલ છે.

#### (1) પ્રો. કાઉથર :

“જે વસ્તુ વિનિમયનું માધ્યમ, મૂલ્યના માપદંડ તેમજ મૂલ્યના સંગ્રહક તરીકે સર્વસ્વીકૃત છે તે નાણું છે.”

#### (2) પ્રો. જે. આર હિક્સ :

“જે વસ્તુ ગણતરીના એકમ તરીકે, મૂલ્યના સંગ્રહક તરીકે અને વિનિમયના માધ્યમ તરીકેના પરંપરાગત કાર્ય કરે છે તે નાણું.

#### (3) પ્રો. સિડવિક :

“જે નાજીાંનું કાર્ય બજાવે છે તે નાણું.”

#### (4) પ્રો. ડી. એચ. રોબર્ટસન :

“વસ્તુની કે સેવાની ભરીદી વખતે થતી ચૂકવણીમાં તેમજ વ્યાપારી ચૂકવણીઓમાં જેનો બહોળો/વધારે ઉપયોગ થાય છે તે દરેકને નાણું કહી શકાય.”

#### (5) પ્રો. આલ્ફેડ માર્સલ :

“કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે શકા વિના તેમજ વિશેષ તપાસ કર્યા વગર વસ્તુ કે સેવાના ભરીદ-વેચાણના સાપન તરીકે જેનો સ્વીકાર થતો હોય તે નાણું છે.”

❖ નાવાંના લક્ષણો :

- (1) વિનિમય પાત્રતા
- (2) મૂલ્યનું માપદંડ
- (3) મૂલ્યનું સંગ્રહક
- (4) સર્વ સ્વીકૃતતા

❖ સંપત્તિનો અર્થ :

સામાન્ય વ્યક્તિઓના મતે નાથું અને સંપત્તિ બંને એક જ વસ્તુ છે. પરંતુ અર્થશાખામાં સંપત્તિનો વિશિષ્ટ અર્થ થાય છે. સંપત્તિની વ્યાખ્યા નીચે મુજબ અર્થશાખાઓએ રજૂ કરેલી છે.

(1) રાઉંડિંગ :

“દરેક આર્થિક વસ્તુને સંપત્તિ કહી શકાય.”

(2) પ્રો. માર્શલ :

“જે વસ્તુ ઉપયોગી હોય, સિમિત હોય, બદ્ધવાપત્ર હોય તેમજ જેના પર વ્યક્તિગત માલિકી સ્થાપિત કરી શકાતી હોય તેને સંપત્તિ કહેવામાં આવે છે.”

❖ સંપત્તિના લક્ષણો :

સંપત્તિના લક્ષણો નીચે પ્રમાણે છે. જે વસ્તુઓમાં નીચેના લક્ષણો હોય તેનો સમાવેશ સંપત્તિમાં થાય છે.

(1) તુટિયુષા :

જે આર્થિક વસ્તુઓમાં માનવીની ઈચ્છાઓ અને જરૂરિયાતોને સંતોષવાનો ગુણ હોય તેને સંપત્તિ કહેવાય છે. મુક્ત વસ્તુઓ દારા પણ માનવ જરૂરિયાત સંતોષાય છે, પણ તેને સંપત્તિ કહી શકાય નહિ.

(2) અધત :

સંપત્તિનું આ લક્ષણ વસ્તુના પુરવઠા પર આધાર રાખે છે. સામાન્ય રીતે આર્થિક વસ્તુઓનો પુરવઠો તેની માંગ કરતાં ઓળો હોય છે. તેથી વસ્તુઓની અધત જોવા મળે છે. જે વસ્તુની અધત હોય તેને સંપત્તિ ગણવામાં આવે છે.

### (3) વિનિમય યોગ્યતા :

વસ્તુમાં તુટ્ટિગુણ હોય, વસ્તુની અછત હોય પણ જે તેનામાં માલિકીપણાની હેરકેર કરવાની કષમતા કે બદલાપાત્રતા ન હોય, તો સંપત્તિ ગણી શકાય નહિ. વસ્તુનો વિનિમય એટલે ખરીદ-વેચાજી કે જ્યાં માલિકી હક્ક બદલાવો જોઈએ તો જ સંપત્તિ ગણાય. દા.ત. જમીન, મકાન વગેરે.

### (4) જથ્થો રાખી શકાય તેમ હોય જોઈએ :

બધી જ આર્થિક વસ્તુઓ સંપત્તિ ગણી શકતી નથી. જથ્થાના સંગ્રહના સંદર્ભમાં સંપત્તિનો અર્થ વિચારવો જોઈએ. માર્શિલના મત પ્રમાણે સેવાઓ (અભૌતિક વસ્તુઓ) કે જે અસ્તિત્વમાં આવતાની સાથે વપરાઈ જાય છે. જેને સંપત્તિ ગણી શકાય નહિ. આ ઉપરાંત નાશવંત વસ્તુઓ દ્વારા, શાકભાજ વગેરેનો જથ્થો સંગ્રહી શકતો નથી.

### (5) બાબ્દ સ્વરૂપ :

વસ્તુમાં તુટ્ટિગુણ હોય, અછત હોય પણ તેનું ચોક્કસ સ્વરૂપ ન હોય તો તે સંપત્તિ ગણાય નહિ. જેમ કે, કવિની કવિતા રચનાની શક્તિ, ખેલાડીનું રમત અંગેનું ક્રોશલ્ય જેની અછત હોય છે તેમજ તેમાંથી તુટ્ટિગુણ પણ મળે છે. તેમ છતાં તેનું ખરીદ-વેચાજી થઈ શકતું નથી. કારણ કે તે તેના આંતરિક ગુણો છે, તેના માલિકી અધિકારનો બદલો થઈ શકતો નથી.

#### ❖ સંપત્તિના પ્રકારો :

સંપત્તિના પ્રકારો નીચે પ્રમાણે જોવા મળે છે.

### (1) વ્યક્તિગત સંપત્તિ અથવા ખાનગી સંપત્તિ :

જ્યારે કોઈ વસ્તુ પર વ્યક્તિ, કંપની કે કોઈ સમૂહની માલિકી હોય ત્યારે તેને ખાનગી સંપત્તિ અથવા તો વ્યક્તિગત સંપત્તિ કહેવાય છે. દા.ત., જમીન, મકાન, ઐતર વગેરે. ધ્યા કે વેપારની પેટન્ટ, કોપીરાઇટ તેમજ પ્રતિષ્ઠા વગેરે અભૌતિક ખાનગી કે વ્યક્તિગત સંપત્તિ છે.

### (2) સાર્વજનિક સંપત્તિ અથવા જાહેર સંપત્તિ :

જે સંપત્તિ પર સમગ્ર સમાજની માલિકી હોય તેને સાર્વજનિક સંપત્તિ કહે છે. આવી સંપત્તિ પર કોઈ પણ વ્યક્તિનો વિશેષ અધિકાર હોતો નથી.

સાર્વજનિક સંપત્તિનો ઉપયોગ દરેક નાગરિક કરી શકે છે. દા.ત. બળીચા,  
પુલો, ગૌચરની જમીન, તળાવ વગેરે.

### (3) રાષ્ટ્રીય સંપત્તિ :

દેશમાં રહેતા નાગરિકોની વ્યક્તિગત સંપત્તિ અને સાર્વજનિક સંપત્તિને  
બેંગી કરવાથી રાષ્ટ્રીય સંપત્તિનું સર્જન થાય છે. વ્યક્તિગત અને સાર્વજનિક  
સંપત્તિ ઉપરાંત નૈસર્જિક સંપત્તિ જેવી કે પર્વતો, જંગલો, નહીંઓ વગેરેનો  
સમાવેશ રાષ્ટ્રીય સંપત્તિમાં થાય છે. માર્શલના મટે કુદરતી સંપત્તિ પણ  
રાષ્ટ્રીય સંપત્તિનો એક હિસ્સો છે.

### (4) આંતરરાષ્ટ્રીય સંપત્તિ :

જે સંપત્તિ પર વિશ્વના દરેક દેશોની માલિકી હોય તેને આંતરરાષ્ટ્રીય  
સંપત્તિ કહેવાય છે. દા.ત., વિશ્વ બેંક, આંતરરાષ્ટ્રીય નાનાબંડોળ, યુનિસેફ,  
યુનો વગેરેના સાધનો, મિલ્ક્ટો અને મકાનો તેમજ મહાસાગરો વગેરે.

#### ❖ સંપત્તિ અને કલ્યાણ :

સંપત્તિ વધે એટલે કલ્યાણ વધે તે બાબત સાચી નથી. સંપત્તિ એ સાધન  
છે સાચ્ય નથી. સંપત્તિ અને સુખાકારીનો ઘ્યાલ વ્યક્તિગત છે. અર્થશાલમાં માર્શલી  
સૌથી પહેલાં ભૌતિક કલ્યાણનો ઘ્યાલ રજૂ કર્યો. સંપત્તિ સાધન છે અને માનવ  
કલ્યાણ સાચ્ય (ધ્યેય) છે. સંપત્તિ વધતા કેટલીક વાર કલ્યાણ ધટે છે. જેમ કે  
સિગારેટ, ગુટખા, દાડ વગેરેનું પ્રમાણ વધતાં કલ્યાણ ધટે છે.

સંપત્તિમાં વધારો થવાથી કલ્યાણમાં વધારો થશે કે નહિ તેનો આપાર માત્ર  
સંપત્તિના જથ્થા ઉપર નથી પણ બીજી કેટલાક પરિબળો પર રહેલો છે, જે નીચે  
પ્રમાણે છે.

### (1) સંપત્તિનું સ્વરૂપ :

કલ્યાણની દાખિએ સંપત્તિનો જથ્થો કે પ્રમાણ નહિ, પરંતુ સંપત્તિનું  
સ્વરૂપ મહત્વાનું છે. જો સંપત્તિના સ્વરૂપમાં મકાન, યંત્રો, ઉત્પાદનના સાધનો  
વગેરેનું પ્રમાણ વધે તો તે કલ્યાણમાં વધારો કરે છે. પણ જો દાડ, અણીણ,  
તમાકુ જેવી વસ્તુનું પ્રમાણ વધતાં સંપત્તિ વધે તો કલ્યાણમાં વધારો થતો  
નથી.

## (2) સંપત્તિના ઉત્પાદનની પદ્ધતિ :

વસ્તુઓનું ઉત્પાદન કઈ પદ્ધતિથી થાય છે, તે મહત્વની બાબત છે. જો કારખાનાં અને ફેકટરીમાં કામદારનું શોખણ કરીને સંપત્તિનું સર્જન કરવામાં આવે તો તેના થાય છે. કલ્યાણમાં વધારો થાય છે. કલ્યાણમાં વધારો થતો નથી.

## (3) સંપત્તિની વહેંચણી :

દેશમાં સંપત્તિના જગ્યામાં વધારો થવાથી કલ્યાણ કે સુખાકારી વધ્ય છે તેમ કહેવું સાચું નથી. સંપત્તિનો મોટો હિસ્સો સમાજના અમૃત વર્ગ કે સમૂહ પાસે જ કેન્દ્રિત થઈ જતો હોય તો તેમનું જ કલ્યાણ વર્ષે છે. બાકીના વર્ગના લોકોની સુખાકારીમાં કોઈ વધારો થતો નથી. સંપત્તિની વહેંચણીમાં જેટલી સમાનતા વધુ તેટલું લોકોનું કલ્યાણ વધુ થાય છે.

## (4) સંપત્તિના સર્જનનો સામાજિક ભર્યા :

માનવસંપત્તિના ભોગે જો સંપત્તિના પ્રમાણમાં વધારો થાય તો કલ્યાણમાં ઘટાડો થાય છે. ઉદ્યોગોના વિકાસને કારણે પ્રદૂષણમાં વધારો થાય છે. જેને કારણે કારખાનાની નષ્ટકના વિસ્તારના લોકોનું સ્વાસ્થ જીવખરમાં મૂકાય છે. ઔદ્યોગિક એકમોની આસપાસ ખુમાડા, ધોંઘાટ તેમજ ગંદા પાણીનો નિકાલ થવાને કારણે ગંભીર બિમારીઓથી લોકો પીડાય છે. સામાજિક ભર્યા ઘટાડીને કલ્યાણમાં વધારો કરી શકાય.

## (5) મુક્ત વસ્તુઓનું પ્રમાણ અને સંપત્તિ :

સંપત્તિના સર્જનને કારણે મુક્ત વસ્તુઓનું પ્રમાણ ઘટતું હોય તો તે કલ્યાણમાં ઘટાડો દર્શાવે છે. જેમ જેમ કારખાનાં ઓનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ લોકોને મુક્ત વસ્તુઓ ઓછી મળે છે. શહેરની નષ્ટકના ગ્રામ્ય વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો શરૂ કરવાથી વૃક્ષોને કાપવા પડે છે. જેથી વૃક્ષ નીચેની ઠંડક તેનો છાંધડો તેના ફળ વગેરે લોકો હારા વપરાતી મુક્ત વસ્તુઓનું પ્રમાણ ઘટે છે. જે સુખાકારીમાં ઘટાડો કરે છે.

❖ નાણું અને સંપત્તિ વચ્ચેનો તફાવત :

નાણું	સંપત્તિ
(1) નાણું સાધન છે, સાધ્ય નથી. તેના દ્વારા માનવીની પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષી રાકાતી નથી. સંપત્તિ ખરીદવામાં તેનો ઉપયોગ થાય છે. પછી સંપત્તિમાંથી સંતોષ અળે છે.	(1) સંપત્તિ સાધ્ય છે. તેના ઉપયોગથી બજિની પ્રત્યક્ષ રીતે જરૂરિયાત સંતોષી રહે છે. દા.ત., કપડાં, વાહન વગેરેના વપરાશથી જરૂરિયાત સંતોષાય છે.
(2) નાણું રાખ્યની દસ્તિએ સંપત્તિ ગંભીર શકાય નહિ.	(2) બજિની દસ્તિએ નાણું એ સંપત્તિ છે.
(3) નાણાંથી પ્રત્યક્ષ સુખાકારી કે કલ્યાણ વધતું નથી.	(3) સંપત્તિને કારણે પ્રત્યક્ષ સુખાકારી કે કલ્યાણમાં વધારે થાય છે.

(5) મૂલ્ય અને કિંમત :

સામાન્ય રીતે મૂલ્ય અને કિંમતનો અર્થ એક જ થાય તેવું સામાન્ય બ્યક્ઝિટ્સો  
સમજે છે. પરંતુ અર્થશાસ્ત્રમાં મૂલ્ય અને કિંમત બંને શબ્દોના વિશેષ અર્થ થાય  
છે. બંને બાબતો જુદી છે.

મૂલ્ય :

મૂલ્ય શબ્દ સાપેક્ષ તેમજ નિરપેક્ષ અર્થમાં વપરાય છે. મૂલ્યનો અર્થ નીચે  
પ્રમાણે આપી શકાય.

“કોઈ પણ વસ્તુના વિનિમયમાં બીજી વસ્તુઓ પ્રાપ્ત કરવાની શક્તિને મૂલ્ય  
કહેવાય છે.” દા.ત. એક પણ ચોખાના બદલવામાં ત્રણ મજા ધર્યું પ્રાપ્ત થાય છે.  
તો એક પણ ચોખાનું મૂલ્ય ત્રણ મજા ધર્યું કહી શકાય. વિનિમય મૂલ્ય ધરાવતી  
આર્થિક વસ્તુના ત્રણ લક્ષ્યો નીચે મુજબ છે.

- (1) વસ્તુમાં તુઢિગુણ હોવો જોઈએ.
- (2) વસ્તુ વિનિમયપાત્ર હોવી જોઈએ.
- (3) વસ્તુ અધ્યત ધરાવતી હોવી જોઈએ.

❖ મૂલ્યના પ્રકારો :

મૂલ્યના મુખ્યત્વે બે પ્રકારો છે :

(1) વપરાશ મૂલ્ય અથવા ઉપયોગિતા મૂલ્ય

(2) વિનિમય મૂલ્ય

(1) વપરાશ મૂલ્ય/ઉપયોગિતા મૂલ્ય :

વપરાશની રીતે જે ચીજવસ્તુ મહત્વની છે તેને વપરાશ મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. જે વસ્તુના વપરાશથી માનવીની જરૂરિયાતો સંતોષપાત્રી હોય તેને વપરાશી મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. ચીજવસ્તુઓ કે સેવાઓ વ્યક્તિના જીવનમાં કેટલી મહત્વતા પરાવે છે તેના મૂલ્ય તેનું વપરાશી મૂલ્ય નક્કી થાય છે. દા.ત. સૂર્યપ્રકાશ, હવા, પાણી વગેરે જેવી વસ્તુઓ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. આવી વસ્તુઓનું વપરાશી મૂલ્ય વધારે હોય છે.

(2) વિનિમય મૂલ્ય :

જ્યારે એક વસ્તુ આપીને બદલામાં બીજી વસ્તુ મેળવી શકતી હોય ત્યારે તે વિનિમય મૂલ્ય ધરાવે છે તેમ કંઈ શકાય. દરેક આર્થિક વસ્તુઓ વિનિમય મૂલ્ય ધરાવે છે. પરંતુ વપરાશ મૂલ્ય ધરાવતી બધી જ વસ્તુઓ વિનિમય મૂલ્ય ધરાવે છે તેવું કહેવું અયોગ્ય છે. જે વસ્તુમાં વપરાશમૂલ્ય કે ઉપયોગિતા મૂલ્ય હોય તેમાં વિનિમય મૂલ્ય હોય પણ ખંડું અને ન પણ હોય. પરંતુ વિનિમય મૂલ્ય ધરાવતી દરેક વસ્તુઓમાં ઉપયોગિતા કે વપરાશી મૂલ્યનું અસ્તિત્વ હોય છે. વ્યક્તિઓ ઉપયોગી વસ્તુઓનો જ વિનિમય કરે છે. આમ, દરેક આર્થિક વસ્તુઓ વિનિમય મૂલ્ય અને વપરાશી મૂલ્ય બંને ધરાવે છે. દા.ત. અનાજ, વણ, વાહન વગેરે.

❖ મૂલ્યનો વિરોધાભાસ :

અમૃક વસ્તુઓ એવી છે કે જેના વગર માનવીઓનું અસ્તિત્વ ટકી શકે તેમ નથી. દા.ત. હવા, સૂર્યપ્રકાશ, પાણી વગેરેનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ ઊંચું છે. પરંતુ તેનું વિનિમય મૂલ્ય શૂન્ય છે. જ્યારે સોંનું, ચાંદી, હીરા વગેરે વસ્તુઓનું ઉપયોગિતા મૂલ્ય નથી તેમ છતાં તેનું વિનિમય મૂલ્ય

ખૂબ જ ઊંચું છે. આ મકારની પરિસ્થિતિને અર્થશાસ્ત્રમાં “મૂલ્યના વિરોધાભાસ” તરીકે ઓળખવામાં આવે છે. મૂલ્યના વિરોધાભાસના પાયાનું કારણ વસ્તુઓના પુરવઠાનું પ્રમાણ છે. હવા, સૂર્યપ્રકાશ વગેરે વસ્તુઓનો પુરવઠો વિપુલ પ્રમાણમાં છે. તેથી તેનું વિનિમય મૂલ્ય નથી. જ્યારે સોના, ચાંદી, માણેક જેવી વસ્તુઓનો પુરવઠો તેની ભાંગ કરતાં ઓછો છે. તેની અછત છે જેથી તેનું વિનિમય મૂલ્ય ઊંચું છે. ભલે વપરાશી મૂલ્ય ઓછું હોય.

#### \* કિંમત :

પ્રાચીન સમયમાં વસ્તુના બદલામાં વસ્તુઓ પ્રાપ્ત થતી હતી જેને સાચા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હતી. વર્તમાન સમયમાં નાણાં દ્વારા વસ્તુ મેળવવામાં આવે છે. વસ્તુ પ્રાપ્ત કરવા માટે નાણાંની જરૂર પડે છે. કિંમત એટલે નાણામાં અંકિત થતું વસ્તુનું મૂલ્ય. જ્યારે વસ્તુનું વિનિમય મૂલ્ય નાણાંના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે ત્યારે તેને કિંમત તરીકે ઓળખવામાં આવે છે. બજારમાં જે કોઈ આર્થિક વસ્તુઓ વેચાય છે તે દરેકનું મૂલ્ય કિંમતમાં રજૂ થાય છે. પંખાની કિંમત ૩. ૮૦૦ ટૂંકામાં કિંમત એટલે વસ્તુનું નાણાંના સ્વરૂપમાં વ્યક્ત થતું વિનિમય મૂલ્ય.

#### \* મૂલ્ય અને કિંમત વચ્ચેનો તફાવત :

સામાન્ય રીતે વ્યક્તિઓ મૂલ્ય અને કિંમત વચ્ચે કોઈ તફાવત નથી તેણું માને છે. પરંતુ તે સાચું નથી બંને શર્ધાના અર્થ જુદા થાય છે.

મૂલ્ય	કિંમત
(1) મૂલ્ય હંમેશાં વસ્તુના પ્રમાણમાં નક્કી થાય છે. દા.ત., એક મજા ધર્તના બદલામાં દોઢ મજા બાજરી.	(1) વસ્તુનું મૂલ્ય નાણામાં નક્કી થાય છે ત્યારે તેને કિંમત તરીકે ઓળખવામાં આવે છે. દા.ત. 1 મજા ધર્તના 180 રૂ.
(2) બધી જ વસ્તુઓના મૂલ્ય એકસાથે વધી કે ધરી શકતા નથી.	(2) જ્યારે બધી જ વસ્તુઓની કિંમત એક સાથે વધી કે ધરી શકે છે.
(3) મૂલ્યનો ઘ્યાલ સાટા પદ્ધતિમાં મહત્વનો હતો.	(3) કિંમતનો ઉપયોગ કે મહત્વ નાણાં આધારિત અર્થતંત્રમાં જરૂરી છે.
(4) મૂલ્ય એ સાપેક્ષ ઘ્યાલ છે.	(4) કિંમત એ નિરપેક્ષ ઘ્યાલ છે.
(5) વસ્તુનું મૂલ્ય અનેક રીતે નક્કી થાય છે. દા.ત. મજા ધર્તની સામે દોઢ મજા બાજરી હોઈ શકે તેમજ 1 મજા ધર્તની સામે બે મજા બાજરી પજા મળે.	(5) જ્યારે વસ્તુઓની કિંમત એક જ હોય છે. જે લગભગ નિશ્ચિત હોય છે. દા.ત., એક મજા ધર્તના 3. 180.

## પ્ર - ૫ માર્શલનો ગ્રાહકના અધિક સંતોષનો ઘ્યાલ સમજાવો.

### ગ્રાહકનો અધિક સંતોષ (Consumer's Surplus)

ઠ.સ. ૧૮૪૭માં સૌપદ્ધતિ કેન્ચ ઈજનેર ડયપીટ નામના અર્થશાસ્ત્રીએ ગ્રાહકના અધિક સંતોષનો ઘ્યાલ આપ્યો છે. આ ઘ્યાલને પ્રો. માર્શલે તુટિગુણ વિશ્વેષણ દ્વારા વૈશાનિક ઢબે વિકસાયો છે. ગ્રાહકના અધિક સંતોષનો ઘ્યાલ ઘટાના સીમાંત તુટિગુણના ઘ્યાલ સાથે સંકળાયેલો છે. ગ્રાહકના અધિક સંતોષના ઘ્યાલની રામજૂતી તુટિગુણ વિશ્વેષણ અને તત્ત્વ રેખા વિશ્વેષણ અને રીતે આપી શકાય. પરંતુ અહીં આપણે તુટિગુણ વિશ્વેષણની સરળ પદ્ધતિ દ્વારા આ ઘ્યાલનો અભ્યાસ કરશું.

#### ૧) અર્થ :

૧. પ્રો. માર્શલના મતે ગ્રાહક જ્યારે કોઈ વસ્તુ વિના ગ્યાલાની દેવાને બદલે માનસિક રીતે વસ્તુમાં વધુ જેટલી કિમત ચૂકવવા, તૈયાર થાય છે અને વાસ્તવમાં જે કિમત ચૂકવવી પડે છે, તે બંને વચ્ચેના તકાવતને ગ્રાહકનો અધિક સંતોષ જોડે છે. દાન. સેઈ વિદ્યાર્થી પેન મેળવવા રૂ. ૧૦ ચૂકવવા તૈયાર છે, પરંતુ તે પેન વિદ્યાર્થીને રૂ. ૮માં પ્રાપ્ત થાય છે. તો અહીં વિદ્યાર્થીને રૂ. ૨ જેટલો અધિક સંતોષ મળે છે, તેમ કહી શકાય.

દૂંકમાં ગ્રાહકનો અધિક સંતોષ = માનસિક રીતે વસ્તુની કિમત ચૂકવવાની તૈયારી - વાસ્તવમાં ચૂકવેલી કિમત

૨. બીજા શબ્દામાં કહીએ તો વસ્તુનો ઉપયોગ કરવાથી ગ્રાહકને પ્રાપ્ત થાનાં તુટિગુણમાંથી વસ્તુની કિમત ચૂકવવાથી ગ્રાહકને થાનાં બિનતુટિગુણને બાદ કરતાં જે માપ મળે, તેને ગ્રાહકનો અધિક સંતોષ કહે છે. જેને દૂંકમાં કહીએ તો,

ગ્રાહકનો અધિક સંતોષ = વસ્તુમાંથી પ્રાપ્ત થાનો તુટિગુણ - કિમત ચૂકવવાથી મળતો બિનતુટિગુણ

#### ૨) ગ્રાહકનાં અધિક સંતોષની સમજૂતી :

ગ્રાહકને અધિક સંતોષ મળવાનું કારણ ઘટતો સીમાંત તુટિગુણ છે. આ દાખિએ જોઈએ તો ગ્રાહક જે-તે વસ્તુમાંથી મળનાર તુટિગુણ જેટલી કિમત ચૂકવવા તૈયાર હોય છે. ગ્રાહક વસ્તુની કિમત ચૂકવીને વસ્તુ મળે છે. ગ્રાહક જ્યારે મેળવેલ વસ્તુનો ઉપયોગ કરે છે, ત્યારે તેમાંથી તુટિગુણ પ્રાપ્ત થાય છે અને તે વસ્તુ મેળવવા જે કિમત ચૂકવવી પડે છે, તેમાંથી બિનતુટિગુણ મળે છે. અહીં ગ્રાહકનો અધિક સંતોષ એટલે વસ્તુના ઉપયોગ દરમાન મળેલા તુટિગુણ અને વસ્તુ મેળવવા ચૂકવવી પડેલી કિમતમાંથી મળેલ બિનતુટિગુણનો તકાવતાંત્રિકટા સીમાંત તુટિગુણના નિયમમાં આપણે જોમું કે ગ્રાહક જ્યારે મહેલી વસ્તુ ખરીટે ત્યારે તેમાંથી તુટિગુણ વધુ મળે છે અને ત્યારબાદ જેમ જેમ તે વસ્તુના વધારે ગેકો મેળવતો જાય છે, તેમ જેરચિયાત પૂરી થતી જતી હોયાથી તે વસ્તુઓમાંથી પ્રાપ્ત થાનો સીમાંત તુટિગુણ ઘટતો જાય છે, આથી ગ્રાહક વધુને વધુ વસ્તુ પ્રાપ્ત કરવા કિમત ચૂકવવાની તૈયારી ધારાંતો જાય છે. અહીં વસ્તુનો

ઉપભોગ કરવાથી મળતો તુટિંગુણ અને વસ્તુ પ્રાપ્ત કરવા કિમતની ચૂકવણી રૂપે મળતો સીમાંત બિનતુટિંગુણ સરખા થશે, ત્યારે ગ્રાહક વસ્તુની ખરીદી બંધ છુટ્ટે. આમ, સીમાંત એકમમાંથી અધિક સંતોષ શૂન્ય થાય ત્યાં ગ્રાહક સંમતુલા પ્રાપ્ત કરે છે. પરંતુ પૂર્વ સીમાંત એકમોમાંથી અધિક સંતોષ પ્રાપ્ત થતો હોય છે. અહીં આપણે ગ્રાહકના અધિક સંતોષના ઘ્યાલને નીચેની ધારણાઓના આધારે અનુસૂચિ તથા આકૃતિ દ્વારા સમજશું.

#### ધારણાઓ :

1. તુટિંગુણ સંખ્યામાં માપી શકાય છે.
2. નાણાંનો સીમાંત તુટિંગુણ સ્થિર રહે છે.
3. બજારમાં જે વસ્તુની ખરીદી કરવામાં આવે છે, તેની અવેળ વસ્તુ ઉપલબ્ધ નથી.

#### ઉદાહરણ, આકૃતિ દ્વારા સમજૂતી :


ધારો કે કોઈ ગ્રાહક અનુક વસ્તુના એકમો ખરીદતો જાપ છે, તેમ તે વસ્તુમાંથી પ્રાપ્ત થતો અધિક સંતોષ નીચેના કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યો છે.

#### અનુસૂચિ

વસ્તુનો ક્રમ	કિમત ચૂકવવાની તૈયારી (રૂ.) / વસ્તુમાંથી મળતો તુટિંગુણ (એકમમાં)	વાસ્તવમાં ચૂકવેલ કિમત (રૂ.) / વસ્તુમાંથી મળતો બિનતુટિંગુણ (એકમમાં)	ગ્રાહકનો અધિક સંતોષ
૧	૧૦૦	૧૦	૬૦
૨	૭૫	૧૦	૬૫
૩	૫૫	૧૦	૪૫
૪	૨૫	૧૦	૧૫
૫	૧૦	૧૦	૦
કુલ	૨૬૫	૫૦	૨૧૫

સમજૂતી : ઉપરની અનુસૂચિમાં જોઈ શકાય છે ગ્રાહકને પહેલી વસ્તુમાંથી ૧૦૦ એકમ તુટિંગુણ મળે છે. આથી ગ્રાહક પહેલી વસ્તુની ખરીદી માટે રૂ. ૧૦૦ કિમત ચૂકવવા તૈયાર છે, પરંતુ વાસ્તવમાં તેમણે રૂ. ૧૦ કિમત ચૂકવવી પડે છે, જેથી તેને ૧૦ એકમ બિનતુટિંગુણ મળે છે. અહીં પહેલી વસ્તુમાંથી ગ્રાહકને ૬૦ રૂપિયા અથવા ૮૦ એકમ જોટલો અધિક સંતોષ મળે છે. એ જ રીતે વસ્તુના બીજા એકમમાંથી ગ્રાહકને ૭૫ એકમ તુટિંગુણ મળતો હોવાથી ગ્રાહક રૂ. ૭૫ કિમત ચૂકવવા તૈયાર

છે, પરંતુ બીજી વસ્તુ પણ રૂ. 10 માં મળે છે. નાણાંનો સીમાંત તુટિયુષા સ્થિર રહેતો હોવાથી બીજી વસ્તુની ખરીદી કરવાથી ગ્રાહકને 10 એકમ બિનતુટિયુષા મળે છે. તેથી બીજી વસ્તુ માથી ગ્રાહકને રૂ. 15 અથવા 15 એકમ જેટલો અધિક સંતોષ મળે છે. આ જ રીતે ગ્રેજા અને ચોથા એકમમાંથી ગ્રાહકને અનુકૂમે 15 અને 15 જેટલો અધિક સંતોષ મળે છે, જ્યારે પાંચમાં એકમમાંથી અધિક સંતોષ શૂન્ય થાય છે. આથી ગ્રાહક પાંચમાં એકમથી ખરીદી કરતો નથી. અહીં સમગ્ર રીતે જોઈએ તો પાંચ વસ્તુની ખરીદી માટે ગ્રાહક રૂ. 245 ચૂકવવા તૈયાર છે. પરંતુ હિક્કતે તેણે રૂ. 50 ચૂકવવા પડે છે. માટે ગ્રાહકને રૂ. 215 જેટલો અધિક સંતોષ મળે છે. અને તુટિયુષાના સંદર્ભમાં જોઈએ તો અહીં ગ્રાહકને પાંચ વસ્તુની ખરીદીમાંથી કુલ 245 એકમ તુટિયુષા પ્રાપ્ત થાય છે. અને પાંચ વસ્તુની ખરીદી માટે ચૂકવેલ કિમત દારા ગ્રાહકને 50 એકમ બિનતુટિયુષા મળે છે. તેથી કુલ 215 એકમ જેટલો અધિક સંતોષ મળે છે. આ બાબતને આકૃતિ વારા નીચે પ્રમાણે સમજાવી શકાય છે.



ઉપરની આકૃતિમાં  $OX$  ખરી પર વસ્તુના એકમો અને  $OY$  ખરી ઉપર વસ્તુની કિમત અને સીમાંત તુટિયુષા આપવામાં આવ્યો છે. આકૃતિમાં  $Mu$  રેખા સીમાંત તુટિયુષા રેખા છે. એટલે કે ગ્રાહક જેમ વધારે વસ્તુનો ઉપયોગ કરતો જાય તેમ સીમાંત તુટિયુષા ઘટતો જાય છે. પરિણામે સીમાંત તુટિયુષાની રેખા જાણાવાલી છે.

આકૃતિમાં જોઈએ તો  $OP$  કિમતે ગ્રાહક  $OA$  વસ્તુ ખરીદે છે. આથી ગ્રાહકને કુલ સંતોષ / કુલ તુટિયુષા  $OA$  એકમની વપરાશમાંથી  $OMBA$  મળે છે. જ્યારે  $OA$  વસ્તુ ખરીદવા  $OP$  કિમત ચૂકવવી પડે છે. આથી ગ્રાહકને  $OPBA$  બિનતુટિયુષા પ્રાપ્ત થાય છે. આથી ગ્રાહકને  $OA$  વસ્તુની વપરાશમાંથી  $PMB$  અધિક સંતોષ મળે છે.

અહીં બાજુ શર્દીમાં કહીએ તો OA વસ્તુ ખરીદવા ગ્રાહક OMBA કિમત ચૂકવવા તૈયાર છે. પરંતુ વાસ્તવમાં તેમણે OPBA કિમત ચૂકવવી પડે છે. જેથી PMB જેટલો અધિક સંતોષ મળે છે.

(૩) મહત્વ : ગ્રાહકના અધિક સંતોષનાં ખ્યાલનું મહત્વ નીચે મુજબ છે :

૧. કરવેરા : નાણાંપદાનને ગ્રાહકનો અધિક સંતોષ કરવેરા નાખવામાં માર્ગદર્શનરૂપ બને છે. જેમ કે, જે વસ્તુમાં ગ્રાહકનો અધિક સંતોષ વધુ હોય તે વસ્તુઓ ઉપર કરવેરા નાખવાથી ગ્રાહકો વિરોધ કરશે નહિં.

૨. દાજુરાદારને કિમત નક્કી કરવામાં મદદરૂપ : દાજુરાદાર પેઢીને પોતાની વસ્તુની કિમત નક્કી કરવામાં ગ્રાહકનો અધિક સંતોષ મદદરૂપ થાય છે. જેમ કે, જેમ વસ્તુમાં ગ્રાહકને અધિક સંતોષ વધુ મળતો હોય તે વસ્તુની કિમત ઊંચી રાખી રાકારો. કારણ કે અહીં કિમત ઊંચી રાખવા છતાં વેગાશામાં ઘટાડો થશે નહીં અને જેમાં અધિક સંતોષ ઓછો હોય તેની કિમત નીચે રાખશો. કારણ કે, આવી વસ્તુની કિમત ઊંચી રાખવામાં આવશે તો વેગાશા ઘટી જશે.

૩. કલ્યાણાલક્ષી અર્થશાસ્ત્રમાં ઉપયોગી : ગ્રાહકના અધિક સંતોષનો ખ્યાલ રાખ્ણા કલ્યાણમાં વધારો કરવા અને કલ્યાણ જ્ઞાવવામાં ઉપયોગી થાય છે. જેમ કે, જે ગ્રાહકીને વધારે સંતોષ મળતો હોય તેમ કલ્યાણની સપાઠી ઊંચી ગણાયું. આવી રાજ્યે લોકોનું કલ્યાણ મહત્તમ કરું હોય તો ગ્રાહકનો અધિક સંતોષ મહત્તમ કરવો જોઈએ અને તે માટે રાજ્યે ગ્રાહકનો અધિક સંતોષ વધે તે રીતે ઉત્પાદન, કરવેરા, કિમત, ખર્ચ વગેરે નીતિઓ ઘડવી જોઈએ.

૪. જીવન ધોરણાની સપાઠી જ્ઞાવવા : જુદા જુદા દેશોના લોકોના જીવન ધોરણાની તુલના કરવામાં ગ્રેહકના અધિક સંતોષનો ખ્યાલ મહત્વનો બને છે. જેમ કે, જે દેશમાં ગ્રાહકીને અધિક સંતોષ વધારે મળતો હોય તે દેશમાં લોકોનું જીવન ધોરણ ઊંચું હશે અને જે દેશનાં લોકોનો અધિક સંતોષ ઓછો હોય તેઓનું જીવન ધોરણ સ્ત્રીયું રહેશે.

૫. એડમ સ્થિથના મૂલ્યના ખ્યાલને સમજાવવામાં ઉપયોગી : એડમ સ્થિથે મૂલ્યના બે પ્રકારો પાડ્યા છે. જેવા કે, ઉપયોગીતા મૂલ્ય અને વિનિમ્યોગ મૂલ્ય. આ ખ્યાલને સમજાવવા ગ્રાહકના અધિક સંતોષનો ખ્યાલ મહત્વારી છે.

(૪) મર્યાદા :

૧. નાણાંનો સીમાંત તુલિંગુણ સ્થિર રહેતો નથી : ગ્રાહકનાં અધિક સંતોષનો ખ્યાલમાં નાણાંનાં સીમાંત તુલિંગુણને સ્થિર પારવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવમાં નાણાંનો સીમાંત તુલિંગુણ સ્થિર રહેતો નથી. જેમ કે, કોઈ એક ધનિક વ્યક્તિ માટે અને કોઈ એક ગરીબ વ્યક્તિ માટે એક રૂપિયાનું મહત્વ સમાન હોતું નથી. આવી આ પોટી ધારણા પર રચાયેલ ગ્રાહકનાં અધિક સંતોષનો ખ્યાલ મર્યાદિત બને છે.

૨. પ્રાથમિક જરૂરિયાતોના સંદર્ભમાં : જીવન જરૂરિયાતની પ્રાથમિક વસ્તુઓના

સંદર્ભમાં આ ખ્યાલ આંભક બને છે. જેમ કે, જીવન જરૂરિયાતની વસ્તુની ખરીદી માટે ગ્રાહક ગમે તેટલી ઊંચી કિમત ચૂકવવા તૈયાર હોય છે અને જો આ વસ્તુ નીચી કિમતે પ્રાપ્ત થાય તો ગ્રાહકને ખૂબ અધિક સંતોષ મળે છે, તેમ ન કહેવાય. દા.ત. કોઈ એક તરસી વ્યક્તિ પાણીના એક ગ્લાસ માટે અનંત નાણાં ચૂકવવા તૈયાર હોય અને હિક્કતે તેને વિના મૂલ્યે પાણીનો ગ્લાસ મળે તો આ વ્યક્તિને પાણીના એક ગ્લાસમાંથી અનંત અધિક સંતોષ મળ્યો તેમ કહેવું આંભક છે.

૩. તુણિગુણને સંચાતમક રીતે માપી શકાતો નથી : ગ્રાહકના અધિક સંતોષના ખ્યાલમાં તુણિગુણને ચોક્કસ માપી શકાય છે, તેવી રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તુણિગુણ એ આત્મલક્ષી ખ્યાલ છે. તેને ચોક્કસ માપી શકાતો નથી. માત્ર એટલું જ કહી શકાય કે એક વસ્તુની તુલનાએ બીજી વસ્તુમાં વધુ કે ઓછો તુણિગુણ પ્રાપ્ત થાય છે.

૪. રિવાજુ વસ્તુમાં ગ્રાહકનાં અધિક સંતોષનો ખ્યાલ અવ્યવહારને છે : કારણ કે રિવાજ વસ્તુઓ એવી હોય છે કે તે લોકો ઈચ્છે કે ન ઈચ્છે પરંતુ તેને ખરીદવી પડતી હોય છે. આથી તેને તેમાં અધિક સંતોષ પ્રાપ્ત થતો નથી. જો ગ્રાહક રિવાજ મુજબ કાર્ય ન કરે તો તેને સંતોષ થશે નહિ. આથી આવી વસ્તુની બાબતમાં ગ્રાહકના અધિક સંતોષનો ખ્યાલ અવ્યવહારને છે.

૫. મોજશોખની વસ્તુમાં ગ્રાહકના અધિક સંતોષનો ખ્યાલ મર્યાદિત નિષ્પત્ત છે : ગ્રાહકના અધિક સંતોષમાં એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે વસ્તુની કિમત ઘટે છે ત્યારે, તેમાં અધિક સંતોષ વધે છે. પરંતુ મોજશોખની વસ્તુમાં જોઈએ તો એમ વસ્તુની કિમત ઘટે છે, તેમ તેનું પ્રતિષ્ઠા મૂલ્ય ઘટે છે. પરિણામે તેમાંથી મળતો અધિક સંતોષ ઘટે છે. આથી અહીં ગ્રાહકના અધિક સંતોષનો ખ્યાલ ઓટો પડે છે.

૬. સેખુઅલસનના મતે આ સિદ્ધાંત માત્ર સૈદ્ધાંતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનો છે. પરંતુ વ્યવહારમાં ધારીવાર અવાસ્તવિક પરિણામ તરફ દોરી જાય તેવું બને છે.

## પ્ર-૬ માંગ અને પુરવઠોનો અર્થ - પુરવઠો અને જથ્થો.

### માંગનો અર્થ

સામાન્ય વ્યવહારમાં 'માંગ' અને 'ઈચ્છા' વચ્ચે આપણે કોઈ તફાવત જોતા નથી. પરંતુ અર્થશાસ્ત્રમાં 'માંગ' અને 'ઈચ્છા' વચ્ચે તફાવત છે. અર્થશાસ્ત્રમાં દરેક ઈચ્છા એવેલે માંગ નહીં, પરંતુ અસરકારક ઈચ્છા એવેલે માંગ. નીચેની ચાર શરતોનું પાલન થાય તો ઈચ્છા અસરકારક ઈચ્છામાં પરિણામે છે અને તે માંગ કહેવાય છે :

- (1) કોઈ એક વસ્તુ મેળવવાની ઈચ્છા હોવી જોઈએ.
- (2) તે ખરીદવા જેટલી ખરીદશક્તિ એવેલે કે તેટલું નાણું હોવું જોઈએ.
- (3) ખરીદવા જેટલું નાણું હોય તો તે ખર્ચ કરવાની તૈયારી હોવી જોઈએ.
- (4) વસ્તુની પ્રાપ્તા કે ઉપલબ્ધતા હોવી જોઈએ.

આમ વસ્તુની ઈચ્છા ઉપરાંત વસ્તુ ખરીદવાની શક્તિ તેમજ તૈયારી હોય અને વસ્તુ બજારમાં પ્રાપ્ત હોય તારે તેને માંગ કહી શકાય. વસ્તુની ઈચ્છા હોય પરંતુ ખરીદવાની શક્તિ ન હોય તો તે માંગ બની શકતી નથી. દા. ત. કોઈ બિભાગીને મોટરની ઈચ્છા છે પરંતુ તેની પાસે ખરીદશક્તિ નથી તેથી તેની ઈચ્છા એ માંગ નથી. તેવી જ રીતે વસ્તુની ઈચ્છા હોય, ખરીદશક્તિ પણ હોય પરંતુ ખરીદવાની તૈયારી ન હોય તો પણ તેને માંગ કહી શકાય નહીં. જેમ કે કોઈ ધનિક કંજૂસને મોટરની ઈચ્છા છે અને મોટર ખરીદવાની તેની શક્તિ પણ છે પરંતુ મોટર ખરીદવાની તેની તૈયારી ન હોય તો તેની ઈચ્છા તેમજ ખરીદશક્તિને માંગ કહી શકાય નહિ. આથી અર્થશાસ્ત્રમાં માંગ = ઈચ્છા + ખરીદવાની શક્તિ + ખરીદવાની તૈયારી + વસ્તુની પ્રાપ્તા.

### (II) માંગનો સંદર્ભ :

વસ્તુની માંગને વસ્તુની ડિમત, સમય તથા સ્થળનો અનિવાર્ય સંદર્ભ છે. કારણ કે વસ્તુની ઈચ્છા, ખરીદશક્તિ તથા ખરીદવાની તૈયારીનો આધાર વસ્તુની ડિમત; સમય તથા સ્થળ પર રહેલો છે. આથી, ડિમત, સમય અને સ્થળના સંદર્ભમાં માંગનો ઘ્યાલ રહ્યો થાય છે.

વસ્તુની ડિમત જેમ જુદી તેમ વસ્તુની માંગ પણ જુદી હોય છે. જેમ ડિમત ઊચી તેમ માંગ ઓછી અને જેમ ડિમત ઓછી તેમ માંગ વધુ હોય છે. આમ, માંગનો આધાર ડિમત ઉપર રહેલો છે. વસ્તુની અમુક માંગ છે તેનો અર્થ એવો થશે કે અમુક ડિમતે અમુક માંગ છે. જેમ કે, કોઈ એક કુટુંબની દૂધની માસિક માંગ 60 લિટર છે તેમ કહેવું હોય તો દૂધની ડિમત પણ દર્શાવવી જોઈએ. કારણ કે જુદી જુદી ડિમતે માંગ જુદી જુદી હોય છે. જો દૂધની ડિમત લિટરના 10 રૂપિયા હોય તો માસિક 60 લિટર માંગ છે અને ડિમત લિટરના 12 રૂપિયા હોય તો માસિક 40 લિટર માંગ છે તેમ કહી શકાય. આમ, વસ્તુની માંગનો વસ્તુની ડિમત સાથે અનિવાર્ય સંદર્ભ છે. ડિમતના સંદર્ભ વગર માંગનો કોઈ અર્થ નથી.

વસ્તુની માંગને વસ્તુના સમય તથા સ્થળ સાથે સંદર્ભ છે. જુદા જુદા સમયે માંગ જુદી જુદી હોય છે જેમ કે શિપાણામાં ગરમ પીજાંની માંગ વધુ હોય છે અને ઠડા પીજાંની માંગ ઓછી હોય છે. તો ઊનાળામાં ગરમ પીજાંની માંગ ઓછી હોય છે અને ઠડા પીજાંની માંગ વધુ હોય છે. આમ, માંગને સમયનો પણ સંદર્ભ છે. ઉપરાંત જુદા જુદા સ્થળે માંગ જુદી જુદી હોય છે. જેમ કે જ્યાં વીજળી સુલભ હોય ત્યાં વીજળીના પંપા અને અન્ય વીજળીથી ચાલતાં ઉપકરણોની માંગ હોઈ શકે અને જ્યાં વીજળી સુલભ નથી તેવા દૂરના નાનાં ગમડાંઓમાં પંપા કે અન્ય વીજળીથી ચાલતાં ઉપકરણોની માંગ હોઈ શકે નહિ. આમ, માંગ સાથે સ્થળનો પણ સંદર્ભ છે.

આથી, કોઈ એક નિયત કિમતે, નિયત સમયે અને નિયત સ્થળે વસ્તુનો જેટલો જ્યાં ખરીદવામાં આવતો હોય તેને વસ્તુની માંગ તરીકે ઘોળાયી શકાય.

## [6] પુરવઠો

### (I) અર્થ :

સામાન્ય વ્યવહારમાં લોકો વસ્તુનું જેટલું ઉત્પાદન થાય તેને પુરવઠો કહે છે. પરંતુ અર્થશાસ્ત્રમાં પુરવઠાનો તે અર્થ સ્પીકારવામાં આવતો નથી. ઉત્પાદન અને પુરવઠો બન્ને જુદાં છે. ઉત્પાદક કે વેચનાર હંમેશાં બધું જ ઉત્પાદન બજારમાં વેચવા માટે મૂકવા તૈયાર હોતા નથી. કેટલીક વખત તે ઉત્પાદનમાંથી અમુક જ્યાંથી સંગ્રહાનું ચોગ્ય ગણે છે તો કેટલીક વખત ચાલુ ઉત્પાદન ઉપરાંત ભૂતકાળમાં કરેલા સંગ્રહમાંથી પણ તે કેટલો ભાગ બજારમાં વેચાણ માટે મૂકે છે. આ રીતે એમ કહી શકાય કે પુરવઠો એટલે ઉત્પાદક જ્યાં બજારમાં ચાલુ કિમતે વેચાણ માટે મૂકવા તૈયાર હોય તે.

રિચાર્ડ ઝ. વિફીના મંત્ર્ય અનુસાર પણ 'વસ્તુનો પુરવઠો એટલે વસ્તુનો એ જ્યાં કે ઉત્પાદકો વેચવા માટે શક્તિમાન હોય અને તૈયાર પણ હોય.'

વસ્તુના પુરવઠાને વસ્તુની કિમત સાથે અનિવાર્ય સંબંધ છે. કોઈ એક સમયે વસ્તુનો પુરવઠો કેટલો છે તેનો આધાર વસ્તુની કિમત ઉપર રહેલો છે. જો એમ કહેવામાં આવે કે બજારમાં 1000 ડિવન્ટલ ધર્ણનો પુરવઠો છે તો તેનો કોઈ અર્થ નથી કારણ કે જુદી જુદી કિમતે પુરવઠો જુદી જુદી હોય છે. આથી કિમતનો સંદર્ભ આપી પુરવઠા અંગે વિધાન કરવું જોઈએ. જેમ કે 600 રૂપિયાના ડિવન્ટલની કિમતે 1000 ડિવન્ટલ ધર્ણનો પુરવઠો છે. તે જ રીતે સમયના નિર્દેશ વિના પુરવઠા વિષેની રજૂઆત અપૂરતી બને છે કારણ કે સમયનું પરિણામ પુરવઠા પર અસર કરે જ છે. જુદા જુદા સમયે પુરવઠો જુદો જુદો હોય છે. આથી પુરવઠાની રજૂઆત સમયના સંદર્ભમાં કરવી જોઈએ. જેમ કે અમુક દિવસે તે મહિને 600 રૂપિયાના ડિવન્ટલની કિમતે 1000 ડિવન્ટલ ધર્ણનો પુરવઠો છે. આમ, કોઈ પણ વસ્તુનો પુરવઠો એટલે અમુક સમયે, અમુક કિમતે ઉત્પાદક કે વેચનારની તે વસ્તુ વેચવાની તૈયારી.

### (II) જ્યાં અને પુરવઠા વચ્ચે લેણ :

સામાન્ય વ્યવહારમાં જ્યાં અને પુરવઠા વચ્ચે કોઈ લોદ માનવામાં આવતો નથી. પરંતુ અર્થશાસ્ત્રમાં તે બન્ને વચ્ચે તહીવત છે. કોઈ પણ વસ્તુનું જેટલું ઉત્પાદન થાય તેને

તે વસ્તુનો જથ્યો કહેવાય છે. આ જથ્યામાંથી કેટલો ભાગ અમુક સમયે, અમુક ડિમતે બજારમાં વેચાશુ માટે મૂકવામાં આવે તેને તે વસ્તુનો પુરવઠો કહેવાય છે. વસ્તુનો જથ્યો અને પુરવઠો સરપા હોઈ શકે, અથવા તો વસ્તુના જથ્યા કરતાં પુરવઠો ઓછો હોઈ શકે. પરંતુ વસ્તુના જથ્યા કરતાં પુરવઠો વધુ હોઈ શકે નહિ.

વસ્તુના જથ્યામાંથી કેટલો ડિસો વેપારીઓ વેચવા તૈયાર છે તેનો આધાર વસ્તુની ડિમત પર રહેલો છે. વસ્તુની ડિમત ઊચી હોય તો વધુ જથ્યો અને ડિમત નીચી હોય તો ઓછો જથ્યો વેચવા તૈયાર થાય છે. દા. ત., બજારમાં વેપારીઓ પાસે કેરોસીનનાં દસહજાર ડલ્બાઓનો જથ્યો છે અને કેરોસીનના ડલ્બાની ડિમત 250 રૂપિયા છે, તો તે ડિમતે વેપારીઓ દસહજાર ડલ્બા વેચવા તૈયાર છે. આથી જથ્યો અને પુરવઠો બન્ને સરપા છે. પરંતુ ધરો કે એક ડલ્બાની ડિમત ઘટીને 200 રૂ. થઈ જાય છે. તો તે ડિમતે વેપારીઓ સાતહજાર ડલ્બા વેચવા તૈયાર થાય છે. આમ, જથ્યા કરતાં પુરવઠો ઓછો હોઈ શકે. જો વસ્તુ ટકાઉ હોય તો જ તેના જથ્યા કરતાં પુરવઠો ઓછો હોઈ શકે છે. કારણ કે ટકાઉ વસ્તુનો સંગ્રહ થઈ શકે છે પરંતુ જો વસ્તુ નાશવંત હોય તો જથ્યો અને પુરવઠો સરપા હોય છે. કારણ કે નાશવંત વસ્તુનો સંગ્રહ થઈ શકતો નહીં હોવાથી વેપારીની પાસે જેટલો જથ્યો હોય તે સમગ્ર જથ્યાને વેચી નામવો પડે છે. આથી, વસ્તુની જે ડિમત પ્રવર્તતી હોય તે ડિમતે સમગ્ર જથ્યો વેચવા તૈયાર હોય છે. આમ, નાશવંત વસ્તુના જથ્યા અને તેના પુરવઠા વચ્ચે હોઈ તકાવત હોતો નથી.

## પુરવઠો અને જથ્થો.

સામાન્ય રીતે જથ્થા અને પુરવઠા ને સમાન માનવામાં આવે છે પણ તે જુદા છે.

પુરવઠો.

ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનના જે ભાગ વેચવાની હોયા , શક્તિ અને તયારી દર્શાવે તેને પુરવઠો કહેવાય.

જથ્થો.

જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ.

વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય તથા વેચવાની તૈયારી ન હોય તેવા વસ્તુના તમામ એકમોનું પ્રમાણ એટલે જથ્થો.

વસ્તુ નાતમામ એકમો વર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તો જથ્થો અને પુરવઠો જુદા પડે છે. દા.ત. ઉત્પાદક પાસે વસ્તુના 500 એકમ છે તેમાંથી પ્રવર્તમાન કિંમતે તે 300 એકમ વેચવા તૈયાર થાય છે. તો પુરવઠો 300 એકમ થયો ગણાય.

આમ ઉત્પાદક કે વેપારી ની વસ્તુ વેચવાની શક્તિ એ જથ્થો છે. અને પ્રવર્તમાન કિંમતે વેચવાની શક્તિ અને તૈયારી એ પુરવઠો છે.

આમ જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. પુરવઠો જથ્થા કરતા ઓછો હોઈ શકે છે. કારણ કે અગાઉના ઉત્પાદનમાંથી ન વેચાયેલા એકમો પણ જથ્થામાં સમાવિષ્ટ થાય છે.

વ્યવહારીક રીતે કહ્યે તો વ્યાપારી પાસે દુકાનમાં કે ગોડાઉનમાં વસ્તુના વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો અને તેમાંથી પ્રવર્તમાન કિંમતે વેચવાની તૈયારી અને હીથા એટલે પુરવઠો.

## UNIT - 2

### Demand Analysis and Consumer Behavior (માંગ વિશ્લેષણ અને ગ્રાહકવર્તન)

- ❖ માંગ વિધેય- માંગનો નિયમ- માંગનાં નિર્ણયકો (અસર કરતા પરિબળો)
- ❖ માંગની મુલ્યસાપેક્ષતા, માંગની આવક સાપેક્ષતા, માંગની પ્રતિમુલ્ય સાપેક્ષતા.(અર્થ & પ્રકારો)
- ❖ માંગના પ્રકારો:- (વ્યક્તિગત માંગ & બજારમાંગ, ઉદ્યોગ & પેઢીની માંગ, વપરાશી વસ્તુઓની માંગ & ઉત્પાદક વસ્તુઓની માંગ)
- ❖ ટકાવ વસ્તુની માંગ અને બિન ટકાવ વસ્તુઓની માંગ.

## UNIT - 2

### માંગ વિશ્લેષણ અને ગ્રાહકવર્તન

**પ્ર - ૧ માંગ વિષેય :**

આશ્વિ માંગના નિયમમાં વસ્તુની ડિમ્યત અને વસ્તુની માંગ વચ્ચે વ્યાત્ત સંબંધ સમજાવેલ છે. માંગ વિષેય એક ગાણિતિક ઘણાલ છે. માંગના નિયમમાં ડિમ્યત સિવાયના પરિબળોને સ્થિર ખારેલા છે તેથી વસ્તુની માંગને માત્ર ડિમ્યતના ફેરફારો પર આધારિત હોય ત્યારે માંગ વિષેય નીચે મુજબ દર્શાવી શકાય.

$$x = F(P)$$

જ્યાં,  $x$  = વસ્તુની માંગ

$F$  = વિષેયની સંખ્યા

$P$  = વસ્તુની ડિમ્યત

માંગના નિયમને વિષેયના સ્વરૂપમાં ફેન્ચ અર્થશાસ્ત્રી કોન્ટોટને 1838માં ૨જૂ કરેલ માંગને અસર કરનાર પરિબળોમાં ડિમ્યત સિવાયના પરિબળો પણ છે. કોઈ પણ વસ્તુની માંગ માત્ર ડિમ્યત પર આધારિત નથી, ડિમ્યત સિવાયના પરિબળો પણ માંગને અસર કરે છે. જેમ કે, ગ્રાહકોની આવક, ગ્રાહકોની સંખ્યા, ગ્રાહકોની અભિસુધિ, અન્ય વસ્તુના ભાવ વગેરે બાબતો વસ્તુની માંગને અસર કરે છે. આ અન્ય પરિબળો ઘાનમાં લઈને માંગ વિષેય નીચે પ્રમાણે ૨જૂ કરી શકાય.

$$D_x = F(P, C, I, O, U, E, W)$$

જ્યાં,  $D_x$  = વસ્તુની માંગ

$F$  = વિષેયની સંખ્યા

$P$  = વસ્તુની ડિમ્યત

$C$  = ગ્રાહકોની સંખ્યા

$I$  = ગ્રાહકોની આવક

$O$  = અન્ય વસ્તુના ભાવો (અનેક વસ્તુ અને પૂરક વસ્તુઓના)


$U$  = ગ્રાહકોની પસંદગી અને અભિસુધિ

$E$  = ભવિષ્યના ભાવો માંગની અટકળો

$W$  = અન્ય પરિબળો

માંગ વિષેયને સમીકરણમાં દર્શાવેલ પરિબળો અસર કરે છે. વસ્તુ કે સેવાની માંગ માત્ર તેની ડિમ્યત દારા નક્કી થતી નથી પણ ઉપર ૨જૂ કરેલ પરિબળો પણ અસર કરે છે. જેમાં અન્ય પરિબળો જેવાં કે જાહેરખબરો, સરકારની નીતિ કે પોજનાઓ વગેરે.

❖ માંગ વિધેયની આકૃતિ :



આકૃતિમાં DD માંગ વિધેય રેખા છે.

❖ માંગ વિધેયના લક્ષણો :

- (1) માંગ વિધેય કિંમત અને માંગ વચ્ચે વસ્ત સંબંધ રજૂ કરે છે.
- (2) માંગ વિધેયના આધુરે પ્રવર્તમાન કિંમતે વસ્તુની માંગ નિરીખત થાય છે.
- (3) માંગ વિધેય ઘટતું વિધેય છે.
- (4) માંગ વિધેયની રેખાનો ઋણ ઢાળ હોય છે.

## પ્ર - ૨ માંગનો અર્થ અને માંગનો નિયમ :

### ❖ પ્રસ્તાવના :

અર્થશાખ એક સામાજિક વિજ્ઞાન છે. જેમાં માહિતીનું એક્સ્પ્રીક્શન અને મેળવેલ માહિતીનું વિશ્વેષણ કરવામાં આવે છે. વિશ્વેષણના અંતે તારણો કાઢવામાં આવે છે. જે તારણો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. સિદ્ધાંત એટલે વાસ્તવિકતાનું વ્યવસ્થિત રીતે નિરૂપણ કરતું. નિયમમાં કાર્યકારણનો સંબંધ પ્રસ્થાપિત થયેલો હોય છે. માંગનો નિયમ પણ આવો સિદ્ધાંત છે. જે અર્થશાખમાં મહત્વના ગણાતા નિયમોમાંથી એક છે.

### ❖ માંગનો અર્થ :

સામાન્ય રીતે વ્યક્તિઓની ઈચ્છાઓને માંગ તરીકે ઓળખવામાં આવે છે. અર્થશાખમાં માંગ શરૂનો વિશિષ્ટ અર્થ કરવામાં આવે છે. અર્થશાખમાં માંગ શરૂને નીચે પ્રમાણે સમજીવવામાં આવે છે.

"માંગ એટલે અમુક નિશ્ચિત સમયગાળા દરમિયાન પ્રવર્ત્તમાન કિંમતે (અથવા નિશ્ચિત કિંમતે) વ્યક્તિની વસ્તુઓ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી."

ઉપરોક્ત ૨૩૭ કરેલ માંગ શરૂના અર્થમાં મુખ્યત્વે ત્રણ બાબતોને ધ્યાનમાં લીધેલ છે. એટલે કે તે ત્રણેય બાબતોનું પાલન થાય તો જ માંગ બને છે.

- (1) ઈચ્છા : વ્યક્તિની ખરીદશક્તિ હોય, તૈયારી હોય પણ જો તે વસ્તુ મેળવવાની તેની ઈચ્છા ન હોય તો માંગ ઉભી થતી નથી.
- (2) શક્તિ : વ્યક્તિને વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય, તૈયારી હોય પણ વસ્તુ મેળવવા માટે તેની પાસે જરૂરી નાણાં ન હોય તો તે માંગ બનતી નથી.
- (3) તૈયારી : વ્યક્તિને ઈચ્છા હોય, વસ્તુ ખરીદવા તેની પાસે નાણાં હોય પણ નાણું ખર્ચ કરવાની તેની તૈયારી ન હોય તો પણ માંગ ઉભી થતી નથી.

ઉપરોક્ત ગ્રંથાને બાબતો એકસાથે સંતોષાય તો જ માંગ બને છે. આમ ટૂંકમાં, કહીએ તો

$$\text{માંગ} = \text{ઈંદ્રજિત} + \text{શક્તિ} + \text{તેપારી}$$

❖ માંગનો નિયમ :

માંગના નિયમની રજૂઆત અર્થશાલી પ્રો. માર્શલે કરી છે. તેમણે રજૂ કરેલ માંગના નિયમને આ પ્રમાણે દર્શાવી શકાય.

“અન્ય પરિબળો યથાવતુ (સ્થિર) રહેતાં વસ્તુની કિંમતમાં વધારો થતાં વસ્તુની માંગમાં સંકોચન (ઘટાડો) થાય છે અને વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં માંગનું વિસ્તરણ (વધારો) થાય છે.”

માર્શલે રજૂ કરેલ ઉપરોક્ત નિયમમાં કિંમત અને માંગ વચ્ચે વસ્ત સંબંધ રજૂ કરેલ છે. એટલે કે કિંમત અને માંગ બંને વચ્ચે પરસ્પર વિરોધી સંબંધે રહેલા છે. આઈ આગળ કિંમતમાં ફેરફાર એ કારણ છે અને માંગમાં ફેરફાર એ પરિણામ છે. માંગના નિયમને સમજવા માટે માર્શલી કેટલીક ધારણાઓ કરેલી છે. આ ધારણાઓમાંથી મોટા ભાગની ધારણા સાચી ન પડે તો માંગનો નિયમ સાચો ઠરતો નથી. આ ધારણાઓ નીચે પ્રમાણે છે.

❖ માંગના નિયમની ધારણાઓ :

માંગના નિયમની ધારણાઓ નીચે પ્રમાણે રજૂ કરી શકાય.

(1) ગ્રાહકોની સંખ્યા સ્થિર રહે છે :

વસ્તુઓની કિંમતો વધે તેની સાથે જે ગ્રાહકોની સંખ્યા પણ વધતી હોય, તો વસ્તુની કિંમત વધવા છતાં વસ્તુની માંગમાં ઘટાડો કે સંકોચન થતું નથી. જે બાબત નિયમથી વિરુદ્ધ જોવા મળે છે. જે નિયમને સાચો બનાવવો હોય, તો ગ્રાહકોની સંખ્યાને સ્થિર રાખેલી પડે છે.

(2) ગ્રાહકોની આવક સ્થિર રહે છે :

કિંમત અને માંગ વચ્ચે રહેલો વસ્ત સંબંધ ત્યારે જ સાચો ગજાય છે કે જ્યારે ગ્રાહકોની આવકો પણ સ્થિર રહે. કિંમતો વધવાની સાથે જ જે ગ્રાહકોની આવકોમાં પણ વધારો થતો હોય તો વસ્તુઓની માંગમાં ઘટાડો થવાને બદલે વધારો થાય છે. જે માંગના નિયમને ખોટો બનાવે છે. આમ,

વસ્તુની માંગ પર માત્ર કિમતોના ફેરફારોને તપાસવા હોય તો ગ્રાહકોની આવકોને સ્થિર રાખવી પડે છે.

(3) ગ્રાહકોની અભિરુચિ, પસંદગી અને ટેવો સ્થિર રહે છે :

ગ્રાહકો જે વસ્તુઓની વપરાશ કરતા હોય તે વસ્તુઓ પ્રત્યેની તેમની અભિરુચિ અને પસંદગી બદલાવી જોઈએ નથી. જો વસ્તુઓની કિમતો વધવા સાથે ગ્રાહકોની પસંદગી તે જ વસ્તુઓ માટે વધતી હોય, તો કિમત વધવા છતાં વસ્તુની માંગમાં ઘટાડો થતો નથી. આમ, માંગના નિયમને સમજવા માટે ગ્રાહકોની પસંદગી, ટેવો, પરિબળો સ્થિર રહેવાં જોઈએ.

(4) અન્ય વસ્તુઓના ભાવો સ્થિર રહેવા જોઈએ :

જે તે વસ્તુઓની અવેજ તેમજ પુરક વસ્તુઓ કણી શકાય તેવી વસ્તુઓના ભાવો સ્થિર રહેવા જોઈએ. જો અવેજ અને પુરક વસ્તુઓની કિમતો બદલાતી હોય તો માંગનો નિયમ સાચો જણાતો નથી. તેથી અન્ય વસ્તુઓના ભાવોને સ્થિર ધારવામાં આવે છે.

(5) ભવિષ્યના ભાવોની અટકળો/અફવાઓની ગેરહાજરી :

ભવિષ્યમાં વસ્તુઓના ભાવો વધશે/ઘટશે તેવા પ્રકારના અંદાજો/આગાહીઓ થતી નથી તેવી ધારણા માંગના નિયમને સાચો બનાવવા માટે કરેલી છે. એટલે કે અર્થતંત્રમાં કિમતોના પરિવર્તનો વિશેના કોઈ પણ ફેરફારોથી અટકળો થતી જોવા મળતી નથી.

જે ભવિષ્યમાં ભાવો વધવાના છે તેવી અફવા ગ્રાહકોમાં ફેલાય તો વર્તમાનમાં ભાવો વધ્યા હોવા છતાં વસ્તુની માંગમાં વધારો જોવા મળે છે.


❖ માંગના નિયમની અનુસૂચિ દ્વારા/ઉદાહરણ દ્વારા સમજૂતી :

માંગના નિયમને માંગની અનુસૂચિ દ્વારા સમજવી શકાય છે. માંગની અનુસૂચિ એટલે કોઈ પણ ગ્રાહક ચોક્કસ સમયગાળા દરમિયાન ક્યા ક્યા ભાવોએ કેટલા કેટલા પ્રમાણમાં વસ્તુઓ ખરીદવાની શક્તિ/વૃત્તિ પરાવે છે તે દર્શાવતી વિગતને માંગની અનુસૂચિ કહેવામાં આવે છે. માંગની કાલ્યાનિક અનુસૂચિ નીચે પ્રમાણે રજૂ કરી શકાય.

### માંગની અનુસૂચિ :

વસ્તુઓની કિંમત (રૂ. માં)	વસ્તુઓની માંગ (એકમમાં)
10	500
20	400
30	300
40	200
50	100

ઉપરોક્ત અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે 10 રૂપિયા કિંમત હતી ત્યારે માંગ સૌથી વધારે છે. એટલે કે 500 એકમ છે. કિંમતમાં જેમ જેમ વધારો થતો જાય છે તેમ તેમ માંગમાં ઘટાડો થતો જાય છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે 10 રૂપિયાની કિંમત વધીને અનુક્રમે 20, 30, 40 અને 50 રૂ. થાય છે ત્યારે માંગ ઘંટીને અનુક્રમે 400, 300, 200 અને 100 એકમ થાય છે. જે બાબત દર્શાવે છે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત/વિરોધી સંબંધ રહેલો છે. આ જ બાબતને આપ્યું દારા નીચે પ્રમાણે રજૂ કરી શકાય.



ઉપરની આકૃતિમાં OX આડી ધરી ઉપર વસ્તુની માંગ એકમમાં દરશવિલ છે અને OY ઉભી ધરી ઉપર વસ્તુઓની કિમત રૂ.માં દરશવિલ છે. CD એ માંગ રેખા છે. જે કિમતમાં વધારો થતાં માંગમાં ઘટાડો (સંકોચન) અને કિમતમાં ઘટાડો થતાં માંગમાં વધારો (વિસ્તરણ) દરશવે છે. આમ કિમત અને માંગ વચ્ચે બસ્તા/વિરોધી સંબંધ દરશવિ છે. જેને કારણે માંગની રેખા ઝડપ ઢાળ પરાવે છે.

#### ❖ માંગના નિયમના અપવાદો :

માંગનો નિયમ જે વસ્તુ અથવા જે પરિસ્થિતિને લાગુ પાડી શકતો નથી તેને માંગના નિયમના અપવાદો તરીકે ઓળખવામાં આવે છે. માંગના નિયમના અપવાદો નીચે પ્રમાણે છે.

#### (1) હલકી અને ગીફન વસ્તુઓ :

હલકા પ્રકારની વસ્તુના સંદર્ભમાં આ નિયમ કામ કરતો નથી. જેમ કે, ભારતમાં જુવાર, બાજરી, બરછટ, કાપડ વગેરે હલકી વસ્તુઓ ગણાય છે. જો આવી વસ્તુઓની કિમતો ઘટે તો ગ્રાહકની વાતાવિક આવકમાં વધારો થાય છે. જેને કારણે ગ્રાહકો હલકી વસ્તુઓની ખરીદી ઘટાડીને અધ્યવા તો તેને સ્થિર ચાખીને સામાન્ય વસ્તુની ખરીદીમાં વધારો કરે છે. આમ, હલકી વસ્તુના ભાવોમાં ઘટાડો થતાં તેની માંગ વધતી નથી.

#### (2) પ્રતિષ્ઠા મૂલ્યવાળી ચીજવસ્તુઓ :

કેટલીક વસ્તુઓની વપરાશથી ગ્રાહકોની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થતો હોય છે. દા.ત. હીરા, માણેક, જવેરાત જેવી વસ્તુઓને પ્રતિષ્ઠા-મૂલ્ય વસ્તુઓ ગણવામાં આવે છે. આ વસ્તુઓ જેમ મૌંધી (ભાવ વધારે) તેમ ધનિક લોકો દેખાવ કરવા માટે પ્રતિષ્ઠા વધારવા માટે તેની માંગ વધારે છે.

જો વસ્તુઓ સર્સી બની જાય તો સામાન્ય વ્યક્તિઓ પણ તેની ખરીદી કરી શકે છે. તેથી ધનિકોની પ્રતિષ્ઠા રહેતી નથી. આમ, આવી વસ્તુઓની કિમત વધારે તેમ માંગ વધે છે. તેને માંગના નિયમનો અપવાદ કરી શકાય.

#### (3) ગ્રાહકોમાં અશાન :

કેટલીક વખત ગ્રાહકો વસ્તુની ગુણવત્તા અને વસ્તુઓના કિમત બાબતે અશાન હોય છે. ઊંચી કિમતે વસ્તુઓ સારી ગુણવત્તાવાળી મળે તેવું ગ્રાહકો

સમજે છે. તેથી વસ્તુઓની ઉંચી કિંમતે વસ્તુઓની માંગ ઘટવાને બદલે વધતી જોવા મળે છે. આ પ્રકારના વલણને માંગના નિયમનો અપવાદ કરી શકાય.

#### (4) અફવાઓ અને અટકણો :

જે ગ્રાહકોને એમ લાગે કે વસ્તુના ભાવો બિલિયન્સમાં વધવાના છે તો ગ્રાહકો નીચા ભાવે પણ વસ્તુઓની ખરીદી વધારે છે. બિલિયન્સમાં ભાવો ઘટવાના છે તેવી અફવાઓ ચાલતી હોય તો વર્તમાનમાં ભાવોમાં ઘટાડો કરવા છતાં માંગમાં વધારો કરી શકતો નથી.

આમ, માંગના નિયમના અપવાદો એવા હોય છે કે જે ગ્રાહકના વર્તનને માંગના નિયમની વિરુદ્ધ વર્તન કરવા પ્રેરે છે.

→ માંગનું વિસ્તરણ, સંકોચન અને માંગનો વધારો-ઘટાડો :

વસ્તુ અંગેની માંગ બે રીતે થાય છે. વ્યક્તિગત માંગ અને બજારમાંગ. કોઈ પણ ચીજવસ્તુની કોઈ પણ વ્યક્તિ દ્વારા ખરીદી થાય ત્યારે તેને વ્યક્તિગત માંગ કહેવાય છે. એટલે કે કોઈ પણ એક ગ્રાહકનો ખરીદી, વિશેનો નિર્ણય એ વ્યક્તિગત માંગ ઉભી કરે છે. જ્યારે બજારમાંગ અનેક ગ્રાહકો દ્વારા વસ્તુઓની માંગ થાય છે ત્યારે તેને બજારમાંગ તરીકે ઓળખવામાં આવે છે. આ બજારમાંગ રેખાને માર્શલી માંગના નિયમ દ્વારા સમજાવેલ છે. બજારમાંગ રેખા દીરતી વખતે અન્ય પરિબળોને સ્થિર ધારી લીધેલ છે. માંગ બે પ્રકારના પરિબળો ઉભા કરે છે.

(1) માંગમાં વિસ્તરણ અને સંકોચન અને

(2) માંગમાં વધારો અને ઘટાડો.


આ બંને પરિબળો આદૃતિની મદદથી નીચે પ્રમાણે સમજાવી શકાય.

(1) માંગમાં વિસ્તરણ અને સંકોચન :

સામાન્ય રીતે માંગમાં વધારો થાય ત્યારે તેને વિસ્તરણ અને માંગમાં ઘટાડો થાય ત્યારે તેને સંકોચન શર્દદ્યી ઓળખવામાં આવે છે. વિસ્તરણ વધારો અને સંકોચન ઘટાડો આ બંને સમાનાર્થી શર્દી તરીકે સામાન્ય વ્યક્તિ સુમજે છે. પરંતુ અર્થશાલમાં આ દ્રેક શર્દને વિશિષ્ટ અર્થમાં સમજવામાં આવે છે.

અન્ય પરિબળો યથાવત રહેતાં કિંમતમાં ઘટાડો થાય ત્યારે માંગમાં વધારો થાય તેને વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે અને કિંમતમાં

વધારો થતાં માંગમાં જે ઘટાડો થાય છે તેને સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. આમ અહીં આગળ કિમતના ફેરફારને લીધે માંગમાં ફેરફારો થાય છે. જેને વિસ્તરણ-સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. વિસ્તરણ સંકોચનમાં કિમતના ફેરફારો કારણ છે અને માંગના ફેરફારો એ પરિણામ છે. માંગનું વિસ્તરણ-સંકોચન એક જ માંગરેખા ઉપર દર્શાવી શકાય છે. જે નીચેની આદૃતિમાં રજૂ કરેલ છે.



ઉપરની આદૃતિમાં  $OX$  આડી ધરી વસ્તુના એકમ  $OY$  ઉભી ધરી ઉપર વસ્તુની કિમત દર્શાવે છે.  $CD$  એ માંગરેખા છે. જ્યારે વસ્તુની માંગ  $OP$  હોય ત્યારે વસ્તુનોની માંગ  $OQ$  એકમો જેટલી છે. કિમત વધતાં હવે  $OP$  કિમતનો નક્કી થાય છે ત્યારે કિમત વધારાને કારણે માંગમાં સંકોચન થાય છે. તેથી આદૃતિમાં બલાવ્યા પ્રમાણે  $OQ$  થી વધીને  $OQ_1$  થાય છે.


આદૃતિમાં બલાવ્યા પ્રમાણે જ્યારે કિમતોમાં ઘટાડો થાય છે એટલે કે કિમતો  $OP$  થી ધરીને  $OP_2$  થાય છે તેના કારણે માંગમાં વિસ્તરણ થાય છે. જે  $OQ$  થી વધીને  $OQ_2$  થાય છે.

આમ, માંગમાં થતો આ ફેરફાર એક જ માંગરેખા ઉપર દર્શાવી શકાય છે. વાસ્તવમાં માંગનો નિયમ આ જ બાબતની રજૂઆત કરે છે. માંગમાં થતો વધારો-ઘટાડો :

જ્યારે કિમત સિવાયના પરિબળો માંગમાં ફેરફાર લાવતાં હોય ત્યારે તેને માંગમાં વધારો-ઘટાડો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કિમત સિવાયનાં પરિબળો જેવાં કે પ્રાઇકોની સંખ્યામાં વધારો-ઘટાડો, પ્રાઇકોની આવકમાં વધારો, પ્રાઇકની પરસંગળી, અલિન્યુન્ની ટેવોમાં ફેરફારો તેમજ અન્ય વસ્તુનોના ભાવોમાં ફેરફારો થાય તેના કારણે માંગમાં જે ફેરફારો થાય છે તેને માંગમાં વધારો-ઘટાડો શાન્દ દ્વારા ઓળખવામાં આવે છે. આમ,

માંગમાં થતા વધારો ઘટાડાને સમજવા માટે કિંમતને સ્થિર ધારવામાં આવે છે. અન્ય પરિબળોની અસર માંગ ઉપર થાય છે. તે માંગના વધારો-ઘટાડા તરીકે ઓળખવામાં આવે છે.

જો ગ્રાહકોની સંખ્યા કે આવકમાં વધારો થાય તો કિંમત સ્થિર રહેવા છતાં માંગમાં વધારો થાય છે. તેનાથી વિરુદ્ધ જો ગ્રાહકોની સંખ્યામાં કે આવકમાં ઘટાડો થાય તો કિંમતો સ્થિર રહેવા છતાં માંગમાં ઘટાડો થાય છે. આ ગ્રાફના ફેરફારોને આફૂતિમાં બતાવ્યા પ્રમાણે રજૂ કરી શકાય.



આફૂતિમાં બતાવ્યા પ્રમાણે OY પરી ઉપર કિંમત અને OX પરી ઉપર માંગ એકમમાં રજૂ કરેલ છે. આફૂતિમાં દર્શાવ્યા પ્રમાણે OD એ મૂળ માંગ રેખા છે જે OP કિંમતે OQ વસ્તુની માંગ દર્શાવે છે. હવે વસ્તુઓની કિંમતો સ્થિર રહે છે. પરંતુ કિંમત સિવાયનાં પરિબળો જેવાં કે ગ્રાહકોની સંખ્યા, ગ્રાહકોની આવકો, ગ્રાહકોની અભિરુચિ, પસંદગી વગેરે પરિબળોમાં ફેરફારો થાય છે. જેના કારણે માંગમાં ફેરફાર થાય છે.

કિંમત સિવાયના પરિબળોને કારણે માંગમાં વધારો થાય તો માંગરેખા મૂળ માંગરેખા DD ની જમણી બાજુ તરફ ખસે છે. જે આફૂતિમાં D1, D, માંગરેખા દ્વારા દર્શાવેલ છે. જો કિંમત સિવાયના પરિબળોને કારણે માંગમાં ઘટાડો થાય, તો માંગરેખા DD ની ડાબી બાજુ તરફ નીચે ખસે છે. જે આફૂતિમાં D0D0 દ્વારા બતાવવામાં આવી છે.

આમ, માંગનો વધારો અને માંગનો ઘટાડો દર્શાવવા માટે નવી માંગરેખા દોરવી પડે છે, જ્યારે માંગનું વિસ્તારણ-સંકોચણ એક જ માંગરેખા ઉપર દર્શાવી શકાય છે.

## ૫ - ઉમાગના નિર્ણાયકો જણાવો

અથવા

### માંગને અસર કરતા પરિબળો

#### ૩.૨ વસ્તુની માંગને અસર કરતાં પરિબળો (Factors Affecting Demand/Determinants of Demand)

માંગને અસર કરતાં પરિબળો (માંગના નિર્ણાયકો) મુજબ બે છે : (૧) વસ્તુની ડિમાન્ડ (૨) ડિમાન્ડ સિવાપણના પરિબળો (અન્ય પરિબળો).

**૩.૨.૧ વસ્તુની ડિમાન્ડ :** વસ્તુની માંગ પર ગોઠી વધુ અસર કરતાં અને મૂળ જ અગતનું પરિબળ એ જે તે વસ્તુની ડિમાન્ડ છે. કરાસક એમ વસ્તુની ડિમાન્ડ હોય, વસ્તુ સહી બને છે અને તેથી વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે. જ્યારે વસ્તુની ડિમાન્ડ વધતાં, વસ્તુ મૌખી બને છે તેથી માંગ સંકોચન પામે છે. આમ, વસ્તુની ડિમાન્ડ અને વસ્તુની માંગ એકનીકા થાયે વાલતું સંબંધિત છે. એટી કઢી શક્ય કે વસ્તુની ડિમાન્ડ એ વસ્તુની માંગ પર ગોઠી વધુ અસર કરનાર નિર્ણાયક પરિબળ છે.

#### ૩.૨.૨ વસ્તુની ડિમાન્ડ સિવાપણના પરિબળો (અન્ય પરિબળો) :

**૩.૨.૨.૧ વિકિની અભિવૃત્તિ અને પરંદાની :** ગ્રાહકરૂપ વિકિની અભિવૃત્તિ અને પરંદાની વસ્તુની માંગ એપ અસર પાડતાં પરિબળ છે. વિકિનો ગમો-અગુમો, શોષ, પરંદાની વર્ગે વસ્તુની માંગના કેરસાર લાણી સકે છે. એટી કઢી શક્ય કે વસ્તુની માંગ એ વિકિની પરંદાની રક્ખાવે છે. દાત., નાની ઊરે વાચનનો શોષ થોડું હોય તો તે ઊરે વદ્ધતાના વિકિના વાચનનો પ્રકાર બદ્ધાય છે. એમકે નાની ઊરનાં બાબતોને વાતાવર્ણ વાચન, પુના ઊરે નવલક્ષણ અને મૌખી ઊરે ખાર્ફિક પુસ્તકોનું વાચન કરતું જાય છે.

**૩.૨.૨.૨ વિકિની આકાર :** વિકિની આકાર અને વસ્તુની માંગ વચ્ચે ગોઠી સંબંધ છે. એટેટે વિકિની આકાર વિતાની તે વિકિની વસ્તુ પસ્તીદાની શક્તિ વિશે છે અને વસ્તુની માંગ પણ વિશે છે. જ્યારે વિકિની આકાર વિતાના, વિકિની પરીક્ષાદાની ઘણી વિશે વસ્તુની માંગ પણ હોય છે. અહીં નિયમ ગુણવત્તાવાળી વસ્તુઓ અપવાહદૂપ વસ્તુઓ અને છે કરાસ કે આવી વસ્તુઓની માંગ, વિકિની આકારમાં વધારો થવા છાંચ હોય છે.

**૩.૨.૨.૩ સંબંધિત વસ્તુઓની ડિમાન્ડ :** સાપાન્ય રીતે વસ્તુઓને અન્ય વસ્તુઓ સાથે એ પ્રકારના સંબંધો હોય છે : (૧) અવેજાપણાનો સંબંધ (૨) પૂર્કપણાનો સંબંધ. આવા પ્રકારની વસ્તુઓને સંબંધિત વસ્તુ અને તેથી વસ્તુઓની ડિમાન્ડ કહેવામાં આવે છે.

(I) અવેજા વસ્તુની ડિમાન્ડ : એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષપણ માટે વાપરી ગણની હોય તો તેથી વસ્તુઓને અવેજા વસ્તુ કરે છે. આ પ્રકારની વસ્તુઓમાં કિસ્સાઈંજ તાર તીવ્ર (૧૫) હોય છે. દાત., સમાન લાશાલિકાના પણવતા ને કુરુ-કુરુંડી કંપનીના રીતી, બાઈક, કિઝ વરેણે. અહીં મૂળ વસ્તુની ડિમાન્ડ કેરસાર ન પામે અને તેની અવેજા વસ્તુની ડિમાન્ડ વિશે તો, મૂળ વસ્તુ અને અવેજા વસ્તુ એકસારની હોવાની અવેજા વસ્તુ સહી ભનતાં તેની માંગ વિશે છે અને તેથી મૂળ વસ્તુની માંગ હોય છે. આનું વિરુદ્ધ દિલ્લાના કેરસાર વખતે પણ બને છે. કે સ્પષ્ટ કરે છે કે અવેજા વસ્તુની ડિમાન્ડ, મૂળ વસ્તુની માંગને અસર કરે છે.

(II) પૂર્ક વસ્તુની ડિમાન્ડ : પૂર્ક વસ્તુ એટેટે એ તે વસ્તુઓ ઉપયોગ કરાવા માટે જરૂરી એવી બીજી વસ્તુ. આવી વસ્તુઓ હેઠળના એકલીખ સાથે જોડાવેલી હોય છે. એક વસ્તુના વપરાસ માટે બીજી વસ્તુ વાપરની આવસ્થક હોય તો તેથી વસ્તુઓ એકલીખની પૂર્ક વસ્તુ કહેવાય છે. દાત., મોબાઇલ અને સીયર્ટ, એ.સી. અને વીજાલી, બસમાની ફેમ અને તેણા ક્ષેત્ર વરેણે. અહીં મૂળ વસ્તુની ડિમાન્ડનાં કેરસાર ન થાય પણ, પૂર્ક વસ્તુની ડિમાન્ડ વિશે તો, મૂળ વસ્તુ અને પૂર્ક વસ્તુ બંને એકલીખની જોડાવેલ હોવાની પૂર્ક વસ્તુ મૌખી ભનતાં તેની માંગ વટતા મૂળ વસ્તુની માંગ પણ હોય છે. આનું તેનાથી વિરુદ્ધ દિલ્લાના કેરસાર વખતે પણ બને છે. કે સ્પષ્ટ કરે છે કે પૂર્ક વસ્તુની ડિમાન્ડ, મૂળ વસ્તુની માંગને અસર કરે છે.

**૩.૨.૨.૪ ભવિષ્યની ડિમાન્ડ અનેની અટકણો :** વિકિની ભવિષ્યાના વસ્તુઓની ડિમાન્ડ વિશેની અટકણો (અનુભાવ) વર્તમાન સમયના, વસ્તુની માંગના મૌખી કેરસારો લાયે છે. જો વિકિની ભવિષ્યાના વસ્તુની ડિમાન્ડનાં વધાર અનેની અટકણ હોય તો વર્તમાન સમયમાં વસ્તુની માંગ વધારે છે, એટી તે વિકિની ભવિષ્યાના ભયત કરી શકે છે.

3.2.2.5 વસ્તી અને વસ્તીનું વધ્યકૃત : વસ્તીનું પ્રમાણ પણ વસ્તુની ભજારમાંગને અસર કરનારું એક અગત્યનું પરિબળ છે. દેશની વસ્તી (જનસંખ્યા) જેટલા હોય તેના પ્રમાણમાં જ વસ્તુઓની વપરાશ થતી હોય છે. તેથી કહી રક્ષા કે વસ્તી વરે તો વસ્તુઓની માંગ પણ વધ્યો અને વસ્તી ઘટે તો વસ્તુઓની માંગ પણ વધ્યો વસ્તીના વધ્યકૃતના થતા ફેરફારો પણ વસ્તુની માંગમાં ફેરફારો લાવે છે.

#### ૫-૪ માંગની મૂલ્યસાપેક્ષતાનો અર્થ, પ્રકારો, અસર કરતાં પરિબળો અને મહત્વ :

માંગની મૂલ્યસાપેક્ષતા વસ્તુની કિંમતમાં થતા ફેરફાર અને તેની માંગમાં થતા ફેરફાર વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે. એટલે કે માંગની મૂલ્યસાપેક્ષતા એ માંગના ટકાવારી ફેરફાર અને કિંમતના ટકાવારી ફેરફારના ગુણોત્તરનું માપ છે.

##### ❖ વ્યાખ્યાઓ :

- (1) પ્રો. માર્શિલ : “કિંમતના સાપેક્ષ ફેરફાર અને માંગના સાપેક્ષ ફેરફારનું ગુણોત્તર પ્રમાણા.”
- (2) સ્ટોનિયર અને હેગ : “વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં તેના માટેની માંગમાં જેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તે.”
- (3) આર. જી. લિપ્સી : “કિંમતમાં ફેરફાર થવાના પ્રત્યુત્તરરૂપે માંગમાં જે ફેરફાર થાય છે તેને માંગની મૂલ્યસાપેક્ષતા કહે છે.”
- (4) પ્રો. બેન્ઝામ : “માંગની મૂલ્યસાપેક્ષતા એટલે વસ્તુની કિંમતમાં થતા વધારા-ધારાની માંગના જથ્થા પર થતી અસર.”
- (5) પ્રો. બોલ્ડિંગ : “વસ્તુની કિંમતમાં આવતા ફેરફારોના સંદર્ભમાં તેની માંગના મતિભાવો માપવા માટેનું પરિમાણાત્મક માપ એટલે માંગની મૂલ્યસાપેક્ષતા.”
- (6) શ્રીમતી જોન રોબિન્સન : “કિંમતમાં થયેલા થોડા ફેરફારને પરિણામે માંગમાં જેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તેની કિંમતમાં થયેલા ફેરફારના પ્રમાણ વડે ભાગવાથી જે આંક મળે તે માંગની મૂલ્ય-સાપેક્ષતા છે.”

ટૂકમાં, કિમતમાં વધવાને પરિણામે માંગમાં જે ઘટાડો કે વધારો થાય છે તેનું માપ એટલે માંગની મૂલ્યસાપેક્ષતા. માંગની મૂલ્યસાપેક્ષતા સૂત્ર દ્વારા નીચે મુજબ સમજાવી શકાય :

$$\text{માંગની મૂલ્યસાપેક્ષતા} = \frac{\text{વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર}}{\text{વસ્તુની કિમતમાં થતો ટકાવારી ફેરફાર}}$$


\* માંગની મૂલ્યસાપેક્ષતાના પ્રકારો :

- (1) મૂલ્યસાપેક માંગ
- (2) મૂલ્ય અનપેક માંગ
- (3) એકમ મૂલ્યસાપેક માંગ
- (4) સંપૂર્ણ મૂલ્યસાપેક માંગ
- (5) સંપૂર્ણ મૂલ્યઅનપેક માંગ

(1) મૂલ્યસાપેક માંગ :

“જ્યારે વસ્તુની કિમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય ત્યારે મૂલ્યસાપેક માંગ કહેવાય. સામાન્ય રીતે મોજશોખ અને સુખસગવડની વસ્તુઓની માંગ મૂલ્યસાપેક હોય છે. દા.ત., વસ્તુની કિમતમાં 10 ટકા ફેરફાર થાય ત્યારે તેને પરિણામે માંગમાં 50 ટકાનો ફેરફાર થાય ત્યારે માંગ મૂલ્યસાપેક કહેવાય.”

$$\text{માંગની મૂલ્યસાપેક્ષતા} = \frac{\text{માંગમાં ટકાવારી ફેરફાર}}{\text{કિમતમાં ટકાવારી ફેરફાર}} = \frac{+50}{-10} = -5$$



બાજુની આકૃતિ મુજબ  $X$  વસ્તુની કિમત રૂ. 10 હતી ત્યારે વસ્તુની માંગ 100 એકમોની થતી હતી. પરંતુ વસ્તુની કિમત ઘટીને રૂ. 9 થતાં વસ્તુની માંગ વધીને 150 એકમોની થાય છે. એટલે માંગમાં 10% નો ઘટાડો થતાં માંગમાં 50% નો વધારો થયો. DD મૂલ્યઅનપેક્ષ માંગ રેખા છે.


## (2) મૂલ્યઅનપેક્ષ માંગ :

“જ્યારે વસ્તુની કિમતમાં યતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય ત્યારે મૂલ્યઅનપેક્ષ માંગ કહેવાય.” સામાન્ય રીતે ભીઠું, પોસ્ટકાર્ડ, ટિવાસળીની પેટી, ટાંકણી વગેરે વસ્તુઓની માંગ મૂલ્યઅનપેક્ષ હોય છે. દા.ત.,  $X$  વસ્તુની માંગમાં 25% નો અને કિમતમાં 50% નો વધારો થાય તો માંગ મૂલ્યઅનપેક્ષ કહેવાય.

$$\text{માંગની મૂલ્યઅનપેક્ષતા} = \frac{\text{માંગમાં ટકાવારી ફેરફાર}}{\text{કિમતમાં ટકાવારી ફેરફાર}}$$

$$= \frac{+25}{-50}$$

$$= \frac{1}{2}$$



આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે  $X$  વસ્તુની કિમત રૂ. 4માંથી ઘટીને રૂ. 2 થાય છે ત્યારે  $X$  વસ્તુની માંગ વધીને 100 એકમથી 125 એકમ થાય છે. એટલે વસ્તુની માંગમાં 25 ટકા વધારો અને કિમતમાં 50 ટકા ઘટાડો થયો છે. DD માંગરેખા મૂલ્ય અનપેક્ષ છે.


(3) એકમ મૂલ્યસાપેક્ષ માંગ :

જ્યારે માંગના ટકાવારી ફેરફારો અને કિમતના ટકાવારી ફેરફારો સરખા હોય ત્યારે એકમ મૂલ્યસાપેક્ષ માંગ કહેવાય. દા.ત., વસ્તુની કિમતમાં 10 ટકાનો ફેરફાર થાય અને તેની માંગમાં 10 ટકાનો ફેરફાર થાય તો એકમ મૂલ્યસાપેક્ષ માંગ કહેવાય.

$$\text{માંગની મૂલ્યસાપેક્ષતા} = \frac{\text{માંગનો ટકાવારી ફેરફાર}}{\text{કિમતનો ટકાવારી ફેરફાર}}$$

$$= \frac{+10 \text{ ટકા}}{-10 \text{ ટકા}}$$

$$= 1$$




આકૃતિ મુજબ જ્યારે X વસ્તુની કિમત 10 રૂ. હતી ત્યારે માંગ 100 એકમોની હતી. જ્યારે કિમત રૂ. 9 થઈ ત્યારે માંગ વધીને 110 એકમોની થઈ. એટલે કે કિમતમાં 10 ટકા ઘટાડો થતા માંગમાં 10 ટકા વધારો થયો છે. DD એકમ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા છે.

(4) સંપૂર્ણ મૂલ્યસાપેક્ષ માંગ :

જ્યારે વસ્તુની કિમતમાં થતો નજીવો ફેરફાર તેની માંગમાં અમયીદિત ફેરફાર લાવે ત્યારે તે સંપૂર્ણ મૂલ્યસાપેક્ષ માંગ કહેવાય. દા.ત., વસ્તુની કિમતમાં 1 ટકાનો ફેરફાર થાય, પરંતુ માંગમાં અમાપ ફેરફાર થાય. જે સૂત્ર અનુસાર,

$$\begin{aligned}
 \text{માંગની મૂલ્યસાપેક્ષતા} &= \frac{\text{માંગની ટકાવારી ફેરફાર}}{\text{કિમતની ટકાવારી ફેરફાર}} \\
 &= \frac{X}{I} \\
 &= X \text{ (માંગ/અમાપ)}
 \end{aligned}$$




ઉપરની આકૃતિમાં DD રેખા કિટિજને સમાંતર છે. જે દરાવી છે કે આપેલ બજાર કિમતે વસ્તુની માંગ અમયાદિત હોય છે. વાળારામાં આવા પ્રકારની માંગ જોવા મળતી નથી.

#### (5) સંપૂર્ણ મૂલ્યઅનપેક્ષ માંગ :

જ્યારે વસ્તુની કિમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં વસ્તુની માંગમાં બિલકુલ ફેરફાર ન થાય તો તેને સંપૂર્ણ મૂલ્યઅનપેક્ષ માંગ કહેવામાં આવે છે. દા.ત., વસ્તુની કિમતમાં ગમે તેટલો ફેરફાર કરવામાં આવે છે. વસ્તુની માંગ 100 એકમ સ્થિર રહેવા પામે છે.

$$\begin{aligned}
 \text{માંગની મૂલ્યસાપેક્ષતા} &= \frac{\text{માંગમાં ટકાવારી ફેરફાર}}{\text{કિમતમાં ટકાવારી ફેરફાર}} \\
 &= \frac{0}{25} \\
 &= 0 \text{ (શૂન્ય)}
 \end{aligned}$$



આકૃતિમાં X વસ્તુની કિમતમાં રૂ. 4થી વધીને રૂ. 8 અને ત્યાર બાદ રૂ. 10 થાય છતાં X વસ્તુની માંગ 100 એકમ સ્થિર રહે છે. જે DD રેખા ઉભી પરીને સમાંતર રહે છે.

**૫. માગની મૂલ્યસાપેક્ષતાને અસર કરતાં પરિણામો :**

જુદી જુદી વસ્તુઓની માગની મૂલ્યસાપેક્ષતા જુદી જુદી શા માટે હોય છે અને કાળકમે કોઈ એક જ વસ્તુની મૂલ્યસાપેક્ષતા શા માટે બદલાય છે એ પ્રશ્નોના જવાબ મેળવવા માટે માગની મૂલ્યસાપેક્ષતા નક્કી કરતાં પરિબળોનો પરિચય જરૂરી છે. સામાન્ય રીતે માગની મૂલ્યસાપેક્ષતાને અસર કરતાં પરિબળો ચાર છે એમ કહી શકાય : (૧) અવેજણી શક્યતા, (૨) વસ્તુનો પ્રકાર, (૩) ગ્રાહકના બજેટમાં વસ્તુનું સ્થાન અને (૪) જમ્યાનો ગાળો. આપણે દરેક પરિબળ વસ્તુની માગની મૂલ્યસાપેક્ષતાને કઈ રીતે અસર કરે છે એ તપાસી લઈએ.

(૧) અવેજણી શક્યતા : કોઈ એક વસ્તુની અવેજણમાં આવી શકે એવી વસ્તુઓ જેમ વધુ સંપાદમાં ઉપલબ્ધ હોય તેમ તો વસ્તુની માગ વધુ મૂલ્યસાપેક્ષ હોય છે. દા.ત., કોરહેન્સ ટ્રૂથપેસ્ટની અવેજણમાં આવી શકે એવી અનેક ટ્રૂથપેસ્ટ ઉપલબ્ધ છે. આથી કોરહેન્સ ટ્રૂથપેસ્ટની કિંમત વધે તો ઘણા પ્રાકૃતી કોરહેન્સ ટ્રૂથપેસ્ટને બદલે અન્ય બાન્ડ-ની ટ્રૂથપેસ્ટ ખરીદશે. આથી કોરહેન્સ ટ્રૂથપેસ્ટની માગ નોંધપાત્ર પ્રમાણમાં ઘટશે. એથી ઊલટું, કોરહેન્સ ટ્રૂથપેસ્ટની કિંમત ઘટે તો ઘણા લોકો અન્ય બાન્ડની ટ્રૂથપેસ્ટને બદલે કોરહેન્સ ટ્રૂથપેસ્ટ ખરીદશે. પરિણામે કોરહેન્સ ટ્રૂથપેસ્ટની માગમાં નોંધપાત્ર વધારો થશે. જો કોરહેન્સ સિવાય બીજી કોઈ પણ ટ્રૂથપેસ્ટ બજીબાં ઉપલબ્ધ ન હોય તો તેની કિંમત વધે તો પણ લોકોએ તેની ખરીદી ચાલુ રાખવી પડશે. આથી એની માગમાં ખાસ ઘણાએ થશે નહીં. એનાથી ઊલટું, એની કિંમત ઘટે ત્યારે માગમાં ખાસ વધારો થશે નહીં, કારણ કે એવી કોઈ અવેજ વસ્તુ નથી જેને બદલે લોકો કોરહેન્સ ટ્રૂથપેસ્ટ ખરીદવા લલચાય.

(૨) વસ્તુનો પ્રકાર : માગની મૂલ્યસાપેક્ષતાનો આધાર વસ્તુ કેવા પ્રકારની છે તે બાબત પર છે. આ મુશ્કેનીયાની ર્થાની પરથી સ્પષ્ટ કરો :

(i) ગ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની માગ મૂલ્યઅનપેક્ષ હોય છે. દા.ત., અનાજની અમુક પ્રમાણમાં વપરાશ અનિવાર્ય છે. આથી કિંમત વધે તો માગ ખાસ ઘટતી નથી. તેની વ્યક્તિગત વપરાશને અમુક મર્યાદા છે. આથી કિંમત ઘટે તો માગ ખાસ વધતી નથી. એનાથી વિપરીત મોઝ્જોખની વસ્તુઓની માગ મૂલ્યસાપેક્ષ હોય છે, કારણ કે તેમની વપરાશ ન તો અનિવાર્ય છે કે ન તો વ્યક્તિગત રીતે મર્યાદિત છે.

(ii) અનેક ઉપયોગો પરાવતી વસ્તુઓની માગ મૂલ્યસાપેક્ષ હોય છે. દા.ત., વીજળીના દર ઘટે તો અનેક ઓછી અગત્યના ઉપયોગમાં તેની વપરાશ વધે છે. આથી કુલ માગમાં વધારો નોંધપાત્ર હોય છે. વીજળીના દર વધે ત્યારે અનેક ઓછી અગત્યની દિશાઓમાં એની વપરાશ ઘટે છે. આથી એની કુલ માગમાં નોંધપાત્ર ઘટાડે થાય છે. અનેક ઉપયોગો પરાવતી વસ્તુની તુલનામાં એક જ ઉપયોગ પરાવતી વસ્તુની માગની મૂલ્યસાપેક્ષતા જોઈ હોય છે.

(iii) ખરીદી મુલાકાવી રાખી શકાય એવી વસ્તુઓની માગ મૂલ્યઅનપેક્ષ હોય છે, દા.ત., સાઈકલ, સ્કુટર, રૈલ્ફો વગેરે આવી વસ્તુઓના ભાવ વધુ હોય તારે લોકો ખરીદી મોક્ક રાખી શકે છે. આથી ઊચા ભાવે માગ ખૂબ ઓછી હોય છે. ભાવ ઘટે ત્યારે મોક્ક રાખવામાં આવેલી માગ એકત્તાથે સંતોષવામાં આવે છે. તેની માગ પુષ્ટ વધે છે. એનાથી ઊલટું, ખરીદી મુલાકાવી રાખી ન શકાય એવી વસ્તુઓની માગ મૂલ્યઅનપેક્ષ હોય છે. ઊચા ભાવે પણ

એની ખરીદી કરવામાં આવશે. આથી જીવા ભાવે માગમાં ઘટાડો નજીવો હશે. ભાવ ઘટે ત્યારે માગ ખાસ વધશે નહીં, કારણ કે અહીં ભૂતકાળની મોફું રાખેલી માગ અસ્તિત્વ પરાવતી નથી.

(iv) ખૂબ મોંઢી કે ખૂબ સર્તી વસ્તુઓની માગ મૂલ્યઅનપેક્ષ હોય છે. હીરામાણેક જેવી ખૂબ મોંઢી વસ્તુઓની કિંમત ઘટે ત્યારે માગમાં ખાસ વધારો થતો નથી; કારણ કે કિંમત ઘટે તો પણ આમજનતા માટે તો એ વસ્તુઓ શક્તિ બધારની રહે છે. મીઠું, સોય, પોસ્ટકાર્ડ વગેરે જેવી સર્તી વસ્તુઓની કિંમત ઘટે ત્યારે માગમાં વધારો થતો નથી; કારણ કે સર્તી હોવાને લાખે આ વસ્તુઓની જરૂરિયાત અગ્રાહી જ લગભગ પૂરી સંતોષાર્થ ગઈ હોય છે.

(5) ગ્રાહકના બજેટમાં વસ્તુનું સ્થાન : ગ્રાહક કોઈ એક વસ્તુ પર પોતાની આવકનો કેટલો ભાગ ખર્ચ છે એના આધારે એ વસ્તુનું એ ગ્રાહકના બજેટમાં સ્થાન નક્કી થાય છે. મીઠું, સોય, પોસ્ટકાર્ડ, વર્તમાનપત્ર વગેરે જેવી વસ્તુઓ પર ગ્રાહકો આવકનો નજીવો ભાગ ખર્ચ છે. આથી આ વસ્તુઓની કિંમતમાં વધારની ગ્રાહકના બજેટ પર ખાસ અસર પડતી નથી. આથી ગ્રાહકો કિંમતની વધારને અવગારીને વપરાશ યથાવત ચાલુ રાખે છે. આમ જે વસ્તુઓ પર ગ્રાહકો પોતાની આવકનો નજીવો ભાગ ખર્ચ છે તે વસ્તુઓની માગ મૂલ્યઅનપેક્ષ હોય છે. એનાથી ઊલંઘ, મોટરકાર, મકાન વગેરે જેવી વસ્તુઓની ખરીદી આવકનો મોટો ભાગ ખેંચી જાય છે. આવી વસ્તુઓની કિંમતમાં વધારની ગ્રાહકોના બજેટ પર નોંધપાત્ર અસર પડે છે. આથી ગ્રાહકો કિંમતની વધારને અવગારી શકતા નથી. આ કારણસર જે વસ્તુઓ પર ગ્રાહકો પોતાની આવકનો મોટો ભાગ ખર્ચ છે તે વસ્તુઓની માગ મૂલ્યસાપેક્ષ હોય છે.

(6) સમયનો ગાળો : કોઈ પણ વસ્તુની માગ ટૂંકા ગાળામાં ઓછી મૂલ્યસાપેક્ષ અને લાંબા ગાળે વધુ મૂલ્યસાપેક્ષ હોય છે. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો વસ્તુની કિંમત ઘટે ત્યારે તરત માગ પર અસર વાતાવરી નથી. પણ સમયના વહેણ સાથે માગ વધુ ને વધુ પ્રતિભાવ દર્શાવે છે. આ હીકિકત માટે મુખ્ય ત્રણ કારણો જવાબદાર છે :

(i) ટેવ અને રિવાજ : ચાની સરખામણીમાં કોઈ સર્તી થાય ત્યારે ચાથી ટેવયેલા લોકો તરત ચાને બદલે કોકાની વપરાશ કરી દેતા નથી. માણસ તરત પોતાની ટેવ બદલી શકતો નથી. અલબાન્સ લાંબે ગાળે તે ટેવ બદલી શકે છે. આથી કોકાની માગ લાંબે ગાળે વધુ વધશે. લોકો રીતરિવાજે પણ તુરેત બદલી શકતા નથી. મૌખવારીને લીધે વરઘોડામાં બેન્ડવાજાનો રિવાજ થીમે લુપતા થઈ રહ્યો છે, તત્કાળ એ રિવાજ તોડી શકાયો નથી.

(ii) ટેક્નિકલ મુશ્કેલીઓ : કેટલીક વસ્તુઓ સર્તી હોય તો એમની વપરાશ કરવા માટે પૂરુક વસ્તુઓ ખરીદીની પડે છે. જેથી કે વીજાળીના વધુ વપરાશ માટે પાંખો, રેઝિયો, ઈઝો વગેરેમાં રોકાણ આવશક છે. આ કારણસર કિંમતધરાણની માગ પર અસર તરત નહીં, લાંબા-ગાળે વર્તાવ છે. બૂટ-ચંપલ જેવી ટકાઉ વસ્તુઓની કિંમત ઘટે તો લોકો જે બૂટ-ચંપલ ચાલુ વપરાશમાં છે તે કાઢીને કંકી દેતા નથી. આથી આ વસ્તુઓના કિંમત ઘટાડાની અસર પણ તરત દર્શિયોચર થતી નથી.

(iii) બજારની અપૂર્ણતા : અપૂર્ણ બજારમાં ગ્રાહકોને બજારની પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન અને માછિયી હોતોં નથી. વસ્તુની કિંમત ઘટી છે એવી માછિયી સમયના વહેણ સાથે થીમે વાપક બને છે. આથી કિંમત ઘટાડાની માગ પર અસર અમૃત સમય બાદ જોવા મળે છે.

માગની મૂલ્યસાપેક્ષતાનો ઘણાલ એ માર્શિલનું મહિંદ્રનું પ્રદાન ગજાય છે. કારણ કે માગ સૈદ્ધાંતિક દિલ્લીએ જનહીં, વ્યવહારુદ્દ્દિલીએ પણ માગની મૂલ્યસાપેક્ષતાનો ઘણાલ ઉદ્ઘોગપત્રિઓ, સરકાર, ખેડૂતો અને મજૂરમંડળો માટે જૂબ ઉપયોગી સાભિત થયો છે.

(૧) મહિંદ્રમ નફાનો ઉદેશ ધરાવતા ઉત્પાદકોએ પોતાની વસ્તુની કિંમત નક્કી કરતી વખતે માગની મૂલ્યસાપેક્ષતા ધ્યાનમાં લેવી પડે છે. જો માગ મૂલ્યસાપેક્ષ હોય તો નીચી કિંમત રાખવી લાભદાર્યક છે, કારણ કે આ સ્થિતિમાં કિંમત ઘટતાં ગ્રાહકોનું ખર્ચ વધે છે. આથી ઉત્પાદકોને વધુ વેચાણ આવક અને નકો મળે છે. જો માગ મૂલ્યઅનપેક્ષ હોય તો ઊચી કિંમત લાભદારી હોય છે કારણ કે આ સ્થિતિમાં કિંમત વધે રોગ ગ્રાહકોનું ખર્ચ વધે છે. આથી ઉત્પાદકોને વધુ વેચાણ આવક અને નકો મળે છે.

(૨) વસ્તુ બધાં બજારોમાં એકસરખા ભાવે વેચવી કે નહીં એ નક્કી કરવામાં માગની મૂલ્યસાપેક્ષતાનો ઘણાલ ઉત્પાદકોને મદદરૂપ બને છે. જો જુદાં જુદાં બજારોમાં માગની મૂલ્યસાપેક્ષતા જુદી જુદી હોય તો જુદી જુદી કિંમત વેચાણ કરવાથી નકો વધશે. વધુ મૂલ્યસાપેક્ષ માગ ધરાવતા બજારમાં નીચી કિંમત રાખવામાં આવશે, અને ઓછી મૂલ્યસાપેક્ષ માગ ધરાવતા બજારમાં ઊચી કિંમત રાખવામાં આવશે.

(૩) કઈ ચીજાવસ્તુઓ પર વેચાણવેરો, આબકારી જીકાત અને આયાતજીકાત નાખવી એ નક્કી કરતી વખતે નાશપાણને પણ માગની મૂલ્યસાપેક્ષતા ધ્યાનમાં લેવી પડે છે. જે વસ્તુઓની માગ મૂલ્યઅનપેક્ષ હોય એવી વસ્તુઓ પર કરવેરા નાખવાથી સરકારને પુઝળ કરવિપદ્ધ પ્રાપ્ત થશે કારણ કે કરવેરાને લીધે વસ્તુઓની કિંમત વધે તોપણ તેની માગમાં ખાસ-ઘટાયે થશે નહીં. લોકોએ બરીદી સાથે કરની રકમ ચૂકવવી પડશે.

(૪) મજૂરમંડળોએ વધુ વેતનની લડત શરૂ કરતાં પહેલાં પોતે જે શ્રમ પૂરો પાડે છે તેની માગ મૂલ્યઅનપેક્ષ છે કે નહિ તે જોતું પડશે. જો શ્રમની માગ મૂલ્યઅનપેક્ષ હોય તો એનો અર્થ એ છે કે વધુ વેતન આપીને પણ ઉત્પાદકોએ શ્રમ ખરીદવો પડશે. શ્રમની માગમાં ઘટાડો શક્ય નથી. આ સંજોગોમાં ઉત્પાદકોની ગરજનો લાલ લઈને મજૂરમંડળો વેતનવૃદ્ધિ સહેલાઈથી મેળવી શકશે.

(૫) દેશના ચલણનું (એટલે કે રૂપિયાનું) અવમૂલ્યન કરવું કે નહીં એ નક્કી કરતી વખતે સરકારે આયાત વસ્તુઓ અને નિકાસ વસ્તુઓની માગની મૂલ્યસાપેક્ષતા ધ્યાનમાં લેવી પડે છે. જો બંનેની માગ મૂલ્યસાપેક્ષ હોય તો રૂપિયાનું અવમૂલ્યન કરવાથી ભારતના લોકોને આયાત વસ્તુઓ મૌંઠી પડશે. આથી આયાત ઘટશે, જ્યારે વિદેશી ગ્રાહકોને ભારતની નિકાસ વસ્તુઓ સહ્સી પડશે. આથી નિકાસો વધશે. આમ, અવમૂલ્યન દારી ભારતની લોકાદેશની તુલામાં ખાખ દૂર કરી શકશે.

(૬) ધારી વાર ખેતઉત્પાદન ઘટે તારે હુલ ખેતઆવક વધે છે અને ખેતઉત્પાદન વધે તારે હુલ ખેતઆવક ઘટે છે. આ આશ્રમજનક વિરોધાભાસની સેદ્ધાંતિક સમજૂતી માગની મૂલ્યસાપેક્ષતાના ઘણાલમાં મળી રહે છે. ખેતગોદાશોની માગ મૂલ્યઅનપેક્ષ છે. આથી મનુલાં

પાક ઉત્તરે અને ખેતપેદાશોનો પુરવઠો વધે ત્યારે તેમના ભાવ ઘટે છે અને ભાવ ઘટતાં ગ્રાહકોનું ખેતપેદાશો પરનું કુલ ખર્ચ ઘટે છે. આથી ખેતઆવક ઘટે છે. એનાથી ઉલંબ, પાક નિર્ણણ જાય અને ખેતપેદાશોનો પુરવઠો ઘટે ત્યારે ભાવ વધે છે અને ભાવ વધતાં ગ્રાહકોનું કુલ ખર્ચ વધે છે. આથી ખેતઆવક વધે છે. આ જ કારણસર યુ.એસ.એ. અને ભારત જેવા અનેક દેશોમાં ખેતપેદાશોના તળિયાના ભાવો નક્કી કરવામાં આવ્યા છે અને સરકારે ખેતપેદાશોના ભાવો એનાથી નીચે ન જાય એ જેવાની જવાબદારી સ્વીકારી છે.

#### (8) માંગની મૂલ્યસાપેક્ષતા માપવાની પદ્ધતિઓ :

માંગની મૂલ્યસાપેક્ષતા માપવાની મુખ્ય ચાર પદ્ધતિઓ છે :

- (1) પ્રો. ફલકસે આપેલી ટકાવારી કે પ્રમાણાત્મક પદ્ધતિ.
  - (2) પ્રો. માર્શલની કુલ ખર્ચ અથવા કુલ આવકની પદ્ધતિ.
  - (3) ભૌમિતિક અથવા બિંદુ પદ્ધતિ.
  - (4) ચાપ પદ્ધતિ અથવા સરાસરી પદ્ધતિ
- આ પદ્ધતિઓનો આપણે વિગતે અભ્યાસ કરીએ.
- (1) પ્રો. ફલકસે આપેલી ટકાવારી કે પ્રમાણાત્મક પદ્ધતિ (Percentage method) :

પ્રો. ફલકસે માંગની મૂલ્યસાપેક્ષતા માપવાની જે રીતે આપી છે તે ટકાવારી પદ્ધતિ કે પ્રમાણાત્મક પદ્ધતિ તરીકે ઓળખાય છે. આ પદ્ધતિ

અન્વયે વસ્તુની કિંમતમાં થતાં ટકાવારી ફેરફારોને લીધે તેની માંગમાં થતાં ટકાવારી ફેરફારોની તુલના કરી તેના આપારે માંગની મૂલ્યસાપેક્ષતા માપવામાં આવે છે. આમ;

- (1) જો વસ્તુની કિંમતમાં થતાં ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો માંગની મૂલ્યસાપેક્ષતા એકમ કરતાં વધુ કહેવાશે.
- (2) જો વસ્તુની કિંમતમાં થતાં ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો માંગની મૂલ્યસાપેક્ષતા એકમ કરતાં ઓછી કહેવાશે.
- (3) જો વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર જેટલો જ માંગમાં ટકાવારી ફેરફાર થાય, એટલે તે કિંમત અને માંગમાં ટકાવારી ફેરફાર એકસરખો હોય, તો માંગની મૂલ્યસાપેક્ષતા એકમનાં બચાબર છે એમ કહેવાશે.  
ઉપરોક્ત બાબતોને સૂત્રના રૂપમાં આ રીતે મૂડી શકાય :

$$\text{માંગની મૂલ્યસાપેક્ષતા} = \frac{\text{માંગમાં થતો ટકાવારી ફેરફાર}}{\text{કિંમતમાં થતો ટકાવારી ફેરફાર}}$$

$$= \frac{\text{માંગમાં ફેરફાર}}{\frac{\text{મૂળ માંગ}}{\text{કિંમતમાં ફેરફાર}}} \\ = \frac{\text{મૂળ કિંમત}}{\text{મૂળ માંગ}}$$

સંશાના રૂપમાં રજૂ કરીએ તો;

$$P_e = \frac{\frac{\Delta Q}{Q}}{\frac{\Delta P}{P}} = \frac{\Delta Q}{Q} \div \frac{\Delta P}{P}$$

$$= \frac{\Delta Q}{Q} \times \frac{P}{\Delta P}$$

$$= \frac{\Delta Q}{\Delta P} \times \frac{P}{Q}$$

અહીં,  $P_e =$  માંગની મૂલ્યસાપેક્ષતા

$\Delta Q =$  માંગમાં ફેરફાર

$\Delta P =$  કિંમતમાં ફેરફાર

$Q =$  મૂળ માંગ

$P =$  મૂળ કિંમત

### ઉદાહરણ 1 :

ધારો કે કોઈ એક વસ્તુની કિંમત રૂ. 10 છે અને આ કિંમતે તેની માંગ 1000 એકમો જેટલી છે. હવે જ્યારે વસ્તુની કિંમત ઘટીને રૂ. 9 થાય છે ત્યારે માંગ વધીને 1200 એકમો જેટલી થાય છે. માંગની મૂલ્યસાપેક્ષતા શોધો.

$$\Rightarrow \text{સૂત્ર પ્રમાણે, } \text{માંગની મૂલ્યસાપેક્ષતા} = \frac{\text{માંગમાં થતો ટકાવારી ફેરફાર}}{\text{કિંમતમાં થતો ટકાવારી ફેરફાર}}$$

$$= \frac{20}{10}$$

$$= 2$$

અહીં, વસ્તુની માંગની મૂલ્યસાપેક્ષતા = 2 જેટલી છે, એટલે કે તે એકમ કરતાં વધુ છે. ( $e > 1$ )

$$\text{સંશાના રૂપમાં રજૂ કરીએ તો, } P_e = \frac{\Delta Q}{\Delta P} \times \frac{P}{Q}$$

$$= \frac{200}{1} \times \frac{10}{1000}$$

$$= 2$$

એટલે કે, માંગની મૂલ્યસાપેક્ષતા = 2 જેટલી છે અને તેથી તે એકમ કરતાં વધુ છે. ( $e > 1$ )

- (2) પ્રો. માર્શલે આપેલી કુલ ખર્ચ અથવા કુલ આવકની પદ્ધતિ (Total outlay method or Total revenue method) :

પ્રો. માર્શલે સૂચવેલી આ પદ્ધતિમાં ગ્રાહકો દ્વારા વસ્તુ માટે કરવામાં આવત કુલ ખર્ચના સંદર્ભમાં માંગની મૂલ્યસાપેક્ષતા માપવામાં આવે છે. કુપનીની દણિએ કે પેઢીની દણિએ જોઈએ તો ગ્રાહકોનો વસ્તુ ખરીદીનો કુલ ખર્ચ એ પેઢીની કુલ આવક બને છે. આમ, ગ્રાહકોનો કોઈ એક વસ્તુ માટેનો ખરીદીખર્ચ અને પેઢીઓની કુલ વેચાણ—આવક એ બન્ને એક જ બાબત છે એમ કઈ શકાય. કિમતમાં થતા ફેરફારોને લીધે ગ્રાહકોનો વસ્તુ માટે થતો કુલ ખર્ચ અથવા પેઢીઓની વેચાણ—આવકની વર્તણૂકનો અભ્યાસ કરીને માંગની મૂલ્યસાપેક્ષતા માપવામાં આવે છે. આ અંગે નીચેની ગજા નિયમો તારવી શકાય :

- (1) કિમતમાં ફેરફાર થવાથી ગ્રાહકો દ્વારા વસ્તુ પાછળ થતા કુલ ખર્ચનું પ્રમાણ અથવા પેઢીઓની વેચાણ આવક સ્થિર રહે તો માંગની મૂલ્યસાપેક્ષતા એકમની બરાબર છે એમ કહેવાશે.

એકમ મૂલ્યસાપેક્ષ માંગ

કિમત (રૂ.)	માંગ અથવા વેચાણ (નંગ)	ગ્રાહકોનો કુલ ખર્ચ અથવા પેઢીઓને થતી કુલ આવક (રૂ.)
5	100	500
4	125	500
2	250	500

આઈ, કિમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગ અથવા વેચાણમાં વધારો થાય છે પરંતુ તેમ છતાં ગ્રાહકોના કુલ ખર્ચ અથવા પેઢીઓની કુલ આવકમાં કોઈ ફેરફાર થતો નથી. આથી માંગની મૂલ્યસાપેક્ષતા એકમની બરાબર છે એમ કહેવાશે.

- (2) કિમતમાં ફેરફાર થવાથી માંગમાં એ રીતનો ફેરફાર થાય છે કે જેથી ગ્રાહકોના ખર્ચ અને પેઢીની આવકમાં મોટો ફેરફાર થાય તો માંગની મૂલ્યસાપેક્ષતા એકમ કરતાં વધુ છે એમ કહેવાશે.

**એકમ કરતાં વધુ મૂલ્યસાપેક્ષ માંગ**

કિંમત	માંગ અથવા વેગાણ	ગ્રાહકોનો કુલ ખર્ચ અથવા પેઢીઓની કુલ આવક
(રૂ.)	(નંબર)	(રૂ.)
5	100	500
4	130	520
3	180	540
6	80	480
7	60	420


અહીં કિંમતમાં ઘટાડો થવાથી માંગમાં એ રીતનો વધારો થાય છે કે ગ્રાહકોના કુલ ખર્ચમાં અગાઉ કરતાં મોટો વધારો થાય છે અથવા પેઢીઓને અગાઉ કરતાં વધુ આવક પ્રાપ્ત થાય છે. આથી વિપરીત, કિંમતમાં વધારો થતાં ગ્રાહકોના કુલ ખર્ચમાં અથવા પેઢીઓની કુલ આવકમાં સારો એવો ઘટાડો નોંધાય છે. આથી માંગની મૂલ્યસાપેક્ષતા એકમ કરતાં વધુ છે એમ કહેવાશે.

- (3) કિંમતમાં ઘટાડો થવાથી માંગમાં એ રીતના ફેરફાર થાય કે જેથી ગ્રાહકોનું ખર્ચ અથવા પેઢીની આવકમાં અગાઉ કરતાં ઘટાડો નોંધાય અથવા તો કિંમતમાં વધારે થતાં ખર્ચ અથવા આવકમાં અગાઉ કરતાં વધારો થાય તો માંગની મૂલ્યસાપેક્ષતા એકમ કરતાં ઓછી છે એમ કહેવાશે.

**એકમ કરતાં ઓછી મૂલ્યસાપેક્ષ માંગ**

કિંમત	માંગ અથવા વેગાણ	ગ્રાહકોનો કુલ ખર્ચ અથવા પેઢીઓની કુલ આવક
(રૂ.)	(નંબર)	(રૂ.)
5	100	500
4	120	480
3	130	390
6	90	540
7	80	560

અહીં કિંમતમાં ઘટાડો થવાથી માંગમાં એ રીતનો વધારો થાય છે કે, જેથી ગ્રાહકોના કુલ ખર્ચમાં અગાઉ કરતાં ઘટાડો થાય છે અથવા પેઢીઓને અગાઉ કરતાં ઓછી આવક પ્રાપ્ત થાય છે. આથી વિપરીત, કિંમતમાં વધારો થતાં ગ્રાહકોના કુલ ખર્ચમાં અથવા પેઢીઓની કુલ આવકમાં સારો એવો વધારો નોંધાય છે. આથી માંગની મૂલ્યસાપેક્ષતા એકમ કરતાં ઓછી છે એમ કહેવાશે. ઉપરોક્ત ચર્ચા નીચેની આદૃતિ દ્વારા સમજ શકાશે :



એ આદૃતિની સમજૂતી આ રીતે આપી શકાય. ધારો કે વસ્તુની કિંમત  $OP_1$  છે અને વસ્તુ પર થતો કુલ ખર્ચ  $OQ_1$  છે. હવે જ્યારે કિંમત વધીને  $OP_2$  થાય છે, ત્યારે કુલ ખર્ચ  $OQ_1$  પરથી વધીને  $OQ_2$  થાય છે. આમ,  $P_1$  થી  $P_2$  સુધીના કિંમત વિસ્તાર દરમિયાન તે વસ્તુની માંગની મૂલ્યસાપેક્ષતા એકમ કરતાં ઓછી છે. ( $e < 1$ )

જ્યારે કિંમત વધીને  $OP_3$  થાય છે, ત્યારે વસ્તુ પાછળ થતો કુલ ખર્ચ  $OQ_2$  સ્થિર રહે છે. આમ,  $P_2$  થી  $P_3$  સુધીની કિંમત વિસ્તાર દરમિયાન તે વસ્તુની માંગની મૂલ્યસાપેક્ષતા એકમની બરાબર છે એમ કહેવાય. ( $e = 1$ ) અને જ્યારે વસ્તુની કિંમત  $OP_3$  થી વધીને  $OP_4$  થાય છે, ત્યારે વસ્તુ પાછળ થતો કુલ ખર્ચ  $OQ_2$  પરથી ઘટીને  $OQ_3$  થાય છે. આમ,  $P_3$  થી  $P_4$  સુધીના કિંમત દરમિયાન તે વસ્તુની માંગની મૂલ્યસાપેક્ષતા એકમ કરતાં વધુ છોપ છે. ( $e < 1$ )


આમ, કુલ ખર્ચ અથવા કુલ વેચાણ આવકના ફેરફાર પરથી માંગની મૂલ્યસાપેક્ષતા જાણી શકાય છે. પરંતુ અને એ યાદ રાખવું ધટે કે, આ

પદ્ધતિ દ્વારા માંગની મૂલ્યસાપેક્ષતાનો વર્ગ જાહી શકાય છે, પરંતુ તેનો અંક જાહી શકતો નથી. માંગની મૂલ્યસાપેક્ષતાનો અંક જાહીવા માટે આપણે ભૌમિતિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. આમ છતાં કુલ બર્ચ/વેચાજા આવક પદ્ધતિનું આર્થિક મહત્વ એ છે કે, તે ભાવનીતિ અને તેની માંગ અને આવક પરની અસરો નક્કી કરતી વખતે સ્પષ્ટ, વ્યવહારિક માર્ગદર્શન આપે છે કે કુલ બર્ચ અથવા કુલ વેચાજા આવક પર ડિમ્બત ફેરફારની કેવી અસર જિશે.

### (3) ભૌમિતિક પદ્ધતિ અથવા બિંદુ પદ્ધતિ :

માશ્વલે માંગરેખાના કોઈ એક બિંદુએ મૂલ્યસાપેક્ષતા માપવા માટે બીજી એક પદ્ધતિ પડ્યા સૂચવી છે જે ભૌમિતિક પદ્ધતિ તરીકે ઓળખામ છે. અગાઉ આપણે જોઈ ગયા છીએ કે, માંગની રેખા પરના દરેક બિંદુએ મૂલ્યસાપેક્ષતા જુદી જુદી હોય છે. બિંદુ પદ્ધતિ માંગરેખા પરના કોઈ એક આપેલ બિંદુ પરની મૂલ્યસાપેક્ષતા માપે છે. માંગરેખાના અમુક બિંદુએ મૂલ્યસાપેક્ષતા કેટલી છે તે જાણવા માટે તે બિંદુના જમણી બાજુના પ્રમાણને તે બિંદુના ડાબી બાજુના પ્રમાણ વડે ભાગવામાં આવે છે.

બિંદુ પદ્ધતિને સમજવવાની સરળ રીત માંગની સીધી રેખા (Linear demand curve) ઘાણમાં લેવાની છે. આ હકીકત નીચેની આકૃતિ દ્વારા સ્પષ્ટ થશે.



ઉપરોક્ત આકૃતિમાં AB માંગરેખા છે. હવે આ રેખાની બરાબર મધ્યમાં C બિંદુ લેવામાં આવે છે, ત્યારે આ માંગરેખા બે વિભાગમાં વહેંચાઈ જાય છે. હવે બિંદુ મૂલ્યસાપેક્ષતા માપવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે :

$$\text{બિંદુ મૂલ્યસાપેક્ષતા} = \frac{\text{માંગરેખાનો નીચલો ભાગ}}{\text{માંગરેખાનો ઉપલો ભાગ}}$$

$$e = \frac{CA}{CB}$$

માંગરેખાના બંને ભાગનું ઓક્કસ માપ લેતાં CA = 2.75 સેન્ટીમીટર અને CB = 2.75 સેન્ટીમીટર થાય છે, આથી C બિંદુએ મૂલ્યસાપેક્ષતા નીચે પ્રમાણે ગણી શકાય :

$$\begin{aligned} e &= \frac{CA}{CB} \\ &= \frac{2.75}{2.75} \\ &= 1 \end{aligned}$$

આમ C બિંદુએ માંગની મૂલ્યસાપેક્ષતા એકમની બરાબર છે એમ કાઢી શકાય.

એ જ રીતે જો C બિંદુને બદલે E બિંદુ પરની મૂલ્યસાપેક્ષતા માપવી શોધ તો,

$$\begin{aligned} e &= \frac{EA}{EB} \\ &= \frac{1.5}{4.0} \\ &= - .37 \end{aligned}$$

આમ, E બિંદુએ માંગની મૂલ્યસાપેક્ષતા એકમ કરતાં ઓછી છે એમ કાઢી શકાય.

એ જ પ્રમાણે D બિંદુએ માંગની મૂલ્યસાપેક્ષતા નીચે મુજબ માપી શકાય :

$$e = \frac{DA}{DB}$$

$$= \frac{4.0}{1.5}$$


$$= 2.6$$

આમ D બિંદુએ માંગની મૂલ્યસાપેક્ષતા એકમ કરતાં વધુ છે એવ કાર્ય શકાય.

આ રીતે જોતાં ઉપરોક્ત આંકૃતિમાં,

- (1) A બિંદુએ માંગની મૂલ્યસાપેક્ષતા શૂન્ય છે.
- (2) B બિંદુએ માંગની મૂલ્યસાપેક્ષતા અમાપ છે.
- (3) C બિંદુએ માંગની મૂલ્યસાપેક્ષતા એકમની બરાબર છે.
- (4) D બિંદુએ માંગની મૂલ્યસાપેક્ષતા એકમ કરતાં વધારે છે.
- (5) E બિંદુએ માંગની મૂલ્યસાપેક્ષતા એકમ કરતાં ઓછી છે.

જો માંગરેખા સીધી રેખાને બદલે વળાંકવાળી હોય તો જે બિંદુ પરની મૂલ્યસાપેક્ષતા શોખવાની હોય તે બિંદુએ એક સ્પર્શિભા (tangent) દોરીને ઉપરની રીત મુજબ મૂલ્યસાપેક્ષતા શોધી શકાય. આ હકીકત નીચેની આંકૃતિ દ્વારા સ્પષ્ટ થશે :



ઉપરોક્ત આકૃતિમાં C બિંદુએ માંગની મૂલ્યસાપેક્ષતા અગાઉના સૂત્ર મુજબ નીચે પ્રમાણે માપી શકાય :

$$e = \frac{CA}{CB}$$

અહીં C બિંદુ મધ્યમાં આવેલ હોવાથી આ બિંદુએ માંગની મૂલ્યસાપેક્ષતા એકમની બાબત છે. C બિંદુની જમણી બાજુના દરેક બિંદુએ માંગની મૂલ્યસાપેક્ષતા એકમ કરતાં ઓછી હશે, જ્યારે C બિંદુની ડાબી બાજુના દરેક બિંદુએ માંગની મૂલ્યસાપેક્ષતા એકમ કરતાં વધુ હશે. અથબા, B બિંદુએ માંગની મૂલ્યસાપેક્ષતા અમાપ હશે જ્યારે A બિંદુએ એ શૂન્ય હશે.

આમ, બિંદુ પદ્ધતિ દ્વારા માંગરેખાના કોઈ એક બિંદુએ મૂલ્યસાપેક્ષતા કેટલી છે તે માપી શકાય છે.

#### (4) ચાપ પદ્ધતિ અથવા સરાસરી પદ્ધતિ (Arc Elasticity) :

આ પદ્ધતિનો ઉપયોગ માંગરેખાના અમુક ખંડ કે ભાગ (arc) પર માંગની મૂલ્યસાપેક્ષતા કેટલી છે તે જાણવા માટે છે. વ્યવહારમાં આ રીતનો વિશેષ ઉપયોગ થતો જોવા મળે છે. કારણ કે તેમાં બિંદુ પદ્ધતિની જેમ કિમત અને માંગના માત્ર સૂક્ષ્મ અંગે અવાસ્તવિક ફરજારો લક્ષમાં ન લેતાં કિમત અને માંગમાં થતા વાસ્તવિક ફરજારો ખાનમાં લેવામાં આવે છે. દાખલા તરીકે, વસ્તુની કિમત રૂ. 1થી વધીને રૂ. 1.50 થાય તો મૂળ કિમતમાં 50 ટકાનો વધારો થયો કહેવાય અને તેને લીધે ધારો કે, માંગમાં 35 ટકાનો ઘટાડો થાય છે. અગાઉ જાણાવેલ બિંદુ પદ્ધતિ પ્રમાણે માંગની મૂલ્યસાપેક્ષતા એકમ કરતાં ઓછી છે એમ કહેવાશે પરંતુ રૂ. 1 અને રૂ. 1-50ની આ બે કિમતોએ ગ્રાફ માંગ પરિમાણોનાં બિંદાઓની વચ્ચેના બિંદુઓએ અનેક મૂલ્યસાપેક્ષતાઓ હોય છે. ચાપ પદ્ધતિમાં બે જુદા જુદા ભાવોએ માંગ-પરિમાણોનાં બે બિંદુઓ વચ્ચે સરેરાશ મૂલ્યસાપેક્ષતા માપવામાં આવે છે. આ માટેનું સૂત્ર નીચે પ્રમાણે છે :

$$e_p = \frac{\frac{Q_2 - Q_1}{Q_2 + Q_1}}{\frac{P_2 - P_1}{P_2 + P_1}}$$

અહીં,  $e_p$  = માંગની મૂલ્યસાપેક્ષતા

$Q_1$  = કિમતમાં ફેરફાર થતાં અગાઉની નવી માંગ

$Q_2$  = કિમતમાં ફેરફાર થયા પછીની નવી માંગ

$p_1$  = મૂળ કિમત

$p_2$  = નવી કિમત

એક ઉદાહરણ લઈએ. ધારો કે રૂ. 10ની કિમતે અમુક વસ્તુના 2000 એકમોની માંગ છે; ત્યાર બાદ કિમત ઘટીને રૂ. 9 થતાં તેની માંગ વધીને 2500 એકમો જેટલી થાય છે, તો માંગની મૂલ્યસાપેક્ષતાની ગણતરી નીચે પ્રમાણે થઈ શકે.

ઉપર જ્ઞાવેલા સૂત્ર પ્રમાણે :

$$\text{માંગની મૂલ્યસાપેક્ષતા} = \frac{\frac{2500 - 2000}{2500 + 2000}}{\frac{9 - 10}{9 + 10}}$$

$$= \frac{\frac{500}{-1}}{\frac{4500}{19}} = \frac{\frac{1}{9}}{\frac{-1}{19}} = \frac{19}{-9}$$

$$= - \frac{19}{-9}$$

$$= - 2.11$$

અતે આ યાદ રાખવું જોઈએ કે, માંગની મૂલ્ય-સાપેક્ષતા હંમેશાં ઋણ (negative) હોય છે, કારણ કે કિમત ઘટતા માંગનો વધારો થાય છે અને કિમત વધતા માંગમાં ઘટાડો થાય છે. એક ધના (positive) હોય તો બીજું ઋણ (negative) હોય છે, એટલે તેમનો ભાગાકાર હંમેશાં ઋણ આવે છે.

## ૫ - ૫ માગની આવકસાપેક્ષતા :

(૧) અર્થ : અન્ય પરિબળો સ્થિર હોય અને ગ્રાહકની આવકના ફેરફારને લીધે માગમાં જે ફેરફાર થાય છે તેને માગની આવકસાપેક્ષતા કહી શકાય. પરંતુ અર્થશાખમાં માગની મૂલ્યસાપેક્ષતાની વધુ ચોક્કસાઈભરેલી વ્યાખ્યા આપવામાં આવે છે. વોટસનના શબ્દોમાં કહીએ તો 'માગની આવકસાપેક્ષતા એટલે માગનો ટકાવારી ફેરફાર અને આવકનો ટકાવારી ફેરફાર એ બંને વચ્ચેનું ગુણોત્તર પ્રમાણ.' આમ, માગની આવકસાપેક્ષતા આવકફેરફારના પ્રત્યાધારતુપે વસ્તુની માગમાં થતા ફેરફારનું માપ છે.

માગની આવકસાપેક્ષતા માપવા માટે ટકાવારી ફેરફારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં માગના ટકાવારી ફેરફારની આવકના ટકાવારી ફેરફાર સાથે તુલના કરીને માગની આવકસાપેક્ષતાનો ચોક્કસ આંક મેળવવામાં આવે છે. સૂત્રના સ્વરૂપમાં કહીએ તો,

માગમાં ટકાવારી ફેરફાર

$$\frac{\text{આવકમાં ટકાવારી ફેરફાર}}{\text{આવકમાં ટકાવારી ફેરફાર}} = \text{માગની આવકસાપેક્ષતા.}$$

સંજ્ઞાઓનો ઉપયોગ કરીને ઉપર્યુક્ત સૂત્રની રજૂઆત આ પ્રમાણે કરી શકાય :

$$\frac{\Delta D}{D} \div \frac{\Delta Y}{Y}$$

$$= \frac{\Delta D}{D} \times \frac{Y}{\Delta Y}$$

$$= \frac{\Delta D}{\Delta Y} \times \frac{Y}{D}$$

જેમાં  $D$  = મૂળ માગ  $\Delta D$  = માગમાં ફેરફાર,  $Y$  = આવક અને  $\Delta Y$  = આવકમાં ફેરફાર.

ઉદાહરણની મદદથી આ સૂત્ર વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય. ધારો કે કોઈ એક ગ્રાહકની આવક રૂ. ૧,૦૦૦ છે અને તેની ખાંડની વપરાશ ૧૦ કિલોગ્રામ છે. હવે ધારો કે તેની આવક રૂ. ૧,૪૦૦ થતાં ખાંડની વપરાશ ૧૨ કિલોગ્રામ થાય છે. આ પરિસ્થિતિમાં  $D = ૧૦$ ,  $\Delta D = ૨$ ,  $Y = ૧,૦૦૦$  અને  $\Delta Y = ૪૦૦$  છે. આથી ખાંડની માગની આવકસાપેક્ષતા  $\frac{1}{2}$  થશે.


$$\begin{aligned}
 &= \frac{\Delta D}{\Delta Y} \times \frac{Y}{D} \\
 &= \frac{2}{400} \times \frac{9,000}{10} \\
 &= \frac{9}{2}
 \end{aligned}$$

આ ઉદાહરણમાં માગની આવકસાપેક્ષતા હકારાત્મક કે ધન છે, કારણ કે આવક વધતાં માગ પણ વધે છે. આવકનો ધન ફેરફાર માગમાં ધન ફેરફાર લાવે છે. તથુપરંતુ આ ઉદાહરણમાં માગની આવકસાપેક્ષતા એકમથી ઓછી છે. આવકમાં 40 ટકા વધારો થતાં ખાંડની માગમાં 20 ટકા વધારો થાય છે. આવકના ટકાવારી ફેરફારથી માગનો ટકાવારી ફેરફાર ઓછો છે.

(2) માગની આવકસાપેક્ષતાના પ્રકારો : ઉપરના ફક્રા પરથી સ્પષ્ટ થાય છે કે માગની આવકસાપેક્ષતાનું વર્ગીકરણ બે દિશિકોષાથી થઈ શકે : એક, આવકમાં વધારો થતાં માગ વધે છે, ધન છે તે રિશ્યુ રહે છે એ દાખિએ અને બીજું, આવકના ટકાવારી ફેરફારની સરખામણીમાં માગનો ટકાવારી ફેરફાર વધુ છે, ઓછો છે કે સપ્રમાણ છે એ દાખિએ.

પ્રથમ દિશિકોષા મુજબ માગની આવકસાપેક્ષતાના ત્રણ પ્રકારો છે : (i) હકારાત્મક આવકસાપેક્ષતા (ii) નકારાત્મક આવકસાપેક્ષતા અને (iii) શૂન્ય આવકસાપેક્ષતા. આપણો દરેકનો પરિચય મેળવીએ.

(i) માગની હકારાત્મક આવકસાપેક્ષતા : આવક વધતાં માગ વધે (અથવા આવક ઘટતાં માગમાં ઘટાડો થાય) ત્યારે માગની આવકસાપેક્ષતા હકારાત્મક કે ધન કહેવાય છે. સાધારણ પ્રકારની બધી વસ્તુઓ (જે Normal goods કહેવાય છે.)ની માગ ધન આવકસાપેક્ષતા પરાવે છે. માગની આવકસાપેક્ષતા હકારાત્મક ત્યારે આવક-માગ સંબંધ દર્શાવતી રેખા ધન ઢાળની હોય છે. (જુઓ આદૃતી-૪)



(II) માગની નકારાત્મક આવકસાપેક્ષતા : આવક વધતાં માગ ઘટે અને આવક ઘટતાં માગ વધે ત્યારે વસ્તુની માગની આવકસાપેક્ષતા નકારાત્મક કે ઝણ કહેવાય છે. ખલકા પ્રકારની વસ્તુઓની માગની આવકસાપેક્ષતા નકારાત્મક હોય છે. માગની આવકસાપેક્ષતા નકારાત્મક હોય ત્યારે આવક-માગ સંબંધ દર્શાવતી રેખા ઝણની હોય છે. (જુઓ આદૃતી-૫)

(III) માગની શૂન્ય આવકસાપેક્ષતા : આવક વધે કે ધટે, વસ્તુની માગનું પ્રમાણ સ્થિર રહેતું હોય તો માગની આવકસાપેક્ષતા શૂન્ય કહેવાય છે. સામાન્ય રીતે પોસ્ટકાર્ડ, મીલ્સ, સોય વગેરે જેવી વસ્તુઓની માગ પર આવક ફેરફારની કશી અસર પડતી નથી. માગની આવકસાપેક્ષતા શૂન્ય હોય ત્યારે આવક-માગ સંબંધ દર્શાવતી રેખા જિભા પરીને સમાંતર સીધી રેખા હોય છે.


(જુઓ આફૂતિ-૬)

બીજા દાટકોણ મુજબ, માગની આવકસાપેક્ષતાના ત્રણ પ્રકારો છે : (I) એકમ આવકસાપેક્ષતા કે સામ્રાજ્ય આવકસાપેક્ષતા, (II) એકમથી વધુ આવકસાપેક્ષતા અને (III) એકમથી ઓછી આવકસાપેક્ષતા. દરેકનો પરિચય મેળવીએ.

(I) એકમ આવકસાપેક્ષતા : માગનો

ટકાવારી ફેરફાર આવકના ટકાવારી ફેરફાર જેટલો જ હોય ત્યારે માગની આવકસાપેક્ષતા એકમ બરાબર હોય છે. દા.ત., આવકમાં ૧૦ ટકા વધારો થતાં વસ્તુની માગ બરાબર ૧૦ ટકા વધે છે. માગની આવકસાપેક્ષતા લકારાત્મક અને એકમ બરાબર હોય ત્યારે આવક-માગ દર્શાવતી રેખા પણ ઢાળની હોય છે અને તે બરાબર ૪૦%ને ખૂલ્લે દરેલી હોય છે.


આફૂતિ-૭માં OA આવકની સપાટીએ



વસ્તુની માગની OC છે અને OB આવકની સપાટીએ માગ OD છે. આમ આવકમાં AB (૫૦ ટકા) વધારો થતાં માગમાં CD (૫૦ ટકા) જેટલો વધારો થાય છે. આમ માગની આવકસાપેક્ષતા  $50/50 = 1$  છે.


(II) એકમથી વધુ આવકસાપેક્ષતા :

માગનો ટકાવારી ફેરફાર આવકના ટકાવારી ફેરફારથી વધુ હોય ત્યારે માગની આવકસાપેક્ષતા એકમથી વધુ હોય છે. સામાન્ય રીતે મોજશોખની વસ્તુઓની માગની આવકસાપેક્ષતા આ પ્રકારની હોય છે. માગની આવકસાપેક્ષતા લકારાત્મક હોય અને એકમથી વધુ હોય ત્યારે આવક-માગ સંબંધ દર્શાવતી રેખા પણ ઢાળની હોય છે અને ઉલ્લિ પરીને (ક્રીએન) છેદ છે.



આફ્ટર-ટમાં OA આવકે OC માગ છે અને OB આવકે OD માગ છે. આવકમાં AB (20 ટકા) વધારો થતાં માગમાં CD (40 ટકા) વધારો થાએ છે. માગની આવકસાપેક્ષતા  $\frac{40}{20} = 2$ . ૫ છે.

(III) એકમથી ઓછી આવકસાપેક્ષતા : માગનો ટકાવારી કેરકાર આવકના ટકાવારી કેરકારથી ઓછો હોય ત્યારે માગની આવકસાપેક્ષતા એકમથી ઓછી હોય છે. સામાન્ય રીતે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની માગ એકમથી ઓછી મૂલ્યસાપેક્ષતા હોય છે. આવક વધે પણ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની માગ અને વધરાચ વધે છે ખરી, પણ માગમાં ટકાવારી વધારો આવકના ટકાવારી વધારાચી ઓછો હોય છે. માગની આવકસાપેક્ષતા હકારાત્મક



હોય અને એકમથી ઓછી હોય ત્યારે આવક-માગ સંબંધ દર્શાવતી રેખા મન ઢાળની હોય છે અને આવક ખરીને ( $3 \times$  ધરીને) છેદ છે.

આફ્ટર-ટમાં OA આવક OC માગ છે અને OB આવકે CD માગ છે. આમ આવકમાં AB (20 ટકા) વધારો થતાં માગ CD (40 ટકા) જેટલી વધે છે. આથી માગની આવકસાપેક્ષતા  $20/40 = 2/5$  છે.

(૩) માગની આવકસાપેક્ષતા પર અસર કરતાં પરિણામો : જુદી જુદી વસ્તુઓની માગની આવકસાપેક્ષતા જુદી હોય છે. માગની આવકસાપેક્ષતાને અસર કરતાં પરિણામો મુજબત્વે બે છે : વસ્તુનો પ્રકાર અને આવકની સપાઠી.

(I) વસ્તુનો પ્રકાર : સામાન્ય રીતે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની માગની આવકસાપેક્ષતા એકમથી ઓછી હોય છે, જ્યારે મોજશોભની વસ્તુઓની માગની આવકસાપેક્ષતા એકમથી વધુ હોય છે.

સાધારણ પ્રકારની વસ્તુઓની માગની આવકસાપેક્ષતા હકારાત્મક હોય છે, જ્યારે હલકા પ્રકારની વસ્તુઓની માગની આવકસાપેક્ષતા નકારાત્મક હોય છે.

(II) આવકની સપાઠી : નીચી આવકની સપાઠીએ લોકો સ્કુટર-જેવી વસ્તુઓની ખરીદીનો વિચાર પણ કરતાં નથી. આવકની નીચી સપાઠીએ તે વસ્તુઓની માગની આવકસાપેક્ષતા શૂન્ય હોય છે. અમુક સપાઠી પછી આવક વધે તો લોકો સ્કુટર ખરીદે છે અને આવક સતત વધતી રહે તો હુંબના બધા સભ્યોની જરૂરિયાત ઘાનમાં લઈ તેઓ એકથી વધુ સ્કુટર પણ ખરીદે છે. આમ આવકની સપાઠીની અમુક કક્ષામાં માગની આવકસાપેક્ષતા હકારાત્મક હોય છે. પરંતુ ઓપછી આવક સતત વધતી રહે તો લોકો સ્કુટરને બદલે ગોટરકાર ખરીદે છે. આમ ખૂબ ઊચી આવકે સ્કુટરની માગની આવકસાપેક્ષતા ફરી શૂન્ય થઈ જાય છે.

(૪) માગની આવકસાપેક્ષતાના ખાલાનું મહાવ : વસ્તુની માગની આવકસાપેક્ષતા અંગેની માહિતી પેડીના સંચાલકો માટે ખૂબ ઉપયોગી છે. આ માહિતીના આધારે તેઓ વેચાણની

આગાહી કરી શકે છે અને ઉત્પાદનશક્તિના વિસ્તરણ અંગે પૂર્વઆયોજન કરી શકે છે. દા.ત., ટેલિવિઝન સેટની માગની આવકસાપેક્ષતા ખૂબ જીથી જાણાઈ છે. આથી ટેલિવિઝન સેટના ઉત્પાદકો અને વિકેતાઓ દેશમાં આર્થિક વિકાસ સાથે લોકોની આવકમાં જેમ વધારો થાય તેમ ટેલિવિઝન સેટના વધુ વેચાણની અપેક્ષા રાખે છે.

બીજું, આયોજન પંચ માટે પણ આ ખ્યાલ ઉપયોગી છે, પંચવર્ધીય ઘોજનામાં જુદા જુદા ઉદ્ઘોગો વચ્ચે સાપનોની ફળવણી અંગેના નિર્ણયો લેતી વખતે રાખ્યી આવક અને માથાદિ આવકની ભાવિત વૃદ્ધિ અંગેના અંદાજોના આધારે આયોજના પંચ જુદી જુદી વસ્તુઓની માગવૃદ્ધિનાં વલભોનો કમાસ મેળવી શકે છે અને એ માગવૃદ્ધિ સંતોષવા માટે જુદા જુદા ઉદ્ઘોગોમાં ઉત્પાદનકુમતાનું આયોજન કરી શકે છે.

#### ૫ - ૬ માગની પ્રતિમૂલ્યસાપેક્ષતા :

(૧) માગની પ્રતિમૂલ્યસાપેક્ષતાનો અર્થ : કોઈ એક વસ્તુની માગ પર તેની પોતાની કિમત અને ગ્રાહકોની આવક ઉપરાંત અન્ય સંબંધિત વસ્તુની કિમતમાં થતા ફેરફારની પણ અસર પડે છે. x વસ્તુની કિમતમાં ફેરફારની y વસ્તુની માગ પર અસર પડે છે અને y ની કિમતના ફેરફારની x ની માગ પર અસર પડે છે. અર્થશાલમાં x ની કિમતના ફેરફારને પરિષામે y ની માગમાં થતા ફેરફારના માપને y વસ્તુની માગની પ્રતિમૂલ્યસાપેક્ષતા (અથવા પરસ્પર મૂલ્યસાપેક્ષતા અંથવા સામસામી મૂલ્યસાપેક્ષતા) કહે છે. ફરજુસનના શબ્દોમાં કહીએ તો x-nી કિમતમાં ટકાવારી ફેરફાર અને y ની માગમાં ટકાવારી ફેરફાર એ બંનેના ગુણોત્તર મ્રમાણને માગની પ્રતિમૂલ્યસાપેક્ષતા કહેવામાં આવે છે.

વસ્તુની માગની પ્રતિ મૂલ્યસાપેક્ષતાનું માપ મેળવવા માટે ટકાવારી ફેરફારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો આ પદ્ધતિમાં x વસ્તુની કિમતનો ટકાવારી ફેરફાર અને y ની માગનો ટકાવારી ફેરફાર એ બંનેની સરખામકી કરવામાં આવે છે. સૂત્રના સ્વરૂપમાં કહીએ તો —

$$\frac{y \text{ ની માગમાં ટકાવારી ફેરફાર}}{x \text{ ની કિમતમાં ટકાવારી ફેરફાર}} = x \text{ના સંદર્ભમાં } y \text{ ની માગની પ્રતિમૂલ્યસાપેક્ષતા.}$$

સંશોધનો ઉપયોગ કરીને આ સૂત્ર નીચે મ્રમાણે રજૂ કરી શકાય :

$$\frac{\Delta Dy}{Dy} \div \frac{\Delta Px}{Px}$$

$$= \frac{\Delta Dy}{Dy} \times \frac{Px}{\Delta Px}$$

$$= \frac{\Delta Dy}{\Delta Px} \times \frac{Px}{Dy}$$

જેમાં  $Dy = y$  ની મૂળ માગ  $\Delta Dy = y$  ની માગમાં કેરકાર,  $Px = x$  ની મૂળાંકિત અને  $\Delta Px = x$  ની કિમતમાં કેરકાર.




આ પદ્ધતિ વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે એક કાલ્યનિક ઉદાહરણ બાઈએ. ધારો કે ચાની ડિલોગ્રામ દીઠ કિમત ૧૦૦ રૂ. પરથી વધીને ૧૨૫ રૂ. થાય છે અને તેના પરિણામે કોફીની માગ ૧૦૦ ડિલોગ્રામ પરથી વધીને ૧૧૦ ડિલોગ્રામ થાય છે. આ પરિસ્થિતિમાં ચાની કિમતના સંદર્ભમાં કોફીની માગની પ્રતિમૂલ્યસાપેક્ષતા ૨/૫ છે. આપણો કોફીને  $y$  સંશા અને  $x$  સંશા દ્વારા દર્શાવીએ તો,

$$\begin{aligned} \frac{\Delta Dy}{\Delta Px} &\times \frac{Px}{Dy} \\ &= \frac{10}{25} \times \frac{100}{100} = \frac{2}{5} \end{aligned}$$

અહીં ચાની કિમત વધતાં કોફીની માગ વધે છે. આથી કોફીની માગની પ્રતિ મૂલ્યસાપેક્ષતા હકારાત્મક છે. વળી, ચાની કિમતના ટકાવારી કેરકારથી માગનો ટકાવારી કેરકાર ઓછો છે. આથી કોફીની માગની પ્રતિમૂલ્યસાપેક્ષતા એકમણી ઓછી છે.

(2) માગની પ્રતિમૂલ્યસાપેક્ષતાના પ્રકારો : માગની પ્રતિમૂલ્યસંપોદના ત્રણ પ્રકારની છે : હકારાત્મક પ્રતિમૂલ્યસાપેક્ષતા, નકારાત્મક પ્રતિમૂલ્યસાપેક્ષતા અને શૂન્ય પ્રતિમૂલ્યસાપેક્ષતા. આ પૈકી દરેક વિરો પરિયત મેળવી લાઈએ.

(i) હકારાત્મક પ્રતિમૂલ્યસાપેક્ષતા : જે  $x$  ની કિમત વધતાં  $y$  ની માગ વધે અને  $x$  ની કિમત ઘટતાં  $y$  ની માગ ઘટે તો  $y$  વસ્તુની માગની પ્રતિમૂલ્યસાપેક્ષતા હકારાત્મક કે ધન હોય છે. યની માગની પ્રતિમૂલ્યસાપેક્ષતા હકારાત્મક હોય ત્યારે  $x$  ની કિમત અને  $y$  ની માગનો સંબંધ દર્શાવી રેખા ધન ઢાણની હોય છે. જેમ કે આકૃતિ-૧૦માં  $x$  ની કિમતમાં AB વધારો થતાં  $y$  ની માગ CD વધે છે.



(ii) નકારાત્મક પ્રતિમૂલ્યસાપેક્ષતા : x ની કિંમત વધતાં y ની માગ ઘટે અને x ની કિંમત ઘટતાં y ની માગ વધે તો y ની માગની પ્રતિમૂલ્યસાપેક્ષતા નકારાત્મક જાણ હોય છે. આ પરિસ્થિતિમાં x ની કિંમત અને y ની માગ વચ્ચેનો સંબંધ દર્શાવતી રેખા જાણની હોય છે. જેમ કે આકૃતિ-૧૧માં x ની કિંમતમાં AB વધારો થતાં y ની માગમાં DC ઘટાડો થાય છે.

(iii) શૂન્ય પ્રતિમૂલ્યસાપેક્ષતા : x ની કિંમતમાં વધારો થાય કે ઘટાડો, y ની માગનું પ્રમાણ સ્થિર રહેતું હોય તો y ની માગની પ્રતિ મૂલ્યસાપેક્ષતા શૂન્ય હોય છે. આ પરિસ્થિતિમાં x ની કિંમત અને y ની માગ વચ્ચેનો સંબંધ દર્શાવતી રેખા જાણી બરીને સમાંતર સીધી રેખા હોય છે. આકૃતિ-૧૨માં x ની કિંમતમાં AB વધારો થાય છે, છતાં y ની માગ OC સપાટીએ સ્થિર છે.

(૩) માગની પ્રતિમૂલ્યસાપેક્ષતાનો અસર કરતાં પરિણામો : વસ્તુઓની માગની પ્રતિ મૂલ્યસાપેક્ષતાનો આધાર એ વસ્તુઓ કેવા પ્રકારની છે અને તેમની વચ્ચે કેવો સંબંધ છે એ બાબતો પર છે. આપણે કહી શકીએ કે,

(i) x અને y અવેજી વસ્તુઓ હોય તો માગની પ્રતિમૂલ્યસાપેક્ષતા હકારાત્મક હોય છે. દા.ત., ચા અને કોઈ. ચા ભૌંધી થાય ત્યારે લોકો ચાની અવેજીમાં કોઈની વપરાશ કરે છે. આથી કોઈની માગ વધે છે.

(ii) x અને y પૂર્ક વસ્તુ હોય તો માગની પ્રતિમૂલ્યસાપેક્ષતા નકારાત્મક હોય છે. દા.ત., મોટરકાર અને પેટ્રોલ. મોટરકાર ભૌંધી થાય તો મોટરકારની માગ ઘટે છે અને તેની સાથે પેટ્રોલની માગ અને વપરાશ પક્ષ ઘટે છે.

(iii) x અને y સ્વતંત્ર વસ્તુઓ હોય તો માગની પ્રતિમૂલ્યસાપેક્ષતા શૂન્ય હોય છે. દા.ત., ચા અને પેટ્રોલ. ચાની કિંમતના ફેરફારની પેટ્રોલની માગ પર કશી અસર પડતી નથી અને પેટ્રોલની કિંમતના ફેરફારની ચાની માગ પર કશી અસર પડતી નથી.

(૪) માગની પ્રતિ મૂલ્યસાપેક્ષતાના ખાલનું મહત્વ :

(i) આર્થિક વિશ્વેષણમાં ચીજવસ્તુઓનાં બજારોનું વળ્ફિકરણ કરવામાં માગની પ્રતિમૂલ્યસાપેક્ષતાના ખાલનો ઉપયોગ કરવામાં આવે છે. પૂર્ણ હરીકાઈમાં બધા ઉત્પાદકો બધી રીતે એકસરખી વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરે છે. આથી તેમની પેદાશો વચ્ચે માગની પ્રતિમૂલ્યસાપેક્ષતા અગાપ કે અનાંત હોય છે. ઠાજારાયુક્ત હરીકાઈમાં ઉત્પાદકો નજીકની અવેજ વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરે છે. તેમની પેદાશો બધી રીતે એકસરખી નથી. તેથી માગની પ્રતિમૂલ્યસાપેક્ષતા અગાપ હોતી નથી. અગાપથી ઓછી હોય છે, પરંતુ પેદાશો વચ્ચેનો તફાવત નજીવો હોય છે તેથી ઠાજારાયુક્ત હરીકાઈમાં માગની પ્રતિમૂલ્યસાપેક્ષતા વહુ પ્રબળ હોય છે. ઠાજારામાં એક વેચાણ હોય છે અને એની પેદાશની અવેજ વસ્તુઓ ઉપલબ્ધ હોતી નથી. આથી ઠાજારામાં માગની પ્રતિમૂલ્યસાપેક્ષતા નજીવી હોય છે. આમ સાબીત થાય છે કે કોઈ એક ઉત્પાદકના વસ્તુની માગની પ્રતિમૂલ્યસાપેક્ષતા જેમ ઓછી હોય તેમ તેની ઠાજારાશક્તિ વહુ મળજ હોય છે.

(ii) વેચાણવિષયક નીતિના ઘટતરમાં સંચાલણો માટે માગની પ્રતિમૂલ્યસાપેક્ષતાનો ખાલ (ઉપયોગ) છે. ખાલનોંના ઉત્પાદનનું આયોજન કરતી વખતે ઉત્પાદકોને ધીના ભાવનાં વલણો ખાલનમાં લેવાં પડે છે. જો ધીના ભાવ વપણા હોય તો ખાલને વખતે ગેવી અપેક્ષા તેઓ રાખી શકે છે.

## ૫-૭ માંગના પ્રકારો

અહીં આપણે જુદા જુદા પ્રકારની માંગ જેવી કે ઉત્પાદક અને વપરાશી વસ્તુ માટેની માંગ, ટકાઉ અને નાશવંત વસ્તુ માટેની માંગ, બુત્પન અને સ્વતંત્ર માંગ, ઉઘોળી માંગ અને પેઢીની માંગ તેના નિર્ણાયક પરિબળોનો અભ્યાસ કરીશું.

### ૧. ઉત્પાદક વસ્તુ અને વપરાશી વસ્તુ માટેની માંગ :

અર્થ : જે વસ્તુ બીજી વસ્તુઓના ઉત્પાદન માટે વપરાય છે, તે ઉત્પાદક વસ્તુ કહેવાય છે. આ રીતે બીજી વસ્તુઓ વપરાશી અથવા ઉત્પાદક હોઈ શકે. ઉદાહરણ તરીકે સીવવાના સંચાનું ઉત્પાદન કરનાર યંત્રો ઉત્પાદક વસ્તુ છે, પરંતુ તે યંત્રો દ્વારા જેણું ઉત્પાદન થયું તે સીવવાનો સંચો પોતે ઉત્પાદક વસ્તુ છે. સીવવાના સંચા દ્વારા સીવેલાં કપડાં તૈયાર થાય છે જે વપરાશી વસ્તુ છે.

જે અંતિમ વપરાશ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે વપરાશી વસ્તુ છે. દા. ત., સીવેલાં કપડાં, બિસ્ટિ, વપરાશી વસ્તુના ટકાઉ અને નાશવંત એવા પ્રકારો પારી શકાય. જેણો એક કરતાં વધારે વખતા વપરાશ ન થાય તે નાશવંત વસ્તુ કહેવાય. દા. ત., દૂપ, લિંગકા, ચોકેલેટ. જેણો વપરાશ અમુક સમગ્ર સુધી અનેક વાર માટે થયા કરતો હોય તેવી વસ્તુ ટકાઉ વસ્તુ કહેવાય. દા. ત., ટેલેવિઝન, છત્રી, બૂટ. ઉત્પાદક વસ્તુના પણ જે પ્રકારો પારી શકાય. વપરાશમાં લઈ શકાય તેવી વસ્તુ જેવી કે યંત્રો, સ્લેલસા, વીજળી. અહીં વસ્તુ ક્યા ઉપયોગમાં લેવામાં આવેલ છે તેનો આધારે તેનો લેદ પારાખી શકાય. કોલસાનો ઉપયોગ રસોઈ બનાવવાના કામમાં થતો હોય તો તે વપરાશી વસ્તુ છે અને કારખાનામાં થતો હોય તો તે ઉત્પાદક વસ્તુ છે.

સામાન્ય રીતે ઉત્પાદક વસ્તુની માંગ વપરાશી વસ્તુની માંગ કરતાં જુદી પડે છે. તેના નાશ કારણો છે :

- (1) ઉત્પાદક વસ્તુના ખરીદનારા ધંધાદારીઓ હોય છે. તેઓ ખરીદીમાં નિષ્પાત હોય છે. તેઓ અવેજ વસ્તુથી માણિતગાર હોય છે.
- (2) તેઓનો હેતુ શુદ્ધ રીતે આર્થિક હોય છે. તેઓ વસ્તુઓ માત્ર પોતાના ઉપયોગ માટે નથી ખરીદતા, પરંતુ તેમાંથી નફો કમાવા માટે ખરીદે છે. આથી તેઓ કિમતમાં રહેતા નજીવા તકાવતને પણ ધ્યાનમાં લે છે.
- (3) ઉત્પાદક વસ્તુની માંગ વપરાશ અથવા ઉત્પાદનમાંથી ઊભી થાય છે. આથી તેની માંગમાં જુદી જુદી રીતે પરિવર્તનો આવે છે. સામાન્ય રીતે આ પરિવર્તનો વધુ તીવ્રતા ધરાવતાં હોય છે.

ઉત્પાદક અને વપરાશી વસ્તુ વચ્ચેનો લેદ ઉપયોગી છે, પરંતુ તે મનસ્ત્વી બની જાય છે. અમુક વસ્તુ ઉત્પાદક છે કે વપરાશી છે તેનો આધાર તે વસ્તુ શા માટે ખરીદવામાં આવે છે તેના પર રહેલો છે. આ રીતે લેદ પાડવામાં પણ મનસ્ત્વિતાનું તત્ત્વ આવી જાય છે.

વળી, કટલાક વસ્તુ માત્ર આર્થિક હેતુસર ખરીદવામાં આવતી હોતી નથી. દા. ત., મેનેજર માટે ઓફિસિયાં ટેલલ અને પુરશીની ખરીદીમાં આર્થિક હેતુ કરતાં પ્રતિષ્ઠાનો હેતુ વધારે મહત્વાનો બને છે.

## 2. ટકાઉ વસ્તુ અને નાશવંત વસ્તુ માટેની માંગ :

માંગ-વિશ્વેષણમાં નાશવંત વસ્તુ કરતાં ટકાઉ વસ્તુ વધારે જટિલ સમસ્યા ઉભી કરી છે. નાશવંત વસ્તુનું વેચાણ મોટા ભાગે ચાલુ માંગને પહોંચી વણવા માટે થતું હોય છે. ટકાઉ વસ્તુનું વેચાણ અસ્તિત્વમાં હોય તેવી વસ્તુના જથ્થામાં વધારો કરે છે. આથી ટકાઉ વસ્તુની ચાલુ માંગને બે ભાગમાં વહેચવામાં આવે છે.

(1) જૂની ટકાઉ વસ્તુને બદલે થતી માંગ; અને

(2) ટકાઉ વસ્તુના હુલ જથ્થામાં થતો વધારો.

ટકાઉ વસ્તુ માટેની માંગનું એક લક્ષણ એ છે કે તે ધ્યાનની પરિસ્થિતિ સાથે અખ્યાર સંબંધ ધરારે છે, કારણ કે ટકાઉ વસ્તુનું ચાલુ ઉત્પાદન તે પ્રકારની વસ્તુમાંથી માંગવામાં આવતી હુલ ચાલુ કામગીરીઓને, અમૃક ભાગ જ પૂરો પાડે છે. આથી વસ્તુ દ્વારા મળતી કામગીરી માટેની માંગમાં થોડો ફેરફાર થાય તો પણ તે વસ્તુના વેચાણમાં તીવ્ર ફેરફારો થાય છે. દા. ત., આપણો ધ્યાનીએ કે ઓટોમોબાઈલના વાર્ષિક ઉત્પાદનનો નીચેની રીતે ઉપયોગ થાય છે.

(1) મોટરકારના ચાલુ જથ્થાના 10 ટકા જેટલો પ્રમાણનું પ્રતિસ્થાપન કરવા માટે;

(2) મોટરકારના પ્રમાણમાં 5 ટકા જેટલો વધારો કરવા માટે.

ત્યાર બાદ જો મોટરકાર દ્વારા થતા વાહનબ્યવહારની માંગ ઉં ટકા વધી તો મોટરકારની માંગ 20 ટકા જેટલી વધશે. ગતિવર્ધનની પ્રક્રિયાને કારણે આમ બને છે. આ હકીકત વિનાને સમજાએ. ધ્યારો કે મોટરકારનો ચાલુ જથ્થો 1,00,000નો છે. 10 ટકા પ્રતિસ્થાપન માટે એટલે 10,000 મોટરકારના પ્રમાણમાં 5 ટકા જેટલો વધારો કરવા માટે એટલે કે 5,000. આમ ચાલુ ઉત્પાદન 15,000 મોટરકારનું છે. હવે જો માંગ 3 ટકા વધી તો વધારાની 3,000 મોટરકારની માંગ સર્જય; જે 15,000 જેટલી મોટરકારના ચાલુ ઉત્પાદનના 20 ટકા કરેલાય.

ટકાઉ વસ્તુ માટેની માંગનું વિશ્વેષણ : પરંતુ ટકાઉ વસ્તુ માટેની માંગનું વિશ્વેષણ સરળ હોતું નથી. પ્રતિસ્થાપન માટેની માંગ અને ચાલુ જથ્થામાં વધારા માટેની માંગનાં નિશ્ચાયિક પરિબળોના અનેક સેટ હોય છે. મોટરકારનું જ દાયાત્મક ચાલુ રાખીએ તો પ્રતિસ્થાપન માટેની માંગનો આધાર મોટરની એક લોખંડના ભંગાર તરીકે કેટલી કિમત છે અને તે ચાલુ મોટરની વાહનબ્યવહારના સાધન તરીકે કેટલી કિમત છે તેના પર રહેલો છે. જ્યારે ચાલુ જથ્થામાં વધારા માટેની માંગ એકાએક પૂરી થાય છે ત્યારે વપરાયેલી મોટરનું મૂલ્ય ભંગારના મૂલ્ય કરતાં વધારે હોય છે. આથી નકામી થતી મોટરોનું પ્રમાણ ઓછું રહે છે અને આમ પ્રતિસ્થાપન માટેની માંગ ઘટે છે.

પ્રતિસ્થાપનનું સૌથી મહત્વનું નિશ્ચાયિક પરિબળ અપ્રયલન દર (Obsolescence rate) છે, જે જૂની વસ્તુની બજારમાં કિમત નક્કી કરે છે. મોટરકારના ભંગાર મૂલ્યને ધ્યાનમાં લીધા વગર તે કાઢી નાખવામાં આવે ત્યારે લોખંડના ભંગારની કિમત બનું ઓછો મહત્વનો ભાગ ભજવે છે. અમેરિકામાં આર્થિક મ્યુનિની સપાઈ નક્કી કરવામાં અપ્રયલન વાપાક અને જૂલાટ્યક સ્થાન ધરાવે છે. ટકાઉ વસ્તુના ગતિવિધિનું ગ્રાફિક બગાડ એ ભાગે જ નિશ્ચાયિક પરિબળ ગણાય છે. વપરાયી વસ્તુ માટે અને આશર્યજનક કલાએ ઉત્પાદક વસ્તુ માટે પણ સર્ટાઇલ, સગવડ અને આવક એ માંગ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

**ટકાઉ વસ્તુ માટેની માંગનાં નિર્ણાયક પરિબળો :** ટકાઉ વસ્તુ અને નાશવંત વસ્તુના ચાલુ જાચામાં વધારો કરવા માટેની માંગનાં નિર્ણાયક પરિબળો સ્પષ્ટાત્માં જુદાં જાહેતાં નથી, પરંતુ વ્યવહારમાં ટકાઉ વસ્તુની ખરીદીનો નિર્ણય વધુ ગુંયવાણભરેલો હોય છે, કરવા કે ભવિષ્ય વિષેનાં અનુમાનો તીવ્ર રીતે આદકના મગજમાં ઉદ્ઘવે છે. તે ભવિષ્યમાં તેના નિભાવ માટે વિષે કરે છે અને પોતાની ભવિષ્યની આવકના સંદર્ભમાં તેના સંચાલન ખર્ચનો વિચાર કરે છે. તે વસ્તુ વેચી નાખવામાં આવે તો તેની ડિમત કેટલી ઉપજરો તેનું તે અનુમાન કરી પોતાની ખરીદી મુલાંબી રાખે તો ભવિષ્યમાં તે વસ્તુના ભાવ વધશે કે ઘટશે તે વિષે વિચાર કરે છે. આ રીતે ટકાઉ વસ્તુ માટે ચાલુ ડિમત તથા આવક જ નહિ પરંતુ તેના ચાલુ વલશો અને આશાવાદની સ્થિતિ એ પણ યોગ્ય પરિબળો ગણાય અને તેમનો સમાવેશ નાંગ વિવેધનાં કરવો જોઈએ.

### 3. વ્યૂટ્પન માંગ અને સ્વયાત્ર માંગ :

**અર્થ :** જ્યારે વસ્તુની માંગ કોઈ મૂળ વસ્તુની ખરીદી સાથે જોડાયેલ હોય ત્યારે તેવી માંગ વ્યૂટ્પન માંગ કહેવાય છે. ઉદાહરણ તરીકે સિમેન્ટની માંગ વ્યૂટ્પન માંગ કહેવાય, જે મનનાંધકાપની પ્રવૃત્તિ સાથે સંકળાપેલ છે. કેટલીક વપન બોલણ વસ્તુની માંગ પર આધારિત વસ્તુની માંગ એ મૂળ વસ્તુની અગભૂત ભાગ હોય છે. દા. ત., બારી-બારણા એ મનનાં અંગભૂત ભાગો છે. કેટલીક વપન એક વસ્તુની બીજા પરની આધીનતા પૂરકતાને લીધે ઉદ્ઘલાયે છે. વર્તમાન યુગમાં એ ડિક્રિટ શોધવી મુશ્કેલ છે કે કઈ વસ્તુની માંગ બીજા વસ્તુની માંગ કરતાં સાવ સ્વતંત્ર છે, બધી જ ઉત્પાદક વસ્તુઓ, કાચો માલ અને અંગભૂત ભાગો માટેની માંગ વ્યૂટ્પન માંગ છે. આમ, વ્યૂટ્પન માંગ સામાન્ય ડિક્રિટ છે. વ્યવહારમાં સ્વતંત્ર માંગ અને વ્યૂટ્પન માંગ વચ્ચેનો બેદ મનસ્વી બની જાય છે.

વ્યૂટ્પન માંગની મૂલ્યસાપેક્ષતા સ્વતંત્ર મૂલ્યસાપેક્ષતા કરતાં ઓછી હોય છે તેથું ધારવામાં આવે છે. વસ્તુના અંગભૂત ભાગો કે જેની ડિમત સ્થિર કે જડ હોય છે તેને લીધે આમ બનતું હોય છે. સ્ટીલના ભાવમાં 10 ટકા ઘટાડો મોટરના ઉત્પાદન ખર્ચમાં માત્ર 1 ટકાનો ફેરફાર લાવે છે. અન્ય ખર્ચનો પથાવતૂ રહે અને સ્ટીલ પરનું ખર્ચ કુલ ખર્ચના 10 ટકા જેટલું હોય તો આવું પરિણામ આવે છે.

**મૂળ વસ્તુ અને પરાધીન વસ્તુ વચ્ચેનું પ્રમાણ સ્થિર હોય ત્યારે :** કેટલીક વસ્તુઓ તેમના ઉપયોગની રીતે બીજા વસ્તુઓ સાથે એટલી બધી ગાડ રીતે સંકળાપેલી હોય છે કે તે તેમની માંગનાં જુદાં નિર્ણાયક પરિબળો હોતાં નથી. જ્યારે આવી વસ્તુનો માત્ર એક જ ઉપયોગ હોય અને મૂળ વસ્તુ સાથે તેનું પ્રમાણ સ્થિર હોય ત્યારે આ પ્રમાણો બને છે. દા. ત., દી. વી. સેટ અને એન્ટેના. પરંતુ બે વસ્તુઓ વચ્ચે આવું સ્થિર પ્રમાણ ભાગ્યે જ હોય છે. સામાન્ય રીતે પ્રમાણમાં ફેરફાર થયા કરે છે અને પરાધીન વસ્તુના એક કરતાં વધારે ઉપયોગ હોય છે. મોટર વાહનોની સંખ્યા સાથે કાગ્યા રલરની માંગ જોડવામાં આવે. ત્યારે આ બંને પક્ષરનાં વલશો જોવા મળે છે.

**મૂળ વસ્તુ અને પરાધીન વસ્તુ વચ્ચેનું પ્રમાણ સ્થિર ન હોય ત્યારે :** જ્યારે મૂળ વસ્તુ અને પરાધીન વસ્તુ વચ્ચેનું પ્રમાણ સ્થિર ન હોય ત્યારે મૂળ વસ્તુની માંગના આધારે પરાધીન વસ્તુની માંગ અર્થાતું વ્યૂટ્પન માંગ નક્કી કરવી મુશ્કેલ છે. તે જ પ્રમાણો પરાધીન વસ્તુના અનેક ઉપયોગ થઈ શકતા હોય તો મૂળ વસ્તુની માંગના આધારે તેની માંગ નક્કી કરવાનું

કઠિન બને છે. ઇલેક્ટ્રિક મોટર અને સલ્જુરિક એસિડ અનેક મૂળ વસ્તુઓ સાથે ઉપયોગમાં લેવામાં આવે છે, આથી તેમની માંગ સરળતાથી નક્કી થઈ શકતી નથી.

મૂળીગત વસ્તુ જેવી કે પ્લાન્ટ અને સાધનોની માંગ વ્યૂપન માંગ છે. પરંતુ તેમના ઉપયોગની તીવ્રતામાં આવતા તકાવતો એટલા મોટા હોય છે કે તૈયાર વસ્તુની માંગના સંદર્ભમાં તેમની માંગનો અંદાજ માત્ર અટકણ બની રહે છે. દા. ત., સુતરાઉ કાપડ ઉદ્ઘોગમાં 'લૂમ'ની માંગ સુતરાઉ કાપડની માંગ દ્વારા ઉપયોગની તીવ્રતામાં ફેરફારો થયા કરે છે. સુતરાઉ કાપડની માંગ વધી તો ચિહ્નોની બે પાણી કે જ્યા પાણી ચલાવવામાં આવે. પરિણામે એવું બને કે 'લૂમ'ની માંગ વધી જ નહિએ.

#### 4. ઉદ્ઘોગની માંગ પેઢીની માંગ :

આર્થ : અમૃક વસ્તુની આખાયે ઉદ્ઘોગની કુલ માંગ બનાવવા માટે 'ઉદ્ઘોગની માંગ' શબ્દપ્રયોગ થાય છે. દા. ત., આપાં દેશની પોલાદાની કુલ માંગ એ પોલાદ ઉદ્ઘોગની માંગ કહેવાય, જ્યારે પેઢીની માંગ કોઈ એક પેઢીની અમૃક વસ્તુની માંગ સૂચને છે. દા. ત., 'ટીસ્લી' દ્વારા ઉત્પાદિત થતા પોલાદાની માંગ. કોઈ એક ઉદ્ઘોગની બધી જ પેઢીઓની માંગનો સરવાળો કરીને સમગ્ર ઉદ્ઘોગની માંગ મેળવી શકાય.

અહીં એ બાબત ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે ખાન્ડ દ્વારા વસ્તુવિમન્તતા બીજી કરવામાં આવી હોવા છતાં એક ઉત્પાદક જે વસ્તુ વેગે છે તેની અવેજી બીજા ઉત્પાદક દ્વારા વેચાતી વસ્તુ લઈ શકે, કારણ કે અહીં વસ્તુઓ એકબીજાની નજીકની અવેજીઓ હોય છે. આમ, ઉદ્ઘોગમાં જુદી જુદી બ્રાન્ડની વસ્તુઓ કે જે એકબીજાની નજીકની અવેજી વસ્તુઓ હોય છે, તેમનું ઉત્પાદન કરતી બધી જ પેઢીઓનો સમાવેશ થાય છે. દા. ત., વનસ્પતિ ધીના ઉદ્ઘોગમાં ગાલા, રથ, પનથટ વગેરે વનસ્પતિ ધીનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમાવેશ થાય. દેખીતી રીતે જ દૂરની અવેજી વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીનો ઉદ્ઘોગમાં સમાવેશ કરી શકાય નહિએ. શુદ્ધ ધી, સ્વાગતેલ, સરસવનું તેલ એ વનસ્પતિ ધીની દૂરની અવેજી વસ્તુઓ કહેવાય, તેથી વનસ્પતિ ધી-ઉદ્ઘોગમાં આ વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમાવેશ ન થઈ શકે.

ઉદ્ઘોગની માંગની અનુસૂચિ : ઉદ્ઘોગની માંગની અનુસૂચિ ઉદ્ઘોગોમાંની બધી જ પેઢીઓની કુલ માંગ અને કિમત વચ્ચેનો સંબંધ દરખાવે છે. જ્યારે બધી જ પેઢીઓની વસ્તુઓ નજીકની અવેજી વસ્તુઓ હોય ત્યારે આ રીતે ઉદ્ઘોગની માંગની અનુસૂચિ રચી શકાય છે. જ્યારે ઉદ્ઘોગમાં વસ્તુવિમન્તતાનું પ્રમાણી ખૂલ વધારે હોય ત્યારે ઉદ્ઘોગની માંગની અનુસૂચિનો ખ્યાલ અસ્પષ્ટ બની જાય છે. સંચાલકીય દસ્તિએ માત્ર ઉદ્ઘોગની માંગનો અભ્યાસ પર્યાપ્ત નથી. સંચાલકીય દસ્તિએ જે મહત્વાનું છે. તે એ છે કે ઉદ્ઘોગની કુલ માંગમાં પેઢીનો હિસ્સો કેટલો છે. ઉદ્ઘોગની કુલ માંગ અને પેઢીના હિસ્સા વચ્ચે શો સંબંધ છે. આમ છતાં પેઢીના વેચાણની આગાહી. માટે ઉદ્ઘોગની માંગની આગાહી કરીય એ એક સ્વાભાવિક ક્રમ છે.

ઉદ્ઘોગના માંગના અનુસૂચિ એ પેઢીના માંગના અભ્યાસ માટે ઉપયોગી પૂર્વનૂંખેકા પૂરી પાડે છે. વ્યક્તિગત પેઢીની માંગનો કિમત જાયેનો સંબંધ ઉદ્ઘોગની માંગની અનુસૂચિને આધારે નક્કી કરવામાં આવે છે. વ્યક્તિગત પેઢીની માંગ અને કિમત વચ્ચેના સંબંધની કથાનો આધાર ઉદ્ઘોગમાં કેવા મકારની હરીકાઈની સ્થિતિ પ્રવર્તે છે તેના પર રહેલો છે.

## प्रतिशुल्क विवरण

### व्यक्ति के कुहमानी अंग :

ने कोई एक व्यक्ति के कुहमानी  $\neq$  वस्तुओं आणी अंगांने विचार कराऱ्या तो, वस्ती आणे आवडी चहेचलीना माझो रहेता नव्ही. व्यक्तिनी अलिंगी, तेंनी आवडी आणे अन्य वस्तुओंना लावा. स्थिर ठेण्या येता  $\neq$  वस्तुनी डिमतमां पटाऊ थार्ड व्यक्तिनी  $\neq$  आणेती. अंग वधी तेंनी सहजतेनी घावले लाई तेंनी नागनी काल्पनिक अनुसूची नीचे सुलभ घनावी याचाय:

(विभाग (इन्हीनी))

(३, ५)

10

9

8

7

6

(विभाग (डायरी))

आचिक

1


2

3

4

5

घपस्ती आहितीना आधारे व्यक्ति के कुहमानी सहजतेनी अंग दर्शवती रेखा आकृतिमां नीचे सुलभ घावी याचाय:




અનુભાવના માંગ :

વ્યક્તિની આગની અનુભાવના આપારે એમણે અનારની આગની અનુભાવના તારણી શકાય બનારામાં કુલ જેણ્ટી વ્યક્તિઓ જિન્હે જિન્હે વસ્તુની જિન્હે જિન્હે આગની કરતી હોય ને દ્વારાવળી અનુભાવની નોંધ કરી શકાય નીચે દર્શાવ્યા સુજાતા બનારામાં આગની કાલ્પનિક અનુભાવના તારણી શકાય.

કિંમત (ડકનાની) (આગ ડકનાની)

(ડ. ના)	(આગ ડકનાની)
10	10,000
9	15,000
8	20,000
7	25,000
6	30,000

અનુભાવના દર્શાવતી હાલી આજુથી જમાણી આજુ રાહે હાતી અનાર આપણે રેખાની નીચે સુજાતા પ્રાપ્ત થશે:



## અનુભૂતિની માંગ :

અસ્તિત્વની આજની અનુભૂતિના આધારે, સમય અનુભૂતિની આજની અનુભૂતિની સરસી બાળપણે અનુભૂતિના કુલ જોડાની વ્યક્તિનો લિન-ન લિન. ક્રિએ વસ્તુની લિન-ન લિન આજની કરતી હોય તે દર્શાવતી અનુભૂતિનો સુખલાગે. કરીને અનુભૂતિમાં ભર્તી આજની અનુભૂતિ પ્રાપ્ત કરી થકાયા નીચે દર્શાવ્યા સુજાતા અનુભૂતિમાં આજની કાલ્પનિક અનુભૂતિની સરસી રાહાયાનું.

(ક્રમાંક (ડાયનાની))

(રૂ. માટી)

10

(આજ (ડાયનાની))

(માસિક)

10,000

9

15,000

8

20,000


7

25,000

6

30,000


અનુભૂતિમાં દર્શાવેલો ડાયી પાણીની જરૂરની લાભ તરફ કણી આજની રેખા નીચે સુજાતા પ્રાપ્ત થયે:



આનુભૂતિ : ૩૦૦

मांगनी का रेखा परनुँ डॉड पल्ट भिन्हु डिमत अने मांग वर्तयेत। संभव होते हैं। डिमत धरतां मांगनी चाहती थाथ के से DD रेखाना आणु लाग्न(negative slope)मो जेवा भये हे। मांगनी अनुसूचिना ए डिमत-मांग संभवी आपेक्षा हे ते दशावतां भिन्हुओने जेवीने मांगनी रेखा दोहरवामा आवी हे। वास्तवमां आपेक्षा भिन्हु उत्तरायन भिन्हुओ। डिमत-मांगना अब दोहरावामा आपेक्षा रीते दशावी शक्ति नहि। मांगनी रेखा दोहरवा भये आपेक्षा भिन्हुओने बोहवामा आव्यां हे, परं ऐ भिन्हुओ वर्तयेनी लाई परं असंभव भिन्हुओ हे अने ते कि डिमतमांग संभवी दशावे हे ते अन्नरमां उपलोक्ताओंने दशावेका (आपेक्षा डॉडपेक्षा) संभवी नहीं।

उपर दशावेल उदाहरणमां 10 रु. डिमत(डमनी) होए तारे सदरमनी मांग अन्नरमां 10,000 डमनी हे। आपेक्षु एवी कृत्यना करी वर्तयेके अन्नरमां डिमत 15 रु. (डमनी) होए तो सदरमनी मांग शुरू यह लाय आ। सोनेगामा मांगनी रेखानुँ एक भिन्हु ५ धरी पर आवे, एकले के रेखा २ धरी परथी शुरू यह धीमे धीमे डायी बाजूयी जमाणी तरक्की नाचे लाती रुप्य अने।



## UNIT - 3

### Production, Cost and Revenue Analysis (ઉત્પાદન, ખર્ચ અને આવક વિશ્લેષણ)

- ❖ ઉત્પાદન અને ઉત્પાદન વિધેય- ટુકડગાળાનું અને લાંબગાળાનું ઉત્પાદન વિધેય.
- ❖ ઉત્પાદન શક્યતા રેખા.
- ❖ સમ-ઉત્પાદન રેખા અને સમ-ખર્ચ રેખાઓ અને પેઢીની સમતુલ્ય.
- ❖ ખર્ચ વિશ્લેષણ:- વિવિધ ખર્ચના ઘણાલો:- કુલ સ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચે સંબંધ, વૈકલ્પિક ખર્ચ.
- ❖ આવકના ઘણાલો:- કુલ આવક, સીમાંત આવક, સરેરાશ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક વર્ણેના સંબંધો.

# UNIT - 3

## ઉત્પાદન, ખર્ચ અને આવક વિશ્લેષણ

પ્ર - ૧ ઉત્પાદન વિષેયનો અર્થ / લક્ષણો / સ્વરૂપ સમજાવો.

### ઉત્પાદન

પ્રસ્તાવના:

ઉત્પાદન એટલે વસ્તુના તુછિગુણમાં ઉમેરો કરવો તે. વસ્તુના તુછિગુણમાં ઉમેરો, વસ્તુના સ્વરૂપાંતર, સ્થળાંતર અને સમયાંતર દ્વારા થઈ શકે છે. ઉદાહરણ તરીકે - (i) સુધાર, લુધાર વગેરે કારીગરો જે કે વસ્તુઓ બનાવે છે. તેમાં તેઓ વસ્તુના સ્વરૂપમાં કેરકાર કરીને તેમાં પ્રાણીગુણનો ઉમેરો કરે છે. મોટા ભાગની ઉત્પાદનની પ્રક્રિયા સ્વરૂપાંતરની છે. (ii) ભાગના કોલસાને ફેકટરીમાં લાવવા, નદીડિનારા પરથી રેતી બાંધકામના સથે લાવવી, ખેડૂતોને ત્યાંથી અનાજ અને બીજી ખેતપેદાશો બજારમાં લાવવી એ સ્થળાંતરની પ્રક્રિયા છે. વસ્તુનું સ્થળાંતર થતાં તેના તુછિગુણમાં ઉમેરો બતો હોય છે. વેપારીઓ, દલાલો, ગેજનો વગેરેની પ્રવૃત્તિઓ વસ્તુના સ્થળાંતરની પ્રક્રિયાને પોશે છે. (iii) જ્યારે અમુક સમયે અમુક વસ્તુનો પુરવણો વધુ હોય તારે વેપારીઓ તેનો સંબંધ કરે છે અને જ્યારે તેની અધ્યત ઊંઝી થાય ત્યારે તેને બજારમાં વેવા માટે મૂકે છે. આ રીતે તેઓ સમયાંતર દ્વારા વસ્તુના તુછિગુણમાં ઉમેરો કરે છે. પરિણામે અધ્યતના સમયે વસ્તુ ઊંઝી કિમતે વેગીને તેઓ નશે મેળવી શકે છે. વસ્તુ વાપરનાર કે ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધી ઉત્પાદનની પ્રક્રિયા એક અથવા બીજા પ્રકારે ચાલુ જ રહે છે.

### 2. ઉત્પાદનનો સિદ્ધાંત

પ્રાણાલિગત એવા ઉત્પાદનના સિદ્ધાંતમાં ઉત્પાદનમાં વપરાતાં સાધનોને Factors of Production તરીકે ઓળખાવમાં આવતાં હતાં, પરંતુ હવે ઉત્પાદનમાં વપરાતાં સાધનો નીપણજીકો (inputs) તરીકે ઓળખાય છે; જેનો અર્થ ઉત્પાદનની પ્રક્રિયામાં ભૂમિ, શમ, મૂડી અને નિયોજનશક્તિ દ્વારા જે સેવાઓ આપવામાં આપે છે તેમનો ઉપયોગ એથે થઈ રહે. જ્યારે વિવિધ નીપણજી દ્વારા જે વસ્તુનોનું ઉત્પાદન થાય છે તેને નીપણજી કે ઉત્પાદન (output) કહે છે. નિર્ધારિત ઉત્પાદન માટે આપેલી ટેક્નોલોજીના સંઝોગેમાં વિવિધ નીપણજીનું સંયોજન કેવી રીતે કરવું તેની સાથે ઉત્પાદનનો સિદ્ધાંત સંબંધ પદ્ધતિ હોય છે. ઉત્પાદનના સિદ્ધાંતમાં ઉત્પાદન વિષેયનો ઘ્યાલ ઘડો મહારાનો છે. ગ્રામી હવે ગ્રામી ઉત્પાદનવિષેય વિષે વિગતાનીએ.

### 3. ઉત્પાદનવિષેય

ઉત્પાદન વિષેયનો ઘ્યાલ ઉત્પાદન સિદ્ધાંતમાં કેન્દ્રવત્તી સ્થાન પરાવે છે. નીપણજીક-નીપણજી વચ્ચેનો ટેક્નોલોજીકલ સંબંધ ઉત્પાદનવિષેય તરીકે ઓળખાય છે. વિસ્તૃત રીતે કઢીએ તો પેઢીના નીપણજી અને નીપણજી (ઉત્પાદન) વચ્ચેનો વિષેયાભક્ત સંબંધ ઉત્પાદનવિષેય કહેવાય. આપ ઉત્પાદનવિષેય એ એક ગાણિતિક સંબંધ છી કે જેમાં અમુક ચોક્કસ પ્રકારની વસ્તુનું ઉત્પાદનનું પ્રમાણ તેના માટે વાપરવામાં આવેલ અમુક ચોક્કસ પ્રકારના નીપણજી પર કંઈ રીતે આપાર રાખે છે તેનું વર્ણન કરવામાં આવે છે. (The production function is a mathematical relationship describing the way in which the quantity of a particular product depends upon the quantities of particular inputs used.)

ઉત્પાદન વિષેય નીચેનાં પરિબળો પર આધાર રાખે છે :

- (1) પેડીનું કદ
- (2) ઉપયોગમાં લેવામાં આવનારા નીપણકો (સાધનો)નું પ્રમાણ
- (3) નીપણકોના ભાવો
- (4) ટેકનિકલ જ્ઞાન સંબંધી સ્થિતિ
- (5) ઉત્પાદનની પદ્ધતિ.

જો આ પરિબળોમાં ફેરફાર થાય તો ઉત્પાદનવિષેયમાં આપોઆપ ફેરફાર થાય છે.  
દા. ત., નીપણકોનું પ્રમાણ વધારવામાં આવે અથવા નીપણકોનું સંયોજન બદલવામાં આવે  
અથવા ઉત્પાદનની અધ્યતન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો અગાઉ જેટલું ઉત્પાદન થતું  
હોય તેના કરતાં ઉત્પાદનમાં વધારો થાય છે.

**ઉત્પાદરણ :** વસ્તુની ગુણવત્તા અને પ્રમાણનો આધાર ઉત્પાદન માટે વાપરવામાં આવેલ  
નીપણકોની ગુણવત્તા અને પ્રમાણ પર આધાર રાખે છે. દા. ત., 1 ટન ચૂનાના પથ્થરો  
નીપણક તરીકે ઉપયોગમાં લેવાથી 2 ટન સિમેન્ટનું ઉત્પાદન થાય છે. ત્યાર બાદ જો ચૂનાના  
પથ્થરોનું પ્રમાણ વધારોને 2 ટન કરવામાં આવે તો સિમેન્ટનું ઉત્પાદન 4 ટન થાય છે. અહીં  
જોઈ શકાય છે કે ચૂનાના પથ્થરો કે જે નીપણક છે તેના પ્રમાણમાં ફેરફાર કરવાથી સિમેન્ટ કે  
જે નીપણ છે તેના ઉત્પાદનમાં પણ ફેરફાર થાય છે. અમૃક મકારના નીપણકોનું અમૃક રીતે  
સંયોજન કરવામાં આવે તો તેમાંથી કેટલું ઉત્પાદન મળશે તે વિશેની માહિતી ઉત્પાદનવિષેય  
દ્વારા મળે છે. નીપણકોનાં જુદાં જુદાં ઘણાં સંયોજનો શક્ય બને છે. તેથી જુદાં જુદાં ઘણાં  
ઉત્પાદનવિષેય હોઈ શકે છે. તેમાંથી એવું ઉત્પાદનવિષેય પસંદ કરવામાં આવે છે કે પેડીને  
મહત્વામં નથી આપાવે. એક વખત ઉત્પાદનવિષેય શોધી લીધા પછી પેડી માટે ઉત્પાદન અંગેના  
નિર્ણયો લેવામાં તે ખૂબ ઉપયોગી બને છે.

(અ) ઉત્પાદનવિષેયની રજૂઆત :

ઉત્પાદનવિષેય અનેક સ્વરૂપે રજૂ કરી શકાય. તે કોણાના રૂપમાં, સમીક્ષણના રૂપમાં  
અને કુલ, સરેરાચ અને સીમાંત નીપણકના રૂપમાં દર્શાવવામાં આવે છે. જ્યારે બે નીપણકો  
આપેલા હોય ત્યારે તે સમ-નીપણ વક્તો (isoquants) દ્વારા દર્શાવી શકાય. તે નીપણક-નીપણ  
કોઠા દ્વારા પણ રજૂ કરી શકાય. ઉત્પાદનવિષેય સામાન્ય રીતે ગાણિતિક સ્વરૂપમાં દર્શાવવામાં  
આવે છે. દા. ત., P = f(A). P is a function of A અહીં વસ્તુની નીપણ અમૃક મકારના એક  
જે નીપણક પર આધાર રાખે છે તેની રજૂઆત થયેલી છે. (P = નીપણ અને A = નીપણક).  
જો આપણે એવી રજૂઆત કરવી હોય કે વસ્તુની નીપણ અમૃક મકારના પાંચ નીપણકો પર  
આધાર રાખે છે તો આપણે ઉત્પાદનવિષેય આ રીતે લખી શકીએ. P = f(A, B, C, D, E); P is  
a function of A, B, C, D, E. અહીં P = નીપણ અને A, B, C, D, E એ અમૃક મકારનાં પાંચ  
નીપણકો છે. આ નીપણકોની ગુણવત્તા અને તેના પ્રમાણમાં ફેરફાર થતાં વસ્તુની નીપણ

(ઉત્પાદન)માં ફેરફાર થાય છે.

## ઉત્પાદન વિષેયના લક્ષણો અને સ્વરૂપ

ફક્તમાં, ઉત્પાદન વિષેયના લક્ષણો નીચે મુજબ આપી શકાય :

(૧) આપકો પાદ રાખતું જોઈએ કે ઉત્પાદન વિષેય બાતે છે કે સાપનોના ચોક્કસ સંયોજન દ્વારા વહું વહું કેટલું ઉત્પાદન મેળવી શકાય છે અથવા ઉત્પાદનનું ચોક્કસ પ્રમાણ મેળવવા માટે ઓછામાં ઓછાં કેટલા પ્રમાણમાં સાપનોની જરૂર પડે.

(૨) માર્ગવિષેયની જેગ ઉત્પાદન વિષેયની રજૂઆત પણ સમયના સંદર્ભમાં થવી જોઈએ. કારણ કે ચોક્કસ સમયગાળા દરમિયાન સાપનોના ચોક્કસ પ્રમાણ વહું કેટલું ઉત્પાદન મેળવી શકાય છે, તે ઉત્પાદન વિષેય દ્વારા બતાવવામાં થાયે છે.

(૩) કોઈ પણ પેઢીમાં ઉત્પાદન વિષેયનો આધાર એની ટેફ્નોલોજી પર હોય છે. ટેફ્નોલોજી નદ્વાપ તો ઉત્પાદન વિષેય બદલાપ છે. નવી ટેફ્નોલોજી વહું કાર્યક્રમ હોય તો ચોક્કસ સાપન સંયોજન વહું પહેલાં કરતાં વહું ઉત્પાદન પ્રમાણ થાય છે અથવા ચોક્કસ ઉત્પાદન મેળવવા પહેલાં કરતાં ઓછા પ્રમાણમાં સાપનો વપરાય છે.

### (ક) ઉત્પાદનવિષેયનાં સ્વરૂપો :

અર્થશાસ્ત્રીઓને નીપજકોમાં થતા કેરકાર અને તેને પરિષ્ઠામે નીપજ કે ઉત્પાદનમાં થતા કેરકાર વચ્ચેના સંભાળના આંકડાકીય વિશ્વેષજ્ઞને આધારે કેટલાક ઉત્પાદનવિષેયો ૨૨ કર્ચ્ચ છે. આમાંથી અમેરિકાના મેન્યુકેક્ચરિંગ લુઓગ માટે C. W. Cobb અને P. H. Douglas દ્વારા તૈયાર કરવામાં આવેલ ઉત્પાદનવિષેય સૌથી વહું અણીતું બન્યું છે. તે ઉપરાં CES (Constant Elasticity of Substitution) અને VES (Variable Elasticity of Substitution) ઉત્પાદનવિષેય, Leontief ઉત્પાદનવિષેય, સૂરેખ આધ્યાત્મિક-આધ્યાત્મિત ઉત્પાદનવિષેય વગેરે સ્વરૂપનાં ઉત્પાદનવિષેયો પણ જોવા મળે છે. જો કે તે કોબ-ડગલાસ-ઉત્પાદનવિષેય કેટલા પ્રયત્નિત બન્યા નથી. આમ છતાં અર્થશાસ્ત્રીઓ તે ઉત્પાદનવિષેયનો પણ ઉપયોગ કરે જ છે.

કેટલાક મહત્વના ગણી શકાય તેવા ઉત્પાદનવિષેયનાં સ્વરૂપો આ પ્રમાણો રજુ કરી શકાય :

- (૧) સાહુ સૂરેખ ઉત્પાદનવિષેય
- (૨) કોબ-ડગલાસ ઉત્પાદનવિષેય
- (૩) C. E. S. (Constant Elasticity of Substitution) ઉત્પાદનવિષેય
- (૪) V. E. S. (Variable Elasticity of Substitution) ઉત્પાદનવિષેય
- (૫) Leontief ઉત્પાદનવિષેય
- (૬) સૂરેખ આપોજન-આધારિત ઉત્પાદનવિષેય (Linear Programming Production function).

હવે, ઉત્પાદનવિષેયના આ દરેક પ્રકાર વિષે સમજૂતી મેળવીએ.

### (૧) સાહુ સૂરેખ ઉત્પાદનવિષેય :

આ ઉત્પાદનવિષેય નીચે પ્રમાણો લાની શકાય :

$$Q = \alpha K + \beta L \quad (Q - ઉત્પાદન,$$

$\alpha$  અને  $\beta$  (આંકડા અને બીજા) અચલાં,

$$K = મૂડી અને L = શરીર)$$

આ પ્રકારના ઉત્પાદનવિષેયમાં સમઉત્પાદન રેખાઓ સીધી રેખા આવે, અંતગ૊ળ

આવે નહિ. શ્રમ અને મૂડીની સીમાંત ઉત્પાદકતા સ્થિર રહે, જે ઘટતા મળતરના નિયમનું ઉલ્લંઘન કરે છે.

## (2) કોબ-ડગલાસ ઉત્પાદનવિષેય :

આ ઉત્પાદનવિષેયનો ઉપયોગ મેન્યુફેન્કચરિંગ ઉધોગમાં નીપજક અને નીપજ (ઉત્પાદન) વર્ણણના સંબંધનો અંદાજ કાઢવા માટે થયો હતો. હવે તેનો ઉપયોગ ઉત્પાદન સૌંત્રે મોટા ભાગના વિભાગોમાં કરવામાં આવે છે. આ ઉત્પાદનવિષેય આ પ્રમાણે લખી શકાય :  
 $X = AL \alpha K^\beta U$ . અહીં  $X$  = ઉત્પાદન,  $L$  = શ્રમ,  $K$  = મૂડી,  $A$  = અથલાંક,  $U$  = disturbance term,  $\alpha$  અને  $\beta$  (આલ્ફા અને બીટા) એ પોઝિટિવ પેરામીટર્સ છે.

આ વિષેય નીચેની શરતને આધીન છે.  $L > 0, K > 0, \alpha > 0, \beta > 0$ .

આ ઉત્પાદનવિષેયના લક્ષણો : (1) તેમાં સ્થિર મળતરની ધારકા રહેલી છે. (2) અવેજ-સાપેક્ષતા એકમ બચાબર છે. (3) જો એક નીપજકનું મૂલ્ય શૂન્ય હોય તો ઉત્પાદન પણ શૂન્ય થશે. (4)  $a$  અને  $b$  (આલ્ફા અને બીટા) ઉત્પાદનમાં અનુકૂળ શ્રમ અને મૂડીનો હિસ્સો દરખાસ્ત છે. (5)  $a$  અને  $b$  (આલ્ફા અને બીટા) શ્રમ અને મૂડીના સંબંધમાં ઉત્પાદનની સાપેક્ષતા પણ દરખાસ્ત છે.

ઓરો, ચેન્નાઈ, મિન્હાસ અનો સોલો (Arrow, Chenery, Minhas and Solow) જેવા અર્થશાસ્ત્રીઓએ કોબ-ડગલાસ ઉત્પાદનવિષેયની સખત ટીકા કરી છે. જેમ કે - (1) આ ઉત્પાદનવિષેયમાં શ્રમ અને મૂડી એ બે જ નીપજકો લેવામાં આવ્યા છે. કાચો માલ જેવા મહત્વના નીપજકને પણ તેમાં સામેલ કરવામાં આવેલ નથી. (2) તેમાં સ્થિર મળતરના નિયમની ધારકા રહેલી છે જેથી તે અવાસ્તવિક બની જાય છે. (3) તેમાં મૂડીના માપની સમસ્યા વિકટ બને છે. (4) સાધન બજારમાં પૂર્ણ હરીકાઈ પ્રવર્તે છે તેવી અવાસ્તવિક ધારકા તેમાં રહેલી છે.

## (3) C. E. S. ઉત્પાદનવિષેય :

આ ગ્રાકારના ઉત્પાદનવિષેયમાં અવેજ-સાપેક્ષતા સ્થિર રહે છે તેવી ધારકા રહેલી છે. અવેજ-સાપેક્ષતા અનિવાર્ય પણે એકમ બહાર હોતી નથી એવી માન્યતા તેમાં જોવા મળે છે.

આમ છતાં કોબ-ડગલાસ ઉત્પાદનવિષેય કરતાં C. E. S. ઉત્પાદનવિષેય વધુ સામાન્ય સ્વરૂપ ધરાવે છે. કારણ કે તેમાં સ્થિર, વધતા અને ઘટતા મળતરને આવરી લેવામાં આવે છે. તેમાં વિશેષજ્ઞામાં એ કરતાં વધુ નીપજકોને સામેલ કરી શકાય છે.

## (4) V. E. S. ઉત્પાદનવિષેય :

આ ગ્રાકારના ઉત્પાદનવિષેયમાં અવેજ-સાપેક્ષતા બદલતી રહે છે, સ્થિર રહેતી નથી. We do not fix "a priori" the value of substitution. આપણે તેમાં અવેજનું મૂલ્ય અગાઉથી નકરી કરી દેતા નથી.

### (5) લીઓન્ટીક ઉત્પાદનવિધેય :

આ ઉત્પાદનવિધેય નિશ્ચિત પ્રમાણના ઉત્પાદનવિધેય તરીકે પણ જાહીરું છે. અહીં એવી ધારણા રહેલી છે કે ઉત્પાદનની પ્રક્રિયામાં વાપરવામાં આવતાં જુદાં જુદાં સાધનોનું પ્રમાણ નિશ્ચિત હોય છે. આથી જે કોઈ સાધન તેની નિશ્ચિત જરૂરિયાત કરતાં પણ પ્રમાણમાં પ્રાપ્ત બને તો તેનો વધારાનો જથ્થો નિર્ધિક બની રહે છે. જે કોઈ એક સાધન તેની નિશ્ચિત જરૂરિયાત કરતાં ઓછા પ્રમાણમાં મળે તો તેની સાથે વપરાતાં અન્ય સાધનો અનુક્ત પ્રમાણમાં redundant બની રહે છે.

### (6) સુરેખ આધોજન-આપારિત ઉત્પાદનવિધેય :

નીપજકોનું પ્રમાણ સતત રીતે બદલાતું નથી. દા. ત., મૂરીસાધનો. તેવી જ સાધન-સંખોજનની દરિયાને નીપજકોનું પ્રમાણ તથા સ્થિર પણ નથી રહેતું. આ રીતે નીપજકોનું પ્રમાણ અનિયામિત અને બિનસતત રીતે બદલાય છે. પરિણામે ઉત્પાદનમાં પણ એ પ્રકારે ફેરફાર થયા કરે છે, જેના વિશ્લેષણ માટે સુરેખ આધોજન-આપારિત ઉત્પાદનવિધેયનો ઉપયોગ કરવો વધુ હોય ગણાય.

ઉત્પાદનવિધેયનો ઘ્યાલ પેઢી માટે કઈ રીતે ઉપયોગી ? :

જો કે ઉત્પાદનવિધેયનો ઘ્યાલ અમૂર્ત જણાય છે. આમ છતાં તે પેઢી માટે ઘણો ઉપયોગી નીવેં છે. પેઢીને નિર્ણય લેવાની બાબતમાં તે બે દરિયાં માર્ગદર્શનરૂપ બની શકે.

(1) એક તો એ બાબતમાં કે જ્યારે નીપજકોનું પ્રમાણ આપેલું હોય ત્યારે તેના વડે મહત્તમ ઉત્પાદન કેવી રીતે મેળવવું તે એંગે ઉત્પાદનવિધેયની મદદથી નિર્ણય લઈ શકાય.

(2) અને બીજું એ બાબતમાં કે જ્યારે અમુક નિશ્ચિત પ્રમાણમાં ઉત્પાદન કરવાનું નક્કા કરેલ હોય ત્યારે તે ઓછામાં ઓછા પ્રમાણના નીપજકો દ્વારા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે એંગે ઉત્પાદનવિધેયની મદદથી નિર્ણય લઈ શકાય. જો કે મોટી સંખ્યાનાં નીપજકો અને અનેક વસ્તુના ઉત્પાદનનો પ્રશ્ન હોય ત્યારે ઈસ્ટમ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જે ગણતરીઓનો કરવાનું જરૂરી બને છે તે ખૂબ જાટિલ બની જાય છે. પરંતુ આવા પ્રશ્નના ઉકેલ માટે સુરેખ આધોજન (Linear Programming)ની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોમ્પ્યુટરના વધુને વધુ ઉપયોગને લીધે હવે જાટિલ એવાં ઉત્પાદનવિધેયોના સંદર્ભમાં નિર્ણય લેવાની કામગીરી સરળ બનતી જાય છે એમ કહી શકાય.

ઉત્પાદનવિધેયની રચના ખરેખર તો Production Engineering સાથે સંબંધ ધરાવે છે. આથી અર્થશાસ્ત્રમાં ઉત્પાદનવિધેયનું સ્વરૂપ આપેલું છે તેનું માનવામાં આવે છે. અર્થશાસ્ત્રની દરિયાં આપણે નીચેનાં સ્વરૂપો ધરાવતા ઉત્પાદનવિધેયનો અભ્યાસ કરવાનો છે :

- (1) જેમાં કોઈ એક નીપજક કે સાધન અસ્થિર હોય તેનું ઉત્પાદનવિધેય
- (2) જેમાં બધા નીપજકો કે સાધનો અસ્થિર હોય તેનું ઉત્પાદનવિધેય
- (3) જેમાં બે નીપજકો કે સાધનો અસ્થિર હોય તેનું ઉત્પાદનવિધેય

## ૫ - ૨ ઉત્પાદન વિવેયના પ્રકારો, અથવા

ટૂંકાગાળાનું અને લાંબાગાળાનું ઉત્પાદન વિવેય.

અર્થશાસ્ત્રમાં ત્રણ મકારના ઉત્પાદન વિવેયનો અભ્યાસ થાય છે :

(૧) ટૂંકા ગાળાનું ઉત્પાદન વિવેય જે એવી ધારણા પર આધારિત છે કે માત્ર એક જ સાધન પરિવર્તનશીલ છે, એ સિવાયનાં બધાં સાધનો સ્થિર છે. આ ઉત્પાદન વિવેય આપણને બદલતા સાધનપ્રમાણનો નિયમ (અથવા બિનપ્રમાણસર ઉત્પાદનનો નિયમ) આપે છે. (૨) લાંબા ગાળાનું ઉત્પાદન વિવેય જે એવી ધારણા પર આધારિત છે કે બધાં સાધનો અસ્થિર છે. આ ઉત્પાદન વિવેય આપણને પેઢીનાં કદના વિકાસને પરિણામે પ્રાપ્ત થતા વળતર અંગેનો નિયમ આપે છે. (૩) ઉત્પાદન માત્ર બે સાધનોની મદદદી થતું હોય અને બંને સાધનો પરિવર્તનશીલ હોય એવી પરિસ્થિતિ સાચે સંબંધિત ઉત્પાદન વિવેય, જે આપજો સમ-ઉત્પાદન રેખાઓ આપાનો પેડી માટે હું સાધન-સંયોજન શોધી કાઢવામાં મદદ કરે છે.

(અ) ટૂંકા ગાળાનું ઉત્પાદન વિવેય : ટૂંકા ગાળામાં કેટલાંક સાધનો સ્થિર હોય છે. કોઈ એક સાધનના પ્રમાણમાં જ વપારો-વટાડો થઈ શકે છે. આ પરિસ્થિતિમાં ઉત્પાદનમાં કેવો કેરકાર થાય છે તે ટૂંકા ગાળાના ઉત્પાદન વિવેય દ્વારા દર્શાવવામાં આવે છે. ટૂંકા ગાળાના ઉત્પાદન વિવેયનું સમીકરણ નીચે મુજબ છે :

$$Q = f(L, K)$$

જેમાં  $Q$  = ઉત્પાદન,  $L$  = શ્રમ,  $K$  = મૂડી અને  $K$  પરની રેખા સૂચયે છે કે મૂડી સ્થિર સાધન છે. અહીં માત્ર શ્રમ અસ્થિર સાધન છે અને માત્ર શ્રમનું પ્રમાણ વપારીને ઉત્પાદન વપારવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે અહીં શ્રમ અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ વર્ણવવામાં આવે છે.


શ્રમ તબક્કામાં શ્રમનું પ્રમાણ વધે છે તેમ શ્રમની સીમાંત ઉત્પાદકતા વધે છે પરિણામે હુલ ઉત્પાદન વધતા દરે વધે છે.

બીજા તબક્કામાં શ્રમનું પ્રમાણ વધે છે તેમ શ્રમની સીમાંત ઉત્પાદકતા ઘટે છે. પરિણામે હુલ ઉત્પાદન ઘટતા દરે વધે છે.

ત્રીજા તબક્કામાં શ્રમનું સીમાંત ઉત્પાદન નકારાત્મક હોય છે. આથી શ્રમનું પ્રમાણ વધે છે તેમ હુલ ઉત્પાદન ઘટે છે.

## (બ) લાંબા ગાળાનું ઉત્પાદન વિવેય :

ટૂંકા ગાળામાં કેટલાંક સાધનો (દા.ત., પ્લાન અને યત્નો) સ્થિર હોય છે. એટલે પેડી અસ્થિર સાધન (દા.ત., શ્રમ)નું પ્રમાણ વપારીને ઉત્પાદન વપારવાનો પ્રયાસ કરે છે. આ પરિસ્થિતિમાં ઉત્પાદનનું વલખ કેવું હોય છે તે પરિવર્તનશીલ સાધનપ્રમાણના નિયમ દ્વારા સમજાવવામાં આવે છે. પરંતુ લાંબા ગાળે બધાં સાધનો પરિવર્તનશીલ હોય છે. બધાં સાધનોનું પ્રમાણ એકસાથે વપારી રહાય છે. આખી પેડીનું કદ વિસ્તાર પામે છે. આ પરિસ્થિતિમાં ઉત્પાદનનું વલખ કેવું હોય છે તે કદવિકાસના મળતર અંગેના નિયમ દ્વારા સમજાવવામાં આવે છે. કદવિકાસના મળતર માટે Relativity of Scale શબ્દો પ્રયુક્તિ છે. કદવિકાસ એવી પરિસ્થિતિ છે કે જેમાં બધાં સાધનોમાં એકસાથે એકસરાના પ્રમાણમાં વપારો રહ્યા હોય છે. પરિણામે સાધનો વચ્ચેનું આપેણ પ્રમાણ બદલતું નથી. બધાં સાધનોમાં વપારો થાય છે પણ સાધનપ્રમાણ બદલતું નથી. કદવિકાસનો પરો નર્થ આ છે. સાધનોનું સાધેણ પ્રમાણ અને કદવિકાસ વચ્ચેનો તહાવત ગાફુરિની મદદદી નિયમ મુજબ સ્પષ્ટ કરી રહાય :



(આકૃતિ- ૧)

આકૃતિ-૧માં આડી પરી પર શ્રમ અને ઊભી પરી પર મૂરીના એકમો દર્શાવવામાં આવ્યા છે. આપણે માની લઈએ છીએ કે વસ્તુના ઉત્પાદન માટે માત્ર જે સાધનો શ્રમ અને મૂરીની જરૂર પડે છે. ઊભી પરીને સમાંતર રેખા CD બાતાવે છે કે શ્રમના એકમો (OC) સિધેર છે અને CD પર જેમ ઊંચે ગતિ કરવામાં આવે તેમ મૂરીના એકમો વરી છે. એની જ રીતે આડી પરીને સમાંતર રેખા AB બાતાવે છે કે મૂરીના એકમો OA સિધેર છે અને AB રેખા પર જમણી તરફ જેમ ગતિ થાય છે તેમ શ્રમના એકમો વરેણે. આમ, CD અને AB બંને રેખાઓ પરિવર્તનશીલ સાધનપ્રમાણની રજૂઆત કરે છે. હવે જપણા ખૂબી દોરલી OP રેખાની વાત કરીએ. આ રેખા પર O થી P તરફ જેમ ગતિ કરવામાં આવે તેમ શ્રમ અને મૂરી બંને એકસાથે એકસરાખા પ્રમાણમાં વરેણે. સાધનપ્રમાણ બદલાતું નથી. પેઢીનું માત્ર કદ વિસ્તાર પામે છે.

લાંબા ગાળાનું ઉત્પાદન વિષેય સમીકરણના સ્વરૂપમાં નીચે મુજબ ૨૫ કરવામાં આવે છે :

$$Q = f(x_1, x_2, x_3 \dots x_n, T)$$

જેમાં  $Q =$  ઉત્પાદન

$x_1, x_2, x_3 \dots x_n =$  વિભિન્ન સાધનો

T = ટેક્ઝોલોજી જે સિધેર છે.

f = વિષેયાત્મક સંબંધ.

બધાં સાધનોનું પ્રમાણ એકસાથે વધારવામાં આવે છે ત્યારે ઉત્પાદનનાં વલાંઘો ગ્રસ્ત તબક્કામાં વહેંચાયેલાં જોવા મળે છે. આ ત્રણ તબક્કા નીચે મુજબ છે :

વધતું મળતર : પેઢીનું કદ ૫૦ ટકા વિસ્તારવામાં આવે (એટલે કે પ્રતેક સાધનના પ્રમાણમાં ૫૦ ટકા વધારો કરવામાં આવે) અને પરિણામે ઉત્પાદનમાં ૫૦ ટકાથી વધુ વધારો થાય તો એને વધતું મળતર કહેવામાં આવે છે. અહીં સાધનોની જરૂરમણીમાં ઉત્પાદન વધુ વરે છે. સીમાંત વળતર વધતું છોય છે.

સિધેર મળતર : પેઢીનું કદ ૫૦ ટકા વિસ્તારવામાં આવે અને પરિણામે ઉત્પાદનમાં પણ ૫૦ ટકા વધારો થાય તો તેને ચિન્હ મળતર કહેવામાં આવે છે. આડી કદનું સીમાંત મળતર સિધેર છોય છે.

ઘટતું મળતર : પેઢીનું કદ ૫૦ ટકા વિસ્તારવામાં આવે અને પરિણામે ઉત્પાદનમાં ૫૦ ટકાથી ઓછો વધારો થાય તો તેને ઘટતું મળતર કહેવામાં આવે છે. આડી કદનું સીમાંતર ઘટતું છોય છે.

### ૫- ૩ ઉત્પાદન શક્યતા રેખા :

કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવાની શક્યતા છે તે દર્શાવતી રેખાને ઉત્પાદન શક્યતા રેખા કે ઉત્પાદન સંભાવના રેખા કહેવામાં આવે છે. ઉત્પાદન સંભાવના રેખા નીચેની ધારણાઓ પર આપારિત છે :

- (૧) આપેલ ઉત્પાદન સાધન દરા પેડી બે વસ્તુઓનું ઉત્પાદન કરે છે.
- (૨) પેડી X અને Y વસ્તુઓનું જુદા જુદા મ્રાગાંમાં ઉત્પાદન કરી શકે છે.
- (૩) બે વસ્તુઓના ઉત્પાદનમાંથી પેડી એક વસ્તુનું વધારે ઉત્પાદન કરે છે તો બીજી વસ્તુનું ઓછા મ્રાગાંમાં ઉત્પાદન કરે છે.
- (૪) ઉત્પાદન પદ્ધતિમાં સોધી કેરળ થાતો નથી.
- (૫) હૂકા ગાળાના સમય માટે ઉત્પાદન કરવામાં આવે છે.

### [૩.૨] અનુસૂચિ દ્વારા સમજૂતી :


આ પારણાઓની આધે હવે નીચેની અનુસૂચિ દ્વારા આ ખ્યાલને સમજાઓ :

#### ઉત્પાદન શક્યતા અનુસૂચિ

સંભાવનાઓ	Xનું ઉત્પાદન	Yનું ઉત્પાદન
A	0	250
B	100	230
C	150	200
D	200	150
E	250	0



આ અનુસૂચિમાં જોઈ શકાય છે કે A અને E સંભાવનાઓઓ કે જું પેડી આપેલ ઉત્પાદન સાધન વડે કંઈ તીવ્ય માત્ર છે. 250 એકમો અધ્યવા માત્ર જું 250 એકમોનું ઉત્પાદન કરી શકે છે. પરંતુ આપેલ અહીં એ પારણા કરીને છીએ કે પેડી બને વસ્તુઓનું ઉત્પાદન કરે છે. બને વસ્તુઓનું ઉત્પાદન કરે તો એક વસ્તુનું વધારે તો બીજી વસ્તુનું ઓછું ઉત્પાદન કરે છે. આ અનુસૂચિ મ્રાગાં સંભાવના મ્રાગાં પેડી Xના 100 એકમો અને Yના 230 એકમો C સંભાવના મ્રાગાં પેડી Xના 150 એકમો અને Yના 200 એકમો. D સંભાવના અનુસાર Xના 200 એકમો અને Yના 150 એકમોનું ઉત્પાદન કરે છે. અહીં જોઈ શકાય છે કે પેડી Xના વધારે એકમોનું ઉત્પાદન કરે તો Yના ઓછા અને Yના વધારે એકમોનું ઉત્પાદન કરે તો Xના ઓછા એકમોનું ઉત્પાદન કરે છે.

Xનું વધારે ઉત્પાદન કરવા માટે Yના ઉત્પાદનમાંથી કેટલાંક સાધનોને પાછા જોયીને Xના ઉત્પાદનમાં પ્રયોજવામાં આવે છે. B થી C તરફ જતા Xના 50 એકમોનું વધારે ઉત્પાદન કરવા માટે Yના 30 એકમોનું બલિદાન આપવામાં આવે છે. D થી E તરફ જતા Xના 50 એકમોનું વધારે ઉત્પાદન કરવા માટે Yના 50 એકમોનું બલિદાન આપવામાં આવે છે. હવે આ જ બાબત આપણે આકૃતિ દ્વારા સમજાઓ.



**આકૃતિ દ્વારા સમજૂતી:** ઉપરોક્ત અનુસૂચિનું આ મ્રમાણે આકૃતિમાં રૂપાંતર કરી શકાય. આ આકૃતિમાં  $OX$  રેખા પર  $X_1$  એકમો અને  $OY$  રેખા પર  $Y_1$  એકમો દર્શાવ્યા આવ્યા છે.  $AE$  રેખા ઉત્પાદનની સંભાવનાઓ દર્શાવતી રેખા છે.  $X$  અને  $Y$  એકલાં (ઉત્પાદનની સંભાવના આપેલા સાધન દ્વારા છે તે દર્શાવતી આ રેખાને ઉત્પાદન સંભાવના રેખા કહી શકાય. આપેલા સાધન દ્વારા  $X$  અને  $Y$  એકલાં એકમોનું (ઉત્પાદન થશે) તે  $A, B, C, D$  અને  $E$  ઉત્પાદન સંભાવના સંપોજનો દર્શાવેલ છે.  $AE$  રેખાને રૂપાંતરણ રેખા (Transformation Curve) પણ કહી શકાય. કારણ કે તે એક વસ્તુના ઉત્પાદનનું બીજી વસ્તુના ઉત્પાદનનું રૂપાંતરણ પણ દર્શાવે છે.  $X_1$  એકલાં એકમોનું  $Y_1$  અને  $Y_2$  એકલાં એકમોનું  $X_2$  આ ઉત્પાદન સંપોજનોએ રૂપાંતરણ દર્શાવે છે. આથી આ રેખાને રૂપાંતરણ રેખા કહેવામાં આવે છે. તેનાં વિવિધ બિંદુઓ રૂપાંતરણ દર્શાવે છે. આ રેખા આંતરગોળ હોવાથી જ્યારે આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ છીએ ત્યારે સીમાંત રૂપાંતરણ દર વર્ષે છે.


ઉત્પાદન સંભાવના કે રૂપાંતરણ રેખા મોટેલાં મૂળબંદું હોય જોતાં આંતરગોળ હોય છે. પરંતુ તેમાં બે અપવાદો છે. જ્યારે બે વસ્તુઓ અવેળ વસ્તુઓ હોતી નથી. પરંતુ સંપુર્કત પેદાશો હોય અથવા તો તેનો નિર્ધિષ્ટ ગ્રામ્યજીમાં જ ઉપયોગ થઈ શકતો હોય તી ઉત્પાદન સંભાવના (શક્યતા) રેખા આંતરગોળ નથી હોતી આ બાબતને આકૃતિ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ.



ઉપરોક્ત આકૃતિ - 2માં A - B - C ઉત્પાદન શક્યતાઓ X અને Yની ચોક્કસ ઉત્પાદન શક્યતા દર્શાવે છે. આપેલ સાધન દ્વારા ઉત્પાદન કરતાં X અને Y બન્નેના એકમો વધતાં જાય છે. જેનું ઉત્પાદન કરવામાં આવે છે તે બન્ને વસ્તુઓ અવેજી ન હોય તો તેની રૂપાંતરણ રેખાઓનો આકાર  $y_1 Ax_1$ ,  $y_2 Bx_2$  અને  $y_3 Cx_3$  હશે જે આકૃતિ : 2માં દર્શાવવામાં આવેલ છે. તેનો સીમાંત રૂપાંતરણ દર શૂન્ય છે.

તેનાથી વિરુદ્ધ જો બન્ને વસ્તુઓ સંપૂર્ણ અવેજી વસ્તુઓ હોય તો ઉત્પાદન સંભાવના રેખાઓ રીધી રેખાઓ હશે જે આકૃતિ : 3માં દર્શાવવામાં આવેલ છે. તે અનુસાર X અને Y વસ્તુઓ સંપૂર્ણ અવેજી વસ્તુઓ છે.  $y_1 x_1$ ,  $y_2 x_2$ ,  $y_3 x_3$  ઉત્પાદન સંભાવના રેખા સીધી રેખા છે. આ બન્ને પેદાશોનો સીમાંત રૂપાંતરણ દર એકમ બચાવર છે. Xના વધુ એકમો મેળવવા માટે જ્ઞાન તેટલા જ એકમો છાડી દેવા પડે છે.

જ્યારે ઉત્પાદકતા સંભાવના રેખા સંભવિત ઊંચી કુલ આવક રેખાને સ્પર્શી ત્યારે બે વસ્તુઓનું ઈષ્ટતમ સંયોજન બને છે. અને પેઢીને મહત્તમ નક્કો પ્રાપ્ત થાય છે. આ બાબતને આકૃતિ દ્વારા આ રીતે દર્શાવી શકાય.



#### આકૃતિ : 4

આ આકૃતિમાં  $TR$ ,  $T_1 R_1$  અને  $T_2 R_2$  કુલ આવક દર્શાવે છે કે તેને સમ આવક રેખા કરેવાગાં આવે છે.  $AEB$  ઉત્પાદન સંભાવના રેખા છે.  $AEB$  ઉત્પાદન સંભાવના રેખાને  $T_1 R_1$  સાગાઉત્પાદન રેખા એ નિંદુએ સ્પર્શી છે. આથી X વસ્તુનું  $OX_1$  અને Y વસ્તુનું  $OY_1$  જેટલું ઉત્પાદન થાય છે. આ ઉત્પાદનને આપણે ઈષ્ટતમ ઉત્પાદન કહી શકીએ કરાશ કે આલા ઉત્પાદન દ્વારા ઉત્પાદનને મહત્તમ આવક પ્રાપ્ત થાય છે.)

## □ 5. સમઉત્પાદન રેખા □

(Iso-quant Curve)

પ-૪ \* સમઉત્પાદન રેખા એટલે શું ? સમઉત્પાદન રેખાનાં લક્ષણો જણાવો.  
\* ટૂંકનોંથ લખો : સમઉત્પાદન રેખા

□ જવાબના મુદ્દા □

(1) સમઉત્પાદન રેખા એટલે શું ? (2) ટેક્નિકલ સીમાંત અવેજી દર (3) સમઉત્પાદન રેખાનાં લક્ષણો

(1) સમઉત્પાદન રેખા એટલે શું ?

ઉત્પાદનનાં કોઈપણ બે સાધનો વત્તાઓછા અંશે એકબીજાની અવેજી લઈ શકે છે. તેથી કોઈ એક સાધનનું પ્રમાણ ઘટાડીને અને બીજા સાધનનું પ્રમાણ વધારીને એકસરખું ઉત્પાદન મેળવી શકાય છે. એટલે કે ઉત્પાદનમાં કોઈ કેરકાર જન્માવ્યા સિવાય એક સાધનનું પ્રમાણ ઘટાડીને બીજા સાધનનું પ્રમાણ વધારી શકાય છે.


“બે સાધનોનાં જુદાં જુદાં સંયોજનો વડે એકસરખું ઉત્પાદન વ્યક્ત કરતી રેખાને સમઉત્પાદન રેખા તરીકે ઓળખવામાં આવે છે.”

આનો અર્થ એ થાય કે અમુક ચોક્કસ ઉત્પાદન મેળવવા માટે એક કરતાં વહુ સાધનસંયોજન શક્ય હોય છે. લિન લિન સાધનસંયોજનો દ્વારા એકસરખું ઉત્પાદન મેળવી શક્તાં હોય તો તેવા સાધનસંયોજનને સમઉત્પાદન સાધનસંયોજન તરીકે ઓળખી શકાય.

પારષ્પાણો :

- (1) ઉત્પાદક ઉત્પાદન કરવા માટે અમ અને મૂડી એમ બે સાધનોનો ઉપયોગ કરે છે.
- (2) ઉત્પાદનપદ્ધતિ આપેલી છે.
- (3) ઉત્પાદનના દરેક સાધનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે.

આપનસંયોજન	શ્રમ અને મૂડીનું પ્રમાણ (એકમોમા)	સીમાંત અવેળનો દર મૂડી : શ્રમ	કુલ ઉત્પાદન (એકમોમા)
A	1 + 25	-	100
B	2 + 17	1 : 8	100
C	3 + 11	1 : 6	100
D	4 + 6	1 : 5	100



આકૃતિમાં OX રેખા પર શ્રમ અને OY રેખા પર મૂડીનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે. A, B, C અને D નિંદુઓ એકસરાનું ઉત્પાદન આપી શકે તેવાં આપનસંયોજનો દર્શાવે છે.

સંયોજન	શ્રમ + મૂડીનું પ્રમાણ
A સંયોજન	1 + 25
B સંયોજન	2 + 17
C સંયોજન	3 + 11
D સંયોજન	4 + 6 દર્શાવે છે.


A, B, C અને D બિંદુઓને જોડતાં એક સર્વાંગ રેખા માપી થાય છે, જેને સમઉત્પાદન રેખા, "Iso-quant Curve" અથવા "equal product curve" તરીકે ઓળખવામાં આવે છે.

આમ, "સમઉત્પાદન રેખા એટલે એકસરણું ઉત્પાદન કરી શકે તેવાં બે સાધનોનું ભિન્ન ભિન્ન પ્રમાણ પરાવતાં સાધનસંયોજનો દર્શાવતી રેખા."

### (2) ટેક્નિકલ સીમાંત અવેણ દર

કુલ ઉત્પાદનમાં ફેરફાર જન્માયા સિવાય શ્રમના પ્રમાણમાં એક એકમનો વધારો કરવા માટે મૂરીના ફેટલા એકમો ઘટાડવા પડે છે તે શ્રમનો ટેક્નિકલ સીમાંત અવેણદર દર્શાવે છે.

$$\text{શ્રમનો ટેક્નિકલ સીમાંત અવેણ દર} = \frac{\text{મૂરીના પ્રમાણમાં ઘટાડો}{\text{શ્રમના પ્રમાણમાં વધારો}$$



$OX$  રેખા પર શ્રમના એકમો અને  $OY$  રેખા પર મૂરીના એકમો દર્શાવ્યા છે. B અને D સંયોજન એકસરણું ઉત્પાદન કરી શકે તેવા શ્રમ અને મૂરીના ભિન્ન ભિન્ન પ્રમાણ દર્શાવતાં સાધનસંયોજન છે.


સંયોજન	મૂરી + શ્રમના એકમો
B સંયોજન =	$OC_1$ $OL_1$
D સંયોજન =	$OC_2$ $OL_2$

B-ની સરખામણીમાં Dમાં મૂડીનું પ્રમાણ C<sub>1</sub>, C<sub>2</sub> (BE) જેટલું ઓછું છે. જ્યારે શ્રમનું પ્રમાણ L<sub>1</sub>, L<sub>2</sub> (ED) જેટલું વધારે છે. એટલે કે કુલ ઉત્પાદનમાં ફેરફાર કર્યા સિવાય મૂડીના બદલે શ્રમનો ઉપયોગ કરી શકાય છે.

$$\text{તેથી શ્રમનો સીમાંત અવેજણો } DR = \frac{BE}{ED} \text{ થાય છે.}$$

### (3) સમઉત્પાદન રેખાનાં લક્ષણો

(1) સમઉત્પાદન રેખા જમણી બાજુ નીચે ઢળતી હોય છે: સમઉત્પાદન રેખા જમણી બાજુ નીચે ઢળતી હોય છે. તેનો અર્થ એ થાય કે સમઉત્પાદન રેખાનો ગ્રાફ ઢાળ છે. એટલે કે, એક સાધનના પ્રમાણમાં, વધારો થાય છે, જ્યારે બાજુ સાધનના પ્રમાણમાં અનિવાર્યપણે ઘટાડો થાય છે. કુલ ઉત્પાદન એકસરખું રાખવું હોય તો એક સાધનનું પ્રમાણ વધારવામાં આવે ત્યારે બીજી સાધનનું પ્રમાણ ઘટાડવામાં આવે છે.




આપૃતિ મુજબ Iq સમઉત્પાદન રેખા છે. તેથી શ્રમના પ્રમાણમાં L<sub>1</sub>, L<sub>2</sub> જેટલો વધારો થાય ત્યારે મૂડીનું પ્રમાણ C<sub>1</sub>, C<sub>2</sub> જેટલું ઘટાડવામાં આવે તો એકસરખું ઉત્પાદન પ્રાપ્ત થાય છે. તેથી સમઉત્પાદન રેખા ઉપરથી નીચે જમણી તરફ ઢળતી રેખા છે.

(2) સમઉત્પાદન રેખા મધ્યનિંદુ તરફ બહિગોળ છે: સમઉત્પાદન રેખાના હોળાવનો આપાર ટેક્નિકલ અવેજણના સીમાંત દર પર રહેલો છે. ટેક્નિકલ સીમાંત અવેજણનો દર ઘટતો જતો હોવાથી સમઉત્પાદન રેખા મધ્યનિંદુ તરફ બહિગોળ છે. જેમ જેમ શ્રમના એકમો વધતા જાય છે તેમ તેમ મૂડીના એકમો પણ છે. તે શ્રમનો સીમાંત અવેજણનો દર દરખાવી છે અને ટેક્નિકલ અવેજણનો સીમાંત દર કમશા: ઘટતો જતો હોવાથી સમઉત્પાદન રેખા મધ્યનિંદુ તરફ બહિગોળ છે.

(3) સમઉત્પાદન રેખા એકળીજાને છેરી રહે નહિ: જો બે રેખાઓ એકળીજાને છેદતી હોય તો તે સમઉત્પાદન રેખાઓ હોઈ શકે નહિ.


આકૃતિમાં A અને B બિંદુઓ એક જ સમર્થતાદન રેખા  $I_{q_1}$  પર આવેલાં છે. તે જ રીતે A અને D બિંદુઓ એક જ સમર્થતાદન રેખા  $I_{q_2}$  પર આવેલાં છે, પરંતુ આ બંને સંયોજનમાં મૂળીનું પ્રમાણ સરબું છે, પરંતુ શ્રમનું પ્રમાણ સરબું નથી. તેથી સમર્થતાદન રેખા કઢી શકાય નહિએ.



સંયોજન	મૂળી	શ્રમના એકમો
A	$OC_1$	$OL_1$
B	$OC_2$	$OL_2$
C	$OC_3$	$OL_3$

#### (4) સમર્થતાદન રેખા જેમ ઉપર તેમ ઉત્પાદન વધુ:

આકૃતિમાં  $I_{q_1}$ ,  $I_{q_2}$ ,  $I_{q_3}$  ગ્રાફ સમર્થતાદન રેખાઓ દર્શાવી છે.  $I_{q_3}$  સમર્થતાદન રેખા જીવી છે, જે નીચેની રેખા કરતાં વધુ ઉત્પાદન આપે છે.  $I_{q_1}$ ,  $I_{q_2}$  કરતાં  $I_{q_3}$  માં શ્રમના એકમો વધારે છે. તેથી તે વધુ ઉત્પાદન દર્શાવે છે. આમ, જેમ સમર્થતાદન રેખા જીવી તેમ ઉત્પાદન વધુ.



□ 6. સમખર્ય રેખા □

(Iso - Cost Curve)

પ્ર-૫ કે. સમખર્ય રેખા એટલે શું ? તેના લાભનો જણાવો.

\* દ્વારાંધોથી લખો : (1) સમખર્ય રેખા

□ જવાબના મુજબ □

(1) સમખર્ય રેખા એટલે શું ? (2) સમખર્ય રેખાનું સ્થાન (3) સમખર્ય રેખાનો લોળાવ.

(1) સમખર્ય રેખા એટલે શું ?

‘ઉત્પાદક પાસે જે આપેલી રકમ હોય તે રકમ વડે ઉત્પાદનનાં બે સાધનોના કચ્ચા સંયોજનો પેઢી ખરીદી શકે તે બાબત દર્શાવતી રેખા એટલે સમખર્ય રેખા.’

‘પેઢી તેજે નકારી કરેલ ખર્ચવા પાત્ર રકમ દ્વારા ઉત્પાદનનાં બે સાધનોના કચ્ચા સંયોજનો ખરીદી શકે તે દર્શાવતી રેખાને સમખર્ય રેખા કહેવુંથી આવે છે.’

ધારો કે ઉત્પાદક પાસે શ્રમ અને મૂર્ખી પાછળ રૂ. 1000 ખર્ચ કરવાનો છે. મૂર્ખી અને શ્રમની ડિમાન્ડ અનુકૂળ રૂ. 10 અને રૂ. 5 છે. ઉત્પાદક માટે એકસરખા ખર્ચ દ્વારા ઉપલબ્ધ સાધન સંયોજન નીચે મુજબ દર્શાવી રજાયા :


શક્ય સાધન સંયોજનો

સંયોજન	શ્રમ + મૂર્ખી (એકસરો)	શ્રમનું ખર્ચ (રૂ.માં)	મૂર્ખીનું ખર્ચ (રૂ.માં)	કુલ ખર્ચ (રૂ.માં)
A	0 + 100	000	1000	1000
B	40 + 80	200	800	1000
C	80 + 60	400	600	1000
D	120 + 40	600	400	1000
E	160 + 20	800	200	1000
F	200 + 00	1000	000	1000

ઉત્પાદક પાસે નજી વિકલ્પો છે :

- (1) ઉત્પાદક વધી જ રકમ મૂર્ખી પાછળ ખર્ચો તો મૂર્ખીના 100 એકસરી શકે છે.
- (2) ઉત્પાદક વધી જ રકમ શ્રમ પાછળ ખર્ચો તો શ્રમના 200 એકસરી શકે છે.
- (3) અમૃક રકમ મૂર્ખી પાછળ અને અમૃક રકમ શ્રમ પાછળ ખર્ચ કરે તો ઉપર મુજબ અનુસૂચિ પરથી મેળવી શકે છે.


આકૃતિમાં A, B, C, D, E અને F બિંદુઓ એકસરખું ખર્ચ થતું હોય તેવા શ્રમ અને મૂડીનાં શક્ય સંપોજનનો દરશાવિ છે. આ બિંદુઓને જોડતા જે સરંગ રેખા પ્રાપ્ત થાય છે તે સમખર્ચ રેખા છે.



### (2) સમખર્ચ રેખાનું સ્થાન


સમખર્ચ રેખાના સ્થાનનો આપાર ઉત્પાદક પાસે ખર્ચવા માટે કેટલી રકમ છે તેના પર રહેલો છે. જેમ ઉત્પાદક પાસે ખર્ચવા માટેની રકમ વધુ તેમ સમખર્ચ રેખાનું સ્થાન ઊંચું હોય છે.

આકૃતિ મુજબ ઉત્પાદક પાસે હ. 1000 છે ત્યારે AB સમખર્ચ-રેખા છે. હ. 1500 છે ત્યારે A'B' સમખર્ચરીખા છે અને 2000 છે ત્યારે A''B'' સમખર્ચ રેખા છે. જેમ ઉત્પાદકનું ખર્ચ વધુ તેમ સમખર્ચ રેખાનું સ્થાન ઊંચું.



### (3) સમખર્ચ રેખાનો ઢોળાવ

જો ખર્ચનું પ્રમાણ વિશેર હોય અને એક સાધનની કિમતમાં ફેરફાર થાય તો તેથી સમખર્ચ રેખાના ઢોળાવમાં ફેરફાર થાય છે. ધારો કે ઉત્પાદક હ. 1000 ખર્ચ કરવા-



માગે છે. મૂરી અને શ્રમની ડિમ્પટ અનુકૂળ હૈ. 10 અને રૂ. 5 છે. ત્યારે AB સમખ્યાર્થ રેખા હૈ. જો શ્રમની ડિમ્પટ ઘટીને રૂ. 5માંથી રૂ. 4 થાય તો ઉત્પાદક શ્રમના 250 એકમ મેળવી શકે હૈ. તેથી સમખ્યાર્થ રેખા AB' AB' આવશે. આમ AB રેખા કરતાં AB' રેખાનો વોળાવ ઓછો હૈ.

### ઉત્પાદનની પેઢીની સમતુલ્યા

[ Producer's equilibrium ]

૫-૬ \* સમ ઉત્પાદન રેખા અને સમ ખર્ચ રેખાની મદદથી ઉત્પાદકની સમતુલ્યાનું પૃથ્વકરણ કરો.

\* સમ ઉત્પાદન રેખા અને સમ ખર્ચ રેખાની મદદથી ન્યૂનતમ ખર્ચ સંયોજનની સમજૂતી આપો.

\* દૂંહનોંધ લખો : (1) ન્યૂનતમ ખર્ચ સંયોજન  
(2) ઉત્પાદકની સમતુલ્યાનું પૃથ્વકરણ

જવાબના મુલા

- (1) સમ ઉત્પાદન રેખા (2) સમ ખર્ચ રેખા (3) ન્યૂનતમ ખર્ચ સંયોજન (4) ઉત્પાદકની સમતુલ્યાનું પૃથ્વકરણ

### (1) સમ ઉત્પાદન રેખા


“એ સાધનોનાં જુદાં જુદાં સંયોજનો વડે એક સરખું ઉત્પાદન વ્યક્ત કરતી રેખાને સમ ઉત્પાદન રેખા તરીકે ઓળખવામાં આવે છે.”

આનો અર્થ એ થાય કે અમૃત ચોક્કસ ઉત્પાદન મેળવવા માટે એક કરતાં વધુ સાધન સંયોજન શક્ય હોય છે. તિન્યાં તિન્યાં સાધન સંયોજનો દ્વારા એક સરખું ઉત્પાદન મેળવી શકતું હોય તો તેવા સાધન સંયોજનને સમ ઉત્પાદન સાધન સંયોજન તરીકે ઓળખી શકાય.

### ધ્યાનસંચારો :

- (1) ઉત્પાદક ઉત્પાદન કરવા માટે શ્રમ અને મૂડી એમ બે સાધનોનો ઉપયોગ કરે છે.
- (2) ઉત્પાદન પદ્ધતિ આપેલી છે.
- (3) ઉત્પાદનના દરેક સાધનનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે.

સાધનસંચારોજન	શ્રમ અને મૂડીનું પ્રમાણ (એકમોમા)	સીમાંત અવેજણો દર મૂડી : શ્રમ	કુલ ઉત્પાદન (એકમોમા)
A	1 + 25	-	100
B	2 + 17	1 : 8	100
C	3 + 11	1 : 6	100
D	4 + 6	1 : 5	100



આકૃતિમાં OX રેખા પર શ્રમ અને OY રેખા પર મૂડીનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે. A, B, C અને D બિંદુઓ એકસરખું ઉત્પાદન આપી શકે તેવાં સાધન સંયોજનો દરશાવે છે. A, B, C અને D બિંદુઓ જોકાં એક સંણંગ રેખા પ્રાપ્ત થાય છે તે સમ ઉત્પાદન રેખા છે.

## (2) સમ ખર્ચ રેખા


“ઉત્પાદક પાસે જે રકમ હોય તે સમ વડે ઉત્પાદનનાં બે સાધનોના કથા સંયોજનો પેઢી ખરીદી શકે તે જાણત દર્શાવતી રેખા એટલે સમ ખર્ચ રેખા.

ધ્યાયો કે ઉત્પાદક પાસે શ્રમ અને મૂડી પાછળ રૂ. 1000 ખર્ચ કરવાનો છે. મૂડી અને શ્રમની ડિમ્યત અનુકૂલે રૂ. 10 અને રૂ. 5 છે. ઉત્પાદક માટે એકસરખા ખર્ચ દ્વારા ઉપલબ્ધ સાધન સંયોજન નીચે મુજબ દર્શાવી શકાય :

શક્ય સાધન સંયોજનો

સંયોજન	શ્રમ + મૂડી (એકમો)	શ્રમનું ખર્ચ (રૂ.માં)	મૂડીનું ખર્ચ (રૂ.માં)	કુલ ખર્ચ (રૂ.માં)
A	0 + 100	000	1000	1000
B	40 + 80	200	800	1000
C	80 + 60	400	600	1000
D	120 + 40	600	400	1000
E	160 + 20	800	200	1000
F	200 + 00	1000	000	1000

ઉત્પાદક પાસે ત્રણ વિકલ્પો છે :



- (1) ઉત્પાદક બધી જ રકમ મૂડી પાછળ ખર્ચો તો મૂડીના 100 એકમ ખરીદી શકે છે.
- (2) ઉત્પાદક બધી જ રકમ શ્રમ પાછળ ખર્ચો તો શ્રમના 200 એકમ ખરીદી શકે છે.
- (3) અસુક રકમ મૂડી પાછળ અને અસુક રકમ શ્રમ પાછળ ખર્ચ કરે તો ઉપર મુજબ અનુસ્થાની પરથી મેળવી શકે છે.

આકૃતિઓની A, B, C, D, E અને F બિંદુઓ એક સરમું ખર્ચ થતું હોય તેવા


શ્રમ અને મૂરીનાં શક્ય સંયોજનો દર્શાવિ છે. આ બિંદુએને જોડતા જે સંંગ રેખા પ્રાપ્ત થાય છે તે સમ ખર્ચ રેખા છે.

### (3) ન્યૂનતમ ખર્ચ સંયોજન (ઉત્પાદકની સમતુલ્ય)

“આજુની આકૃતિમાં પેઢી માટે AB સમ ખર્ચ રેખા છે. પેઢી માટે કોઈ પણ બિંદુએ ખર્ચ સરખું છે. પેઢી અપેલા ખર્ચે જે બિંદુએ સૌથી વધારે ઉત્પાદન કરે છે તે બિંદુ ન્યૂનતમ ખર્ચનું બિંદુ બને છે.”

ટૂંકમાં, સમખર્ચ રેખા શક્ય તેટલી ઊંચામાં ઊંચી સમ ઉત્પાદન રેખાને જ્યાં

સ્પર્શ કરે છે તે બિંદુએ પેઢી સમતુલ્યામાં છે. આકૃતિમાં P બિંદુએ સમ ખર્ચ રેખા AB અને સમ ઉત્પાદન રેખા  $I_{Q_2}$ ને સ્પર્શે છે. જ્યાં પેઢી કે ઉત્પાદકની સમતુલ્ય પ્રાપ્ત થાય છે.



## 1. ઉત્પાદન ખર્ચનું વિશ્વેષણ

પ્ર-૭ ખર્ચના વિવિધ ઘાલો.

પેડીના ઉત્પાદન ખર્ચનું વિશ્વેષણ સમયના ગાળાને લક્ષમાં રાખી રજૂ કરવામાં આવે છે. સમયના ગાળાને બે ભાગમાં વહેંચી શકાય :

(i) ટૂંકી ગાળો અને (ii) લાંબો ગાળો.

(i) ટૂંકી ગાળો એટલો એટલો સમય કે જે સમય દરમિયાન પેડીના કદમાં વધારો કે ઘટાડો થઈ શકતો નથી. જ્યારે (ii) લાંબો ગાળો એટલો એટલો સમય કે જે સમય દરમિયાન પેડીનું કં વધારીને મોટું કરી રાકાય છે અથવા તો તે પટાડીને નાનું કરી રાકાય. આમ, ટૂંકા ગાળામાં પેડીના કદમાં વધાર થઈ શકતી નથી, જ્યારે લાંબા ગાળે પેડીના કદમાં વધાર થઈ શકે છે.

ટૂંકા ગાળામાં ઉત્પાદન વધારથું હોય તો અસ્થિર સાધનોનું પ્રમાણ વધારીને જ ઉત્પાદન વધારી શકાય છે. ઉત્પાદન વધારથું હોય તો અસ્થિર સાધનોનું પ્રમાણ ઘટાડી નાખવામાં આવે છે. ટૂંકા ગાળામાં સ્થિર સાધનોના પ્રમાણમાં વધાર થઈ શકતી નથી. આથી ટૂંકા ગાળામાં પુરવઠો થોડા પ્રમાણમાં વધારી કે ઘટાડી શકાય છે. ટૂંકા ગાળામાં જેટલા પ્રમાણમાં માંગમાં વધાર થાય છે તેટલા પ્રમાણમાં પુરવઠો વધારી કરી શકતી નથી.

લાંબા ગાળે જેટલા પ્રમાણમાં માંગ વધે કે ઘટે તેટલા પ્રમાણમાં પુરવઠો વધારી કે ઘટાડી શકાય છે. આ લાંબા ગાળે પુરવઠામાં આવશ્યકતા પ્રમાણે વધાર કરી શકાય છે. બીજી રીતે કહીએ તો લાંબા ગાળે પુરવઠો સંપૂર્ણ મૂલ્યસાપેક્ષ બને છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો લેટ માત્ર ટૂંકા ગાળા પૂરતો મહત્વનો છે. લાંબા ગાળે બધો ખર્ચ અસ્થિર ખર્ચ બની જાય છે.

(II) સ્થિર ખર્ચ :

પો. માર્શિલ સ્થિર ખર્ચને પૂરક ખર્ચ અથવા ઓવરહેડ ખર્ચ (Supplementary costs or Overhead costs) કહે છે. આ સ્થિર ખર્ચ એ અર્થમાં છે કે ટૂંકા ગાળામાં બદલાતું નથી. તે પૂરક એ અર્થમાં છે કે ઉત્પાદિત વસ્તુ પ્રત્યક્ષ રીતે આ ખર્ચ પર આધ્યાર રાખતી નથી. તે ઓવરહેડ કે સામાન્ય અર્થમાં છે કે વસ્તુના બધાં.૪ એકમો માટે આ ખર્ચ કરવામાં આવે છે. વસ્તુના કોઈ એક એકમ માટે જ પાસ તે કરવામાં આવતું નથી.


સ્થિર ખર્ચ અથવા પૂરક ખર્ચ એ એટું ખર્ચ છે કે જેમાં ઉત્પાદનની વધાર સાથે કોઈ ફરજાર થતો નથી. ઉત્પાદન શુંધ હોય અથવા તો ઉત્પાદન વધે કે ઘટે છતાં સ્થિર ખર્ચ બદલાતું નથી. ઉત્પાદનના પ્રમાણ સાથે તેને પ્રત્યક્ષ સંબંધ નથી. આ પરથી કહી શકાય છે કે જે ખર્ચ ઉત્પાદનમાં વધાર થાય છાં બદલાતું નથી તે સ્થિરખર્ચ કે પૂરક ખર્ચ કહી શકાય. સ્થિર ખર્ચમાં જમીનનું ભાડું, કારખાનાના મકાનનું ભાડું, મૂરીનું વ્યાજ, કાપમી સ્ટાન્ડનું વેતન, સંગ્રહ વસાવવાનું ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. સ્થિર ખર્ચનો

વિચાર અહીં કુલ ખર્ચની રીતે જ કરવામાં આવેલો છે. નીચે આપેલી અનુસૂચિ કુલ સ્થિર ખર્ચનું લક્ષણ સ્પષ્ટ કરે છે.

### કુલ સ્થિર ખર્ચની અનુસૂચિ

ઉત્પાદન (એકમો)	ખર્ચ (રૂપિયા)
શૂન્ય	200
1	200
2	200
3	200
4	200
5	200
6	200

ઉપરોક્ત અનુસૂચિ દર્શાવે છે કે ઉત્પાદન શૂન્ય હોય અથવા તો વધે કે ઘટે તો પણ ઉત્પાદન ખર્ચ સરણું જ રહે છે. અનુસૂચિ પરથી નીચે પ્રમાણે આકૃતિ દોરી શકાય. આકૃતિમાં  $ox$  ખર્ચ પર ઉત્પાદન એકમો અને  $oy$  ખર્ચ પર ખર્ચ લેવામાં આવેલ છે. TF રેખા કુલ સ્થિર ખર્ચની રેખા છે.



આકૃતિમાં કુલ સ્થિર ખર્ચની રેખા TF પાયાની રેખાને સમાંતર રીતે આવેલી છે. તે દર્શાવે છે કે ઉત્પાદન શૂન્ય હોય, 1 એકમ હોય, 2 એકમ હોય કે 6 એકમ હોય તો પણ કુલ સ્થિર ખર્ચ રૂપિયા 200 જ રહે છે.

### (II) અસ્થિર ખર્ચ :

પ્રો. માર્શલ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ (Prime costs) કરે છે. આ ખર્ચ અસ્થિર એ અર્ધમાં છે કે


ઉત્પાદનના પ્રમાણ રાંચે વધાડ પામે છે. તે મુખ્ય એ અર્ધમાં છે કે ઉત્પાદિત વસ્તુ તેની સાથે પ્રત્યક્ષ સંબંધ પરાવે છે, જો અસ્થિર કે મુખ્ય ખર્ચ કરવામાં ન આવે તો વસ્તુનું ઉત્પાદન જ ન થાય.

અસ્થિર કે મુખ્ય ખર્ચ એ એવું ખર્ચ છે કે જેમાં ઉત્પાદનના પ્રમાણની વધણ સાથે ફેરફાર થાય છે. ઉત્પાદન શૂન્ય હોય તો તે ખર્ચ શૂન્ય હોય છે. ઉત્પાદન વધે તો તે વધે અને ઉત્પાદન ઘટે તો તે ઘટે છે. આ પરથી કહી શકાય કે જે ખર્ચ ઉત્પાદનમાં વધારા કે ઘટાડા સાથે પરિવર્તન પામે છે તે તે ખર્ચને અસ્થિર કે મુખ્ય ખર્ચ કહી શકાય. અસ્થિર ખર્ચમાં બળતશી, કાગ્યો માલ, વાહનાંયવહાર, દાડિયા-મજૂરો પર કરવામાં આવતા ખર્ચનો સમાવેશ થાય છે. અસ્થિર ખર્ચનો વિચાર અહીં કુલ અસ્થિર ખર્ચની રીતે જ કરવામાં આવેલો છે. નીચે આપોલી અનુસૂચિ કુલ અસ્થિર ખર્ચનું લક્ષણ રૂપી કરે છે.

### કુલ અસ્થિર ખર્ચની અનુસૂચિ

ઉત્પાદન (એકમો)	ખર્ચ (રૂપિયા)
શૂન્ય	શૂન્ય
1	50
2	60
3	75
4	120
5	200
6	300


ઉપરની અનુસૂચિ દર્શાવે છે કે ઉત્પાદન શૂન્ય હોય તો કુલ અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ વધતું જાય છે. આ માટે આઈતિ જુઓ. આઈતિમાં  $ox$  ખર્ચ પર ઉત્પાદન એકમો અને  $oy$  ખર્ચ પર ખર્ચ લેવામાં આવેલ છે.  $TV$  રેખા કુલ અસ્થિરની ખર્ચની રેખા છે.



આકૃતિમાં જોઈ શકાય છે કે કુલ અસ્થિર ખર્ચની રેખા TV ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય છે, અર્થાત તેનો ઢાળ ધન છે. જેનો અર્થ એ થાપ કે ઉત્પાદન વધતા કુલ અસ્થિર ખર્ચ વધે છે.

### (III) કુલ ખર્ચ :

કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો કરવાથી કુલ ખર્ચ મળે છે. સૂત્રના રૂપમાં કહીએ તો કુલ ખર્ચ = કુલ સ્થિર ખર્ચ + કુલ અસ્થિર ખર્ચ. દા. ત., અગાઉની કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચની અનુસૂચિને આપારે કહી શકાય કે શૂન્ય એકમનું કુલ ખર્ચ જાણતું હોય તો કુલ સ્થિર ખર્ચ + કુલ અસ્થિર ખર્ચ = કુલ ખર્ચ. તેથી  $200 + 0 = 200$  રૂપિયા છે, જ્યારે પહેલા એકમનું કુલ ખર્ચ  $200 + 50 = 250$  રૂપિયા છે અને પાંચમા એકમનું કુલ ખર્ચ  $200 + 200 = 400$  રૂપિયા છે. કુલ ખર્ચની રેખા માટે નીચે ગ્રમાં આકૃતિ દોરી શકાય. આકૃતિમાં  $Ox$  ધરી પર ઉત્પાદન ખર્ચ અને  $Oy$  ધરી પર ખર્ચ લેવામાં આવેલ છે.  $TC$  કુલ ખર્ચનો વક્ત છે.



ઉપરની આકૃતિમાં કુલ ખર્ચની રેખા જોતાં જાણાય છે કે શૂન્ય એકમે કુલ ખર્ચ 200 રૂપિયા છે. પાંચમા એકમે કુલ ખર્ચ 400 રૂપિયા છે. ઉત્પાદન વધતા કુલ ખર્ચ પણ વધે છે. આથી કુલ ખર્ચની રેખા પણ ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય છે એટલે કે તેનો ઢાળ ધન છે.


### (IV) સરેરાશ સ્થિર ખર્ચ :

સરેરાશ સ્થિર ખર્ચ એટલે એકમાંડ સ્થિર ખર્ચ. સૂત્રના રૂપમાં કહીએ તો સરેરાશ સ્થિર ખર્ચ =  $\frac{\text{કુલ સ્થિર ખર્ચ}}{\text{વસ્તુના એકમો}}$ . ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ વધારે ને

વધારે એકમો વચ્ચે વહેંચાઈ જાય છે. તેથી ઉત્પાદન વધતાં સરેરાશ સ્થિર ખર્ચ ઘટતું જાય છે. આગળ કુલ ખર્ચની અનુસ્ફૂચિ આપી છે. તેના પરથી સરેરાશ સ્થિર ખર્ચ આ

$$\text{ચીતે શોધી શકાય : } \frac{200}{1} = 200, \frac{200}{2} = 100, \frac{200}{3} = 66.7, \frac{200}{4} = 50,$$

$\frac{200}{5} = 40, \frac{200}{6} = 33.3$ . અહીં જોઈ શકાય છે કે ઉત્પાદન વધતાં સરેરાશ સ્થિર ખર્ચ ઘટતું જાય છે. ઉપરોક્ત આકડાઓને ધ્યાનમાં રાખીને સરેરાશ સ્થિર ખર્ચની રેખા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દોરી શકાય. નીચેની આકૃતિમાં  $ox$  ખર્ચ પર ઉત્પાદન એકમો અને  $oy$  પરી પર ખર્ચ લેવામાં આવેલ છે.  $AF$  વક્ત સરેરાશ સ્થિર ખર્ચનો પક્કા છે.



ઉત્પાદન વધતાં સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે. તેથી સરેરાશ સ્થિર ખર્ચની રેખા ડાબી બાજુ પરથી જમણી બાજુ નીચે તરફ ઢણે છે. અર્થાત્ તેનો ઢાળ ઋણ છે. તેનો અર્થ એ ચાપ કે ઉત્પાદન વધતાં સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે.


#### (V) સરેરાશ અસ્થિર ખર્ચ :

સરેરાશ અસ્થિર ખર્ચ એટલે એકમદીઠ અસ્થિર ખર્ચ. સૂત્રના રૂપમાં કહીએ તો સરેરાશ અસ્થિર ખર્ચ =  $\frac{\text{કુલ અસ્થિર ખર્ચ}}{\text{પસ્તુના એકમો}}$ . આગળ આપેલી કુલ અસ્થિર ખર્ચની અનુસ્ફૂચિ પરથી સરેરાશ અસ્થિર ખર્ચ આ ચીતે શોધી શકાય :  $\frac{50}{1} = 50, \frac{60}{2} = 30,$

$$\frac{75}{3} = 25, \frac{120}{4} = 30, \frac{200}{5} = 40, \frac{300}{6} = 50.$$

આંકડાઓ જોતાં ખ્યાલ આવે છે કે શરૂઆતમાં સરેરાશ અસ્થિર ખર્ચ વધારે હોય છે પછી તે ઘટતું જાય છે ત્યાર પછી તે ફરીથી વધવા માટે છે. શરૂઆતમાં ઉત્પાદનમાં વધતા મળતરનો અથવા બીજી રીતે કહીએ તો ઘટતા ખર્ચનો નિયમ લાગુ પડતો હોય છે. આથી સરેરાશ અસ્થિર ખર્ચ ધીમે ધીમે ઘટવા માટે છે. જ્યાં સુધી અસ્થિર સાધનનો પૂરેપૂરો ઉપયોગ ન થયો હોય ત્યાં સુધી આમ બને છે.

પરંતુ ઉત્પાદનની માનિયામાં સ્થિર સાધનનો પૂરેપૂરો ઉપયોગ થઈ ગયા છતાં પણ તેના પર અસ્થિર સાધનનોનું પ્રમાણ વપારવામાં આવે તો ખર્ચના પ્રમાણમાં ઉત્પાદન ઓછું વધે છે, એટલે કે ઘટતા મળતરનો નિયમ લાગુ પડે છે અથવા બીજી રીતે કહીએ તો વધતા ખર્ચનો નિયમ લાગુ પડે છે અને તેથી સરેરાશ અસ્થિર ખર્ચ ફરીથી વધવા માટે છે. સરેરાશ અસ્થિર ખર્ચની રૈખા આ પ્રમાણે ઢોરી શકાય. આકૃતિમાં  $ox$  પરી પર ઉત્પાદન અનુકૂળે અને  $oy$  પરી પર ખર્ચ લેવામાં આવે છે.  $AV$  વક્ત સરેરાશ અસ્થિર ખર્ચનો વક્ત છે.



ઉપરની આકૃતિમાં જોઈ શકાય છે કે શરૂઆતમાં સરેરાશ અસ્થિર ખર્ચ વધારે છે ત્યાર બાદ તે ઘટતું જાય છે. બીજા એકમ પછી ફરીથી તે વધતું જાય છે.

જેવી રીતે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ એ બનેનો સરવાળો કરીને કુલ ખર્ચ મેળવી શકાય છે તેવી જ રીતે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ એ બનેનો સરવાળો કરીને સરેરાશ કુલ ખર્ચ મેળવી શકાય છે. સુનના રૂપમાં મૂકીએ તો —

$$\text{કુલ સ્થિર ખર્ચ} + \text{કુલ અસ્થિર ખર્ચ} = \text{કુલ ખર્ચ}$$

$$\text{સરેરાશ સ્થિર ખર્ચ} + \text{સરેરાશ અસ્થિર ખર્ચ} = \text{સરેરાશ કુલ ખર્ચ}$$

સરેરાશ કુલ ખર્ચ વિષે વિચાર કરતાં પહેલાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના મહત્વનો વિચાર કરવો જરૂરી છે.

## (VI) સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો વ્યવહારમાં ઉપયોગ :

ઉત્પાદનો નફો એટલે કુલ ખર્ચ અને કુલ આવક વધ્યેનો તફાવત. જો કુલ ખર્ચ કરતાં કુલ આવક વધારે હોય તો ઉત્પાદક અસામાન્ય નફો કર્માય છે. આ નફો સામાન્ય નફો ઉપરાંતનો છે. સામાન્ય નફાની ગણતરી કુલ ખર્ચમાં કરી લેવામાં આવે છે. જો કુલ આવક કરતાં કુલ ખર્ચ વધારે હોય તો ઉત્પાદકને ખોટ જાય છે.

આનો અર્થ એ થાય કે ઉત્પાદનને ખોટ ન જાય એટલા માટે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બંને નીકળી રહેવા જોઈએ. જો આ બંને ખર્ચ ન નીકળી રહે તો ઉત્પાદકને ખોટ જાય છે. આવે સમયે ઉત્પાદકને સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના ઘાલો, ઉત્પાદન ચાલુ રાખવું કે બંધ કરી દેવું તે અંગેનો નિર્ણય લેવામાં માર્ગદર્શક નીવડે છે.

ઉત્પાદકને થતા નફો કે ખોટનો આધાર બજાર કિંમત પર રહેલો છે.

(1) જો ટૂંકા ગાળામાં સરેરાશ અસ્થિર ખર્ચ કરતાં કિંમત વધારે હોય તો થોડું સરેરાશ સ્થિર ખર્ચ પણ નીકળાનું નથી. આથી ઉત્પાદન ચાલુ રાખવામાં આવે તો કુલ ખોટ ઓછી થાય છે. જો ઉત્પાદન બંધ કરવામાં આવે તો કુલ ખોટ વધારે થાય છે કારણ કે ઉત્પાદન બંધ થતાં સ્થિર ખર્ચ પૂરોપૂરું ઉત્પાદકે ભોગવવું પડે છે. આથી આ સંજોગોમાં ઉત્પાદન ચાલુ રાખવામાં આવે છે.

(2) જો ટૂંકા ગાળામાં સરેરાશ અસ્થિર ખર્ચ કરતાં કિંમત ઓછી હોય તો તેનો અર્થ એ થયો કે અસ્થિર ખર્ચ પણ નીકળાનું નથી. આથી ઉત્પાદન ચાલુ રાખવામાં આવે તો ઉત્પાદકે સ્થિર ખર્ચ ભોગવવું જ પડે છે. વધારામાં કિંમત ઓછી હોવાથી થોડું અસ્થિર ખર્ચ પણ ભોગવવું પડે છે. આ કરતાં તો ઉત્પાદન બંધ કરી દેવામાં આવે તો ઉત્પાદકને માત્ર સ્થિર ખર્ચ જ ભોગવવું પડે. આથી આવા સંજોગોમાં ઉત્પાદન બંધ કરી દેવામાં આવે છે.

દુંકમાં (1) જો ટૂંકા ગાળામાં સરેરાશ અસ્થિર ખર્ચ નીકળી રહે તેટલી બજાર કિંમત હોય તો ઉત્પાદન ચાલુ રાખવામાં આવશે, કારણ કે આ સંજોગોમાં સામાન્ય નફો મળે જ છે. (2) જો ટૂંકા ગાળામાં સરેરાશ અસ્થિર ખર્ચ કરતાં વધારે કિંમત હોય તો થોડું સ્થિર ખર્ચ પણ નીકળી રહે છે, માટે ઉત્પાદન ચાલુ રાખવામાં આવશે. (3) જો ટૂંકા ગાળામાં સરેરાશ અસ્થિર ખર્ચ કરતાં કિંમત ઓછી હોય તો ઉત્પાદન બંધ કરી દેવામાં આવશે, કારણ કે ઉત્પાદન ચાલુ રાખવાથી વધારે ખોટ જાય છે અને ઉત્પાદન બંધ કરી દેવાથી ઓછી ખોટ જાય તેવી સંજીવિત સર્જિય છે.

આમ, ટૂંકા ગાળામાં સરેરાશ અસ્થિર ખર્ચ નીકળી રહે તેટલી બજારકિંમત હોય તો જ ઉત્પાદન ચાલુ રાખવામાં આવે છે. લાંબા ગાળે તો સરેરાશ અસ્થિર ખર્ચ ઉપરાંત સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે સરેરાશ કુલ ખર્ચ નીકળી રહે તેટલી કિંમત હોય તો જ પેઢી ઉત્પાદન ચાલુ રાખશે. સરેરાશ કુલ ખર્ચ કરતાં ઓછી કિંમત હોય તો લાંબા ગાળે પેઢી ઉત્પાદન બંધ કરી દેશે.

## સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ

(૬) સરેરાશ ખર્ચ : સરેરાશ ખર્ચન

સરેરાશ કુલખર્ચ પણ કહેવામાં આવે છે.


સરેરાશખર્ચ એટલે એકમદીઠ ખર્ચ. કુલખર્ચ

(કુલ સ્થિરખર્ચ + કુલ અસ્થિરખર્ચ) ને કુલ ઉત્પાદનથી ભાગીને સરેરાશ ખર્ચ મેળવવામાં આવે છે. સરેરાશખર્ચ = કુલ ખર્ચ ÷ કુલ ઉત્પાદન.

ઉત્પાદન અને સરેરાશખર્ચ વચ્ચેનો સંબંધ સાવચેતીપૂર્વક સમજવા જેવો છે. સરેરાશખર્ચ = સરેરાશ સ્થિર ખર્ચ + સરેરાશ અસ્થિરખર્ચ. આથી સરેરાશખર્ચના વલણ પર સરેરાશ સ્થિરખર્ચ અને સરેરાશ અસ્થિરખર્ચ બંનોના વલણની અસર પડે છે. શરૂઆતમાં ઉત્પાદન વધે તેમ સરેરાશ સ્થિરખર્ચ અને સરેરાશ અસ્થિરખર્ચ બંને ઘટે છે. આથી ઉત્પાદનના વધારા સાથે સરેરાશખર્ચ ઘટે છે. સરેરાશ સ્થિરખર્ચ સતત ઘટનું રહે છે, પણ અમુક બિંદુ પછી સરેરાશ અસ્થિરખર્ચ વધ્યા પાડે છે. જ્યાં સુધી સરેરાશ સ્થિરખર્ચનો ઘટાડો સરેરાશ અસ્થિરખર્ચના વધારાથી વધુ હોય ત્યાં સુધી (સરેરાશ અસ્થિરખર્ચ વધતું હોય છતાં) સરેરાશખર્ચ ઘટે છે. જ્યારે સરેરાશ સ્થિરખર્ચના ઘટાડાની સરખામણીમાં સરેરાશ અસ્થિરખર્ચનો વધારો વડી જાય છે ત્યારે સરેરાશખર્ચ વધે છે. આમ, ઉત્પાદનવૃદ્ધિ સાથે સરેરાશખર્ચ શરૂઆતમાં ઘટનું જાય છે, પણ અમુક બિંદુ પછી તે વધે છે. ઉત્પાદન અને સરેરાશખર્ચ વચ્ચેનો આ સંબંધ અનુસૂચિના સ્વરૂપમાં નીચે મુજબ રજૂ કરી શકાય :

કુલ ઉત્પાદન (એકમો)	સરેરાશ ખર્ચ (રૂ.)
૦	-
૧	૧૬૦.૦૦
૨	૧૩૫.૦૦
૩	૧૧૩.૩૩
૪	૧૦૦.૦૦
૫	૮૪.૦૦
૬	૬૧.૬૭
૭	૬૧.૪૩
૮	૬૩.૭૩
૯	૬૭.૭૮

ઉપર્યુક્ત અનુસૂચિ મુજબ, ઉત્પાદન વધે તેમ સાતમા એકમ સુધી સરેરાશખર્ચ ઘટે છે. સાતમા એકમે લધુતમ સપાતીએ છે. સાતમા એકમ પછી ઉત્પાદનવૃદ્ધિ સાથે સરેરાશખર્ચ વધે છે. સરેરાશખર્ચના વલણો આકૃતિ-ફોર્મા દર્શાવેલ છે.



### આકृति-૬

આકृति-૬માં સરેરાશખરેખા અંગેજ અકાર U આકારની છે: સતતમા એકમ સુધી તે ઋણ ઢાળની છે, તે પછી તે ધનઢાળની બની સુધી સરેરાશખર્ય ઘટે છે, ત્યાર પછી તે વધે છે.  
 (૭) સીમાંતખર્ય: વસ્તુના ઉત્પાદનમાં એક એકમનો ફેરફાર કરતાં કુલખર્યમાં જે ફેરફાર થાય તેને સીમાંતખર્ય (Marginal cost) કહેવામાં આવે છે. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો વધારાનું એકમ ઉત્પાદન કરવાથી કુલખર્યમાં થતો વધારો એ સીમાંતખર્ય છે.

ટૂકા ગાળામાં વધારાનું એકમ ઉત્પાદન કરવા માટે વધારાનું જે ખર્ય કરવામાં આવે છે તે બધું જ અસ્થિર સાધનનોનું ખર્ય હોય છે. એટલે કે સીમાંતખર્ય એ વધારાના એકમના ઉત્પાદનને લીધે કુલ અસ્થિરખર્યમાં થયેલો વધારો દર્શાવે છે. બીજી રીતે કહીએ તો વસ્તુનું વધારાનું એકમ ઉત્પાદન કરવામાં આવે તારે કુલ અસ્થિરખર્યમાં થતો વધારો તપાસીને સીમાંતખર્ય જાણી શકાય છે. ટૂકા ગાળામાં વધારાનું એકમ ઉત્પાદન કરવાથી કુલખર્યમાં થતો વધારો અને કુલ અસ્થિરખર્યમાં થતો વધારો બંને સરાખાં હોય છે.

આપણે જાણીએ છીએ કે ઉત્પાદન વધારવામાં આવે તો આરંભમાં કુલ અસ્થિરખર્ય ઘટતા દરે વધે છે અને અમુક બિંદુ પછી વધતા દરે વધે છે. એનો અર્થ એ છે કે શરૂઆતમાં ઉત્પાદનના વધારા સાથે સીમાંતખર્ય ઘટે છે અને અમુક બિંદુ પછી એ વધે છે. ઉત્પાદન અને સીમાંતખર્ય વચ્ચેનો આ સંબંધ અનુસૂચિમાં નીચે મુજબ દર્શાવી શકાય:

કુલ ઉત્પાદન (એકમો)	કુલ ખર્ય (રૂ. માં)	સીમાંત ખર્ય (રૂ.)
૦	૧૦૦	-
૧	૧૯૦	૯૦
૨	૨૭૦	૮૦
૩	૩૪૦	૭૦
૪	૪૦૦	૬૦
૫	૪૬૦	૬૦
૬	૫૨૦	૮૦
૭	૬૪૦	૬૦
૮	૭૪૦	૧૧૦
૯	૮૮૦	૧૩૦

ઉપર્યુક્ત અનુસૂચિમાં ઉત્પાદન વધતાં ચોથા એકમ સુધી સીમાંતખર્ય ઘટે છે. ચોથા એકમે તે લધુતમ છે. અને ચોથા એકમ પછી વધે છે. સીમાંતખર્યનું આ વલણ આફૂતિ-જમાં રજૂ કરવામાં આવ્યું છે.

આફૂતિ-જમાં સીમાંતખર્યરીખા અંગેજી અસર પ આકારની છે. ચોથા એકમ સુધી. સીમાંતખર્યરીખા ગ્રાફ ઢાળની છે. ચોથા એકમ પછી, ઉત્પાદનવૃદ્ધિ સાથે, સીમાંતખર્ય વધે છે. આથી સીમાંતખર્યરીખા પણાળની બની છોય છે.


(c) સીમાંતખર્ય અને સરેરાશખર્ય વર્ષો સંબંધ : સીમાંત ખર્ય એ વસ્તુનું વધારાનું એકમ ઉત્પાદન કરતાં કુલખર્યમાં થતો વધારો છે, જ્યારે સરેરાશખર્ય એકમદીઠ ખર્ય છે, જે કુલખર્યને કુલ ઉત્પાદનથી ભાગીને મેળવવામાં આવે છે.

સરેરાશખર્યનું વલણ સીમાંતખર્યના વલણ પર આપારિત છે. આ ભાષી નીચે જ્યાનેલા સીમાંતખર્ય-સરેરાશખર્ય સંબંધ અંગેના મુદ્દાઓ પરથી સ્પષ્ટ થશે :

- સીમાંતખર્ય સરેરાશખર્યથી અંતરું હોય ત્યારે સરેરાશખર્ય ઘટે છે.
- સીમાંતખર્ય સરેરાશખર્યથી વધુ હોય ત્યારે સરેરાશખર્ય વધે છે.
- સીમાંતખર્ય સરેરાશખર્ય બરાબર હોય ત્યારે સરેરાશખર્ય સ્થિર અને લધુતમ હોય છે.

નીચેની અનુસૂચિમાં આ મુદ્દા વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાશે :


કુલ ઉત્પાદન (એકમો)	કુલખર્ય (રૂ.)	સીમાંતખર્ય (રૂ.)	સરેરાશ ખર્ય (રૂ.)
0	100	-	-
1	160	60	160.00
2	290	60	134.00
3	380	90	113.33
4	460	60	100.00
5	520	60	84.00
6	540	60	69.67
7	540	60	69.43
8	540	90	63.93
9	540	130	57.78



### આફૂતિ-જ

ઉપર્યુક્ત અનુસૂચિમાં સીમાંતખર્ય ચોથા એકમ સુધી ઘટે છે અને પછી વધવા માટે છે. પરંતુ સાતમા એકમ સુધી સીમાંતખર્ય સરેરાશખર્ય કરતાં ઓછું છે. આથી સાતમા એકમ સુધી સરેરાશખર્ય ઘટે છે. સાતમા એકમ પછી સીમાંતખર્ય સરેરાશખર્યથી વધુ છે. આથી સાતમા એકમ પછી સરેરાશખર્ય વધે છે.


**સીમાંતખર્ય - સરેરાશખર્ય વચ્ચેનો સંબંધ આકૃતિમાં નીચે મુજબ રજૂ કરી શકાય :**



(i) આકૃતિ-Iમાં Q બિંદુ સુધી સીમાંતખર્ય રેખા સરેરાશ ખર્યરેખાની નીચે છે, આથી સરેરાશ ખર્યરેખા ફાળની છે. અર્થાત് સીમાંતખર્ય સરેરાશખર્યથી ઓછું હોવાને લીધે સરેરાશખર્ય ઘટે છે. (ii) Q બિંદુએ સીમાંતખર્ય અને સરેરાશખર્ય સરેરાશ થિંગ્સ એ. (iii) Q બિંદુ પછી સીમાંતખર્યરેખા સરેરાશખર્યરેખાની ઉપર છે, આથી સરેરાશખર્ય રેખા ધન ફાળની બને છે.

એટલે કે સીમાંતખર્ય સરેરાશખર્યથી વધુ હોવાને લીધે સરેરાશખર્ય વધે છે. (iv) Q બિંદુ સરેરાશખર્ય રેખાનું લધુતમ બિંદુ છે, અર્થાત્ Q બિંદુએ સરેરાશખર્ય ઓછામાં ઓછું છે.

(7) સરેરાશ સ્થિરખર્ય, સરેરાશ અસ્થિર-ખર્ય, સરેરાશખર્ય અને સીમાંતખર્ય વચ્ચે સંબંધ અને તેમનાં લક્ષણો : ઉપર્યુક્ત ચર્ચાના સારરૂપે આપણે ટૂંક ગાળામાં કોઈ એક પેઢીમાં સરેરાશ સ્થિરખર્ય, સરેરાશ અસ્થિરખર્ય, સરેરાશખર્ય અને સીમાંત ખર્ય વચ્ચેનો સંબંધ અને તેમનાં લક્ષણો આકાતિ દ્વારા પણ દર્શાવી શકીએ.



આકृतिमાં વિવિધ પ્રકારનાં એકમલકી ખર્ચાઓનાં વલશો અને પરસ્પર સંબંધ નીચે મુજબ રજૂ કરી શકાય :

આકृતિ-Iને આપારે નીચે મુજબ વિધાનો કરી શકાય :

- (i) સરેરાશ સ્થિરખર્ચરીખા સિવાયની તમામ ખર્ચરિબાઓ અંગેજ અંતર પ આકારની હોય છે.
- (ii) સરેરાશ સ્થિરખર્ચરીખા અતિપલય (rectangular hyperbola) આકારની હોય છે.
- (iii) સીમાંતખર્ચ રેખા

સરેરાશખર્ચરીખાને તેમ જ સરેરાશ અસ્થિરખર્ચરીખાને તેમના લધુતમ બિંદુએ છેદીને ઉપર જાય છે. (iv) સરેરાશખર્ચરીખાનું લધુતમ બિંદુ સરેરાશ અસ્થિરખર્ચરીખાના લધુતમ બિંદુની જમણી તરફ હોય છે. (v) સરેરાશ સ્થિર ખર્ચ + સરેરાશ અસ્થિર ખર્ચ = સરેરાશ ખર્ચ. આથી ઉત્પાદનના કોઈ પણ એકમે (દા.ત., A) X ધરી અને સરેરાશ સ્થિરખર્ચરીખા વચ્ચેનું ઊભું અંતર (AB) + X ધરી અને સરેરાશઅસ્થિર ખર્ચરિખા વચ્ચેનું ઊભું અંતર (AC) = X ધરી અને સરેરાશખર્ચરીખા વચ્ચેનું ઊભું અંતર (AD).

(૧૦) સીમાંતખર્ચના ઘ્યાલનું મહત્વ : ઉત્પાદન કેટલું કરવું કે જેથી મહત્તમ નકો મળે (અથવા ઓછામાં ઓછી ખોટ આવે) એ અંગેના નિર્ણયીકરણમાં સીમાંતખર્ચનો ઘ્યાલ ખૂબ ઉપયોગી બને છે. વધારાનું એકમ ઉત્પન્ન કરવું કે નહીં એ નક્કી કરતી વખતે ઉત્પાદક એ બાબત ઘાનમાં લે છે કે વધારાના એકમનું ઉત્પાદન કરવાથી એક તરફ કુલખર્ચમાં કેટલો વધારો થાય છે અને બીજી તરફ કુલ આવકમાં કેટલો વધારો થાય છે. આપણે પ્રકારા ફ-માં સાંબિત કરીશું કે જ્યાં સીમાંતખર્ચ અને સીમાંતઆવક સરખાં થાય તે ઉત્પાદનની સપાટીએ નકો મહત્તમ હોય છે અથવા ખોટ લધુતમ હોય છે.

(૧૧) સરેરાશખર્ચના ઘ્યાલનું મહત્વ : સરેરાશખર્ચનો ઘ્યાલ લાંબા ગાળાના વિશ્લેષણમાં વિશેષ ઉપયોગી બને છે. લાંબે ગાળે પ્રત્યેક પેઢી ઓછામાં ઓછી સરેરાશખર્ચ જેટલી કિમત મળી રહે એવી અપેક્ષા રાખે છે. જો લાંબા ગાળામાં વસ્તુની કિમત સરેરાશખર્ચથી પણ ઓછી હોય તો પેઢીને સાખારાશ નકો પણ મળતો નથી. અથવા નિયોજકને સંચાલનકાર્ય બદલ જે મહેનતાનું મળવું જોઈએ તે પણ મળતું નથી. આથી પેઢી આ ઉદ્યોગ લાંબું દરો. લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવું કે નહીં તે નક્કી કરવાના (કિમતના સંદર્ભમાં) સરેરાશખર્ચ મહત્ત્વનો બાગ ભજ્યે છે.

(૧૨) સ્થિરખર્ચ અને અસ્થિરખર્ચના તફાવતનું મહત્વ : ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવું કે નહીં એ નક્કી કરવામાં સ્થિરખર્ચ અને અસ્થિરખર્ચનો તફાવત ખૂબ ઉપયોગી બને

છે. આ તકાવતના આધારે આપણે સમજાવી શકીએ કે ટૂકા ગાળામાં કેટલીક વાર પેઢી શા માટે ખોટ ખાઈને પણ ઉત્પાદન ચાલુ રાખે છે.

ટૂકા ગાળામાં ઉત્પાદન શૂન્ય હોય તો પણ સ્થિરભર્ય તો ભોગવવું પડે છે. એટલે કે ટૂકા ગાળામાં ઉત્પાદન બંધ કરવામાં આવે તો પણ કુલ સ્થિરભર્ય જેટલી ખોટ ભોગવવી જ પડે છે. હવે ધારો કે વસ્તુની કિમત સરેરાશાખર્યથી ઓછી છે, પણ સરેરાશ અસ્થિરભર્યથી વધુ છે. આ પરિસ્થિતિમાં ઉત્પાદન ચાલુ રાખવાથી આવતી ખોટ, ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અનિવાર્યપણે ભોગવવી પડતી ખોટથી, ઓછી હોય છે. આથી તર્કબદ્ધ રીતે વર્તતી પેઢી ઉત્પાદન ચાલુ રાખે છે.

ઉદાહરણની મદદથી આ મુદ્દો સ્પષ્ટ કરી શકાય. ધારો કે કુલ સ્થિરભર્ય રૂ. ૧૦૦ છે. ચાર એકમો ઉત્પન્ન કરવામાં આવે ત્યારે કુલ અસ્થિરભર્ય રૂ. ૩૦૦ છે. આથી ચાર એકમો ઉત્પન્ન કરવામાં આવે ત્યારે સરેરાશ સ્થિરભર્ય રૂ. ૨૫ છે, સરેરાશ અસ્થિરભર્ય રૂ. ૭૫ છે, જ્યારે સરેરાશભર્ય રૂ. ૧૦૦ છે. હવે ધારો કે વસ્તુની એકમ્બિઠ કિમત રૂ. ૮૦ છે. આ પરિસ્થિતિમાં ઉત્પાદન બંધ કરવામાં આવે તો ખોટ રૂ. ૧૦૦ (કુલ સ્થિરભર્ય જેટલી) છે અને ઉત્પાદન ચાલુ રાખવામાં આવે તો ખોટ રૂ. ૪૦ છે. કારણ કે રૂ. ૮૦ની કિમતે ચાર એકમોનું ઉત્પાદન અને વેચાણ કરવાથી પેઢીને રૂ. ૩૬૦ વેચાણ આવક મળે છે, જ્યારે ચાર એકમોનું કુલ ઉત્પાદનભર્ય રૂ. ૪૦૦ (૧૦૦ કુલ સ્થિરભર્ય + રૂ. ૩૦૦ કુલ અસ્થિરભર્ય) છે. સ્પષ્ટ છે કે પેઢી ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય લેશે. આ ઉદાહરણનો ફલિતાર્થ એ છે કે કિમત સરેરાશ અસ્થિરભર્યથી જેટલા અંશે વધુ હોય તેટલા અંશે પેઢી સ્થિરભર્યનો અમુક ભાગ વસૂલ કરી લે છે. આથી તેટલા અંશે ખોટ ઓછી થાય છે. આથી કિમત સરેરાશ અસ્થિરભર્ય વધુ હોય તો પેઢી ટૂકા ગાળામાં ખોટ ખાઈને પણ ઉત્પાદન ચાલુ રાખે છે.

કિમત સરેરાશ અસ્થિરભર્ય બારાબર હોય તો ઉત્પાદન ચાલુ રાખતાં આવતી ખોટ ઉત્પાદન બંધ હોય ત્યારે ભોગવવી પડતી ખોટથી હોય છે. ઉત્પાદન ચાલુ રાખવામાં આવે કે બંધ કરવામાં આવે, ખોટનું પ્રમાણ બદલાતું નથી. આ પરિસ્થિતિમાં પ્રતિજ્ઞા જાળવી રાખવા ખાતર પેઢી ઉત્પાદન ચાલુ રાખશે.

કિમત સરેરાશ અસ્થિરભર્યથી ઓછી હોય તો ઉત્પાદન ચાલુ રાખતાં આવતી ખોટ, ઉત્પાદન બંધ હોય ત્યારે ભોગવવી પડતી ખોટથી વધુ હોય છે. આથી ટૂકા ગાળામાં કિમત સરેરાશ અસ્થિરભર્યથી ઓછી હોય ત્યારે પેઢીને અવશ્ય તાણું મારવામાં આવશે.

### ૭) વેકલ્પિક ખર્ચ (Opportunity Cost) :

“વેકલ્પિક ખર્ચ એટલે વધાં બધા ઉપયોગો પરાવતા ઉત્પાદનનાં સાધનોએ જે શ્રેષ્ઠ વિકલ્પ જતાં કરવો પડે તે વિકલ્પમાંથી પ્રાપ્ત થનાર આવકને સાધનનો વેકલ્પિક ખર્ચ કહે છે.”

પ્રો. બેનલામના મતે “વેકલ્પિક ખર્ચ એટલે ઉત્પાદનનાં સાધનોએ જતાં કરવા પડેલા શ્રેષ્ઠ વિકલ્પની આવક.”

જે સાધનો વેકલ્પિક ઉપયોગો પરાવતા હોય, તે સાધનો જ્યારે કોઈ એક કામમાં રોકાપ છે, ત્યારે બાકીના અન્ય વેકલ્પિક ઉપયોગો સાધનોએ જતા કરવા પડે છે. આ જતા કરવા પડેલા વેકલ્પિક ઉપયોગોમાંથી જે વિકલ્પમાં સૌથી વધારે કમાણી થવાની હતી, તે કમાણીને તે સાધનોએ જતી કરવી પડે છે. આ જતી કરવી પડતી શ્રેષ્ઠ કમાણીને તે સાધનનો વેકલ્પિક ખર્ચ કહે છે.

દાત. જમીનનાં કોઈ એક ટૂકડામાં ઘઉં, ચોખા, કપાસ અને શેરીનું ઉત્પાદન થઈ રહે છે. જો ટૂકડામાં ઘઉનું ઉત્પાદન કરવામાં આવે તો ૪૦૦ રૂ., બાજરીનું ઉત્પાદન કરવામાં આવે તો ૫૦૦ રૂ., શેરીનું ઉત્પાદન કરવામાં આવે તો ૬૦૦ રૂ. અને કપાસનું ઉત્પાદન કરવામાં આવે તો રૂ. ૧૦૦૦ આવક પ્રાપ્ત થાય તેમ છે. હવે જે જમીનનાં ટૂકડાને કપાસના ઉત્પાદનમાં રોકવામાં આવે તો તે જ સમયે બાકીના ઘઉં, બાજરી અને શેરીના ઉત્પાદનનાં વિકલ્પો જતા કરવા પડે છે. આ જતા કરવા પડેલા ન્યોય વિકલ્પોમાં શેરીનાં ઉત્પાદનનો વિકલ્પ શ્રેષ્ઠ હતો. કારણ કે, શેરીનાં ઉત્પાદન દારા રૂ. ૮૦૦ આવક મળે તેમ હતી જે ઘઉં અને ચોખાની આવક કરતાં વધું છે. તેવી અહીં જમીનના ટૂકડાનો વેકલ્પિક ખર્ચ રૂ. ૮૦૦ છે તેમ કહેવાય. આવી જ રીતે ઉત્પાદનના અન્ય ત્રણ સાધનોનો વેકલ્પિક ખર્ચ ગણી શકાય છે.

#### મર્યાદા :

૧. વેકલ્પિક ઉપયોગ ન હોય ત્યારે : વેકલ્પિક ખર્ચ માત્ર વેકલ્પિક ઉપયોગ પરાવતા સાધનોને જ લાગુ પડે છે. જો કોઈ સાધન વેકલ્પિક ઉપયોગ પરાવતું ન હોય તો તેનો વેકલ્પિક ખર્ચ શૂન્ય હોય છે.

૨. ગતિશીલ ન હોય ત્યારે : વેકલ્પિક ખર્ચનાં ખ્યાલમાં સાધનોને સંપૂર્ણ ગતિશીલ પારવામાં આવ્યા છે, પરંતુ જો કોઈપણ કારણસર સાધન વ્યવસાયિક ગતિશીલતા પરાવતું ન હોય ત્યારે તેને વેકલ્પિક ખર્ચ લાગુ પાડી શકાય નહીં.

૩. બેચોજગારી : ઉત્પાદનના બેચોજગાર સાધનોનું વેકલ્પિક ખર્ચ કેટલું ગણાયું તે મુશ્કેલ છે.

#### મહત્વ :

૧. સાધનનું ન્યુનતમ વળતર નક્કી કરવા : કોઈપણ સાધનને ઉત્પાદનનાં કામમાં ઉપયોગમાં લેવું હોય તો તેને ઓછામાં ઓછું વેકલ્પિક ખર્ચ કરતા વધારે વળતર આપાયું જોઈએ.

૨. સાધનોની અપેક્ષા કરવા : વેકલ્પિક ખર્ચનો અધાર નિયોજકને સાપોનોની અપેક્ષ કરવામાં માનદંશુક બને છે. જેમ કે, જે સાધનનું વેકલ્પિક ખર્ચ ઓછું હોય તેનું પ્રમાણ વધારે વેકલ્પિક ખર્ચની અપેક્ષા સાધનોનું પ્રમાણ ઘટાડવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે.

## ૫ - આવકના વિવિધ ખ્યાલો

કુલ આવક, સીમાંત આવક, સરેરાશ આવક,  
સરેરાશ આવક અને સીમાંત આવક વચ્ચેના સંબંધો.

### (3) પેઢીનાં આવકનાં ખ્યાલો :

સામાન્ય રીતે અર્થશાસ્ત્રમાં પેઢીની આવકનાં વિવિધ ખ્યાલોનો અભ્યાસ કરવામાં આવે છે. જેવા કે, કુલ આવક, ચોખ્ખી આવક, સરેરાશ આવક, સીમાંત આવક વગેરે જેમાંથી જુદા જુદા પ્રકારની પેઢીઓમાં'કિમત અને ઉત્પાદન નિર્ધારણની પહોંચા. સમજાવવા ચોખ્ખી આવકનો ખ્યાલ મહત્વમો નથી. આથી અહીં આપણે જુદા જુદા પ્રકારનાં બજાર નીચે પેઢીની કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવકની ચર્ચા કરશું.

- ૧) **કુલ આવક (Total Income) :** પેઢીમાં ઉત્પાદિત થયેલ સેવા કે વસ્તુનાં એકમને તેનાં બજાર ભાવ વડે ગુણતા પેઢીની કુલ આવક મળ છે.  
દા.ત. એક પેઢી ૧૦૦૦ બલ્બ બનાવે છે અને ૧ બલ્બનો ભાવ રૂ.૧૦ છે, તો પેઢીની કુલ આવક ( $1000 \times 10 = 10,000$ ) રૂ.૧૦,૦૦૦ થાય છે.
- ૨) **સરેરાશ આવક (Average Income) :** પેઢીના કુલ વેચાણ એકમો / કુલ ઉત્પાદન એકમો દ્વારા પ્રાપ્ત થયેલી કુલ આવકને કુલ વેચાણ એકમો / કુલ ઉત્પાદન એકમો વડે/વિભાજતાં જે આવક મળે તેને સરેરાશ આવક કહે છે.  
બીજા શબ્દોમાંકદીએ તો એકમહીઠ આવકને સરેરાશ આવક કહે છે.  
દા.ત. એક પેઢીમાં કુલ ઉત્પાદન ૧૦૦ એકમોનું છે. વેચાણ કિમત રૂ. ૧૦ છે.  
પેઢીની કુલ આવક રૂ. ૧૦૦૦ છે, તો પેઢીની

$$\text{સરેરાશ આવક (AR)} = \frac{\text{કુલ આવક}}{\text{કુલ ઉત્પાદન}} = \frac{1000}{100} = 10 \text{ રૂ. (AR) છે}$$

૩) સીમાંત આવક (Marginal Income) : પેઢીનાં કુલ ઉત્પાદનમાં (કુલ વેચાણમાં) એક એકમનો વધારો કે ઘટાડો કરતા પેઢીની કુલ આવકમાં જે વધારો કે ઘટાડો થાય તેને સીમાંત આવક કહે છે. ટૂંકમાં પેઢીએ ઉત્પાદિત કરેલ છેલ્લા એકમનાં વેચાણ દ્વારા પ્રાપ્ત થયેલી આવકને પેઢીની સીમાંત આવક કહે છે.

દા.ત. , એક પેઢીમાં ૧૦૦ એકમોનું ઉત્પાદન (વેચાણ) થાય છે, અને પેઢીની કુલ આવક રૂ. ૧૦૦૦ છે. હવે જો પેઢીમાં ૧૦૧ (૧૦૦ + ૧) એકમોનું ઉત્પાદન (વેચાણ) કરવામાં આવે તો પેઢીની કુલ આવક રૂ. ૧૦૦૮ (૧૦૦૦ + ૮) થાય છે. તો અહીં પેઢીનાં છેલ્લા ઉત્પાદિત એકમની (વેચાણ એકમની) આવક રૂ.૮ છે. અહીં પેઢીની સીમાંત આવક રૂ.૮ કહેવાય છે.


૪) પૂર્વ હરિફાઈ દેટલ પેઢીની સરેરાશ અને સીમાંત આવક :

પૂર્વ હરિફાઈમાં ઉદ્યોગમાં રહેલી બધી જ પેઢીઓની વસ્તુઓ સંપૂર્ણ અવેજ હોય છે અને ઉદ્યોગમાં ઘણી બધી પેઢીઓ હોય છે. આથી બજાર પર કોઈ એક પેઢીનો અંકુશ હોતો નથી. પૂર્વ હરિફાઈમાં પેઢીએ ઉદ્યોગમાં નક્કી થયેલી કિમત સ્વીકારવી પડે છે. ઉદ્યોગમાં નક્કી થયેલી કિમત કરતા વધુ કિમત વસ્તુલ કરે તો માંગ શૂન્ય થઈ જાય છે. અને નીચી કિમત રાખે તો ખોટ થાય છે. આથી ઉદ્યોગમાં નક્કી થયેલી કિમત સ્વીકારીને જેટલું વેચાણ કરવું હોય તેટલું વેચાણ કરી શકે છે. એટલે કે વધારે વસ્તુનું વેચાણ કરવા કિમત ઘટાડવી પડતી નથી. તેથી પૂર્વ હરિફાઈમાં પેઢીની માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે. જેથી પૂર્વ હરિફાઈમાં પેઢીની સરેરાશ અને સીમાંત આવક નીચે અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે મળે છે.

પૂર્વ હરિફાઈમાં પેઢીની સરેરાશ અને સીમાંત આવકની અનુસૂચિ

ઉત્પાદન / માંગ / વેચાણ (એકમ)	કિમત (રૂ.)	કુલ આવક (રૂ.)	સરેરાશ આવક (રૂ.)	સીમાંત આવક (રૂ.)
૧	૧૦	૧૦	૧૦	૧૦
૨	૧૦	૨૦	૧૦	૧૦
૩	૧૦	૩૦	૧૦	૧૦
૪	૧૦	૪૦	૧૦	૧૦

ઉપરની અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે ચાલુ કિમતે વ્યક્તિગત પેઢી ગમે તેટલા એકમો વેચી શકે છે. કિમત એકસરખી રહે છે. તેથી સરેરાશ આવક એકસરખી રહે છે, તેમજ સીમાંત આવક પણ એકસરખી રહે છે. એટલે કે પૂર્ણ હરિફાઈમાં કિમત = સરેરાશ આવક = સીમાંત આવક રહે છે. આ બાબતને આકૃતિમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય. Y



ઉપરની આકૃતિમાં OX ધરી પર વસ્તુની મંગ અને OY ધરી પર વસ્તુની કિમત દર્શાવવામાં આવી છે. આકૃતિમાં DD રેખા વસ્તુની મંગ રેખા છે. મંગરેખાના ફળ પરથી જોઈ શકાય છે કે પેઢી રૂ. 10ની કિમતે ગમે તેટલા એકમો વેચી શકે છે. એ ઉપરાંત મંગરેખા એ કિમત રેખા પણ છે અને પૂર્ણ હરિફાઈમાં કિમત = સરેરાશ આવક = સીમાંત આવક હોય છે. આથી DD રેખા સરેરાશ આવક અને સીમાંત આવકની રેખા પણ છે. ટૂંકમાં

1. પૂર્ણ હરિફાઈમાં પેઢીની સરેરાશ આવક (મંગ રેખા) = સીમાંત આવક હોય છે અને
2. આ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે.

પ) ઈજારાયુક્ત હરિફાઈ અને ઈજારા હેઠળ પેઢીની સરેરાશ આવક અને સીમાંત આવક :


ઇજારા યુક્ત હરિફાઈ અને ઈજારામાં પેઢીની મંગરેખા પૂર્ણ કરતા ઓછી મૂલ્ય સાપેક્ષ હોય છે. ઇજારાયુક્ત હરિફાઈ અને ઈજારામાં પેઢી કિમત કે ઉત્પાદન બંને પર કાણૂં ધરાવે છે. છતાં પણ કોઈ એક જ સમયે બંને પર કાણૂં ધરાવી શકતી નથી. જો પેઢી ઉંગી કિમત રાખે તો ઉત્પાદન / વેચાણ ઓછું રહે છે અને જો પેઢી વધુ ઉત્પાદન / વેચાણ રાન્નવા હુંચું તો કિમત નીચી રાન્નવી પડે છે. એટલે કે જેમ વધુ વેચાણ કરતું હોય તેમ કિમત ઘટાડતી જવી પડે છે. તેથી ઈજારા અને ઈજારાયુક્ત હરિફાઈમાં પેઢીની સરેરાશ અને સીમાંત આવક રેખા પૂર્ણ હરિફાઈ હેઠળની પેઢીની

સરેરાશ અને સીમાંત આવક રેખા કરતાં અલગ હોય છે. આ બાબત સમજવા પ્રથમ આપણે ઈજારાયુક્ત હરિણાઈ અને ઈજારા ડેફની પેઢીની સરેરાશ અને સીમાંત આવકની અનુસૂચિ જોઈશું.

શરીરાયુક્ત હરિણાઈ અને શરીરામાં પેઢીની સરેરાશ અને સીમાંત આવકની અનુસૂચિ

ઉત્પાદન / માંગ / (એકમ)	કિંમત (રૂ.)	કુલ આવક (રૂ.)	સરેરાશ આવક (રૂ.)	સીમાંત આવક (રૂ.)
૧	૧૦	૧૦	૧૦	૧૦
૨	૮	૧૮	૮	૮
૩	૮	૨૪	૮	૮
૪	૭	૨૮	૭	૪

ઉપરની અનુસૂચિમાં જોઈ શકાય છે કે જેમ વધુ એકમોનું વેચાણ કરવામાં આવે તેમ પેઢીએ કિંમત ઘટાડવી પડે છે. આ કિંમત ઘટાડો માત્ર સીમાંત ગ્રહિકૃપ પૂરતો મધ્યાંદિન રહેતો નથી. પરંતુ આંતર સીમાંત એકમોને પણ લાગુ પડે છે. આથી સીમાંત આવક કિંમત જેટલી ન ઘટાં તેના કરતાં વધુ ઘટે છે અને સરેરાશ આવક કિંમત બચાબદ રહે છે. પેઢી વધારે વેચાણ કરવા કિંમત ઘટાડે છે ત્યારે સરેરાશ અને સીમાંત બંને આવક ઘટે છે. કિંમતનાં ઉત્તોતર ઘટાડા સાથે સરેરાશ આવક કરતાં સીમાંત આવક વધારે ઘટતી જાય છે. આ અનુસૂચિને નીચે પ્રમાણે આદ્યુત્તિમાં દર્શાવી ઈજારાયુક્ત હરિણાઈ અને ઈજારા ડેફની સરેરાશ આવક અને સીમાંત આવક રેખાઓ મેળવશું.



ઉપરની આદ્યુત્તિમાં  $OY$  ધરી પર કિંમત આવક અને સીમાંત આવક જ્યારે  $OX$  ધરી પર વેચાણ / ઉત્પાદન એકમો દર્શાવવામાં આવ્યા છે. આદ્યુત્તિમાં  $AR$  રેખા કે જે કિંમત, સરેરાશ આવક અને માંગ રેખા છે અને  $MC$  રેખા કે જે સીમાંત આવક દર્શાવે છે. તેના ઠાં જાણ રહે છે. એટલે કે પેઢીએ જેમ વધારે વેચાણ કરવા હોય તેમ કિંમત ઘટાડવી પડે છે. આથી સરેરાશ આવક ઘટે છે. સાથે જ સીમાંત આવક પણ ઘટે છે. પરંતુ વધુને વધુ એકમાં વેચાણ રાખે સરેરાશ આવક અને સીમાંત આવક વચ્ચેનું આંતર વધતું જાય છે. બીજા શફ્ટોઝાં કાઢીએ તો સીમાંત આવક રેખા સરેરાશ આવક રેખાથી વધારે નીચે જાય છે. તે બાબત એમ દર્શાવે છે કે કિંમત ઘટવાની સાથે સીમાંત આવક સરેરાશ આવક કરતા વધારે ઘટે છે.

## UNIT - 4

Markets, Product Pricing & Factor Pricing. (બજારો, ઉત્પાદન કિંમત અને સાધન કિંમત)

- ❖ પુર્ણ હરીક્ષાઈ, ઇજારો, અને ઇજારાયુક્ત હરીક્ષાય (ખર્ચ અને લક્ષણો)
- ❖ ઇજારા નિયંત્રણ, કિંમત સેદભાવ અને લાદણ. વેચાણ ખર્ચ અને તેની અસરો.
- ❖ દ્રિહ્સ્તક અને અલ્પ હસ્તક ઇજારાનો ખ્યાલ. જોડાણ મોડેલ, ખાંચાવાળી માંગ રેખા.
- ❖ (અલ્પ હસ્તક ઇજારાનાં સંદર્ભે કિંમત નેતૃત્વ મોડેલ)

## UNIT - 4

### બજારો, ઉત્પાદન કિંમત અને સાધન કિંમત

#### પ્ર - ૧ પૂર્ણ હરીકાઈ : અર્થ અને લક્ષણો

**અર્થ :** હરીકાઈની કસાને આપારે બજારમાં જુદા જુદા પ્રકારો પાડવામાં આવે છે. તેમાં પૂર્ણ હરીકાઈવાળું બજાર વિરોધ મહાવાનું ગણાય છે. જોકે પૂર્ણ હરીકાઈવાળું બજાર વાક્યપદિક જગતમાં ભાગે જ જેવા મળે છે, છતાં તેનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં ઘણો ઉપયોગો છે, કારણ કે તે એક આદર્શ આર્થિક વ્યવસ્થા જિલ્લી કરે છે. પૂર્ણ હરીકાઈનો અર્થ આ રીતે આપી શકાય : જ્યારે સમાન વસ્તુની કિંમત હેરફેરના ખર્ચને બાદ કરતાં એકસરખી જગ્યાય છે ત્યારે બજારમાં પૂર્ણ હરીકાઈ છે તેમ કઢી શકાય.

**લક્ષણો :** નીચે દર્શાવેલી શરતો સંતોષાય ત્યારે હેરફેરના ખર્ચને બાદ કરતાં સમાન વસ્તુની કિંમત એકસરખી હોય છે અને તેથી બજારમાં પૂર્ણ હરીકાઈ અસ્તિત્વમાં આવે છે. બીજી રીતે કહીએ તો પૂર્ણ હરીકાઈવાળા બજારનાં લક્ષણો નીચે મુજબ દર્શાવી શકાય.

#### ૧. અસંખ્ય વેચનારા અને ખરીદનારા :

બજારમાં અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા હોવા જોઈએ. અસંખ્ય એટલે એટલા કે જેથી વેચનારા અને ખરીદનારા બેમાંથી કોઈ બજારકિંમત પર અસર પારી શકે નથિ. અહીં ઉત્પાદક વેચનાર છે તેનું માની લઈએ છીએ. વ્યક્તિગત ઉત્પાદક કુલ પુરવણાની દરિદ્રાને નજ્યારા પુરવણાનું ઉત્પાદન કરતો હોય છે. આથી તે થોડું ઉત્પાદન વધારે કે ધારે તો તેની બજારકિંમત પર અસર પડતી નથી. તેવી જ રીતે વ્યક્તિ, ગ્રાહક કુલ માંગની દરિદ્રાને વસ્તુની બજુ નજ્યારી માંગ કરતો હોય છે. આથી તે પોતાની માંગમાં થોડે વધારો કે ધારે કરે તો તેની બજારકિંમત પર કોઈ અસર પડતી નથી.

આવી સ્થિતિને કારણે વ્યક્તિગત ઉત્પાદક ચાલુ કિંમત સ્વીકારી લઈ કેટલું ઉત્પાદન કરતું તેનો નિર્ણય લેવાનો હોય છે અને વ્યક્તિગત ગ્રાહકે ચાલુ કિંમત સ્વીકારી લઈ કેટલી ખરીદી કરવી તે નક્કી કરવાનું હોય છે.

#### ૨. એકસરખી વસ્તુ :

બજારમાં વેચાતી વસ્તુ એકસરખી કે સમાન ગુણાર્થવાળી હોવી જોઈએ. બીજી રીતે કહીએ તો ગ્રાહકની દરિદ્રાને જુદા જુદા ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થતી કોઈ એક વસ્તુ એકબીજાની સંપૂર્ણ અવેજામાં આવી શકે તેવી હોવી જોઈએ. આવી સ્થિતિને લીધે કોઈ ઉત્પાદક ચાલુ બજારકિંમત કરતાં વસ્તુની કિંમતમાં વધારો કરી શકતો નથી. જો તે કિંમત વધારે તો બીજા ઉત્પાદક પાસેથી વસ્તુ ખરીદે છે અને તેથી ઉત્પાદક બધા જ ગ્રાહકો ગુમાવે છે, કારણ કે ગ્રાહક કોઈ એક ઉત્પાદકની વસ્તુનો બીજા ઉત્પાદકની વસ્તુ કરતાં ચારિયાતી માનતો નથી. આથી એકસરખી વસ્તુની કિંમત એકસરખી જ રહે છે. બજારમાં કોઈ એક વસ્તુની કિંમતમાં બેદભાવ શર્ટ શકતો નથી.

વ્યક્તિગત ઉત્પાદક ચાલુ કિંમતે ગમે તેટલું વેચાસ કરી શકે છે. આથી તેની સરેરાશ આપ્રક અને સીમાંત આવક સરખી જ રહે છે અને તે કિંમત બચાવર હોય છે. વ્યક્તિગત ગ્રાહક ચાલુ કિંમતે ગમે તેટલા પ્રમાણમાં ખરીદી કરી શકે છે. આથી જો

કોઈ ઉત્પાદક વસ્તુની કિમત વધારે તો તેની માંગ શુન્ય થઈ જાય છે. આને લીધે વ્યક્તિગત ઉત્પાદક સામે માંગ રેખા સંપૂર્ણ મૂલ્યસાપેક્ષ હોય છે, એટલે કે માંગ રેખા પાયાની રેખાને સમાંતર હોય છે.

### 3. બજાર વિષેનું સંપૂર્ણ જ્ઞાન :

ખરીદનારા અને વેચનારા બજાર વિષેનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. વસ્તુની કિમત, તેની શુષ્ણવત્તા વગેરે વિષે ગ્રાહકને પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ. આથી કોઈ ઉત્પાદક ખરીદનાર પાસેથી વધારે કિમત લઈ શકતો નથી. ખરીદનાર બજાર વિષેનું જ્ઞાન ધરાવતો હોવાથી વેચાણ ખર્ચ કરવાની પડ્ય જરૂર હોતી નથી. તેવી જ રીતે વેચનાર પણ બજાર સંબંધી સંપૂર્ણ જાણકારી ધરાવતો હોવાથી કોઈ ગ્રાહક પાસેથી વધુ કિમત લેવા પ્રયત્ન કરતો નથી. આ શરતને લીધે બજારમાં સમાન વસ્તુની કિમત એકસરખી રહે છે.

### 4. ઉદ્યોગમાં પેઢીઓની મુક્ત અવરજનવર :

ઉદ્યોગમાં પેઢીઓની અવરજનવર મુક્ત હોવી જોઈએ. કોઈ પડ્ય જાતના અવરોધ વિના ઉદ્યોગમાં પેઢીઓ પ્રવેશી શકે અથવા તો તેઓ ઉદ્યોગ છોડીને ચાલી જઈ શકે તે પ્રકારની સ્વતંત્રતા હોવી જોઈએ. જો આ ચિથ્યિત અસ્તિત્વમાં હોય તો જ બજારમાં પૂર્ણ હરીકાઈ પ્રવર્તી શકે. આ શરત સંતોષાય એટલે ઉત્પાદનનાં સાધનો સંપૂર્ણ રીતે ગતિશીલ બને છે. સાધનો એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં તેમજ એક ધંધામાંથી બીજા ધંધામાં મુક્ત રીતે જઈ શકે છે. આ શરતના પાલનને પરિણામે બજારમાં ઈજારાશાહી ઊભી થઈ શકતી નથી.

### 5. બુદ્ધિયુક્ત વર્તન :

વેચનારા અને ખરીદનારા બુદ્ધિયુક્ત વર્તન કરતા હોવા જોઈએ. અર્થાતું તેઓ પોતાને વધુમાં વધુ લાભ થાય એ રીતે વર્તનાર હોવા જોઈએ. વેચનાર મહત્તમ નહો થાય તે રીતે વેચતો હોય તે જરૂરી છે. તેમજ ખરીદનાર મહત્તમ સંતોષ થાય તે રીતે ખરીદી કરતો હોય તે આવશ્યક છે. જો આ પ્રમાણે ન બને તો બજારમાં સમાન વસ્તુ પડ્ય જુદી જુદી કિમતે વેચાય તેવું બને અને તો પૂર્ણ હરીકાઈ અસ્તિત્વમાં આવી શકે નહિ.

જ્યારે ઉપર આપેલી બધી જ શરતો એકીસાથે પરિપૂર્ણ થાય ત્યારે બજારમાં પૂર્ણ હરીકાઈ પ્રવર્તો છે તેમ કરી શકાય. ઉપરોક્ત શરતો કે લક્ષણો પૂર્ણ હરીકાઈનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે.

## પ્ર-૨ ઈજારો : અર્થ અને લક્ષણો

### ૧. પ્રાસારિક

બજારના માળખાની દાખિએ વિચારતાં કેટલાક જુદાં જુદાં સ્વરૂપો જોવા મળે છે. એકપથીય ઈજારો તે જેમાં વેચનાર કે ખરીદનાર એ બેમાંથી હોઈ એક પણે ઈજારો હોય છે. દ્વિપથી ઈજારો તે જેમાં વેચનાર અને ખરીદનાર બંનેના પણે ઈજારો હોય છે. આપણે અહીં માત્ર વેચનારને પણે જે ઈજારો હોય છે તેનો વિચાર કરવાનો હોય છે. વેચનારના ઈજારાના પૂર્વી ઈજારો અને અપૂર્વી ઈજારો અથવી મર્યાદિત ઈજારો એવા બે પ્રકારો પારી શકાય. આમ પૂર્વી ઈજારો અવાતવિક છે. માત્ર સૈદ્ધાંતિક કલ્પના છે, જ્યારે અપૂર્વી ઈજારો કે મર્યાદિત ઈજારો એ વાતવિક જગતમાં જોવા મળે છે.

### ૨. ઈજારાનો અર્થ

#### ૧. પૂર્વી ઈજારો :

ઇજારા માટે અંગ્રેજમાં Monopoly શબ્દ વપરાય છે. Mono એટલે એક અને Poly એટલે વેચાવાની ડિયા. આ રીતે જોતાં જ્યાં જ્યાં એક વેચનાર દ્વારા જ વેચાશુદ્ધ હોય તાં ઈજારો છે તેમ કંઈ શકાય, પરંતુ ઈજારાનો આ શાન્દિક અર્થ છે. જોકે તે અર્થ આપણને ઈજારાના એક મહત્વાના લક્ષણનું સૂચન કરે છે કે ઈજારામાં વેચનાર એક જ હોય છે.

અર્થશાસ્ત્રમાં ઈજારાનો વિચાર હરીકાઈની કથાને ઘાનમાં રાખી કરવામાં આવે છે. જ્યારે બજારમાં એક જ વેચનાર હોય (અહીં વેચનાર જ ઉત્પાદક છે તેવું માનીએ છીએ) અને તેને હરીકાઈનો બિલકુલ સામનો કરવાનો ન હોય ત્યારે જે ઈજારો અસ્તિત્વમાં આવે છે તેને પૂર્વી કે શુદ્ધ ઈજારો કહે છે.

અર્થશાસ્ત્રની પરિભ્રાણમાં કહીએ તો શુદ્ધ કે પૂર્વી ઈજારો એટલે એવું બજાર કે જેમાં અન્ય વસ્તુઓ અને ઈજારા દ્વારા ઉત્પાદિત વસ્તુ વચ્ચે માંગની સામસામી સાપેક્ષતા (Cross elasticity of demand) શૂન્ય હોય. ભારતમાં રેલવે સેવા એ શુદ્ધ ઈજારો કહી શકાય. જોકે આ ઈજારો માલિકની દાખિએ જોઈએ તો જાહેર ઈજારો છે. જોકે રેલવે સેવામાં હવે ખાનગીકરણની પ્રક્રિયા શરૂ થઈ છે. ખાનગી કેન્દ્રમાં આ પ્રકારનો ઈજારો હોઈ શકે નાહિ. જેને હરીકાઈનો બિલકુલ સામનો કરવાનો ન હોય એવો ઈજારો એટલે કે પૂર્વી ઈજારો એક કાલ્પનિક બઢના જ બની રહે છે. તે કંઈ પણ અસ્તિત્વમાં ન હતો. તે સૈદ્ધાંતિક અર્થશાસ્ત્રની માત્ર કલ્પનાની બાબત છે. (Pure monopoly is a myth. It has never existed anywhere. It is only a figment of the imagination of theoretical economists) આમ, શુદ્ધ કે પૂર્વી ઈજારો એ કાલ્પનિક બાબત છે, પરંતુ અપૂર્વી કે મર્યાદિત ઈજારો વાતવિક જગતમાં જોવા મળે તેવા પ્રકારનું બજાર છે તો મર્યાદિત, ઈજારો એટલે શું તે હવે તપાસીએ.

## 2. મર્યાદિત ઈજારો :

મર્યાદિત ઈજારો માટે જ 'ઈજારો' શબ્દ સામાન્ય રીતે વપરાય છે. અપૂર્વી કે મર્યાદિત ઈજારો એટલે એવું બજાર કે જેમાં એક જ ઉત્પાદક હોય અને તે જે વસ્તુનું ઉત્પાદન કરે તેની નજીકની અવેળ વસ્તુ બજારમાં મળતી હોતી નથી. બજારમાં અવેળ વસ્તુઓ મણે ખરી. પરંતુ ઈજારામાં જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેની નજીકની અવેળ તરીકે કામ આવી શકતી નથી. દા.ત., ગુજરાતમાં વીજળી પુરવઠી ગુજરાત વિદ્યુત બોર્ડ તરફથી પૂરો પાડવામાં આવે છે. આ ઈજારાનું ઉદાહરણ છે. જોકે હવે કેટલીક કંપનીઓ "કેપ્ટીવ પાવર પ્લાન્ટ" સ્થાપાને પોતાને જોઈતી વીજળી ઉત્પન્ન કરી શકે તેવી માર્કિયા થર્ડ થઈ છે. બજારમાં વીજળીની અવેળ વસ્તુઓ-ગેસ, ક્રોસીન, મીલાલતી વગેરે મળે છે. પરંતુ તે વીજળીની નજીકની અવેળ વસ્તુઓ કહી શકાય નાહિએ.

આમ, અહીં જે પ્રકારનો ઈજારો ઊભે થાય છે તે અમર્યાદિત નથી એટલે કે પૂર્વી નથી, પરંતુ મર્યાદિત અથવા અપૂર્વી છે, કારણ કે તેમાં ઈજારાદારને હરીકાઈનો સામનો થોડા પ્રમાણમાં તો કરવો જ પડે છે. જો વીજળીના બાવ બહુ ઊચા જાય તો લોકો તેનો વપરાશ ઘટાડી દૂરની અવેળ વસ્તુઓનો વપરાશ પણ કરવા માંડે છે. આથી ઈજારો મર્યાદિત બને છે.

મર્યાદિત ઈજારાની વ્યાખ્યા આ રીતે પણ આપી શકાય : મર્યાદિત ઈજારો એટલે એવું બજાર કે જેમાં અન્ય વસ્તુઓ અને ઈજારા દ્વારા ઉત્પાદિત વસ્તુ વચ્ચે માંગની સામસામી સપેક્ષતા ઓછી હોય છે. જોકે તે શૂન્ય કરતાં વધારે હોય છે. આથી જ સંચાલકીય અર્થશાસ્ત્ર (Managerial Economics)ના નિષ્ણાત Joel Dean જણાવે છે કે ઈજારા દ્વારા ઉત્પાદિત વસ્તુ 'કાપમી વિશિષ્ટતા પરાવતી વસ્તુ' હોય છે. (A monopolised product is a product of lasting distinctiveness.)

દિચાઈ જી. લિલ્લીના મત પ્રમાણે 'ઈજારો' એટલે એવું બજાર કે જેમાં પેઢી ઢૂંકા ગાળામાં થોડો કે વધારે અસામાન્ય નફો મેળવી શકે છે અને લાંબા ગાળે આ નફાને ટકાવી રાખવા માટે તે વત્તાઓછા પ્રમાણમાં શક્તિમાન હોય છે.\*

અચાન્ક અંતે એમ કહી શકાય કે ઈજારો એટલે એવા પ્રકારનું બજાર કે જેમાં ઉત્પાદિત વસ્તુની નજીકની અવેળ વસ્તુ મળતી હોતી નથી અને તેથી ઈજારાદાર ઢૂંકા તેમજ લાંબા ગાળામાં થોડા ઘણા પ્રમાણમાં અસામાન્ય નફો મેળવતો રહે છે.

## 3. ઈજારાનાં લક્ષણો

મર્યાદિત ઈજારો કે જેને આપણે હવે માત્ર 'ઈજારો' કહીશું તેના લક્ષણો નીચે પ્રમાણે આપી શકાય.

(1) એક જ ઉત્પાદક કે વેચનાર : ઈજારામાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય

ઇ. તેને કોઈ નષ્ટકના હરીકનો સામનો કરવો પડતો નથી. જોકે તેના કેટલાક દૂરના હરીકો હોય છે. આથી તેનો ઈજારો મર્યાદિત બને છે.

(2) ખરીદનારા ધ્યાન : ઈજારામાં વેચનાર એક જ હોય છે, પરંતુ ખરીદનારા ધ્યાન હોય છે. ઈજારામાં સામાન્ય રીતે ખરીદનારને ઈજારા દ્વારા ઉત્પાદિત વસ્તુ વગર ચાલી શકતું નથી. આથી ઈજારદાર થોડો ભાવ વધારે તો પણ તેની માંગ શૂન્ય થઈ જતી નથી. આથી તેની માંગ રેખા સંપૂર્ણ મૂલ્યસાપેક્ષ હોતી નથી. આમ, ઈજારામાં માંગ રેખા સંપૂર્ણ કરતો ઓછી મૂલ્યસાપેક્ષ (less than perfectly elastic) હોય છે, જ્યારે પૂર્વી હરીકાઈમાં વ્યક્તિગત પેઢી થોડો ભાવ વધારે તો તેની માંગ શૂન્ય થઈ જાય છે. આથી તેની માંગ રેખા સંપૂર્ણ મૂલ્યસાપેક્ષ હોય છે.

(3) નષ્ટકની અવેળ વસ્તુનો અભાવ : ઈજારામાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે તેની નષ્ટકની અવેળ વસ્તુ બજારમાં મળતી હોતી નથી. પૂર્વી હરીકાઈમાં પેઢીને હરીકાઈન્નો સામનો કરવાનો હોય છે તેથી તેમાં કોઈ પેઢી ભાવ વધારે તો ગ્રાહક બીજી પેઢી પારેથી વસ્તુ ખરીદે છે, જ્યારે ઈજારામાં નષ્ટકની અવેળ વસ્તુ ન મળતી હોવાથી ખાલ્ફકને ઊચા ભાવે પણ વસ્તુ ખરીદવી પડે છે. એટલું ખરું કે ઊચા ભાવે ઓછા પ્રમાણમાં વસ્તુની ખરીદી થાય છે. ઈજારદાર વસ્તુના ભાવમાં વધારો કરી શકે છે તેનું કારણ એ જ છે કે તેની નષ્ટકની અવેળ વસ્તુ મળતી નથી. જેમ અવેળ વસ્તુ વધારે દૂરની તેમ ઈજારદાર ઊચા ભાવ લેવા માટે શક્તિમાન બને છે.

(4) પેઢી અને ઉદ્ઘોગનો ભેદ હોતો નથી : ઈજારામાં પેઢી એ જ ઉદ્ઘોગ હોય છે. પેઢી અને ઉદ્ઘોગનો ભેદ હોતો નથી. પૂર્વી હરીકાઈની જેમ ઈજારામાં પેઢી અને ઉદ્ઘોગ બને જુદાં જુદાં હોતાં નથી, કારણ કે ઈજારામાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે.

(5) ભાવ અને ઉત્પાદન પર કાબૂ ? ઈજારામાં પેઢી ભાવ નક્કી કરી શકે છે. તેમજ ઉત્પાદન પણ નક્કી કરી શકે છે, પરંતુ કોઈ એક સમયે તે બને નક્કી કરી શકે નાહિ. બનેમાંથી કોઈ એક નક્કી કરી શકે. જો તે ઊચા ભાવ રાખે તો ઓછું ઉત્પાદન વેચાય છે અને જો તે વધારે ઉત્પાદન વેચવાનું નક્કી કરે તો તેથી ઓછા ભાવ રાખવા પડે છે. આમ થવાનું કારણ એ છે કે તેની માંગ રેખા સંપૂર્ણ કરતાં ઓછી મૂલ્યસાપેક્ષ હોય છે એટલે કે તેની માંગ રેખા ડાબી બાજુ ઉપરથી જમડી બાજુ નીચે તરફ ઢાંતી હોય છે.

(6) વસ્તુ એકસરખી : ઈજારામાં ઉત્પાદન થતી વસ્તુ એકસરખી હોય છે, વસ્તુવિવિધતા હોતી નથી. પૂર્વી હરીકાઈવાળા બજારની જેમ ઈજારામાં પણ કોઈ એક વસ્તુના બધાં એકખો એકસરખા હોય છે.

(7) અસામાન્ય નક્કો : ઈજારામાં પેઢી દ્રોષ ગાળામાં થોડો કે વધારે અસામાન્ય નક્કો મેળવી શકે અને લાંબા ગાળે પણ તે આ નક્કો ટકાવી શકે છે. પૂર્વી હરીકાઈમાં પેઢીને લાંબા ગાળે માત્ર સામાન્ય નક્કો મળે છે, પરંતુ ઈજારામાં પેઢીને હરીકાઈનો લય ઓછો હોય છે તેથી ઊચા ભાવ રાખીને લાંબા ગાળે પણ તે અસામાન્ય નક્કો કમાઈ શકે છે.

## ૫ - ૩ ઈજારાયુક્ત હરીફાઈ : અર્થ અને લક્ષણો

હરીફાઈ અને ઈજારાના તત્વોના મિશ્રભાવણા બજારને ઈજારાયુક્ત હરીફાઈ કહી શકાય. જે. એસ. બેઈન જાણાવે છે કે 'સંપૂર્ણ અવેજી વસ્તુઓ નહિ, પરંતુ નશીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉત્પાદકોના મોટા સમૂહમાં પ્રવર્તતી હરીફાઈ એટલે ઈજારાયુક્ત હરીફાઈ.' ઈજારાયુક્ત હરીફાઈની આ વ્યાખ્યા તેનાં બે મહત્વનાં લક્ષણો રજૂ કરે છે : (1) ઉત્પાદકો ઘણા હોય છે. અર્થાત્ ઉત્પાદકોની સંખ્યા થોડા કરતાં વધારે અને પૂર્વી હરીફાઈમાં હોય તેનાં કરતાં ઓછી હોય છે. અને (2) ઉત્પાદકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે એકબીજાની સંપૂર્ણ અવેજીમાં આવી શકે તેવી વસ્તુ હોતી નથી, પરંતુ નશીકની અવેજી વસ્તુ હોય છે.

વાસ્તવિક જગતમાં રેઝિયો, ટી.વી. સેટ, સાબુ, ટૂથપેસ્ટ, બ્લેડ વગેરેનું બજાર ઈજારાયુક્ત હરીફાઈવાળું બજાર કહી શકાય. દા. ત., નાણાવાના સાબુના ઉત્પાદકો ઘણા છે. સાબુના ઉત્પાદકો પોતે જે સાબુનું ઉત્પાદન કરે છે તેમાં ઈજારો પરાવે છે. લફ્સ સાબુના ઉત્પાદકે હમામ અને બીજા પ્રકારના સાબુના ઉત્પાદકોની હરીફાઈનો સામનો કરવો પડે છે. વળી, લફ્સ સાબુ હમામ સાબુની સંપૂર્ણ અવેજી કહી શકાય નહિ, કારણ કે ગ્રાહકની દાખિયે બંને સાબુ જુદા છે. આમ છતાં તે બંને પ્રકારના સાબુ એકબીજાની નશીકની અવેજી છે તેમ જરૂર કહી શકાય.

### (બ) ઈજારાયુક્ત હરીફાઈનાં લક્ષણો :

ઇજારાયુક્ત હરીફાઈનાં લક્ષણો તપાસવાથી તેનો અર્થ વધારે સ્પષ્ટ થશે, તેનાં લક્ષણો નીચે પ્રમાણે છે.

(1) ઘણા ઉત્પાદકો કે વેચનાર : ઈજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદકો કે વેચનારા ઘણા હોય છે. અહીં ઉત્પાદકોની સંખ્યા થોડા કરતાં વધારે અને પૂર્વી હરીફાઈમાં હોય તેનાં કરતાં ઓછી હોય છે. ઈજારાયુક્ત હરીફાઈ હેઠાં ઉત્પાદન કરતી પેઢીનું કદ નાનું હોય છે. નાના નાના કદની વણી પેઢીઓ એક જ વસ્તુના જુદા જુદા મકારોનું ઉત્પાદન કરતી હોય છે. દરેક પેઢી કુલ ઉત્પાદનની દાખિયે બહુ બેનું ઉત્પાદન કરતી હોય છે. આવી પેઈ પેઢી ઉત્પાદનમાં વધ્યાટ કરે તો તેની અસર બીજી પેઢીની વસ્તુની કિંમત પર ખાસ પડતી નથી. દરેક પેઢી જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેમાં ઈજારો પરાવતી હોય છે. આમ છતાં તે પોતાની હરીફ પેઢીઓના ઉત્પાદન, કિંમત અને વેચાણ ખર્ચને લક્ષમાં રાખે છે, કારણ એ. અ. પે. ૬ - ૧૬.

કે હરીક પેઢીઓ દ્વારા ઉત્પાદિત થતી વસ્તુ નશકની અવેજ વસ્તુ હોય છે. આથી ઈજારાયુક્ત હરીકાઈમાં પેઢીએ હરીકાઈનો પક્ષ સામનો કરતો પડે છે.

(2) ઘણા ખરીદનારા : ઈજારાયુક્ત હરીકાઈમાં ખરીદનારની સંખ્યા પક્ષ ઘણી હોય છે. ખરીદનાર એક વસ્તુ કરતાં બીજી વસ્તુને જુદી માને છે. દા. ત., જ્ય સાખું ખરીદનારા હમામ સાખુને જુદી વસ્તુ માને છે. ભુશ રેઝિયો ખરીદનારા મર્કી રેઝિયોને જુદી વસ્તુ માને છે. વિશાળ અર્થમાં સાખું એક જ વસ્તુ હોવા છતાં ખરીદનારની દિલ્હીએ જ્ય અને હમામ સાખું જુદા જુદા છે.

(3) વસ્તુવિવિધતા : વસ્તુવિવિધતા (Product Differentiation) માટે વસ્તુવિભિન્નતા, વસ્તુતૈવિધ અને વસ્તુવિકલન જેવા શબ્દો પક્ષ વપરાય છે. પૂર્વ હરીકાઈમાં વસ્તુ એકસરાયી હોય છે. પૂર્વ હરીકાઈ ડેફન્ની અમૃત વસ્તુનું ઉત્પાદન કરતી નથી જ પેઢીઓ એકસરાયી તે સમાન ગુણાધર્મવાળી વસ્તુનું ઉત્પાદન કરતી હોય છે. બીજી રીતે કદીએ તો પૂર્વ હરીકાઈમાં વસ્તુવિવિધતા હોતી નથી.

પરંતુ ઈજારાયુક્ત હરીકાઈમાં દરેક પેઢી વિશાળ અર્થમાં એક છતાં માટકની દિલ્હીએ લિન લિન એવી વસ્તુનું ઉત્પાદન કરતી હોય છે. દા. ત., કોલગેટ, કલોઝ-અપ, પેસ્સોન્ટ વગેરે ટ્રૂપેસ્ટ વિશાળ અર્થમાં ટ્રૂપેસ્ટ જ છે અને તેનો ઉપયોગ દાંત રાફ કરવા માટે જ થાય છે, પરંતુ ગ્રાહકની દિલ્હીએ કોલગેટ કરતાં કલોઝ-અપ ટ્રૂપેસ્ટ જુદી છે અને કલોઝ-અપ કરતાં પેસ્સોન્ટ જુદી છે.

વસ્તુવિવિધતા એ ઈજારાયુક્ત હરીકાઈનું મહત્વનું લક્ષણ છે. વસ્તુવિવિધતા ગણ રીતે ઊભી થઈ શકે. (I) વસ્તુની ગુણવત્તામાં તકાવત ઊભો કરીને, (II) વસ્તુના વેચાણની પરિસ્થિતિમાં ફેરફાર કરીને, (III) વસ્તુના વેચાણ ભર્યમાં ફેરફાર કરીને.

(I) વસ્તુની ગુણવત્તામાં તકાવત ઊભો કરીને : વસ્તુની ગુણવત્તામાં તકાવત ઊભો કરીને, તેને બીજી વસ્તુ કરતાં જુદી વસ્તુ તરીકે ૨૪ કરવામાં આવે છે. વસ્તુના સ્વરૂપ, રંગ, આકાર, સુગંધ વગેરેમાં ફેરફાર કરીને વસ્તુની ગુણવત્તા બીજી વસ્તુ કરતાં જુદી છે તેમ દર્શાવવામાં આવે છે. તે ઉપરાંત વસ્તુના કટેઈનર, વસ્તુ પરના રેપર, રેપર પરનાં ચિત્ર, વસ્તુના ડ્રેઅર વગેરેમાં ફેરફાર કરીને પક્ષ વસ્તુની ગુણવત્તા બીજી વસ્તુ કરતાં જુદી જ છે તેનું ૨૪ કરવામાં આવે છે. લક્ષ્ણ સાખું કરતાં જ્ય સાખુના સ્વરૂપ, રંગ, આકાર અને સુગંધ જુદા છે. આથી જ્ય સાખું લક્ષ્ણ સાખું કરતાં જુદી ગુણવત્તા પરાવે છે. તેનું તેના ઉત્પાદકો તરફથી કહેવામાં આવે છે. એસો હવે માઈકોશાઈન્ડ કરવામાં આવી છે. સર્ક ડિટાઈન્ટ હવે સુપર સર્ક બન્યો છે. વગેરે હકીકતો ૨૪ કરીને વસ્તુની ગુણવત્તામાં સુપારો કરવામાં આવ્યો છે તેમ તેના ઉત્પાદકો તરફથી કહેવામાં આવે છે. કેલ્વિક વાર વસ્તુની ગુણવત્તામાં કરવામાં આવેલો આ ફેરફાર નામનો જ હોય છે. કદાચ વસ્તુની ગુણવત્તા જ્યા પક્ષ બદલવામાં ન આવી હોય, માત્ર વસ્તુ પરનું રેપર કે રેપર પરસ્નું ચિત્ર બદલી નામવામાં આવ્યુ હોય અને તેમ કરીને વસ્તુની ગુણવત્તા બદલવામાં આવી છે તેનું પક્ષ કહેવામાં આવે છે. આમ વસ્તુના સ્વરૂપ, રંગ, આકાર,

સુંગંધ, રેપર, ટ્રોડમાર્ક વગેરેને લીધે અમુક વસ્તુ બીજી કરતાં જુદી છે તેમ કહેવામાં આવે છે અને આંધકો તે માન્ય પણ રાખે છે.

(II) વસ્તુના વેચાણની પરિસ્થિતિમાં ફેરફાર કરીને : વસ્તુ એકસરખી હોય, પરંતુ વસ્તુના વેચાણની પરિસ્થિતિ જુદી જુદી હોય તો પણ વસ્તુવિવિષ્ટતા અસ્તિત્વમાં આવે છે. વેચનારની દુકાનનું સ્થળ, દુકાનની સ્વચ્છતા, દુકાનમાં ગ્રાહક માટે બેસવાની કે સરખી રીતે ઊભા રહેવાની વ્યવસ્થા, વેચનારનો સ્વભાવ, ઉધાર માલ આપવાની જોગવાઈ, વિના મજૂરીએ માલ વેર પહોંચાડવાની વ્યવસ્થા વગેરેને લીધે પણ વસ્તુવિવિષ્ટતા અસ્તિત્વમાં આવે છે. બે વેચનાર સરખા જ મકારની વસ્તુઓ દા. ત., જ્ય સાલુ, શૈલગેત ટ્રૂયપેસ્ટ, સુપર સર્ફ વગેરે વેચે છે, પરંતુ એકની દુકાન નજીક છે, જ્યારે બીજાની દૂર છે. એક વેચનાર વિનયવિવેકશી વર્તે છે, બીજો ઉદ્ઘાટાઈથી જીવાબ આપે છે. એક વેચનાર ઉધાર આપે તો બીજો ‘પહેલા પૈસા પછી માલ’નો આગાહ રાખે છે, તો અહીં વસ્તુ સમાન હોવા છતાં વસ્તુવિવિષ્ટતાની પરિસ્થિતિ સર્જાય છે.

(III) વસ્તુના વેગાંઝ ખર્ચમાં ફેરફાર કરીને : વસ્તુના વેગાંઝ ખર્ચમાં ફેરફાર કરીને પણ વસ્તુવિવિષ્ટતા ઊભી કરવામાં આવે છે. દા. ત., ક્વોલીટી આઈસ્કીએ કરતાં વાડીલાલ આઈસ્કીમના ઉત્પાદક તરફથી વધારે વેગાંઝ કરવામાં આવે તો ક્વોલીટીને મુકાબલે વાડીલાલ આઈસ્કીમ પર ગ્રાહકોની પસંદગી વપારે પ્રમાણમાં ઊત્તરે છે. વાડીલાલ આઈસ્કીમના ઉત્પાદક તેની વધારે જાહેરત કરીને, બીજા આઈસ્કીમ, કરતાં તેની ગુણવત્તા ધ્વણી ચાલિયાતી છે તેનું ગ્રાહકના મગજમાં ઠસાવીને વેગાંઝ વધારવા પ્રયત્નો કરે છે. આથી તેની માંગમાં વધારો થાય છે. આમ, અહીં વેગાંઝ ખર્ચ વધારીને વસ્તુવિવિષ્ટતા ઊભી કરવામાં આવી છે તેમ કથી શકાય.

(4) વસ્તુની જુદી જુદી કિમત : વસ્તુવિવિષ્ટતાને લીધે દરેક વસ્તુની જુદી જુદી કિમત ઈજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં જોવા મળે છે. પૂર્વ હરીફાઈમાં અમુક વસ્તુના બધા જ એકમો એકસરખા છે અને તેથી એકસરખી વસ્તુની કિમત પણ એકસરખી હોય છે, પરંતુ ઈજારાયુક્ત હરીફાઈમાં એક કરતાં બીજી વસ્તુ જુદી છે. સોડા, લેમન, કોકાંકોલા એ જુદાં જુદાં પ્રકારનાં ઠંડા પીંઠાં છે. આથી તેની કિમત જુદી જુદી હોય છે. ઈજારાયુક્ત હરીફાઈ ડેણની પેઢી પેઢી વસ્તુની કિમત નક્કી કરી શકે છે. અહીં પૂર્વ હરીફાઈ ડેણની પેઢીની જેમ પેઢી કિમત નક્કી જ ન કરી શકે તેવું નથી. તેમ ઈજારાની જેમ કિમત વપારે ઊચી પણ ચાખી શકતી નથી. એક ઉત્પાદક બીજા ઉત્પાદકની વસ્તુ જેટલી નજીકની અવેજી હોય તેટલા પ્રમાણમાં વસ્તુની કિમત નીચી રાખવી પડે છે. જ્ય અને લક્ષ્ય સાલુ નજીકની અવેજી વસ્તુઓ છે. આથી તેમની કિમતમાં ખાસ તફાવત હોતો નથી, જ્યારે જ્ય અને પારદર્શક એવો પિયર્સ સાલુ નજીકની અવેજી વસ્તુ નથી. આથી તે બંનેની કિમતમાં સારો એવો તકાવત હોય છે.

(5) ઉત્પાદકનો ઉત્પાદન અને કિમત પર કાંઈ : ઈજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદક, ઉત્પાદન અને કિમત પર કાંઈ પરાયે છે. તે કેટલું ઉત્પાદન કરવું તે નક્કી કરી શકે છે અને કેટલી કિમત રાખવી તે પણ નક્કી કરી શકે છે. આમ છતાં કોઈ એક સમયે

એકીકાર્યે તે બને નક્કી કરી શકે નહિ, કારણ કે ઈજારાયુક્ત હરીકાઈમાં પેડીની માંગ રેખા સંપૂર્ણ કરતાં ઓછી મૂલ્યસાપેક્ષ હોય છે. બાજુ દીતે કહીએ તો તે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરક ટળતી હોય છે. આથી જો તે ઊંચી કિમત નક્કી કરે તો ઓછી પુરવડો વેચાશે અને જો તે વધારે પુરવડો વેચવાનું નક્કી કરે તો તેણે ઓછી કિમત રાખવી પડે છે.

(6) પૂર્ણ કરતાં ઓછી મૂલ્યસાપેક્ષ માંગ રેખા : ઈજારાયુક્ત હરીકાઈમાં પેડીની માંગ રેખા પૂર્ણ હરીકાઈની પેડીની માંગ રેખા જેવી સંપૂર્ણ મૂલ્યસાપેક્ષ હોતી નથી. તેમ જ ઈજારાની પેડીની માંગ રેખા જેવી ઓછી મૂલ્યસાપેક્ષ પણ હોતી નથી. તેની માંગરેખાની મૂલ્યસાપેક્ષતાનો આપાર પેડીઓ જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે કેટલા પ્રમાણમાં એકબીજાની અવેજામાં આવી શકે તેમ છે તે બાબત પર રહેલો છે. જેમ વસ્તુ એકબીજાની ફરની અવેજા તેમ તેની માંગની મૂલ્યસાપેક્ષતા ઓછી અને જેમ વસ્તુ એકબીજાની નષ્ટકની અવેજા તેમ તેની માંગની મૂલ્યસાપેક્ષતા વધારે હોય છે. ઉપરાંત માંગની મૂલ્યસાપેક્ષતાનો આપાર 'જૂદ' માંની પેડીઓની સંખ્યા પર પડ્ય છે. જો પેડીઓની સંખ્યા વધારે હોય તો માંગરેખા વધારે મૂલ્યસાપેક્ષ અને પેડીઓની સંખ્યા ઓછી હોય તો માંગ રેખા ઓછી મૂલ્યસાપેક્ષ હોય છે.

(7) 'જૂદ'માં પેડીઓની મુક્ત અવરજવર : ઈજારાયુક્ત હરીકાઈ હેઠળ જૂદમાં પેડીઓ મુક્ત રીતે દાખલ વર્દ શકે છે અને મુક્ત રીતે 'જૂદ'ની બહાર જરૂર શકે છે. આ મકારની પરિસ્થિતિને લીધે 'જૂદ'માં રહેલી પેડીઓને લાંબા ગાળે માત્ર સામાન્ય નહો જ માપત થાય છે.

(8) વસ્તુની પસંદગીમાં ગ્રાહકો તત્ત્વ રહેતા નથી : ઈજારાયુક્ત હરીકાઈમાં વસ્તુવિવિધતા અસ્થિતવમાં હોય છે. આથી ગ્રાહકો વસ્તુની પસંદગી બાબતમાં તત્ત્વ રહી રહેતા નથી. ગ્રાહકો અમૃક મકારની વસ્તુ માત્રે વધારે તુંકી પરાવતા હોય છે. આથી અમૃક જ વસ્તુ વાપરવાનો તેઓ આગ્રહ રાખતા હોય છે. નેસ્કાંકે પીનપર જુ કોણી નહિ જ પસંદ કરે. તેવી જ રીતે વિધાન ચા પીનપર જુક બોંડની ચા પસંદ કરશે નહિ. વળી, વસ્તુની પસંદગી બાબતમાં બધા જ ગ્રાહકોનું વલશ પણ સરખું હોતું નથી. જુદા જુદા ગ્રાહકો જુદા જુદા મકારની વસ્તુઓ પર પોતાની પસંદગી ફળે છે. આમ, વસ્તુની પસંદગી કરવામાં ગ્રાહકો પણપાત દાખવતા હોય છે.

(9) વેગાજી ખર્ચ : વેગાજી ખર્ચ ઈજારાયુક્ત હરીકાઈનું ઘણું મહત્વનું લંબણ ગણાય છે. ઈજારાયુક્ત હરીકાઈ એ અપૂર્ણ હરીકાઈનો એક પેટા મકાર છે. હવે જૂધારે હરીકાઈ અપૂર્ણ હોય છે ત્યારે ખરીદનારા બજાર વિશેનું સંપૂર્ણ શાન પરાવતા હોતા નથી. બજારમાં કરી કરી વસ્તુઓ વેચાય છે, તેની કિમત કેટલી છે વગેરે બાબતમાં ગ્રાહકો આજાત હોય છે. આથી વેગાજી ખર્ચ અનિવાર્ય બને છે. વેગાજી ખર્ચ કરીને ઉત્પાદકો ગ્રાહકોને વસ્તુના ઉત્પાદન, તેની ગુણવતા એ તેની કિમત સંખ્યમાં આખકારી આપે છે.

વેગાજી ખર્ચ એટલે વસ્તુનું વેચાણ વધારવા માટે કરવામાં આવતું ખર્ચ. દેનિક છાપાંઓમાં અને સામચિકોમાં વસ્તુની જાહેરખબર, સિનોમા સ્લાઇડ, રેટિયો અનો ટેલેવિજન દ્વારા જાહેરત, નમૂનાનું મકત વેચાણ, બેટ-પોઝના, ટ્રૂક વેપારીને કમિશન, શો-કેરીસમાં વસ્તુ મુક્કી, સેલ્સમેન દ્વારા વસ્તુનો મકાર વગેરે દ્વારા વસ્તુનું વેગાજી વધારવા માટે મ્યાપનો કરવાનું આવે છે અને આ મ્યાપનો માટે જે કાંઈ ખર્ચ કરવામાં આવે છે તેનો સમાવેશ વેગાજી ખર્ચમાં કરી શકાય.

#### ૫ - ૪ ઈજારાનું નિયંત્રણ (Control of Monopoly) :<sup>1</sup>

ઈજારાશાહી સામાજિક કલ્યાણની - દસ્તિએ કેટલે અંશે હિતવાહ છે તે પ્રક્રણ અત્યંત નાજુક છે. ઉપરની ચર્ચામાંથી એવો સૂર્ય નીકળે છે કે ઈજારો નિર્ભર આશીર્વાદરૂપ તો નથી જ. ઈજારાશાહીથી આવકની અસમાનતા વધે છે. વળી ગ્રાહકોને મહત્વામ સંતોષ મળે એ રીતે જુદા જુદા ઉપયોગમાં ઉત્પાદનનાં સાધનોનું રોકાણ થતું નથી. ઉત્પાદનનાં સાધનોને તેમની સીમાના ઉત્પાદકતાથી ઓહું વળતર મળતું હોવાથી સાધનોનું શોખલ થાય છે. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થવાથી સામાજિક અને રાજકીય જીવનમાં અને સંસ્થાઓમાં વિકૃતિઓ દાખલ થવાનો સંભવ છે. પરિણામે વિશ્વના જુદા જુદા દેશોમાં ઈજારાશાહી સંસ્થાઓ ઉપર વિવિધ માર્ગ દ્વારા નિયંત્રણો મૂકવાના રાજ્યે હમેં પ્રયાસો કર્યો છે આ નિયંત્રણના પ્રકાર સામાન્ય રીતે નીચે મુજબના છે :

##### (૧) અચોગ્ય હિતીકારનું નિયમન :

ઈજારાદાર પોતાના હરીકોને દૂર કરવા જે ગેરરીતિઓનો ઉપયોગ કરે છે તેની આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ, દાખલા તરફે અમુક રીતરસમો અજમાવીને ઈજારાદાર તેના હરીકોને ગુંગળાવી દૂર કરેછે, જેમ કે પોતાની પેઢી જ બધી ચીજો પેદા કરે છે તે બધી જ ગ્રાહકોને એકાડ ચીજ જરૂરી હોવાથી લેવાની ફરજ પાડવી એ ગેરવાજબી છે. એ જ રીતે એક બજારમાં નક્કી મેળવી બીજા બજારમાં પોતાના હરીકો કરતાં કિમત ઓછી રાખી તેને "મૂલ્ય-યુક્ત" માં હરાવવો એ પણ ગેરવાજબી છે. આ પ્રકારની અયોગ્ય રીતિઓ પર કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવે અથવા કદક નિયંત્રણ કરવામાં આવે તો ઈજારાદાર નવા નાના હરીકોને એકદમ દૂર કરી શકે નહિ અને ઈજારો સ્થાની શકાય નહિ.

પરંતુ આની કેટલીક મર્યાદાઓ છે :

- (અ) કોઈ એક મહત્વાના ઉત્પાદનના સાધન કે કાચા માલના પુરવઠા પરના સંપૂર્ણ અંકુશને કારણે ઈજારો સ્થપાયો હોય તો આ માર્ગ દ્વારા તે અટકાવી શકાય નહિ.
- (બ) ઈજારાદારની અમુક પદ્ધતિઓનો કાયદામાં નિષેખ કરી શકાય, પરંતુ ખરેખર વ્યવહારમાં એ આ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે કેમ એ પુરવઠા કરવું મુશ્કેલ છે, અનું ઉત્પાદન ખર્ચ કેટલું છે અને એ જાણીજોઈને ઓછી કિમતે લે છે કેમ એ નક્કી કરવું સહેલું નથી.
- (સ) ધારાકીય પ્રતિબંધોના કાર્યક્રમ અમલમાં કેટલીક વહીવટી મુશ્કેલીઓ નહે છે. આથી આ માર્ગ ઈજારાશાહીના અર્થાત્ત્ર પરના ગેરવાજબી આકમણન ખાળવામાં બહુ ઉપયોગી નીપડતો નથી.
- (દ) કેટલીક વાર બજારમાં થોડા વિકેતાઓ હોય અને એમની વચ્ચે અપૂર્ણ સર્વપણી હોય તો આ વિકેતાઓ ચાદ્યગૃહસ્થના કરાર દ્વારા અયાના બીજી કોઈ રીતે એકીકરણ સાથી ઈજારો સ્થાપે છે. આવી સ્થિતિ અટકાવવામાં પણ આ માર્ગ સફળ થતો નથી.

## (2) હરીકાઈને પ્રોત્સાહન :

ઈજારાને અટકાવવાનો અથવા નિર્મૂળ કરવાનો બીજો ઉપાય હરીકાઈને ઉત્તેજન આપવાનો છે. ઉદ્યોગમાં પ્રવેશબંધી હોય તો નવી પેડીઓ તેમાં પ્રવેશ કરવા માટે પ્રેરાય તેવી પરિસ્થિતિ ઊભી કરવી જોઈએ. હરીક પેડીઓ અસરકારક હરીકાઈ કરી શકે તેવી સવલતો આપવી જોઈએ. ઈજારાનો સામનો કરી શકે તેવી પેડીઓને કરવેરામાં રાહત અથવા સભસીરી આપી શકાય. વળી, ઈજારામાં મજાતા નથી, તેનું ઉત્પાદન ખર્ચ, વગેરે બાબતોની લોકોને માર્કિંગ પૂરી પાડવી જોઈએ જેથી ગ્રાહકોમાં જાગૃતિ આવે અને હરીક પેડીઓને તેઓ આવકારે.

## (3) ઈજારાશાહી - વિરોધી કાયદાઓ :

ટ્રૂસ્ટ, કાંટેલ જેવા ઈજારાશાહીનાં વિવિધ સ્વરૂપોને ગેરકાપટેસર જાહેર કરીને ઈજારાને તોડવાના પ્રપત્તો થાય છે. અમેરિકામાં ઈજારાશાહી - વિરોધી કાયદા દાખલ કરવામાં આવ્યા હતા. પણ આવા કાયદાનાં ધ્યાયી પરિશામ આવ્યાં નથી તે આપણે આગળ જોઈ ગયા છીએ. ઈજારાના તનામ સ્વરૂપોને આવરી લે એંધો કાપદો ઘડવાનું કાય સરળ નથી. એક પ્રકારના સ્વરૂપને નિરેખ થાય તો બીજા કોઈ પ્રકારે એકીકરણ થતું રહે છે.

માનો કે આ પ્રકારના કાયદાથી પેડીઓનાં ઝોડાણને અટકાવી શકાય તો પણ એથી પૂર્વી સ્પર્ધાની સ્થિતિ પેદા થશે એમ કહેવું યોગ્ય નથી. એક પેડીને બદલે ત્રણ - ચાર પેડીઓ અરસ્ટિલાં આવે અને એમની વચ્ચે અપકૂર્ષ સ્પર્ધા હોય તો પૂર્વી સ્પર્ધાને બદલે અલ્યુહસ્ટક ઈજારો (oligopoly) સ્થપાવાનો પૂરો સંબંધ છે. પૂર્વી ઈજારા કરતાં અલ્યુહસ્ટક ઈજારો (oligopoly) સામાજિક કલ્યાણની દર્શિએ આવકાર્ય છે એમ તો કહી શકાય નહિ ઊલંઘણ, આ ચાર પેડીઓ અંદરોંદર સમજૂતી કરીને સમજૂતી વિના ઈજારાશાહી ડિમત, ઉત્પાદન અને નકારાની સ્થિતિ જન્માવી શકે છે. વળી ઝોડાણનાં જુદાં જુદાં સ્વરૂપોનો કાયદા દ્વારા નિરેખ કરીએ તો પણ બધી પેડીઓના સંપૂર્ણ ઝોડાણ (merger)ને ગેરકાપટે ઠેરવી શકાય નહિ. આથી આ પરદતિ પણ ઈજારાશાહીને નિર્યંત્રિત કરવાના સંપૂર્ણ કામયાબી મેળવી શકતી નથી.

## (4) ડિમત તથા નકારાનું નિયંત્રણ :

અર્ધકારક્ષમાં જ્યારે પૂર્વી હરીકાઈ અથવા અપકૂર્ષ હરીકાઈની પરિસ્થિતિ ટકવાની શક્યતા ઓછી હોય ત્યારે તે વસ્તુના ઉત્પાદન માટે ઈજારાની પરિસ્થિતિ અનિવાર્ય બની જાય છે. પરંતુ આ ઈજારો સમાજના શોપકાર્યમાં ન પરિણામે તે માટે વસ્તુની ડિમત તથા ઈજારદારના નથી પર નિયંત્રણ મૂકવાં આવશ્યક થઈ પડે છે.

ભાવનિયમનની નીતિ અન્યથે ઈજારદાર જે વસ્તુનું ઉત્પાદન કરેતે માટેના મહત્તમ ભાવ નક્કી કરી આપવામાં આવે છે. આથી વધારે ડિમત ઈજારદાર આહ જો પાસેથી લઈ શકે છે. અલભત, વસ્તુના મહત્તમ ભાવ નક્કી કરવાનું કાર્ય સરળ નથી, અને એટલાથી જ પ્રશ્ન ઊકલી જતો નથી. પોતાનો નક્કી વધારવા ઈજારદાર ઉત્પાદનનાં સાખનોનું શોપકાર્ય - દાખલા તરીકે, કામદારોને ઓછું વેતન ચૂકવે, કાચા માલના માર્કિંગોને ઓછા ભાવ આપે - અનુભૂતિ, એટલે ઉત્પાદનનાં સાખનોને ઈજારદારે જે ભાવ ચૂકવવાના હોય છે તે તળિયાના ભાવ પણ નક્કી કરવામાં આવે કે તેનો સરસરી ખર્ચ (સામાન્ય નકારાની સહિતનો) ડિમત બરાબર થઈ રહે. જે નિયંત્રણ ઈજારાશાહી માંગના રેખા સરસરી ખર્ચની રેખાને કાપે તે નિયંત્રણ ભાવ નક્કી કરતાર પણ માટે માર્ગદર્શક હશે. જે કષાયો ઓંને સરખાં હોય તેટલું પ્રમાણે અને ડિમત રાખવામાં આવશે.

## ઉત્પાદન પ્રમાણ અને ગુણવત્તાનું નિયમન :

ઘટતી પેદાશની પરિસ્થિતિ પ્રવર્તમાન હોય તો મહત્તમ ભાવ ઠરાવવાની નીતિ સફળ ન થાય એવી શક્યતા હોય છે. તેથી તેની સાથે ઉત્પાદન પ્રમાણનું નિયમન અને સાથે સાથે ગુણવત્તાનું નિયમન પણ જરૂરી બને છે. ઈજારદાર વસ્તુનું ઠરાવેલું ઉત્પાદન પ્રમાણ ઠરાવેલા ભાવે આપે ખરો, પરંતુ ગુણવત્તા નીચી લઈ જઈને તે આમ કરે તો ગ્રાહકોને નુકસાન થાય. એટલે ઉત્પાદનનું પરિમાણ (વૃપણક્ષ) ઠરાવવામાં આવે તે સાથે તેની ગુણવત્તા અંગે પણ અંકુષ કે નિયમન જરૂરી બને છે. પરંતુ જ્યાં આંકડોને વસ્તુના વૈવિધ્યમાં રસ હોય તાં આ નીતિનો અમલ કરવો મુશ્કેલ બની જાય. એકસરાખી અને એક જ પ્રકારની ચીજ હોય તાં જ ગુણવત્તાનું નિયમન શક્ય બને.

### નફાનું નિયંત્રણ :

કિમતને બદલે ઈજારદારના નફા પર નિયંત્રણ મૂકુવું જોઈએ એવું પણ સૂચન થયેલું છે; કારણ કે નફા ઉપર નિયંત્રણ મૂકુવાથી કિમત ઉપર આપોણાપ નિયંત્રણ આવી જાય છે. આ માટે ઈજારદારના નફાની મર્યાદા નક્કી કરવામાં આવે છે, એટલે કે તેણે રોકેલી મૂડીના અમુક ટકાથી નફા વધવો જોઈએ નહિ. પરંતુ આ રીતે નફા નક્કી કરવાની કેટલીક મુશ્કેલીઓ છે :

- (૧) રોકેલી મૂડીનું મૂલુક કેવી રીતે નક્કી કરવું ? મૂડીરોકામ થયું હોય તે સમયે મૂડીની કિમત અને મૂડીની વર્તમાન બજાર કિમત વચ્ચે તકાવત હોવાનો પૂરતો સંભલ છે.
- (૨) નફાની ટકાવારી નક્કી કરવા માટે મૂડીના ધસાચાર્યની પણ ગણતરી કરવી પડે જે સરળ કાર્ય નથી.
- (૩) વર્તમાન નફા જ ગણવો કે ભૂતકાળમાં બોગવેલી ખોટનું વળતર પણ નફાની ગણતરી વખતે ધ્યાનમાં લેવું, એ પણ એક અગત્યનો પ્રશ્ન છે.
- (૪) નફાનો વાજબી દર કેટલો તે નક્કી કરવાનું કોઈ આધારભૂત અને વિશ્વસનીય ધોરણ હોતું નથી.
- (૫) નફાની ટોયમર્યાદા નક્કી કરવામાં આવતી હોય તો તળિયાની મર્યાદા શા માટે નક્કી નહીં થવી જોઈએ ? અને અમુક પ્રમાણ કરતાં નફા ઓછો હોય તો ઈજારદારને વળતર આપવાની જોગવાઈ કરી શકાય ?
- (૬) દાઢ્યોદ્યકરણ અથવા રાજ્યની માલિકી :

ઉપર્યુક્ત નીતિઓના અમલમાં કેટલીક મુશ્કેલીઓ તો રહેલી છે જ. આથી આમાંથી સંપૂર્ણ મુક્ત થવા માટે કેટલાક અર્થશાસ્ત્રીઓ સ્વાભાવિક (natural) ઈજારદારીમાં તો રાજ્યની માલિકીની હિમાપત કરે છે, આ પ્રકારની ઈજારદારીને કુદરતી અથવા સ્વાભાવિક ઈજારદારી કહેવામાં આવે છે, કારણ કે તેણે ઉદ્ભબ સ્વાભાવિક રીતો જ થતો હોય છે. પ્રભર મૂડીવાદી વિચારસરણી પરાવતા દેશોમાં પણ આ પ્રકારના ઈજારણ રાજ્યની માલિકીના હોય છે. આમાં રેલવે, જાળનમાર્ગો, વીજણી, ટેલિફોન, પોસ્ટ, ઈન્ટાઇસ સેવાઓનો સમાવેશ થાય છે. આનો વહીવટ કાં તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા સ્થાનિક સંસ્થાઓ કરતી હોય છે. સમાજને

ન્યૂનતમ ભાવે આ સેવાઓ મહત્તમ પ્રમાણમાં મળી રહે છે અને ગ્રાહકોનું શોષણ ન થાય એ, આની પાછળનો આશય હોય છે.

પરંતુ આ સેવાઓનો સર્વોત્તમ લાભ રાજ્યની માલિકીયી ગ્રાહકોને મળશે જે એવું વિધાન ન થઈ શકે. વહીવિદીતંત્ર બિનકાર્યક્રમ હોય અને દેશનું રાજ્યકીય વાતંશા લાંગુલાશવત્તાનો ભૌગોબનેલું હોય તો રાજકીય પક્ષ પોતાના પક્ષના લાભ માટે તેનો ઉપયોગ કરે એવું પક્ષ બને છે. તે વખતે ગ્રાહકનું હિત વિસરાઈ જાય છે.

આ ઉપરાંત, વહીવિદીતંત્ર સાથે સંકળાપેલા અમલદારોને આવા જહેર ઉપયોગના ઉદ્ઘોગનું સંચાલન સૌંપવામાં ભીજા પક્ષ એક ભયનો સામનો કરવો પડે છે. સરકારી કર્મચારીઓને સ્વભાવત: (red tape) તુમારશાહીનો ભોગ બનેલા હોય છે. ઉદ્ઘોગના પ્રક્ષો વિશાળ દીખે અને ઝડપી નિર્ણયો માગી લે છે. જો તેનો અભાવ હોય તો ઉત્પાદનખર્ગ ઊગું આવે અને વસ્તુની ગુણવત્તા હલકી રહે એવું પક્ષ બને છે.

આ તહીવિદીતાંત્રની અભાવ માટે આવી સેવાઓના વહીવટ માટે સ્વતંત્ર કોરોરેશન રચયાંના આવે છે. આ સેવાના જાણકાર ઉદ્ઘોગપતિઓ, મજૂર પ્રતિનિધિઓ અને સરકારના પ્રતિનિધિઓનો તેમાં સમાવેશ કરવાના આવે છે. અમેરિકન ટીવીઓ (T.V.A.) અને લારાનું ડીવીસી (D.V.C.) આવાં કોરોરેશનાં ઉદાહરણો છે.

વળી, રાષ્ટ્રીયકરણ કરતી વખતે ખાનગી માલિકોને પૂરતું વળતર આપવાનો પ્રશ્ન પણ અગત્યનો છે. રાષ્ટ્રીયકરણની ખાનગી, મૂડીરોકાશ અને સાહસવૃત્તિ પર વિપરીત અસર ન થાય તે બાબત પક્ષ ખાસ લક્ષ્યમાં લેવી છે. વળી છેલ્લે રાષ્ટ્રીયકરણને પરિણામે રાજ્યના લાધમાં આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થતાં બજીતની આર્થિક સ્વતંત્રતા હણાય નહિ તે અંગેની સાચીરોષ કાળજી લેવાવી જોઈએ.

#### (૬) સહકારી મંડળીઓ અને મજૂર સંઘો :

સામાજિક કલ્યાણની દસ્તિએ ઈજારાની બે મુખ્ય અસરોને અવરોધની જોઈએ એમ કહી શકાય :

(અ) ઈજારામાં ગ્રાહકોની કિંમત આપવી પડે છે. આથી ગ્રાહકો જો સહકારી મંડળીઓ રેચે તો તેઓ ઓછી કિંમતે વસ્તુઓ મેળવી શકે છે અને ઈજારદારના શોષણમાંથી બચી શકે છે.

(બ.) ધ્રાણ ડિસ્સાઓમાં ઈજારામાં ઉત્પાદનાં સાધનોને તેમની સીમાન્ત ઉત્પાદકતા કરતાં ઓછી કિંમત ચૂકવામાં આવે છે અને કાગ્યો માંબ પૂરી પાડતા નાના ઉત્પાદકોનું પક્ષ શોષણ કરવામાં આવે છે. હવે જો કામદારો મજૂરરસંઘો રચીને અને કાચા માલના નાના ઉત્પાદકો સહકારી મંડળીઓ રચી પોતાની વસ્તુનું વેચાશ કરે તો ઈજારદારના આ પ્રકારના શોષણને અટકાવી શકે છે.

સહકારી મંડળીઓ અને મજૂરરસંઘો. રોમના સભ્યોને સંગાડતી કરી તેમની સોદાશક્તિ (bargaining capacity)માં વધારો ફરે છે જેને પરિણામે તેઓ ઈજારદારનો સામનો કરવા શકે નાના. આમ, ઈજારદારીનો સામનો વિશિષ્ટ પ્રકારની ઈજારદારી કારા થઈ શકે છે. પુરોપના કેટલાય દેશોમાં સહકારી મંડળીઓની પ્રવૃત્તિ સારા એવા પ્રમાણમાં વિકાસ પામી છે અને તેઓ ગ્રાહકોના શોષણ સાથે રક્ષણ કરે છે.

## પ્ર - ૫ કિંમતમાં ભેદભાવયુક્ત ઈજારો

(૧) અર્થ :

કિંમતમાં ભેદભાવ રાખવાની દસ્તિએ ઈજારાના બે પ્રકારો પાડવામાં આવે છે. એક કિંમતમાં ભેદભાવ વગરનો ઈજારો અને બીજો, કિંમતમાં ભેદભાવવાળો ઈજારો. વાક્તિ, ઉપયોગ, સમય, સ્થળ વગેરે બદલાયા છ્ટાં એક જ પ્રકારની વસ્તુની કિંમતમાં કોઈ ભેદભાવ રાખવામાં ન આવે ત્યારે તે કિંમત-ભેદભાવ વગરનો ઈજારો કહેવાય છે. આ પ્રકારના ઈજારા વિષે આપણે 'ઈજારા' હેઠળ વિગતે અભ્યાસ કર્યો. હવે કિંમતમાં ભેદભાવવાળા ઈજારા વિષે વિચાર કરીએ. કિંમતમાં ભેદભાવયુક્ત ઈજારો (Discriminating monopoly) દ્વારાં 'કિંમત-ભેદભાવ' તરીકે ઓળખાય છે.

કિંમત ભેદભાવ એ ઈજારાનું એક વિશીષ સ્વરૂપ છે. જો ઈજારો ન હોય તો કિંમતમાં ભેદભાવ કરી શકાય નહિ. પૂર્વી હરીકાઈની સ્થિતિમાં કિંમત-ભેદભાવ અસ્થિત્વમાં આવી શકે જ નહિ. પૂર્વી હરીકાઈની સાથે કિંમત-ભેદભાવ સુસંગત નથી. (Pricediscrimination is incompatible with perfect competition).\* આથી જ શ્રીમતી જેન રોબિન્સન જણાવે છે કે જ્યાં અપૂર્વી હરીકાઈ હોય ત્યાં થોડા ધૂંધા પ્રમાણમાં કિંમત-ભેદભાવ હોઈ શકે છે.+ આ રીતે ઈજારો અને અપૂર્વી હરીકાઈના સંઝેગોનાં જ કિંમત-ભેદભાવ અસ્થિત્વમાં આવી શકે છે.

વ્યાખ્યા :

કિંમત-ભેદભાવની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવે છે :

(1) શ્રીમતી જેન રોબિન્સન : એક જ ઉત્પાદકની દેખરેખ નીચે ઉત્પાદ કરવામાં આવતી એક જ સરણી વસ્તુ જુદા જુદા ગ્રાહકને જુદી જુદી કિંમતે વેચવામાં આવે ત્યારે તે કિંમત-ભેદભાવ કહેવાય છે.' (The act of selling the same article, produced under a single control at different prices to different buyers is known as price discrimination).×

(2) સ્ટોનિયર અને હેગ : 'વસ્તુનાં એકમો વાસ્તવમાં એકસરખા હોવા છ્ટાં જ્યારે ઈજારદાર જુદાં જુદાં એકમો માટે જુદી જુદી કિંમત લે છે ત્યારે કિંમત-ભેદભાવ અસ્થિત્વમાં આવે છે.\*'

કિંમત-ભેદભાવયુક્ત બજારમાં ઉત્પાદક એક જ વસ્તુની કિંમત જુદી જુદી વ્યક્તિ પાસેથી જુદી જુદી લે છે, તે ઉપરાંત વસ્તુના ઉપયોગો અને વસ્તુના વપરાશના સ્થળ

તथा સમય બદલતાં પણ જુદી જુદી કિમત લે છે. આથી કિમત-ભેદભાવની સર્વગ્રાહી વ્યાખ્યા આ રીતે આપી શકાય : ‘વ્યક્તિ, ઉપયોગ, સમય, સ્થળ, જગ્યા વગેરે બદલતાં એક જ સરખી વસ્તુની જુદી જુદી કિમત લેવામાં આવે ત્યારે કિમત-ભેદભાવ અસ્તિત્વમાં આવે છે.’

### (II) ઉદાહરણો :

વાસ્તવિક જગતમાં કિમત-ભેદભાવનાં ધ્વજાં ઉદાહરણો જોવા મળે છે. ડોક્ટર એક જ પ્રકારની સારવારનો પનિક દર્દી પાસેથી વધારે ચાર્જ લે છે, જવારે ગરીબ દર્દી પાસેથી ઓછો ચાર્જ લે છે. હિસ્સ દરમિયાન દર્દીને ત્યાં વિનિટે જવાનું હોય તો ઓછો ચાર્જ લે અને રાતે જવાનું હોય તો વધારે ચાર્જ લે છે. ટ્રેનમાં પાંચ વર્ષથી નીચેનાની ટિકિટ લેવામાં આવતી નથી. પાંચથી બાર વર્ષ સુધીનાની આર્થિક ટિકિટ અને બાર વર્ષથી ઉપરનાની આર્થિક ટિકિટ લેવામાં આવે છે. ઘરવપરાશ અને ઉદ્ઘોગ માટેના વપરાશ માટેનો વીજળીનો ચાર્જ જુદી જુદી હોય છે. હવા ખાવાના સ્થળે શિયાળામાં વસ્તુના ભાવ ઓછા અને ઊનાળામાં વસ્તુના ભાવ વધારે હોય છે. છૂટક અને જાયાનંખ જરીદીના જુદા જુદા ભાવ લેવામાં આવે છે. હંગલેન્ડ અને અમેરિકામાં પ્રસિદ્ધ થતાં કેટલાંક પુસ્તકોની કિમત અશીયાના દેશો માટે નીચી સાખવામાં આવે છે. સિંચાઈ ધોજના દ્વારા મેઝૂરોને જે પાકી આપવામાં આવે છે તેમાં જુદા જુદા પાક માટે જુદી જુદી ચાર્જ વસ્તુ કરવામાં આવે છે. રેલ્વે કોલસા, અનાજ, ઘાસ વગેરેની હેરફર માટે જુદું જુદું પૂરાભાં લે છે. આમ, રોજબરોજના આર્થિક વ્યવહારમાં જુદાં જુદાં કેત્રમાં કિમત-ભેદભાવનાં ધ્વજાં ઉદાહરણો જોવા મળે છે.

### (III) લક્ષણો :

કિમત ભેદભાવયુક્ત ઈજારાનાં લક્ષણો નીચે પ્રમાણે આપી શકાય :

(1) પૂર્વી હરીકાઈનો અભાવ : કિમત-ભેદભાવયુક્ત બજારમાં પૂર્વી હરીકાઈ હોતી નથી. આવા બજારમાં કાં તો ઈજારો હોય છે અથવા તો અપૂર્વી હરીકાઈ હોય છે.

(2) એક અથવા થોડા ઉત્પાદકો : કિમત-ભેદભાવયુક્ત બજારમાં જો ઈજારો હોય તો એક જ ઉત્પાદક હોય છે, પરંતુ અપૂર્વી હરીકાઈની સ્થિતિ હોય અને તેમાં અલ્પહસ્તક ઈજારો હોય તો થોડા ઉત્પાદકો હોય છે અને ઈજારાયુક્ત હરીકાઈ હોય તો ઘણા ઉત્પાદકો હોય છે.

(3) ખરીદનારા ધ્વજા : કિમત-ભેદભાવયુક્ત બજારમાં ખરીદનારા ધ્વજા હોય છે, ખરીદનારા બજાર વિશેનું ક્ષાન પરાવતા હોતા નથી. આથી જુદા જુદા ખરીદનારાઓ પાસેથી ઉત્પાદક એક જ વસ્તુના જુદા જુદા ભાવ લે છે.

(4) ઉત્પાદકો ભાવ અને ઉત્પાદન પર અંકુશ : કિમત-ભેદભાવયુક્ત બજારમાં ઉત્પાદક ભાવ અને ઉત્પાદન બને પર અંકુશ પારવે છે. આમ છતાં કોઈ એક સમયે તે નેમાંથી એક નક્કી કરી શકે છે. જો તે ઊંચા ભાવ રાખે તો ઉત્પાદન ઓછું વેગાય

અને જો તે વધારે વેવાણ કરવા માંગતો હોય તો તેણે નીચા ભાવ રાખવા પડે છે. અહીં માંગ રેખા સંપૂર્ણ કરતાં ઓછી મૂલ્યસાપેક્ષ હોવાથી આ પ્રમાણે બને છે.

(5) વ્યક્તિ, સમય, સ્થળ, ઉપયોગ વરેરે બદલાતાં જુદા જુદા ભાવ : કિમત-ભેદભાવમાં એક જ પ્રકારની વસ્તુઓ એક વ્યક્તિ પાસેથી અમૃત ભાવ અને બીજી વ્યક્તિ પાસેથી બીજો ભાવ લેવામાં આવે છે. દા. ત., A વ્યક્તિ પાસેથી અમૃત પ્રકારના કાપડના । મીટરના 50 રૂ. લેવામાં આવે અને B વ્યક્તિ પાસેથી તે જ કાપડના 60 રૂ. લેવામાં આવે. સમય બદલાતાં પણ એક જ વસ્તુના જુદા જુદા ભાવ લેવાય છે. શિયાળામાં અને ઉનાળામાં ટેબલફેનના ભાવ જુદા જુદા હોય છે. સ્થળ બદલાતાં પણ એક જ વસ્તુના અલગ અલગ ભાવ લેવામાં આવે છે. જેમ કે શહેરના ગંદરના ભાગમાં અને સોસાયટી વિસ્તારમાં એક જ વસ્તુના જુદા જુદા ભાવ હોય છે. ઉપયોગની દર્શિએ જોઈએ તો ઘરવપરાશ અને ઉઘોગના વપરાશ માટે નીજગીના દર જુદા જુદા હોય છે.

(6) જુદા જુદા બજારોમાં માંગની મૂલ્યસાપેક્ષતા પ્રમાણે ભાવ : કિમત-ભેદભાવમાં જુદા જુદા બજારોમાં માંગની મૂલ્યસાપેક્ષતા પ્રમાણે ભાવ લેવામાં આવે છે. જે બજારમાં માંગની મૂલ્યસાપેક્ષતા વધારે હોય ત્યાં વસ્તુના ઓછા ભાવ લેવામાં આવે છે અને જે બજારમાં માંગની મૂલ્યસાપેક્ષતા ઓછી હોય ત્યાં તે જ વસ્તુ વધુ ભાવ લેવામાં આવે છે.

#### (IV) પ્રકારો :

વ્યક્તિ, વર્ગ, સમય, સ્થળ, ઉપયોગ, જથ્યો અને બ્રાન્ડની દર્શિએ કિમત-ભેદભાવના નીચે પ્રમાણે પ્રકારો પાડી શકાય.

(1) વ્યક્તિલક્ષી કિમત-ભેદભાવ : જથ્યારે એક જ પ્રકારની વસ્તુ અથવા સેવાની જુદી જુદી વ્યક્તિ પાસેથી જુદી જુદી કિમત લેવામાં આવે છે ત્યારે તે વ્યક્તિલક્ષી કિમત-ભેદભાવ કહેવાય છે. દા. ત., ડોક્ટર એક જ પ્રકારની જારવાર માટે ગરીબ દર્દી પાસેથી ઓછી અને ધનિક દર્દી પાસેથી વધારે ચાર્જ લે છે.

(2) વર્ગલક્ષી કિમત-ભેદભાવ : જથ્યારે એક જ પ્રકારની વસ્તુ અથવા સેવાની જુદા જુદા વર્ગ પાસેથી જુદી જુદી કિમત લેવામાં આવે ત્યારે તે વર્ગલક્ષી કિમત-ભેદભાવ કહેવાય છે. દા. ત., બસની મુસાકરીમાં ત્રણ વર્ષથી નીચેનાની ટિકિટ નહિ, ત્રણથી બાર વર્ષ સુધીનાની આપી ટિકિટ અને બાર વર્ષથી ઉપરનાની આપી ટિકિટ લેવામાં આવે છે. અહીં ત્રણ વર્ષથી નીચેના, ત્રણથી બાર વર્ષ સુધીના અને બાર વર્ષથી ઉપરના એમ જુદા જુદા વર્ગ પાડીને જુદા જુદા ચાર્જ લેવામાં આવે છે.

(3) સમયલક્ષી કિમત-ભેદભાવ : એક જ પ્રકારની વસ્તુ કે સેવાની જુદા જુદા સમયે જુદી જુદી કિમત લેવામાં આવે ત્યારે તે સમયલક્ષી કિમત-ભેદભાવ કહેવાય. દા. ત., અવાજાવાના સ્થળે ઉનાળામાં અને શિયાળામાં એક જ પ્રકારની વસ્તુના જુદા જુદા ભાવ હોય છે.

(4) સ્થળલક્ષી કિંમત-ભેદભાવ : જ્યારે એક જ પ્રકારની વસ્તુ કે સેવાની જુદા જુદા સ્થળે જુદી જુદી કિંમત લેવામાં આવે ત્યારે તે સ્થળલક્ષી કિંમત-ભેદભાવ કહેવાય છે. સોસાપટી વિસ્તાર અને શહેરના મધ્ય બાગમાં આવેલી હુકાનો પર એક જ પ્રકારની વસ્તુના જુદા જુદા ભાવ હોય છે.

કોઈ દેશ પોતાને ત્યાં વસ્તુની કિંમત જીચી રાખે અને પરદેશમાં નીચે રાખે તો પણ તે સ્થળલક્ષી કે પ્રાદેશિક કિંમત-ભેદભાવ કહેવાય છે. કોઈ પણ દેશની માલ વેવાની આ પ્રકારની નીતિ ‘માલના દબાણ’ (dumping) તરીકે ઓળખાય છે. જરૂરની અને જ્યાને અનુકૂળ ખાંડ અને કાપડની બાબતમાં જૂતકાળમાં માલના લાદજાની નીતિ અપનાવી ભારતમાં ખોટા પ્રમાણમાં ખાંડ અને કાપડનું વેવાણ કર્યું હતું.

(5) ઉપયોગલક્ષી કિંમત-ભેદભાવ : જ્યારે એક જ પ્રકારની વસ્તુ કે સેવાના જુદા જુદા ઉપયોગ માટે જુદા જુદા ભાવ લેવામાં આવે ત્યારે તે ઉપયોગલક્ષી કિંમત-ભેદભાવ કહેવાય છે. દા. ત., ઘરવપરાશ અને ઉદ્યોગોના વપરાશ માટે વીજળીનો જુદો જુદો ચાર્જ લેવામાં આવે છે.

(6) જચ્ચાલક્ષી કિંમત-ભેદભાવ : જ્યારે વસ્તુ કે સેવાના જુદા જુદા જચ્ચા પ્રમાણે જુદો જુદો ભાવ લેવામાં આવે ત્યારે તે જચ્ચાલક્ષી કિંમત-ભેદભાવ કહેવાય છે. દા. ત., ગ્રાહક જ્યારે ઓછા જચ્ચામાં અથવા છૂટક વસ્તુ ખરીદે છે ત્યારે થોડા વધારે ભાવ લેવામાં આવે છે અને જ્યારે વધારે જચ્ચામાં અથવા જચ્ચાબંધ રીતે વસ્તુ ખરીદે છે ત્યારે થોડા ઓછા ભાવ લેવામાં આવે છે.

(7) ખાંડલક્ષી કિંમત-ભેદભાવ : વસ્તુ લગભગ સમાન જ હોય પરંતુ જુદી જુદી ખાંડ અથવા છાપાનો ઉપયોગ કરીને એક કરતાં બીજી વસ્તુ જુદી છે તેનું ગ્રાહકના મંજુષમાં દસાવીને જુદી જુદી કિંમત લેવામાં આવે ત્યારે તે ખાંડલક્ષી કિંમત-ભેદભાવ કહેવાય છે. દા. ત., ડાલા અને અરુણા વનસ્પતિ ધી, અર્દી વસ્તુ એકસરખી હોવા છતાં ખાંડ જુદી જુદી હોવાને લીધે બંનેના જુદા જુદા ભાવ લેવામાં આવે છે.

(V) કિંમત-ભેદભાવ ક્યારે શક્ય બને છે :

કિંમત-ભેદભાવ નીચે આપેલા સંજોગોમાં શક્ય બને છે. એટલે કે નીચેની શરતો સંતોષાય તો જ કિંમત-ભેદભાવ શક્ય બને છે.

(1) બજારમાં પૂર્વ હરીકાઈનો અભાવ :

બજારમાં પૂર્વ હરીકાઈનો અભાવ કે ગેરહાજરી હોય તો જ કિંમત-ભેદભાવ થઈ શકે છે. પૂર્વ હરીકાઈ અને કિંમત-ભેદભાવ એકબીજા સાથે સુસંગત નથી. આથી બજારમાં હજારો અથવા તો અપૂર્વ હરીકાઈ હોય તો જ કિંમત-ભેદભાવ શક્ય બને છે. અપૂર્વ હરીકાઈમાં આખકો બજાર વિયેની સંપૂર્ણ જાણકારી પરાવતા હોતા નથી. આથી તેમાં કિંમત-ભેદભાવ સહેલાઈથી અપનાવી શકાય છે, પરંતુ કિંમત-ભેદભાવ હોય તાં હંમેશાં અપૂર્વ હરીકાઈ જ હોય તેનું હોય નથી. કિંમત-ભેદભાવ હોય તાં હજારો પણ હોઈ

શકે છે. ઈજારમાં હરીકાઈનો અભાવ હોવાથી ઈજારદાર કિમત-બેદભાવ અમલમાં મૂડી શકે છે.

(2) વેચાણ માટે જુદાં જુદાં બજાર :

વસ્તુના વેચાણ માટે એક જ બજાર હોય તો કિમત-બેદભાવ થઈ શકે નહિ. વસ્તુના વેચાણ માટે એક કરતાં વધારે બજારો હોય તો જ કિમત-બેદભાવ શક્ય બને છે. જુદા જુદા બજારમાં વસ્તુની માંગની મૂલ્યસાપેક્ષાતાને ધ્યાનમાં રાખી જુદી જુદી કિમત વેવામાં આવે છે.

(3) માંગની મૂલ્યસાપેક્ષાતા જુદી જુદી :

વસ્તુના વેચાણ માટે એક કરતાં વધારે બજારો હોય, પરંતુ બધા જ બજારોમાં માંગની મૂલ્યસાપેક્ષા એકસરખી હોય તો કિમત-બેદભાવ શક્ય બનતો નથી. કિમત-બેદભાવ શક્ય બને એટલા માટે જુદા જુદા બજારમાં માંગની મૂલ્યસાપેક્ષાતા જુદી જુદી હોય એ જરૂરી છે.

(4) કિમત-બેદભાવથી નફો વધવો જોઈએ :

કિમત-બેદભાવ કરવાથી ઉત્પાદકનો નફો વધે તો જ કિમત-બેદભાવ કરવામાં આવે છે. નકામાં વધારો ન થાય તો કિમત-બેદભાવ કરવામાં આવતો નથી. જ્યારે જુદા જુદા બજારમાં માંગની મૂલ્યસાપેક્ષાતા જુદી જુદી હોય ત્યારે કિમત-બેદભાવ કરવાથી નફો વધે છે. ઓછી મૂલ્યસાપેક્ષ માંગ ધરાવતા બજારમાં ઊચા ભાવ અને વધારે મૂલ્યસાપેક્ષ માંગ ધરાવતા બજારમાં નીચા ભાવ રાખીને ઉત્પાદક વધારે નફો મેળવી શકે છે.

(5) ખર્ચ કરતાં આવક વધારે હોવી જોઈએ :

કિમત-બેદભાવ ઊભો કરવા માટે ઉત્પાદકે ખર્ચ કરતું પડે છે. દા. ત., સિનેમા-વિયેટરમાં લોઅર સ્ટોલ, અપર સ્ટોલ અને બાલ્કની એવા વિભાગ ઊભા કરવા માટે ખર્ચ કરતું પડે છે. બેઠક વ્યવસ્થામાં તણકાત ઊભો કરવો પડે છે. આ માટે ઠીક પ્રમાણમાં ખર્ચ થાય છે. આ માટે થતાં ખર્ચ કરતાં આવક વધારે પ્રમાણમાં થાય તો જ કિમત-બેદભાવ કરવામાં આવે છે. જો કિમત-બેદભાવ શક્ય બનાવવા માટે જે ખર્ચ કરવામાં આવે તેના કરતાં તેમાંથી થતી આવક ઓછી હોય તો કિમત-બેદભાવ કરવામાં આવતો નથી.

(6) નફકારક પુનર્વ્યાપ ન થઈ શકતું જોઈએ :

જો વસ્તુનું નફકારક પુનર્વ્યાપ થઈ શકે તો કિમત-બેદભાવ અસ્તિત્વમાં આવી શકે નહિ. દા. ત., ઉત્પાદક અમૃત પ્રકારની સારીઓ ટેચોમાં 200 રૂપિયા ભાવે રાખે અમેરિકાનાં તે જ સાડી 150 રૂપિયામાં વેચતો હોય અને અમેરિકાથી ભારતમાં સાડી મોકલવાનું ખર્ચ એકમણીઠ રૂપિયા 30 આવતું હોય તો કિમત-બેદભાવ ટકી શકતો નથી, કારણ કે આ સંજોગોમાં ભારતના ગ્રાહકો ભારતમાંથી 200 રૂપિયાની સાડી

ખરીદવાને બદલે ભારતમાંથી અમેરિકામાં નિકાસ થયેલી સાડીની આપાત કરશે, કારણ કે તે રૂપિયા 180માં મળી શકે છે. ( $150 + 30 = 180$ ). આમ દેશમાંથી ખરીદવાને બદલે અમેરિકામાં ભારતની નિકાસ થયેલી સાડી ખરીદવાથી ગ્રાહકને 20 રૂપિયાનો કષયથો થાય છે. અહીં પુનર્વ્યાપક નકારાક બને છે. તેથી કિમત-ભેદભાવ શક્ય બનતો નથી. આ દાખાંતમાં જો સાડી મોકલવાનું ખર્ચ રૂપિયા 50 કે તેથી વધારે હોય તો પુનર્વ્યાપક નકારાક બની શકતું નથી અને તો તેવા સંજોગોમાં કિમત-ભેદભાવ શક્ય બને છે.

#### (7) સેવાઓના વેચાણમાં કિમત-ભેદભાવ હુમેશાં શક્ય :

ભૌતિક વस્તુઓનું પુનર્વ્યાપક થઈ શકે છે, આથી ટેલ્વિઝ વાર તેમાં કિમત-ભેદભાવ શક્ય બનતો નથી. પાસ કરીને જ્યારે પુનર્વ્યાપક નકારાક બનતું હોય તારે કિમત-ભેદભાવ ટકી શકતો નથી, પરંતુ સેવાઓનું પુનર્વ્યાપક થઈ શકતું નથી. આથી તેમાં ચરણતાથી કિમત-ભેદભાવ કરી શકાય છે. ડોક્ટર, નર્સ, વાર્ણિક વગેરે દ્વારા આપાતી રેવામાં કિમત-ભેદભાવ હુમેશાં શક્ય છે. નારો કે કોઈ ગરીબ દર્દી ડોક્ટર પાસેથી 5 રૂપિયામાં સારવાર મેળવે છે, પરંતુ તે પોતે મેળનેલ સારવાનું વેગાજી પેસાદાર દર્દીને થોડા વધારે પૈસા લઈને કરી શકતો નથી. આથી જ ડોક્ટર પૈસાદાર દર્દી પાસેથી તેને આપેલી સારવારના બદલવામાં વધારે ચાર્જ લઈ શકે છે. કોઈ વાળંદ નક્કી ફરે કે ગોરા માણસની હજામત તે 10 રૂપિયામાં કરી આપશે અને કાળા માણસની હજામતના 20 રૂપિયા લેશે તો અહીં પણ કિમત-ભેદભાવ ટકી શકે છે, કારણ કે કોઈપણ કાળો માણસ ગોરા માણસ પાસેથી વાળંદે આપેલી સેવાઓ ખરીદી શકતો નથી.

#### (8) પ્રાદેશિક અવરોધ :

આપાત પ્રતિબંધ અને આપાત-જકાતનો આશ્રય લઈ દેશ-દેશ વચે વસ્તુની હેરફર સામે અવરોધો ઊભા કરી શકાય છે. આપાત પ્રતિબંધના સંજોગોમાં વસ્તુની આપાત થઈ શકતી નથી અને આપાતજકાતના સંજોગોમાં વસ્તુની આપાત મૌંઠી પડે છે. આથી દેશી અને પરદેશી બજારને જુદ્દી પાડી શકાય છે અને કોઈ એક વસ્તુ દેશમાં ઊચા ભાવે અને પરદેશમાં નીચા ભાવે વેચી શકાય છે. આ રીતે પ્રાદેશિક કિમત-ભેદભાવ અમલમાં આવે છે.

#### (9) કિમતમાં નષ્ટવો તફાવત :

વેચનાર એક ગ્રાહક પાસેથી વસ્તુનો જે ભાવ લે તેના કરતાં બીજા ગ્રાહક પાસેથી તે જ વસ્તુનો થોડોક વધારે ભાવ લે તો કિમત-ભેદભાવ શક્ય બને છે, કારણ કે ભાવમાં થોડોક કે નષ્ટવો તફાવત હોવાથી ગ્રાહક તે લક્ષ્યમાં લેતો નથી.

#### (10) ભાવ અંગેનું અજાન :

જો ગ્રાહકો ભાવ અંગેનું જ્ઞાન કે માહિતી ધરાવતા ન હોય તો વેચનાર એક ગ્રાહક પાસેથી વસ્તુનો થોડો વધુ ભાવ અને બીજા પાસેથી તે વસ્તુનો થોડો ઓછો ભાવ લઈ શકે છે અને એ રીતે કિમત-ભેદભાવ શક્ય બને છે.

(11) વસ્તુની ગુણવત્તા વિશે આહકોનો ખોટો ખ્યાલ :

કેટલીક વાર વસ્તુની ગુણવત્તા વિશે આહકના મનમાં ખોટો ખ્યાલ બંધાઈ જાય છે અને તેથી ડિમત-ભેદભાવ શક્ય બને છે. આહક એટું માની લે છે કે પોતે વસ્તુની બીજા કરતાં વધારે ડિમત ચૂકવે છે, પરંતુ તેને બીજા કરતાં વધારે સારી ગુણવત્તાવાળી વસ્તુ મળે છે. માટે પોતે વધારે ડિમત આપે છે તે વાજબી છે. આહકની આ પ્રકારની મનોવૃત્તિ ડિમત-ભેદભાવને શક્ય બનાવે છે.

(VII) ડિમત-ભેદભાવ કયારે નફાકારક બને છે ?

જુદા જુદા બજારોમાં માંગની મૂલ્યસાપેક્ષા જુદી જુદી હોય તો ડિમત-ભેદભાવ નફાકારક બને છે. જો જુદા જુદા બજારોમાં માંગની મૂલ્યસાપેક્ષા એકસરખી હોય તો ડિમત-ભેદભાવ નફાકારક બનતો નથી. આ હકીકતને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. આ માટે કેટલીક ધારણાઓ કરવી જરૂરી છે.

(1) ઈજારદાર સામે બે બજારો છે.

(સરળતા ખાતર અહીં માત્ર બે બજારોની ધારણા કરેલી છે.)

(2) દરેક બજારમાં ખરીદનારાની સંખ્યા ધંડી મોટી છે. ખરીદનારાઓમાં હરીકાઈ પ્રવર્તત છે.

(3) એક બજારમાં બીજા બજારની વસ્તુનું નફાકારક પુનર્વેચ્ચણ થઈ શકતું નથી.

(4) ઈજારદારનો હેતુ મહત્તમ નહો કરવાનો છે.

(અ) બંને બજારોમાં માંગની મૂલ્યસાપેક્ષા એકસરખી હોય ત્યારે :

નીચેનો કોઠો તપાસવાથી જરૂરી છે કે A બજારમાં 10 ટકા ડિમત વધી તેથી માંગમાં 10 ટકાનો ઘટાડો થયો.  $\frac{\text{માંગનો ટકાવારી ફેરફાર}}{\text{ડિમતમાં ટકાવારી ફેરફાર}}$  એ સૂત્ર અનુસાર અહીં માંગની મૂલ્યસાપેક્ષા એકમ બરાબર થાય છે.  $\left( \frac{-10}{+10} = -1 \right)$  માંગની મૂલ્યસાપેક્ષા હમેશાં ઝંકી હોય છે.

B બજારમાં 10% ડિમત થઈ તેથી માંગમાં 10% નો વધારો થયો. આથી અહીં પણ માંગની મૂલ્યસાપેક્ષા એકમ બરાબર છે.

$$\left( \frac{-10}{+10} = -1 \right)$$

	A બજાર			B બજાર			બંનેબજારોમાં કુલ આવક રૂ.
	કિંમત રૂ.	માંગ એકમો	કુલ આવક	કિંમત રૂ.	માંગ એકમો	કુલ આવક	
કિંમત-ભેદભાવ પહેલાં	1	100	100	1	100	100	200
કિંમત-ભેદભાવ પછી	1.10	90	99	0.90	110	99	198

આમ, અહીં બંને બજારોમાં માંગની મૂલ્યસાપેક્ષતા એકસરખી છે. કિંમત-ભેદભાવ પહેલાં ઈજારદારને બંને બજારોમાંથી કુલ રૂપિયા 200ની આવક થતી હતી. કિંમત-ભેદભાવ પછી તેને રૂ. 198ની કુલ આવક થાય છે. આ પરથી કઢી શકાય કે બંને બજારોમાં માંગની મૂલ્યસાપેક્ષતા એકસરખી હોય તો કિંમત-ભેદભાવ નફકારક નિયમ નહિએ, જે ને બજારો માટે સાચું છે તે ને કરતાં વધારે બજારો માટે પણ સાચું જ છે.

(બ) બંને બજારોમાં માંગની મૂલ્યસાપેક્ષતા જુદી જુદી હોય ત્યારે :

	A બજાર			B બજાર			બંનેબજારોમાં કુલ આવક રૂ.
	કિંમત રૂ.	માંગ એકમો	કુલ આવક	કિંમત રૂ.	માંગ એકમો	કુલ આવક	
કિંમત-ભેદભાવ પહેલાં	1	100	100	1	100	100	200
કિંમત-ભેદભાવ પછી	1.10	90	99	0.90	140	126	225

ઉપરોક્ત કોઈ તપાસવાથી જફ્ફાય છે કે A બજારમાં 10% કિંમત વધી તેથી માંગમાં 10%નો ઘટાડો થયો. આથી માંગની મૂલ્યસાપેક્ષતા એકમ બરાબર થાય છે.

$$\left( \frac{-10}{+10} = -1 \right)$$

B બજારમાં 10% કિંમત વધી તેથી માંગમાં 40% વધારો થયો. આથી અહીં માંગની મૂલ્યસાપેક્ષતા 4 જેટલી  $\left( \frac{+40}{-10} = -4 \right)$  છે.

આ રીતે અહીં A બજારમાં માંગની મૂલ્યસાપેક્ષતા એકમ બરાબર છે અને B બજારમાં તે 4 જેટલી છે. આમ, બંને બજારમાં માંગની મૂલ્યસાપેક્ષતા જુદી જુદી છે.

કિંમત-ભેદભાવ પહેલાં ઈજારદારને બંને બજારોમાંથી કુલ રૂપિયા 200ની આવક થતી હતી. કિંમત-ભેદભાવ પછી તેને રૂપિયા 225ની આવક થાય છે. આ પરથી કઢી શકાય કે બંને બજારોમાં માંગની મૂલ્યસાપેક્ષતા જુદી જુદી હોય તો કિંમત-ભેદભાવ નફકારક થાય છે. કિંમત-ભેદભાવ કરવાથી અહીં 25 રૂ. જેટલી વધારે આવક થાય છે. ઉપરોક્ત અંને ઉદાહરણો એ હફીકત સ્પષ્ટ કરે છે કે રૂ. 7 રૂ. 14ાં રૂ. 14ાં બજારોમાં માંગની મૂલ્યસાપેક્ષતા જુદી જુદી હોય તો જ કિંમત-ભેદભાવ નફકારક બને છે.

## 7. કિમત-બેદભાવનું મૂલ્યાંકન :

કિમત-બેદભાવને લીધે ઈજારારની આવક વધે છે અને એ રીતે તેના નકામાં વધારે થાય છે. આથી ઈજારાર માટે કિમત-બેદભાવ લાભદાયી નીવડે છે. સમાજ માટે પણ કેટલીક બાબતોમાં કિમત-બેદભાવ લાભકારક બને છે અને તેથી તે આવકાર્ય ગણાય. અહીં આપણે તેનું મૂલ્યાંકન કરીશું.

### (અ) કિમત-બેદભાવના લાભો :

આ લાભ નીચે પ્રમાણે રૂળુ કરી શકાય :

(1) ખૂબ ઉપયોગી વસ્તુ કે સેવાનું ઉત્પાદન : સમાજ માટે કેટલીક વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન ખૂબ ઉપયોગી હોય છે, જેમ કે વાહનઘરાર, પાણી, વીજણી, શિક્ષણ, તબીબી સારવાર. આ સેવાઓ સમાજની પ્રાથમિક જરૂરિયાતો છે. તેના વેચાણમાં કિમત-બેદભાવ અનિવાર્ય બને છે. ડોક્ટર જો બધા માટે નીચે ફી રાખે તો તેને પોસાય નહિં. જો ઊંચી ફી રાખે તો ગરીબ વર્ગ તેની સેવાથી વંચિત રહે, પરંતુ પૈસાદાર વર્ગ માટે ઊંચી ફી રાખે અને ગરીબ વર્ગ માટે નીચી ફી રાખે એટલે કે કિમત-બેદભાવ અમલમાં મૂકે તો ડોક્ટરને પણ પોસાય અને ગરીબ વર્ગને પણ તેની સેવા મળી શકે. આમ, કિમત-બેદભાવ અપનાવવામાં આવે તો ડોક્ટરની સેવાનું ઉત્પાદન થાય. જો રેલવે ઓછું ભાડું રાખે તો તેને સેવા આપવી પરંવર્તે નહિં અને તેથી રેલવેની સેવા મળી જ ન શકે. જો તે ઊંચું ભાડું રાખે તો ગરીબ વર્ગ રેલવેની સેવાથી વંચિત રહે. આથી રેલવે માટે કિમત-બેદભાવ અનિવાર્ય બને છે. આ સંબંધમાં શ્રીમતી જોન રોબિન્સન યોગ્ય જ લખે છે કે 'જો કિમત-બેદભાવ ત્યા દેવામાં આવે તો રેલવે બાંધી જ ન શકાય અથવા ડોક્ટર ગામડામાં ગ્રેડિસ જ ન કરે તેનું બને.'\* આમ, કિમત-બેદભાવને લીધે જ ખૂબ ઉપયોગી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે.

(2) સમાજ માટે એકદરે લાભદાયી : કિમત-બેદભાવયુક્ત ઈજારામાં એક જ પ્રકારની વસ્તુ કે સેવાની કિમત અમુક ગ્રાહકો માટે વધારે અને અમુક ગ્રાહકો માટે ઓછી રાખવામાં આવે છે. પરિણામે ઊંચી કિમત ચૂકવનારને ગેરલાભ અને નીચી કિમત ચૂકવનારને લાભ થાય છે. ઊંચી કિમત ચૂકવનારા સામોન્ય રીતે પૈસાદાર હોય છે, જ્યારે નીચી કિમત ચૂકવનારા ગરીબ વર્ગના હોય છે. સમાજમાં પૈસાદાર વર્ગ કરતાં ગરીબ વર્ગ વધ્યો મોટો હોય છે. આથી એવું બને છે કે બહુ ઓછા લોકોને ગેરલાભ અને તેની સામે મોટી સંખ્યાના લોકોને લાભ થાય છે. આથી એમ કહી શકાય કે કિમત-બેદભાવ સમાજ માટે એકદરે લાભદાયી નીવડે છે.

(3) વધતા મળતરનો લાભ : કિમત-બેદભાવ ન કરવામાં આવે તો વેચાણ ઓછું થાય છે અને તેથી ઉત્પાદનનું પ્રમાણ પણ ઓછું રહે છે. તેની સામે કિમત-બેદભાવ અમલમાં મૂકવાથી વેચાણ કરતાં કુલ ઉત્પાદન વધારતું પડે છે. ઉત્પાદન વધતાં સરેરાશ

ઉત્પાદન ખર્ચ હટે છે. એટલે કે પેઢીને વધતી મળતરનો લાભ મળે છે. જોકે આ પ્રકારનો લાભ અમૃત હદ્દ સુધી ઉત્પાદન કરવામાં આવે તો જ મળતો હોય છે. સરેરાશ ખર્ચ અંગેથાં એટલું થાપ તેટલી હદ્દ ઉત્પાદન ધારવામાં આવે ત્યાં સુધી વધતી મળતરના લાભ મળે છે.

(4) ઉત્પાદનમાં વધારો : કિમત-ભેદભાવ વગરના ઈજારામાં એટલે કે સાધા ઈજારામાં જેટલું ઉત્પાદન થાપ તેના કરતાં કિમત-ભેદભાવયુક્ત ઈજારામાં હુલ ઉત્પાદન વહું થતું હોય છે. હુલ ઉત્પાદન વધારે થતું હોય તો વહું વપરાશ થઈ શકે અને તેથી સમાજના કલ્યાણમાં વધારો થાપ છે. જોકે આંદો આપે કિમત-ભેદભાવને લીધે આખળોની અધોગ્ય ફાળવકી થતાં જે ગેરલાભ થાપ છે તેને ધ્યાનમાં લીધા પછી જ સમાજના કલ્યાણમાં વધારો થયો છે કે નહિ તે અંગે અભિપ્રાય આપી શકાય.

(5) કિમત-ભેદભાવના ગેરલાભો :

કિમત-ભેદભાવથી સમાજને કટલાક ગેરલાભો પક્ષ થાપ છે, જે નીચે પ્રમાણે દર્શાવી શકાય.

(1) આહકોનો અધિક સંતોષ હુટ્ટવી લે છે : કિમત-ભેદભાવ વગરનો ઈજારો હોય તો તેમાં બધા આહકો પાસેથી ગેરસરપ્પા કિમત વેવામાં આવે છે. આથી પેસાદાર આહકો જેટલી કિમત ચૂકવતા તેથાર હોય તેના કરતાં ખરેખર ઓછી કિમત ચૂકવતા હોય છે. આથી તેમને અધિક સંતોષ મળે છે. હવે જ્યારે કિમત-ભેદભાવ અમલમાં મુક્તવામાં આવે છે ત્યારે જે જે લોકોની માંગ ઓછી મૂલ્યમાપેલ હોય તેમની પાસેથી વહું કિમત વેવામાં આવે છે, આથી આવા લોકોનો 'અધિક સંતોષ' હુટ્ટવાઈ જાય છે.

(2) દેશના લોકોને ભોગે વિદેશી આહકોને લાભ : માદેશિક કિમત-ભેદભાવ કે કેમાં દેશના લોકો પાસેથી ઊચી કિમત અને વિદેશી આહકો પાસેથી નીચી કિમત વેવામાં આવે છે, તેમાં દેશના લોકોને ભોગે વિદેશી આહકોને લાભ થાપ છે. જોકે ઉત્પાદનમાં વધતી મળતરનો નિયમ અમલમાં હોય તો માંગ વધે અને તેને પરિણામે ઉત્પાદન વધે તો સરેરાશ ઉત્પાદન ખર્ચ નીચું આવે અને તેથી કિમત હટે તો કિમત ઘટાડાનો લાભ દેશના લોકોને પક્ષ મળી શકે.

(3) સાધનોની અધોગ્ય ફાળવકી : કિમત-ભેદભાવયુક્ત ઈજારામાં જે બજારમાં માંગની મૂલ્યા ઓછા હોય ત્યાં ઊચી કિમત રાખવામાં આવે છે. ઊચી કિમતવાળા બજારમાં વસ્તુનું ઉત્પાદન કરવા માટે વહું સાધનો ફાળવવામાં આવે છે. તેની સામે વહું મૂલ્યા માંગ પરાવતા બજારમાં નીચી કિમત હોય છે. નીચી કિમતવાળા બજારમાં વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઓછા સાધનો ફાળવવામાં આવે છે. આમ, અહીં લોકોની વહુંઓની જરૂરિયાત મુજબ ઉત્પાદનના સાધનો ફાળવવામાં આવતા નથી. પરિણામે સાધનોની અધોગ્ય ફાળવકી જોવા મળે છે.

કિમત-ભેદભાવના લાભલાભ તપાસ્યા પછી પક્ષ તે ઈચ્છવા હોય છે કે નહિ તે અંગે અભિપ્રાય આપવો મુશ્કેલ છે. આ સંબંધમાં શ્રીમતી જોન રોબિન્સન હોય જ લખે છે કે સમગ્ર સમાજની રીતે જોઈએ તો કિમત-ભેદભાવ ઈચ્છવા હોય છે કે નહિ તે વિષે કહેનું અશક્ય છે. કિમત-ભેદભાવને લીધે ઉત્પાદનમાં વધારો થાપ છે, પરંતુ તેની સામે અહીં સાધનોની અધોગ્ય ફાળવકી પક્ષ થાપ છે. આથી ઉત્પાદન વધારાના લાભની સામે આ ગેરલાભની તુલના કર્યા પછી જ તેની ઈચ્છનીપતા વિષે અભિપ્રાય આપી શકાય.

## ૫ - ૬ લાદણ

### ● લાદણનો અર્થ.

માલનું લાદણ (Dumping) એટલે સ્થાનિક બજારમાં પ્રવર્તમાન કિંમતથી ઓછી કિંમતે વિદેશી બજારમાં વેચાણ કરવાની ગાત્રી સામાન્ય એવી સમજ હોય છે કે માલનું લાદણ એટલે વિદેશી બજારમાં ઉત્પાદન ખર્ચથી ઓછા ભાવે વેચાણ કરવામાં આવતું હોય પણ સ્થાનિક બજારની કિંમતની તુલનામાં વિદેશી બજારનો ભાવ ઓછો જ હોય તો તેને લાદણ કહેવાય નહીં.

આ વ્યાખ્યા મુજબ લાદણ કિંમતબેદભાવનો એક વિશાળ પ્રકાર છે. તેમાં આંતરિક અને બાબત બજારો વચ્ચે કિંમતબેદભાવ અપનાવવામાં આવે છે. મુખ્ય ત્રણ શરતોનું પાલન થાય ત્યારે લાદણનો અમલ શક્ય બને છે.

### ● શરતો.

#### 1. આંતરિક બજારમાં ઈજરાશાહી હોવી જોઈએ.

આંતરિક બજારમાં ભાવ પર ઉત્પાદનનો કાબુ હોવો જોઈએ.

#### 2. વિદેશી બજારમાં મુક્ત હરિકાઇ હોવી જોઈએ.

આંતરિક બજારમાં વસ્તુની માંગ ઓછી મુલ્ય સાપેક્ષ અને વિદેશી બજારમાં વધુ મુલ્યસાપેક્ષ હોવી જોઈએ.

#### 3. વસ્તુનું પુનર્વેચાણ અશક્ય હોવું જોઈએ.

કિંમત તડાવત વાહનવ્યહાર ખર્ચથી વધુ હોય અથવા આચાતજકાતો કે આચાત પ્રતિબંધ અમલમાં હોય ત્યારે વિદેશી બજારમાંથી આંતરિક બજાર તરફ વસ્તુની હેરફેર થતી નથી.

### ● લાદણના પ્રકારો.

#### લાદણના મુખ્ય ત્રણ પ્રકારો છે.

##### 1. પાસંગિક લાદણ.

##### 2. દુંગાટીય લાદણ.

##### 3. અવિરત લાદણ.

## 1. પ્રાસંગિક લાદણ.

આંતરિક બજારમાં કોઈ કારણ સર વેચાણ ઘરી જાય અને માલનો ભરાવો થાય તો ઉત્પાદક એનાથી છુટકારો મેળવવાના હેતુથી જે લાદણ કરે છે તે પ્રાસંગિક લાદણ છે. વિદેશી બજારમાં માંગ વધુ મુલ્યસાપેક્ષ હોય છે. તેથી ભાવ ઘટાડીને માલનો નિકાલ સહેલાથી કરી શકાય છે.

## 2. લુંટકાટીથુ લાદણ.

વિદેશી બજારમાં ફરીદ ઉત્પાદકોને નિર્ગુજ કરવા ખોટ ખાઈને ઓછા ભાવે વેચાણ કરવામાં આવે તો એને લુંટકાટીથુ લાદણ કહેવામાં આવે છે. કારણ કે ફરીદ નાબુદ થતા વિદેશી બજારમાં ઈજારો પ્રસ્થાપિત થાય સે અને પણી ભાવ વધારીને ગાફકોનું શોષણ કરવામાં આવે છે.

## 3. અવિરત લાદણ.

આંતરિક બજારની સરખામણીમાં વિદેશી બજારમાં ઓછા ભાવે વેચવાની નીતિ લાંબા સમય સંધી ચાલુ રાખવામાં આવે તો એને અવિરત લાદણ કહેવાય છે. આંતરિક બજારની સરખામણીમાં વિદેશી બજારમાં માંગ વધુ મુલ્યસાપેક્ષ હોય છે. ભાવ ઓછા હોય છે અને વેચાણ વધુ હોય છે.

## વેચાણખર્ચ

“ગ્રાહકોને એક વસ્તુને બદલે બીજી વસ્તુ ખરીદવા અર્થવા એક વિકેતાને બદલે અન્ય વિકેતા પાસેથી વસ્તુ ખરીદવા માટે સમજીવવાનું ખર્ચ એ વેચાણખર્ચ છે.”

- મેચર્ચ

આભ્યાસક્રમ :

વેચાણખર્ચ.

### ૫ - ૭ વેચાણ ખર્ચનો અર્થ અને તેની અસરો

૧. વેચાણખર્ચનો અર્થ :

ઇજારાયુક્ત હરીકાઈનો ઉત્પાદક કે વિકેતા મહત્તમ નકો કરવા માટે તેની વસ્તુના ભાવમાં ફેરફાર કરી શકે છે. જો તે આ નીતિનો આશ્રય લે તો તેને ભાવહરીકાઈ કહેવામાં આવે છે. તે ભાવહરીકાઈની સાથે તે મલગ રીતે બિનભાવ હરીકાઈનો આશ્રય લઈ શકે છે. બિનભાવ હરીકાઈમાં ઉત્પાદક તેની વસ્તુના ભાવમાં ફેરફાર કરતો નથી. બિનભાવ હરીકાઈના બે વિકલ્પો છે : (અ) વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરવો અને (બ) વસ્તુનું વેચાણ વધારવા માટે વેચાણખર્ચનો આશ્રય લેવો.

પૂર્ણહરીકાઈ અને ઇજારાની પરિસ્થિતિમાં વેચાણખર્ચની જરૂર રહેતી નથી. પૂર્ણહરીકાઈમાં વસ્તુઓ સમાનગુણી હોય છે. ગ્રાહકોને વસ્તુઓના સ્વરૂપ વિરો સંપૂર્ણ માહિતી હોય છે. આ સંજોગોમાં જો પેઢી વેચાણખર્ચ કરે તો તેને કશો જ લાભ થતો નથી. ઇજારામાં વસ્તુનો ઉત્પાદક એક જ હોય છે. તેને તેનો હરીક હોતો નથી; તેથી પોતાની વસ્તુ માટે વેચાણખર્ચ કરવાની જરૂર રહેતી નથી. પરંતુ ઇજારાયુક્ત હરીકાઈમાં એકબીજાની નજીકની અવેજણી વસ્તુઓ (ઉત્પન્ન કરતી પેઢીઓ વચ્ચે ગ્રાહકો આકર્ષવાની જરૂર ઉપરિસ્થિત થાય છે. આ સંજોગોમાં પોતાની વસ્તુ અન્ય ઉત્પાદક કરતાં ચઠિપાતી છે, તેમ ગ્રાહકના મનમાં ઠસાવવા માટે ઉત્પાદક જાહેરખબરો, મળાર અને વેચાણકળા પાછળ ખર્ચ કરે છે. આ ખર્ચને વેચાણખર્ચ કહી શકાય. વર્તમાનપત્રોમાં આપણે દરરોજ અસ્ત્રાય જાહેરખબરો જોઈએ છીએ. ચોપાનિયાં દ્વારા વસ્તુનો પ્રચાર થાય છે. સિનેમામાં સ્લાઇડો, દુઃખનોમાં રાતે ઘાનાકર્ષક વીજળીના બલબની યોજના અને ટીવીમાં આવતી મનમોહક લોભામણી જાહેરાતો

ગ્રામપણ ક્રિત પર છાપ મુકવાનો પ્રયત્ન કરે છે. બેઠ ઘોજનાઓ, મફતસર્વિસ, ડેલાસરો દ્વારા દેખબે કરીને વસ્તુનો થતો મ્યાર વગેરે વેચાણખર્ચનાં જ ઉત્પાદકો છે. કંપની કે.પીડી આ માટે વેચાણ વિભાગ નિયમો છે. આ વેચાણ વિભાગ જાહેરાત, મ્યાર વગેરે પાંચન ખર્ચ કરે છે. રોલ્સનેનો દૃષ્ટક અને જાણાનંબ વેપારીઓને પગાર અધ્યવા કન્ફિયન આપે છે. આ બધું જ ખર્ચ વેચાણખર્ચ નેને છે. આ પ્રકારના ખર્ચ દ્વારા ઉત્પાદક આધીને પોતાની વસ્તુ અન્ય ઉત્પાદકની વસ્તુ કરતો નિયન અને ચાહિયાતી છે તેમ દ્વારાવા હંઘે છે. આ પ્રકારના વેચાણખર્ચથી વસ્તુ વિભિન્ન ન હોય તો પણ પ્રાક્તના નામાં વસ્તુ વિભિન્ન છે તેમ કશવી શકા છે. તો બીજી બાજુને જો વસ્તુ ખરેખર વિભિન્ન હોય તો તે વિભિન્ના દ્વારાવા વેચાણખર્ચ કરવામાં આવે છે. વેચાણખર્ચ દ્વારા કરવામાં આવતી જાહેરખબર કાં તો પ્રગારાલ્ક સ્વરૂપની અધ્યવા તો માહિતીપ્રક સ્વરૂપની હોય છે. એક જ જાહેરખબર બને સ્વરૂપની પણ હોઈ રહે. લક્સ, પિપર્સ વગેરે સાધુઓની જાહેરખબરો મુખ્યત્વે પ્રગારાલ્ક હોય છે. રેલવેના સમય બદલાય છે તેવી માહિતી આપતી જાહેરખબર માહિતીપ્રક છે. જ્યારે હોલ્ડિનની જાહેરખબર બને સરળો પરાવે છે તેમ કે વિકિતના પોથી અને વિકાસ મારે શાની, કંાં તાત્કાલિન અને વિદ્યાળીનો જરૂર છે તે તેવા દર્શાવ્યું હોય છે. બીજી બાજુને આ તત્ત્વો અને વિદ્યાળીનો હોલ્ડિનની રહેલા છે તેમ જાણીને તેઓ પ્રચાર કરાય છે. પોતા હૃતાંત્રી જાહેરખબરો ઊપર્કૃત બને સરળોના મિથ્યાસરૂપે જ હોય છે. અની તે વેચાણખર્ચ દ્વારા અમૃત પોકસ કિન્તે આધીને વસ્તુની પરીકી કરવા માટે ક વધુ ગરીદા કરવા. માટે લલચાણવામાં આવે છે. નીજા રાન્ધીનાં કહીએ તો માનવેન્યાનું સ્થાન અને તેનો આકાર બદલવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

વેચાણખર્ચની ઊપર્કૃત સમજૂતી બાદ દ્વારા દ્વારા અર્વાણીનોને વેચાણખર્ચની નીચે મગાડે આપેલી વ્યાખ્યાઓ સ્વયં સ્પષ્ટ થાય છે :

✓ મો. મેયર્સ વેચાણખર્ચની વ્યાખ્યા આપતાં જાણે છે કે “આધીને એક વસ્તુને બદલે બીજી વસ્તુ અધ્યવા એક વિકિતનાને બદલે અન્ય વિકિતા પાસેથી વસ્તુ પરીદાવ મારે સમજ્ઞવવાનું ખર્ચ એ વેચાણખર્ચ છે.” દા.ત., લક્સને બદલે પિપર્સ સાથી પરીદાવ મારે અધ્યવા તો અપનાલખેરામાંથી પરીદાવને બદલે પારેસ ડિપાર્ટમેન્ટ સ્લોરમાંથી વસ્તુ પરીદાવ મારે આધીને સમજ્ઞવવા જે ખર્ચ કંઈ હોય તે વેચાણખર્ચ છે. પણ વાત નવીન વસ્તુની આધીને પરિચિત કરવા મારે પણ વેચાણખર્ચ થાય છે.

મો. મેયર્સ વિભિન્નના માટે, “કોઈ એક વસ્તુની માગરેનાનું સ્થાન અને તેનો આકાર બદલવા માટે કર્તૃ પરંતુ ખર્ચ એ વેચાણખર્ચ છે.” વેચાણખર્ચથી માગરેનાનું સ્થાન અને તેનો આકાર કેવી રીતે બદલવા છે તે આપણે વિગતે જોઈશું. તે પહેલાં વેચાણખર્ચનું મહત્વ તથા વેચાણખર્ચ અને ઉત્પાદનખર્ચ વાયોનો તકાત તપાસી લઈએ.

#### ૪. ભાવચરીકાઈ અને વિનભાવચરીકાઈ (વેચાણખર્ચની માગરેના પર અસરો) :

વેચાણખર્ચ દ્વારા ઉત્પાદક આધીની વસ્તુની માગમાં વાપારો કરવાનો પ્રયત્ન કરે છે. ઉત્પાદક જાહેરખબર દ્વારા જ્યારે વેચાણખર્ચ કરે છે ત્યારે વસ્તુની માગ પર જાં પ્રકારની અસરો પડી શકે છે :

(૧) વિનભાવચરીકાઈ-જાહેરખબરખર્ચ અને માગ પરની અસર.


(૨) ભાવચરીકાઈ-જાહેરખબરખર્ચ અને માગ પરની અસર.

(૩) જાહેરખબર દ્વારા નભાવા ગાડકોના માનસ પર આકષમણ.

આ ત્રણીયને આપણે કશરાત તપાસીએ.

(૧) વિનભાવ ચરીકાઈ-જાહેરખબરખર્ચ અને માગ પર પડતી અસર : વેચાણખર્ચના આ વિકલ્પમાં એમ પારવામાં આવ્યું છે કે ઉત્પાદક તેની વસ્તુના ભાવમાં વાખત કરતો નથી એટલે ક અન્ય ઉત્પાદક સાથે તે તાવ (પદ્ધતિ)-ની જરૂરકાઈમાં જીતરતો નથી. પરંતુ પોતાની વસ્તુનું વેચાણ વધારવા મારે તે વસ્તુની શુદ્ધવતામાં સુધ્યારો કરે છે. અને જાહેરખબરનું ખર્ચ કરીને તે માર્ફતીને વસ્તુની શુદ્ધવતામાં વધારવા પારવાની જાણ કરે છે. ઉત્પાદકનાં આ બન્ને પગલાં એ વિનભાવ ચરીકાઈ છે. ગાંધીને જરૂર વિનભાવનું રહેલા સાચ યુદ્ધોની જરૂરકાઈ થાપ છે ત્યારે તે તેના માટે આકષમણ થાય છે. માગરેના જાહેરીના બાજુનું ઊપર તરફ ખસે છે. જુદો આફુતિ-૧૧ વિનભાવી જાહેરખબર કરવાના આવી તે પહેલાં હું, પણ વાતે વસ્તુના ૧૦૦ એકમો વેચાણમાં આવતાં હતાં, પરંતુ આધીને જાહેરખબર દ્વારા વસ્તુના અંતર્ગત ગુજરોથી સભાન કરવામાં આવતા, પહેલાંના ભાવે જ માગ વધીને


૧૫૦ એકમની થઈ. નવી માગ રેખા  $D_1 D_1$  જૂની માગરેખા  $DD$ -ની જમણી બાજુએ આવેલી જોઈ શકાય છે.



### આકૃતિ-૧'


(૨) ભાવહરીકાઈ-જાહેરખબરખર્ચ અને માગ પરની અસર : વૈયાજમર્યાના આ વિકલ્પમાં ઉત્પાદક પોતાની વસ્તુના ભાવ ઘટાડે છે. એટલે કે તે ભાવ હરીકાઈનો આશરો લે છે અને જાહેરખબર ખર્ચ કરીને પોતાની વસ્તુના ભાવ ઘટાડવા અંગે ગ્રાહકોને જાણ કરે છે. ભાવઘટાડો એ ભાવહરીકાઈ છે અને જાહેરખબર એ જિનભાવહરીકાઈ છે. અર્થ ઉત્પાદક આ બન્નેનો ઉપયોગ કરે છે. આપણે માગનો નિયમ જાણીએ છીએ તે મુજબ જે વસ્તુના ભાવમાં ઘટાડો થાય (અન્ય પરિણાળો પથાવત રહે) તો માગનું વિસ્તરણ થાય છે અને વસ્તુના ભાવમાં વધારો થતાં માગનું સંકોચન થાય છે. હંદું ઉત્પાદક જ્યારે ભાવહરીકાઈ દ્વારા વસ્તુના ભાવ ઘટાડે છે ત્યારે વસ્તુની માગનું વિસ્તરણ થાય છે પરંતુ ભાવઘટાડા સાથે જો જાહેરખબરખર્ચ પણ કરવામાં આવે તો માગરેખાના ઢાળમાં ફેરફાર કરી શકાય છે. તેથી ભાવહરીકાઈને કારણે જેટલી માગ વધે છે તેના કરતાં સાથે જાહેરખબરખર્ચ કરવામ આવે તો માગ વધું વધશે. આકૃતિ-૨માં વસ્તુના ભાવ રૂ. ૬ પરથી ઘટાડીને રૂ. ૪ કરવામાં આવું છે ત્યારે માગના નિયમ મુજબ,  $DD$  માગરેખા દરખાયે છે કે માગ ૫૦ એકમથી વધીને ૭૫ ગેડા થાય છે. આમ, માત્ર ભાવહરીકાઈમાં માગ ૨૫ એકમ જેટલી જ વધે છે. પરંતુ ભાવહરીકાઈ સાંચા જિનભાવહરીકાઈ દાખલ કરતાં માગરેખાનો દોણાવ બદલાઈ જાય છે.  $D_1 D_1$  માગરેખા વ મૂલ્યસાપેક્ષ માગ સૂચવે છે. જિનહરીકાઈને કારણે ભાવ રૂ. ૬ પરથી વધીને રૂ. ૪ થતાં માગ ૫૦ એકમ પરથી વધીને ૧૭૫ એકમ થાય છે. આમ, માગ ૧૨૫ એકમ જેટલી વધે છે. માં ભાવહરીકાઈના સંજોગોમાં માગ ૧૨૫ એકમને બદલે ૨૫ એકમ જ વધી હોય.

ભાવહરીકાઈ અને જિનભાવહરીકાઈની સંયુક્ત અસરો માગરેખા પર ચોક્કસ રીતે કંઈ પણ તે જો જાણતું છોય તો ગ્રાહકને પાટે ભાવહરીકાઈ અગત્યાંથી છે કે જિનભાવહરીકાઈ અગત્યની એ જાણતું ખૂબ જ જરૂરી છે. કેમ કે આ બંને સંજોગોમાં માગરેખાના ઢાળ પર જુદી જુદી અસર થાય નથી.



### આકૃતિ-૨


ભાવહરીકાઈ અગત્યની : જો ભાવહરીકાઈ અને બિનાભાવહરીકાઈ બંને એકસા�ે પ્રવર્તમાન હોય અને ગ્રાહક જો દરીકાઈને વધારે અગત્ય આપતો હોય તો તેનો અર્વ એ થયો કે ગ્રાહકો વસ્તુની ગુજરતાને ગ્રાહુ મહત્વ અપાત્ત નથી. ગ્રાહકોને મતે વસ્તુના ભાવ અગત્યના છે. જ્યારે ગ્રાહકો ગરીબ હોય ત્યારે જ સામાન્ય રીતે આમ બને છે. ગ્રાહકોને મન ડિમાન્ડ અગત્યની હોઈ વેચાખાખર્યને કારણે માગરેખાનો નીચેનો ઢાળ ઘેરે છે મતલબ કે વેચાખાખર્ય પહેલાંની માગરેખા કરતાં વેચાખાખર્ય પછીની માગરેખાનો નીચેનો ભાગ વધુ મૂલ્યસાપેક બને છે. આમ, અહીં ઉત્પાદક વેચાખાખર્ય દરાઓ વસ્તુની માગમાં વધુ વધારો જન્માવીને લાભની પરિસ્થિતિમાં મુકાપ છે। કેમ કે આકૃતિ - ઉમાં માત્ર ભાવહરીકાઈની પરિસ્થિતિમાં વસ્તુના ભાવ રૂ. ૬ પરથી ઘટાડીને રૂ. ૪ કરતાં માગ વધીને ૫૦ એકમ



### આકૃતિ-૩

પરથી ઉપ એકમ થાય છે. બિનભાવહરીકાઈને કારણે માગરેખાનો નીચે તરફનો ઢોળાવ બદલાય છે અને  $D_1$ , માગરેખા અસ્તિત્વમાં આવે છે. અહીં ગ્રાહકોને મન વસ્તુના ભાવ અગત્યના હોઈ વેચાખાખર્યને કારણે નીચે તરફ માગરેખા વધુ મૂલ્યસાપેક્ષ બને છે, ઉત્પાદક રૂ. ૪૩ ભાવે ૧૦૦ ઓક્મોનું વેચાશ કરીને પહેલાં કરતાં લાભની પરિસ્થિતિ માપી કરે છે.

**બિનભાવહરીકાઈ અગત્યની :** ગ્રાહકો ખાસ કરીને જ્યારે ધનિક હોય છે, ત્યારે વસ્તુની ગુજ્જાવતાને વધારે મહત્વ આપે છે. વેચાખાખર્યને પરિશ્બામે વસ્તુની ગુજ્જાવતા (વાસ્તવિક કે કાલ્યનિક રીતે) વથી છે તેમ દર્શાવવામાં આવે છે ત્યારે આવા ગ્રાહકો વસ્તુના ભાવ વધવા છતી પણ તેની માગમાં ખાસ ઘટાડો કરતા નથી. એટલે કે વેચાખાખર્યને પરિશ્બામે માગરેખા ઉપર તરફનો ઢોળાવ થયે છે, માગરેખા ઉપર તરફ ઓછી મૂલ્યસાપેક્ષ બને છે, ઉત્પાદક ભાવ વધારે છે. પરંતુ રેથી તે લાભની પરિસ્થિતિમાં મુકાપ છે. જુઓ આડૃતી-૪



આડૃતી-૪

માત્ર ભાવહરીકાઈની પરિસ્થિતિમાં વસ્તુના ભાવ રૂ. ૪ પરથી વધારીને રૂ. ૬ કરતાં માગ ઘટીને ૭૦ ઓકમ પરથી ૪૦ ઓકમની થાય છે. બિનભાવહરીકાઈને કારણે માગરેખાનો ઉપર તરફનો ઢોળાવ બદલાય છે અને  $D_1$ , માગરેખા અસ્તિત્વમાં આવે છે. અહીં ગ્રાહકોને મન વસ્તુના ભાવ કરતાં વસ્તુની ગુજ્જાવતા વધારે અગત્યની હોઈ વેચાખાખર્યને કારણે માગરેખા ઉપરની બજ્જુએ ઓછી મૂલ્યસાપેક્ષ બને છે, ઉત્પાદક રૂ. ૬૩ ભાવે ૧૦૦ ઓક્મોનું વેચાશ કરીને પહેલાં કરતાં લાભની પરિસ્થિતિમાં મુકાપ છે. આ સંજોગોમાં ઉત્પાદક ભાવવધારાની નીતિ અપનાવે છે.

(૩) નખણું માનસ ધરાવતા ગ્રાહકો પર જાહેરખબર ખર્ચ દ્વારા આડમણા : પ્રો. ચેમ્બરલિન જ્ઞાને છે કે ઉત્પાદકો માનસશાલનો ઉપયોગ જાહેરખબરમાં ખૂબ જ સારી રીતે કરે છે. વોચેપ મુકૃત્પ્રયુક્તિઓ દ્વારા ગ્રાહકોને જે તે વસ્તુ તરફ લલચાવવામાં આવે છે. આને પરિશ્બામે ખેતું બને છે કે ગ્રાહકોની જરૂરિયાત જ નદારાઈ જાય છે. ઉત્પાદકો નવીન ગીજીવસ્તુ પેદા કરીને ગ્રાહકોને તે નરીદવાનો આગ્રહ કરે છે. ગ્રાહકોની જરૂરિયાત મુજબ વસ્તુ ઉત્પાદન કરવી અને વસ્તુ ઉત્પાદન કરીને જરૂરિયાત ઊંબી કરવી એ બે લાભની અલગ છે.

## અલ્પહસ્તક ઈજારો

“અલ્પહસ્તક ઈજારામાં વિશાળન જીવનમરણનો પ્રચન બની રહે છે.”

— પ્રો. જામોલ

### અભ્યાસક્રમ :

અલ્પહસ્તક ઈજારો - લક્ષ્યો - ઉત્પાદન અને ભાવના અનિશ્ચિતતા - અલ્પહસ્તક ઈજારાના ગ્રાશેષ સિદ્ધાંતો (મોડેલ્સ) : ભાવનેતૃત્વ, જોડાણ અને તુટક માગરેખા.

### પ્રકરણાના મુખ્ય મુદ્દા :

૧. પ્રાસ્તાવિક
  ૨. દ્વિઈજારો
  ૩. અલ્પહસ્તક ઈજારો : વ્યાખ્યા અને લક્ષ્યો
  ૪. અલ્પહસ્તક ઈજારાના મકારો
  ૫. અલ્પહસ્તક ઈજારામાં અનિશ્ચિત ભાવનીરૂપો
  ૬. સ્વતંત્ર ભાવનીતિનું વિશ્લેષણ
  ૭. પ્રો. ચેમબરલિનનું વિશ્લેષણ
  ૮. તુટકમાગરેખાનું વિશ્લેષણ
  ૯. ભાવનેતૃત્વનું વિશ્લેષણ
  ૧૦. જોડાણનું વિશ્લેષણ
- ★ પ્રકરણસાર ★ સ્વાધ્યાય.

### ૧. પ્રાસ્તાવિક :

અગાઉના પ્રકરણોમાં આપણે પૂર્ણહરીકાઈ, ઈજારો અને ઈજારાયુક્ત હરીકાઈ; બજારવ્યવસ્થાના આ રૂપો મકારો વિશાળતાથી તપાસ્યા. પૂર્ણહરીકાઈ અને ઈજારો એ બે અંતિમ છેડાના ઉદાહરણો (limiting cases) છે તેવું પણ આપણે નોંધ્યું. જ્યારે તેથી ઊલદું ઈજારાયુક્ત હરીકાઈમાં સ્પર્ધા અને એકાવિકારનું સહઅસ્તિત્વ હોય છે. ઉત્પાદકે નજીકની અવેજણની વસ્તુ પેદા કરતા પ્રતિસ્પર્ધાની હરીકાઈનો સામનો પડ્ય કરવાનો છે. જોકે તેની વસ્તુથી ટેવામેલા ગ્રાહકો ગુમાવવાનો તેને ડર નથી. આમ તે ઈજારો અને સ્પર્ધાની વચ્ચાલી પરિસ્થિતિ છે. ઈજારાયુક્ત સ્પર્ધામાં ઉત્પાદકોની સંખ્યા સારી એવી છે, પરંતુ પૂર્ણહરીકાઈની જેમ અસંખ્ય નથી. તેવી જ રીતે ઈજારાની જેમ અહીં ઉત્પાદકો માટે પ્રવેશબન્ધ પણ નથી. વળી, ઈજારાયુક્ત સ્પર્ધામાં પૂર્ણહરીકાઈ અને ઈજારાની જેમ સમાનગુણી વસ્તુઓ (identical goods) નહીં પરંતુ વસ્તુપિકલાન (product differentiation) જોવા મળે છે. આ પ્રકરણમાં આપણે કંઈક જુદી જ પરિસ્થિતિનો અભ્યાસ કરવાનો છે. આ પરિસ્થિતિ એવા બજારનો નિર્દેશ કરે છે કે જેમાં બજારનો પ્રકાર ઈજારા અને ઈજારાયુક્ત હરીકાઈની વચ્ચેનો હોય, આ રીતે જોતાં અર્થશાસ્ત્રીઓએ બજાર પાડ્યા છે:

- (૧) દ્વિઈજારાવાણું બજાર (Duopoly) : જેમાં ઉત્પાદક કે વિકેતા માત્ર બે જ વ્યક્તિઓ હોય છે. તેમ જ
- (૨) અલ્પહસ્તક ઈજારાવાણું બજાર (Oligopoly) : જેમાં ઉત્પાદકો કે વિકેતાની સંખ્યા બેધી

વધુ હોય છે; પરંતુ તેમની સંખ્યા ઈજારાયુક્ત હરીકાઈની કેમ મોટી (large number) નથી; પરંતુ નાના (small number) હોય છે.

બીજી રીતે કહીએ તો દ્વિજારો એ અલ્પહસ્તક ઈજારાનો જ એક ભાગ છે. અલ્પહસ્તક ઈજારાને સમજવા માટે દ્વિજારો અગત્યનો પુરવાર થાય છે. અહીં આપણે અલ્પહસ્તક ઈજારાનો અભ્યાસ કરવાનો છે. તેમ છતાં પણ દ્વિજારાનો પણ થોડો ઘાણ ને...ની લઈશું.

#### ૫ - ૮ દ્વિજારો :

“દ્વિજારાની ગ્રો, આલ્બટ મેરસ નીચે પ્રમાણે વ્યાખ્યા આપે છે : દ્વિજારો એ એવી પરિસ્થિતિ છે કે તેમાં જ પેઢીઓ એકસરણી પ્રમાણિત વસ્તુ અથવા તો પરસ્પર સહેજ જુદી પડતી બે વસ્તુઓ પેદા કરે છે.”

દ્વિજારાનું સહૃદી સરળ ઉદાહરણ એ છે કે જેમાં માન બે જ વિકેતાઓ સમાનગુણી વસ્તુ (identical goods) વેચતા હોય. બને વિકેતાઓ જે વસ્તુઓ વેગાજારી રજૂ કરે તેમાં જુચા પણ વિનાતા (differentiation) ન હોય. આ પ્રકારાની પરિસ્થિતિમાં શું થશે? સ્વાભાવિક રીતે જ આ બને વિકેતાઓ કે ઉત્પાદકો જોડાણ કરશે. તે મુજબ તેઓ એકસમાન ભાવ સ્વીકારશે કે તેમાં ઉત્પાદન (વેગાજા) નો હિસ્સો નક્કી કરશે અને બજારાની પરસ્પર ફાળવણી કરી લેશે. જો બને ઉત્પાદક પેઢીની ખર્ચરિખાઓ સંપૂર્ણ એકસરણી કે લગતના સરળી હશે તેમ જ જો વસ્તુની માગ સ્થિર અને ઓછી મૂલ્યસાપેક્ષ હશે તો આમ બનવાની સંભાવના ખૂબ જ છે. અહીં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જોડાણાની આ પરિસ્થિતિ ઈજારાને મળતી છે : તેથી ઈજારા ડેઢણ જે રીતે ભાવનિર્ધરણ થાય છે, તે જ રીતે આ પ્રકારના દ્વિજારાની પરિસ્થિતિમાં પણ વસ્તુના ભાવ નક્કી થશે.

પરંતુ પારો કે આ બે પેઢીઓ જોડાણ કરે તો શું થશે? સ્વાભાવિક રીતે જ એક પેઢી બીજી પેઢીના ગ્રાહકોને આકર્ષણ માટે વસ્તુના ભાવ ઘટાડશે. તેથી બીજી પેઢી પણ વસ્તુના ભાવ ઘટાડશે. પરિણામે ભાવયુદ્ધ થરું થશે. એક હરીક અન્ય હરીક પેઢીને હરીકાઈમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરશે. બને પેઢીઓની વચ્ચે થતી આ કાતિલ હરીકાઈનો આપાર બને પેઢીઓની સાપેક્ષ ખર્ચરિખાઓ, હરીકાઈથી થાં સાપેક્ષ લાભ, બને પેઢીઓનું સાપેક્ષ કદ, ગ્રાહકની વસ્તુની માગની મૂલ્યસાપેક્ષતા અને ગતિશીલતા, એક હરીક પેઢીની ભાવ-ઉત્પાદનની નીતિને અનુસરવાની અન્ય હરીક પેઢીની ત્વરાતેમ જ ભાવઘટાડાની ગુપતા કેટલા લાંબા સમય સુધી એક પેઢી રાખી શકે છે તેના પર રહેલો છે. દ્વિજારામાં ભાવનિર્ધરણ કરી રીતે થાય છે તે અંગે જુદાં જુદાં અનુમાનોને આપારે વિવિધ નમૂનાઓ (Models) રજૂ થયા છે. જેમાં કોનોટ, બટ્રોન્ડ, એજવર્થ અને સ્ટેકલબર્ગનાં Models અગત્યનાં છે. પરંતુ તે અંગેની વચ્ચી અને અપસ્તુત હોઈ કરી નથી.

આપણે નોંધું તેમ જો બને હરીક પેઢીઓ સંપૂર્ણ સમાન વસ્તુઓ પેદા કરતી હોય તો ગ્રાહક બનેમાં જણે તે એક પેઢી માસેથી તટસ્ય રીતે વસ્તુ જરીદશે. તેથી બને પેઢીઓએ પોતાની વસ્તુના ભાવ એકસરણ જ રાખવા પડશે. જો કોઈ પણ એક વિકેતા વસ્તુના અન્ય પેઢીની તુલનામાં સહેજ પણ જીચા ભાવ લેવા જશે તો તે વસ્તુનું વેગાજા જ નહીં કરી શકે. તેથી બને ઉત્પાદકોએ, જીશે તેઓ એક જ ઈજારાદાર છે, તેમ માનોને જ વસ્તુના ભાવ-કરી કરવા પડશે, તો જ તેઓ મહત્વમની મેળવી શકશે.

જો તેઓ ભાવયુદ્ધ શરૂ કરશે તો પૂર્ણહરીકાઈની પરિસ્થિતિની જેમ માત્ર સામાન્ય નકો જ મેળવી શકશે; પરંતુ જો આ બે હરીક પેઢીઓ સ્વતંત્ર રીતે કુલ બજીરમાગ જેટલું ઉત્પાદન કરવાની ક્ષમતા પરાવતી હશે અને બેમાંથી એક ઉત્પાદક પેઢીનું ઉત્પાદનાખર્ય અન્ય ઉત્પાદક પેઢી કરતાં ઉત્પાદનના દ્વેકતબક્કી ઓછું રહેતું હશે તો તે અન્ય ઉત્પાદક પેઢીને હરીકાઈ દ્વારા બજીરમાંથી હાંડી કાઢશે અને એક માત્ર ઈજારદાર પેઢીનો દરજી પ્રાપ્ત કરશે. તેથી દ્વિઝારામાં રહેલી ઉભય પેઢીઓ માટે સારામાં સારો રસો ઈજારા દેણા નકી થતો ભાવ નકી કરીને બજીર અને નકો વહેંચી લેવાનો છે. દ્વિઝારામાં ટૂંકા ગાળામાં વસ્તુના ભાવ પૂર્ણહરીકાઈ કરતાં પણ ઓછા હોઈ રહે છે અને બને ઉત્પાદકો કદાચ સ્વામાન્ય નકો ન પણ મેળવી શકે તેવી પરિસ્થિતિ પેદા થઈ શકે છે. પરંતુ લાંબે ગાળે દ્વિઝારામાં જે ભાવ નકી થશો તે હરીકાઈના ભાવ અને ઈજારાના ભાવની વચ્ચેના હશે.

પરંતુ જો ઈજારામાં વસ્તુવિકલન હશે તો ઉત્પાદકના પોતાના ખાસ માહિતે હશે તેથી એક પેઢીની ભાવ ઉત્પાદનની નીતિની અન્ય પેઢીની ભાવ-ઉત્પાદન નીતિ પર ખાસ અસર નહીં પડે. પરિણામે આ પેઢીઓ વચ્ચે ભાવયુદ્ધ અને કલાત. જોડાણની રાક્યાતાઓ ખૂલ જ થઠી જશે. જે પેઢીની વસ્તુ વધુ ચાહિયાતી હશે તે અસામાન્ય નકો મેળવી શકશે.

દ્વિઝારાનો આટલો માથમિક ઘ્યાલ મેળવ્યા બાદ અલ્પહસ્ત ઈજારાના અભ્યાસ તરફ વળીએ.

## ૫-૮ અલ્પહસ્તક ઈજારો-અર્થ અને લક્ષણો

**અર્થ:** અલ્પહસ્તક ઈજારા માટે અંગેજમાં Oligopoly શબ્દ છે, જે Oligos અને Pollein એવા બે ગ્રીક શબ્દોનો બનેલો છે. તેનો અર્થ અનુક્રમે 'થોડા' અને 'વેચવું' એવો ધાર્ય છે. આ પરથી થોડા ઉત્પાદકો દ્વારા જેમાં વસ્તુનું વેચાશ થતું હોય તેવા બજારને અલ્પહસ્તક ઈજારો કહેવાય.

અલ્પહસ્તક ઈજારો એ અપૂર્ણ હરીકાઈ છે જેમાં થોડી પેઢીઓ ઉત્પાદન કરતી હોય છે અને ઉત્પાદિત વસ્તુઓ એકભીજાની નજીકની અવેંજ વસ્તુઓ હોય છે. જો કે આ વસ્તુઓ એકભીજાની સંપૂર્ણ અવેંજ હોતી નથી. જ્યોર્જ સ્ટીગલર અલ્પહસ્તક ઈજારાની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે.

'અલ્પહસ્તક ઈજારો' એ બજારની એવી સ્થિતિ છે કે જેમાં પેઢી પોતા-ની ડિમ્યુલ્યુન્યુન -નીતિ પોતાના થોડા નજીકોના અનુમાનિત વર્તનને આપારે ઘડે છે.' બજારની આ સ્થિતિમાં વસ્તુ માટેની માંગની સામસામી મૂલ્યસાપેક્ષતા ટીક ટીક પ્રમાણમાં હોય છે. આથી જ વેચનારે વસ્તુની ડિમત નક્કી કરતી વખતે હરીકોના તે અંગેના પ્રત્યાખાતો લક્ષમાં હેવા પડે છે.

### ૩. અલ્પહસ્તક ઈજારાનાં લક્ષણો

અલ્પહસ્તક ઈજારાનાં લક્ષણો નીચે મુજબ આપી શકાય :

(1) વેચનારા કે ઉત્પાદકોની સંખ્યા થોડી : અલ્પહસ્તક ઈજારામાં વેચનારા કે ઉત્પાદકોની સંખ્યા થોડી હોય છે. તેમાં દરેક પેઢીનું કં એવંતું હોય છે કે તેના દ્વારા થતો ઉત્પાદનમાં વધારો કે ઘટાડો બજારભાવને ગંગાનાપાત્ર રીતે અસર કરે છે. જો ને જ વેચનારા હોય તો તે ડિ-ઇજારો (Duopoly) કહેવાય છે. ભારતમાં સિમેન્ટ, ચાસાયલિક ખાતર, એલ્યુમિનિયમ, મોટરકાર, ટીવી સેટ વગેરે ઉદ્યોગમાં અલ્પહસ્તક ઈજારો જોવા મળે છે.

(2) વસ્તુ એકસરથી અધ્યવા તો વસ્તુવિવિધતા : અલ્પહસ્તક ઈજારામાં વસ્તુ એકસરથી હોય છે. દા. ત., સિમેન્ટ અધ્યવા તો તેમાં વસ્તુવિવિધતા જોવા મળે છે. દા. ત., મોટરકારના ઉદ્યોગમાં ભારતમાં કટ્ટલીક પેઢીઓ ઉત્પાદન કરે છે. દરેક પેઢી દ્વારા ઉત્પાદિત થતી મોટરકાર, મોટેલ, ગુણવત્તા, નામ વગેરેને લીધે એક બીજાથી જુદી પડે છે. આમ, મોટરકારના ઉદ્યોગમાં વસ્તુવિવિધતા છે.

(3) ઉત્પાદક ઉત્પાદનનું પ્રમાણ નક્કી કરી શકે : અર્થી કુલ પુરવણાના પ્રમાણમાં દરેક ઉત્પાદક કે વેચનારના પુરવણાનું કં ઘણું મહત્વ પરાવે છે. આ સંજોગોમાં વેચનારના ઉત્પાદનમાં ફરફારો કરવાથી તેની ડિમત પર કેવી અસર થશે તેનો વિચાર કરીને ઉત્પાદનનું પ્રમાણ નક્કી કરે છે.

(4) વેચનાર વસ્તુની ડિમત પણ નક્કી કરી શકે : અલ્પહસ્તક ઈજારામાં વેચનારા વસ્તુની ડિમત પણ નક્કી કરી શકે છે. ડિમતમાં ફરફાર કરતી વખતે તે પોતે ડિમતમાં ફરફાર કરે તો તેની અસર તેના હરીકો પર કેવી થશે તેનો તે વિચાર કરે છે. તે ડિમત ઘટાડીને વેચાશ વધારી શકે છે, પરંતુ જો તેને એમ લાગે કે તેના હરીકો ટ્રેક સમપરમાં ડિમત ઘટાડે તો તે ડિમત ઘટાડીને વેચાશ વધારવાનું માંડી વાળે છે.

(5) માંગરેખા ખાંચાવાળી : અલપાનું દીકરણનાં માંગરેખા ખાંચાવાળી હોય છે, કરશ કે જો પેઢી વસ્તુની ડિમત ઘટાડે તો તેના હરીકો પણ પોતાની વસ્તુની ડિમત ઘટાડે છે. એટલે કે હરીકો ડિમત ઘટાડાને અનુસરે છે. જેથી પેઢી ડિમત ઘટાડીને માંગ વધારી શકે નહિ. તેથી અહીં પેઢીની માંગ રેખા ઓછી મૂલ્યસાપેક્ષ હોય છે. તેથી વિનુંદે પેઢી વસ્તુની ડિમત વધારે તો તેના હરીકો ડિમત વધારતા નથી. એટલે કે હરીકો ડિમત વધારાને અનુસરતા નથી. હરીકો જૂની ડિમત રાખીને પોતાનું વેચાશ વધારવાની તક જાપી લે છે. તેથી પેઢીની માંગમાં ઘટાડે થાય છે. તેથી અહીં પેઢીની માંગ રેખા વધુ મૂલ્યસાપેક્ષ હોય છે. પરિણામે માંગ રેખામાં ખાંચો ઉદ્ભબે છે.

(6) પરસ્પર અવલંબન : અહીં પેઢીઓ કેટલેક અંશે ઈજારો ધરાવે છે, છતાં તેઓને પોતાના હરીકોના પ્રત્યાધાતનો વિચાર કર્યા વગર ચાલતું નથી. આમ, અલ્યુહસ્ટક ઈજારામાં પેઢીઓ પરસ્પર અવલંબન પરાવતી હોય છે. પેઢી ભાવ કે ઉત્પાદન અંગેની નાિતમાં ફેરફાર કરવાનું વિચારતી હોય તો તેથે તેના હરીકોમાં આ બાબતના કેવા પ્રત્યાધાતો પડશે તે અંગે પારસ્પાંઓ કરવી પડે છે અને તેના આધારે જ તે ભાવ કે ઉત્પાદન અંગેની નાિતમાં ફેરફાર કરે છે.

(7) પેઢીઓ પરસ્પર વિરોધી વલણો ધરાવે છે : અલ્યુહસ્ટક ઈજારામાં પેઢીઓ બે પ્રકારનાં પરસ્પર વિરોધી વલણો પરાવતી હોય છે. એક બાજુથી તે નફો મહત્તમ થાપ એટલા માટે પરસ્પર જોડાશ સાધવાનું વલણ ધરાવે છે, તો બીજુથી બાજુથી પોતાને જ મહત્તમ નફો મળે એટલા માટે બીજુથી પેઢીઓ સાથે ધર્ષજામાં આવી દુશ્મનાવટ ઊભી કરવાનું વલણ ધરાવે છે.  
(Two conflicting trends are at work under Oligopoly, one of co-operation and united action and the other of conflict and antagonism )

(8) બિનાડિમત હરીકાઈ પસંદ કરવામાં આવે છે : અલ્યુહસ્ટક ઈજારામાં ડિમત કરતાં બિનાડિમત હરીકાઈ વધુ પસંદ કરવામાં આવે છે. આનું કારશ એ છે કે ડિમત હરીકાઈમાં હરીકો સહેલાઈથી પ્રતિકાર કરી શકે છે. જ્યારે બિનાડિમત હરીકાઈમાં હરીકી માટે પ્રતિકાર કરવો મુશ્કેલ બને છે. વસ્તુસુધારણા, વિજાપન, વેચાશસેવા વગેરેનું હરીકો સહેલાઈથી અનુકરશ કરી શકતા નથી. પેટન્ટ હક્ક, ટેકનિકલ જ્ઞાનની જરૂરિયાત વગેરે બાબતો હરીકોની પ્રતિકારશક્તિ ઘટાડી નાખે છે.

(9) વિશિષ્ટ રીતે ડિમત નિર્ધારણ : અલ્યુહસ્ટક ઈજારામાં વસ્તુની ડિમત નિર્ધારણની વિશિષ્ટ પદ્ધતિઓ અમલમાં મૂકવામાં આવે છે. કેમ કે કેટલીક વાર પેઢી ડિમત-નેતૃત્વ (Price-leadership) દ્વારા વસ્તુની ડિમત નક્કી કરે છે તો કેટલીક વાર પેઢી નફો સહિતના ખર્ચની ડિમત અર્થાત્ ખર્ચ-વતાની ડિમત નીતિ અપાનાવે છે.

ઉપર મુજબ વેચાનારને પકો અલ્યુહસ્ટક ઈજારાનાં લક્ષણો તારવી શકાય. હરીદનારને પકો પગ્યા અલ્યુહસ્ટક ઈજારાવાળી હરીકાઈ જોવા મળે છે, જેને થોડા હરીદનારનો ઈજારો એટલે કે Oligopsony કરવામાં આવે છે.

#### 4. કિમત-નેતૃત્વ

પ્ર-૬ અલ્પ હસ્તક ઈજારાના સંદર્ભે કિમત નેતૃત્વ મોડેલ

કિમત-ધારાનો પ્રતિકાર કરવાની અસુચિકર સ્થિતિ ટાળવા માટે અલ્પહસ્તક ઈજારામાં કેટલીકવાર કિમત-નેતૃત્વની પદ્ધતિ વિકસાવવામાં આવે છે. કિમત-નેતૃત્વમાં કોઈ એક પેઢી દ્વારા કિમતમાં જે ફેરફાર કરવામાં આવે છે તેને ઉદ્ઘોગની અન્ય પેઢીઓ અનુસરે છે. ઉદ્ઘોગમાંની અન્ય પેઢીઓ તેને પ્રણાલીકા મુજબ કિમત-નેતા તરીકે સ્વીકારે છે.

(I) અર્થ :

અલ્પહસ્તક ઈજારામાં જ્યારે પેઢીઓ પોતાની વસ્તુની કિમતો ઉદ્ઘોગમાની કોઈ એક પેઢીની કિમતને આધારે નક્કી કરે છે ત્યારે કિમત-નેતૃત્વ અસ્તિત્વમાં આવે છે. જે પેઢી પોતાની વસ્તુની કિમતમાં ફેરફાર કરવાની પહેલ કરે તે કિમત-નેતા કહેવાય. ઉદ્ઘોગમાં આવેલી અન્ય પેઢીઓ કે જેઓ કિમત-નેતાએ નક્કી કરેલી કિમત જેટલી કિમત રાખે અથવા તો તેમાં થોડે તફાવત રાપે તે કિમત-અનુસરનાર પેઢીઓ કહેવાય.

વ્યવહારામાં સ્ટિલ, સિસ્ટેમન્ટ વગેરે જેવી પ્રમાણીકૃત વસ્તુઓનું ઉત્પાદન કરતાં પરિપક્વ અને સ્થિર ઉદ્ઘોગમાં કિમત-નેતૃત્વનો અમલ થતો જોવા મળે છે. વસ્તુ વિભિન્નતા પરાવતા ઉદ્ઘોગો જેવા કે ટી.વી.સેટ, કોમ્પ્યુટર વગેરેમાં પણ કિમત-નેતૃત્વનો અમલ જાણાય છે.

કિમત-નેતૃત્વમાં પેઢીઓ વચ્ચે ગર્ભિત કરારો થતા જોવા મળે છે. કિમત-નેતૃત્વમાં કોઈ ઔપचારિક કરારો પેઢીઓ વચ્ચે થતા નથી તેમજ પેઢીઓની ઉત્પાદન અને વેચાણની પ્રવૃત્તિઓનું નિયમન કરવા માટે કોઈ જુદી વ્યવસ્થા ઊભી કરવામાં આવતી નથી તેથી તે ઈજારા વિરોધી કાયદાનો ભંગ પણ કરતું નથી. કિમત-નેતૃત્વ એ અલ્પહસ્તક, ઈજારાવાળી હીરીકાઈમાં અપૂર્ક જોગા (imperfect collusion)નું ઉદાહરણ છે. આમ છતાં કેટલીક વાર એનું જોવા મળે છે કે કિમત-નેતૃત્વમાં કિમત-નેતા અને હીરીક પેઢીઓ વચ્ચે ઔપचારિક કરારો થતા હીએ છે અને હીરીક પેઢીઓ કિમત-નેતાને અનુસરવા માટે સંમત થાય છે.

(II) કિમત-નેતૃત્વના પ્રકારો:

કિમત-નેતૃત્વના પ્રકારો નીચે પ્રમાણે જોવા મળે છે.

(1) વર્ચસ્વ ધરાવતી પેઢીનું કિમત-નેતૃત્વ : આ પ્રકારમાં ઉદ્ઘોગમાની થોડી પેઢીઓમાંથી કોઈ એક પેઢી વસ્તુના કુલ ઉત્પાદનના બહુ મોટા ભાગનું ઉત્પાદન કરતી હોય છે અને તેથી તે બજાર પર વર્ચસ્વ ધરાવતી હીએ છે. આ પેઢી બજાર પર ધારી અસર પાડી શકે છે, જ્યારે અન્ય પેઢીનો બજાર પર પ્રભાવ પાડવા શક્લિતમાન લોતી નથી. પરિણામે વર્ચસ્વ ધરાવતી પેઢી (dominant firm) પોતાની મંગનો અંદાજ નક્કી કરે છે અને વસ્તુની કિમત પણ નક્કી કરે છે. અન્ય પેઢીનો કિમત પર કાંઈ અસર પાડી શકતી નથી તેથી તે વર્ચસ્વ ધરાવતી પેઢીની કિમત સ્વીકારી લે છે અને તેને લક્ષમાં ચખાને વસ્તુનું ઉત્પાદન કરે છે.

(2) પરિસિદ્ધતિ સ્થાક (Barometric Price-leadership) : આ પ્રકારની જૂદી, અનુભવની અને સૌંદર્ય વધુ સંન્માનિત એવી પેઢી કિમત-નેતા બને છે અને અન્ય પેઢીઓનાં પ્રિતોનું રસ્તા કરે છે. કિમત-નેતા વસ્તુની મંગ, ઉત્પાદન અર્થ, અયેજ વસ્તુની હીરીકાઈ વગેરેને લક્ષમાં રાખીને બજારની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે અને તેને આપાએ કિમતમાં ફેરફાર કરે છે. આ રીતે ફેરફાર પામતી કિમતને અન્ય પેઢીઓ સ્વેચ્છાથી અનુસરે છે.

(3) આકમક કિમત-નેતૃત્વ (Aggressive Price -leadership) : આ પ્રકારમાં ધરી મોટી કે વર્ચેસ્ટ ધરાવતી પેઢી આકમક એવી કિમતનીતિ અપનાવીને પોતાનું કિમત-નેતૃત્વ સ્થાપે છે. તે ઉદ્યોગમાંની અન્ય પેઢીઓને પોતે નક્કી કરેલી કિમતને અનુસરવાની ફરજ પાડે છે. અહીં કિમત-નેતા અન્ય પેઢીઓ જો નક્કી કરેલી કિમતને ન અનુસરે તો તેમને બજારમાંથી હાંકી કાઢવાની ધમકી પણ આપે છે.

### (III) કિમત-નેતૃત્વના સંજોગો:

કિમત-નેતૃત્વ વ્યવધારમાં નીચેના સંજોગોમાં અમલમાં આવે છે :

(1) નીચું ઉત્પાદન ખર્ચ અને પૂરવી નાણાકીય અનામતો : ઉદ્યોગમાં કોઈ એક પેઢીને ઉત્પાદન ખર્ચમાં લાભ રહેતો હોય તેનું બને. વળી ગંભીર રીતે નુકસાન પામ્યા વિના તે કિમત-યુક્તિમાં ખોટ સહન કરી શકે તેટલી નાણાકીય અનામતો ધરાવતી હોય તે શક્ય છે. પરિણામે આવી પેઢી વ્યવધારમાં કિમત-નેતૃત્વ પ્રાપ્ત કરે છે.

(2) બજારનો ગણનાપાત્ર હિસ્સો : ઉદ્યોગની સૌથી મોટી પેઢી કિમત-નેતા બને છે, કારણ કે તે બજારનો ગણનાપાત્ર હિસ્સો ધરાવતી હોય છે. જો કે મોટી પેઢી જ કિમત-નેતા બને તેવો નિયમ નથી. પરંતુ મોટી પેઢી ઉદ્યોગનાં હિતોનું સારી રીતે રક્ષણ કરી શકે છે તેમજ તે અનુસરનારા લિબા કરી શકે તેવી શક્તિ ધરાવતી હોય છે. વળી તે ઉદ્યોગની માંગ તથા પુરવણાની પરિસ્થિતિઓ વિષે ઉત્તમ જાણકારી ધરાવતી હોય છે અને એ રીતે સમગ્ર ઉદ્યોગ માટે કિમત નક્કી કરવા બાબતમાં સુસજ્જ હોય છે. આથી સ્વાભાવિક રીતે જ તે કિમત-નેતા બને છે.

(3) કિમત અંગેના યોગ્ય નિર્ણયો લેવા માટે ઘ્યાતિ : ઉદ્યોગમાં અમુક પેઢી બીજી પેઢીઓ કરતાં ઉત્તમ માહિતી અને વધુ અનુભવને આધારે કિમત અંગેના નિર્ણયો લેવા માટે ઘ્યાતિ પામેલી હોય છે. તેથી તે કિમત નેતૃત્વ પ્રાપ્ત કરે છે. વાસ્તવિક જગતમાં મજબૂત અને કાર્યક્ષમ સંચાલન, લાંબા વખત સુધી નકાની પ્રાપ્તિ અને કિમત-નેતા તરીકેના લાંબા અનુભવને લીધે ઉદ્યોગમાં કિમત-નેતૃત્વનો સ્વાભાવિક વિકાસ થયેલો જોવા મળે છે.

(4) પેઢીની પહેલવૃત્તિ : કેટલીક વાર જે પેઢી વસ્તુનો સૌ પ્રથમ વિકાસ સાચે છે અને બજારમાં વસ્તુ મૂકવાની પહેલ કરે છે તે કિમત-નેતૃત્વ જાળવી રાખે છે. તે પેઢી મોઢું બજાર ધરાવે છે કે નહિ તે બાબત અહીં ગૌણ બની જાય છે.

(5) આકમક કિમતનીતિ : ઉદ્યોગમાં કેટલીક વાર નીચી કિમત દારા પેઢી નેતાપદ ગુંઠાની લે છે. આમ કરીને તે રૂઢિયુલત હરીકો પાસેથી મોટાં અને નકારાક બજારો પચાવી પાડે છે. આમ આકમક કિમતનીતિ દારા પણ કિમત-નેતૃત્વ પ્રાપ્ત થયાનાં દણાંતો જોવા મળે છે.


#### (IV) ડિમત-નેતૃત્વ ડેટન ડિમત-નિર્ધારકઃ

ડિમત-નેતૃત્વ ડેટન ડિમત કેવી રીતે નક્કી થાય છે તે બાબતમાં અર્થશાસ્ત્રીઓએ કેટલાક ગોપેલ વિકસાચા છે. તેમાંથી અહીં આપણે, વર્ષસ્વયુક્ત ડિમત-નેતૃત્વ (dominant price-leadership)-ની સ્થિતિ હોય તો ડિમત કેવી રીતે નક્કી થાય છે તે તપાસીએ. આ માટે કેટલાક ધારણાઓ આવશ્યક છે, જે નીચે પ્રમાણે છે:

- (1) ઉદ્યોગમાં A અને B હેઠાનું ઉત્પાદનખર્ચ નીચું છે.
- (2) બંને પેઢીઓ દારા જે વસ્તુનું ઉત્પાદન થાય છે તે એકસરાજી છે.
- (3) દરેક પેઢી સમાન બજાર-હિસ્સો પરાવે છે. આનો અર્થ એ થાપ કે દરેક પેઢી બજારનો અર્થો હિસ્સો પરાવે છે.

આકૃતિ દારા સમજૂતી : હવે ડિમત-નેતૃત્વમાં ઉપરોક્ત ધારણાઓના સંદર્ભમાં ડિમત કેવી રીતે નક્કી થાય છે તે આકૃતિની મદદથી સમજૂતી હોય. (આકૃતિ માટે જુદ્ધો પા.નં. 132)

સમજૂતી : (1) આકૃતિમાં માંગરેખા એ દરેક પેઢીની માંગરેખા છે જે બજારની કુલ માંગનો અર્થો હિસ્સો દર્શાવે છે. (2) સી.આ. રેખા એ દરેક પેઢીની સીમાંત આવકરેખા છે. (3) સી. ખ., A પેઢીનું સીમાંત ખર્ચ દર્શાવતી રેખા છે. (4) સી. ખ., B પેઢીનું સીમાંત ખર્ચ દર્શાવતી રેખા છે. (5) સી. ખ., રેખા, સી. ખ., રેખાની નીચે છે, કારણ કે આપણે એવી ધારણા કરી છે કે B કરતાં A પેઢીનું ઉત્પાદન ખર્ચ નીચું છે.



A - પેઢી OB જેટલું ઉત્પાદન કરો અને AB (અર્થાત् OP) જેટલી ડિમત નક્કી કરો, કારણ કે OB જેટલા ઉત્પાદને સી.આ. = સી.ખ., થાય છે. OB ઉત્પાદને અને AB ડિમતે A પેઢીને મહત્તમ નફો મળશે.

B - પેઢી OM જેટલું ઉત્પાદન કરો અને SM જેટલી ડિમત નક્કી કરો, કારણ કે OM ઉત્પાદને સી.આ. = સી.ખ., થાય છે. OM ઉત્પાદને અને SM ડિમતે B પેઢીને મહત્તમ નફો મળશે.

આકૃતિમાં જોઈ શકાય છે કે A પેઢીના ડિમત AB, B પેઢીના ડિમત SM કરતાં નીચી છે.

બંને પેઢીઓ એક જ સરળી વસ્તુનું ઉત્પાદન કરે છે તેથી તેઓ તેની જુદી જુદી ડિમત વસ્તુનું કરી શકે નારી, A પેઢીના ડિમત AB, B પેઢીના ડિમત SM કરતાં નીચી છે. તેથી A પેઢી B પેઢીને ડિમત અનુસરવા માટે ફરજ પારી શકે. બીજું રીતે કલીએ તો જો બંને પેઢીઓ વગેરે ડિમત-યુદ્ધ થાય તો A પેઢી તેમાં જીતશે અને છેવટે A પેઢી ડિમત-નેતા તરીકે બજાર આપશે. B પેઢીને, A પેઢીના ડિમત અનુસરવાની ફરજ પડશે. આ રીતે A પેઢી ડિમત-નેતા અને B પેઢી ડિમત અનુસરવાની ફરજ પડશે. આ રીતે A પેઢી ડિમત-નેતા અને B પેઢી ડિમત અનુસરવારે પેઢી બનશે.

B પેઢીને AB ડિમત રહીકરવાની ફરજ પડી હોવાથી B પેઢી પણ હવે OB જેટલું ઉત્પાદન કરશે. AB ડિમતે B પેઢી પણ A પેઢી જેટલું ઉત્પાદન અને વેચાણ કરશે (OB જેટલું) કરશું કે બંને પેઢીની માંગરેખા એક જ છે. આમ બંને પેઢીઓ OB જેટલું ઉત્પાદન કરશે અને વસ્તુની AB જેટલી ડિમત નક્કી કરશે.

આમ છતાં બંને પેઢીઓની બાબતમાં તફાવત પણ છે. A પેઢી OB ઉત્પાદન AB ડિમતે વેચીને મહત્તમ નક્કી ગ્રામ કરે છે. પરંતુ B પેઢી OB ઉત્પાદન AB ડિમતે વેચીને મહત્તમ નક્કી મેળવી શક્યો નાહિ, કારણ કે B પેઢીનો નક્કી તો OM ઉત્પાદન SM ડિમતે વેચવાથી જ મહત્તમ બને છે. B પેઢી OB ઉત્પાદન AB ડિમતે વેચશે તેથી તેને મહત્તમ કરતાં ઓછો નક્કી મળશે, કારણ કે B પેઢીનું ઉત્પાદનખર્ચ A પેઢીના ઉત્પાદન ખર્ચ કરતાં વધુ છે.

જો ડિમત-નેતા અને ડિમત અનુસરનપારની વસ્તુ ભિન્ન ભિન્ન હોય તો તેમના દ્વારા લેવામાં આવતી ડિમતો જુદી જુદી હશે, પરંતુ ડિમતો વચ્ચેનો તકાવત બહુ જ ઓછો હશે. આ સંજોગોમાં ડિમત-નેતા અને ડિમત અનુસરનપારની વસ્તુની ડિમત બાબતમાં ડિમત-તફાવતની એક ગોકક્ષ તરેક અસ્તિત્વમાં આવશે.

### 5. કપટયુક્ત જોડાણવાળો અલ્પહસ્તક ઈજારો

પ.૧૦ અલ્પ હસ્તક ઈજારાનાં સંદર્ભે જોડાણ મોડલ

ડિમત-ઘટાડાનો પ્રતિકાર કરવાની સ્થિતિ ટાળવાનો એક માર્ગ કપટયુક્ત જોડાણ (Collusion) રચવાનો છે. અલ્પહસ્તક ઈજારામાં જ્યારે કપટયુક્ત જોડાણ સાધવામાં આવે છે ત્યારે પેઢીઓ ડિમત ન ઘટાડવા સંબંધમાં ઔપયારિક કરારો કરે છે અથવા તો પેઢીઓ પોતાની વચ્ચે વસ્તુનું બજાર વહેંચી લેવાના પણ કરારો કરે છે. આ પ્રકારની ગોઈવણને પરિણામે અલ્પહસ્તક ઈજારાવાળી હરીકાઈવાનું બજાર ઈજારામાં ફરવાઈ જાય છે. જો કે ટેટલીક વાર એવું બને છે કે પેઢી કરારોનો ભંગ કરીને વધુ બજાર-હિસ્સો મેળવી લેવા મ્યાલ્ટો કરે છે. ઈજારા વિરોધી કે દ્રસ્ત વિરોધી કાયદા હેઠળ કપટયુક્ત જોડાણ બિનકાપદેસર ગણાય છે. આમ છતાં કાયદાની છટકબારીઓ શોધીને અલ્પહસ્તક ઈજારામાં પેઢીઓ કપટયુક્ત જોડાણ રચે છે.

અલ્પહસ્તક ઈજારાવાળી હરીકાઈમાં કપટયુક્ત જોડાણના બે પ્રકારો જોવા મળે છે : (1) સંપૂર્ણ કપટયુક્ત જોડાણ (Perfect Collusion) આ પ્રકારનું જોડાણ કાર્ટેલનું સ્વરૂપ ધારણ કરે છે, અને (2) અપૂર્ણ કપટયુક્ત જોડાણ (Imperfect Collusion) આ પ્રકારનું જોડાણ ડિમત-નેતૃત્વનું સ્વરૂપ ધારણ કરે છે. અહીં આપણે સંપૂર્ણ કપટયુક્ત જોડાણનો અભ્યાસ કરીએ.


(1) અર્થ : જ્યારે સંભ્ય પેઢીઓ માટે મહત્તમ નક્કી મેળવવા માટે ડિમત અને ઉત્પાદન નિર્ધારણનું કાર્ય કોઈ મધ્યસ્થ વહીવટી એજન્સીને સોંપી દેવામાં આવે ત્યારે સંપૂર્ણ કાર્ટેલ અસ્તિત્વમાં આવે છે. આમ સંપૂર્ણ કાર્ટેલ એ અલ્પહસ્તક ઈજારામાં એક એવા પ્રકારનું કપટયુક્ત જોડાણ છે કે જેમાં સંભ્ય પેઢીઓ માટે મહત્તમ નકારી પ્રાપ્ત માટે ડિમત અને ઉત્પાદન નિર્ધારણનું કાર્ય સામાન્ય વહીવટી સત્તાને સોંપવામાં આવે છે.

(II) જોડાણની પ્રક્રિયા : જે કુલ નક્કી થાય તે નક્કી થયેલા કરારો મુજબ સભ્ય પેઢીઓ વચ્ચે વહેંચી દેવામાં આવે છે. દરેક પેઢીને વહેંચવામાં આવતો નક્કી અનિવાર્ય રીતે તેના ઉત્પાદનના ક્વોટા મુજબ અને ઉત્પાદનખર્ચ મુજબ હોતો નથી. મધ્યસ્થ વહીવટી સાથા દ્વારા દરેક પેઢીને ઉત્પાદનનો ક્વોટા એટલા પ્રમાણમાં ફળવવામાં આવે છે કે જેથી કુલ ઉત્પાદનનું કુલ ખર્ચ ન્યૂનતમ થાય. હવે અહીં પ્રક્રિયા એ થાય છે કે, દરેક પેઢીને કેટલું ઉત્પાદન કરવાનું કહેવું જોઈએ કે જેથી કુલ ખર્ચ ન્યૂનતમ આવે. આનો જવાબ એ છે કે કુલ ખર્ચ તારે ન્યૂનતમ થાય છે કે જ્યારે જુદી જુદી પેઢીઓનું સીમાંત ખર્ચ એકસરણું થાય છે. તેથી જો કે એમ કહી શકાય કે દરેક પેઢીનું સી.ખ. ન્યૂનતમ થાય એ રીતે દરેક પેઢીને ઉત્પાદન કરવાનું કહેવું જોઈએ. આમ કરવાણી કુલ ખર્ચ ન્યૂનતમ થાય છે. આ પેઢીઓનું ઉત્પાદન એકસરણ પ્રમાણમાં હોતું નથી. તેમને ફળવવામાં આવેલ ઉત્પાદન ક્વોટા જુદો જુદો હોય છે.

(III) કપટયુક્લ જોડાણવાળા અલ્યાહસ્ક ઈજારા હેઠળ હિસ્તેનિર્ધરણ : અલ્યાહસ્ક ઈજારા હેઠળ સંપૂર્ણ કપટયુક્લ જોડાણ (Perfect Collusion)માં એટલે કે સંપૂર્ણ કાર્ટેલામાં કુમત તેવી રીતે નક્કી થાય છે તે હવે તપાસીએ.

પારિષ્ઠક્ય : અહીં આપણે એવું પારીએ છીએ કે ઔપચારિક કરારો દ્વારા ગ્રસ પેઢીઓએ કાર્ટેલાની રેખા કરી છે. કાર્ટેલનો એવું સભ્ય પેઢીઓ માટે મહત્વમાં નક્કી પ્રમાણ કરવાનો છે.

સૌ પ્રથમ કાર્ટેલ વસ્તુની માંગરેખાનો અંદાજ બાંધશે. અહીં માંગરેખા એ કાર્ટેલની કુલ માંગ દર્શાવતી રેખા હશે. આથી માંગરેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢણતી હશે. આ માટે નીચેની આકૃતિ જુઓ.



અહીં દરેક પેઢીને એટલા પ્રમાણમાં ઉત્પાદન ક્વોટા ફળવવામાં આવેલ છે કે જેથી નિયોગ પેઢીનું સી.ખ. એકસરણું થઈ રહે. પરિણામે કાર્ટેલમાં જે કુલ ઉત્પાદન ખર્ચ આવે છે તે ન્યૂનતમ સપાટીએ રહે છે.

સમજૂતી : (1) આકૃતિમાં માંગ દર્શાવતી રેખા માંગરેખા છે, જે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢણે છે. (2) સી.આ. રેખા એ કાર્ટેલની સીમાંત આવકરેખા છે. (3) સી.ખ. રેખા એ કાર્ટેલની સીમાંત ખર્ચ રેખા છે, જે અંદોપ પેઢીઓના સીમાંત ખર્ચનો સરવાળો કરીને મેળવેલ છે. આકૃતિમાં સી.ખ., સી.ખ., અને સી.ખ., રેખાઓ કે જે અનુકૂમે પેઢી 1-2-3-નું સી.ખ. દર્શાવે છે તેમનો સરવાળો કરીને સી.ખ. રેખા મેળવેલી છે.

કાર્ટલને ત્યારે જ મહત્વમાં નથી પ્રામ થાપ છે કે જ્યારે તેનાં સી.આ. = સી. બ. થાપ. સી. આ. અને સી. બ. ની રેખા  $\Delta$ નિંબુએ એકબીજાને છેડે છે એટલે કે S નિંબુએ સી.આ. અને સી. બ. સરામાં થાપ છે. પરિણામે OB જેટલું ઉત્પાદન નક્કી થાપ છે અને AB (અર્થાત OP) જેટલી ડિમતા નક્કી થાપ છે. આમ OB ઉત્પાદન AB ડિમતે વેચવાથી કાર્ટલને મહત્વમાં નથી પ્રામ થાપ છે.

OB જેટલું ઉત્પાદન નક્કી કર્યા પછી કાર્ટલ દરેક પેઢીને એટલા પ્રમાણમાં ઉત્પાદન ક્ષોટા ફાળવે છે કે જેથી દરેક પેઢીનું સી. બ. એકસરાયું થઈ રહે. આકૃતિમાં જોઈ શકાપ છે કે જ્યારે પેઢી-1 OD, જેટલું ઉત્પાદન, પેઢી-2 OD, જેટલું ઉત્પાદન અને પેઢી-3 OD, જેટલું ઉત્પાદન કરે છે ત્યારે દરેક પેઢીનું સીમાંત ખર્ચ એકસરાયું થઈ રહે છે. આકૃતિમાં સી. બ., સી. બ., અને સી. બ., એથું સૂચાપે છે કે જ્યોય પેઢીનું સીમાંત ખર્ચ સરાયું થાપ છે.

આ રીતે પેઢી-1નો ઉત્પાદન ક્ષોટા OD, જેટલો, પેઢી-2નો ઉત્પાદન ક્ષોટા OD, જેટલો અને પેઢી-3નો ઉત્પાદન ક્ષોટા OD, જેટલો નક્કી થશે. કાર્ટલનું કુલ ઉત્પાદન OB એ OD<sub>1</sub>, અને OD<sub>2</sub>, ના સરવાળા બારાબર થાપ છે. બીજી રીતે કહીએ તો  $OB = OD_1 + OD_2 + OD_3$ .

OB ઉત્પાદન અને AB ડિમત કાર્ટલને સભ્ય પેઢીઓ માટે મહત્વમાં નથી અપાવે છે. કાર્ટલની રચના વખતે આ પેઢીઓ વચ્ચે જે કરાર થયા હશે તે મુજબ આ મહત્વમાં નકાની વહેંચવી પેઢીઓ વચ્ચે કરી દેવામાં આવશે. પેઢીઓ વચ્ચે નફાની વહેંચવી તેમજો કરેલા ઉત્પાદન અનુસાર જ થાપ છે તેવું નથી, કારણ કે તેમને જે ઉત્પાદન ક્ષોટા ફાળવવામાં આવે છે તે નફાની વહેંચવીના પાયા પર નહિ પરંતુ સીમાંત ખર્ચ ન્યૂનતમ થાપ એ પાયા પર કરવામાં આવે છે.

**વાસ્તવિક સ્થિતિ :** પરંતુ વાસ્તવિક જગતમાં ઉપર દરશાવેલ સંપૂર્ણ કાર્ટલ ભાગ્યે જ જોવા મળે છે. સામાન્ય રીતે કાર્ટલમાં ડિમતને લગતાં જ કરાર થાપ છે., મહત્વમાં નથી અપાવે તેટલી ડિમત કરાર દ્વારા નક્કી કરવામાં આવે છે. સભ્ય પેઢીઓ પોતાનો વિકિતનગત નથી મહત્વમાં બને એટલા પ્રમાણમાં ઉત્પાદન અને વેચાણ કરવા માટે સ્વતંત્ર રહે છે. સભ્ય પેઢીઓ ડિમતમાં કેરકાર ન કરવા માટે કરારથી બંધાયેલી હોય છે તેથી કાર્ટલમાં ડિમત સ્થિર રહે છે. આ સંજોગેમાં દરેક પેઢી આપેલી ડિમત કેટલું ઉત્પાદન વેચે છે અને ઉત્પાદન કેટલા ખર્ચ કરે છે તેના પર તેના નફાનો આધાર રહે છે. હવે આ વાસ્તવિક સ્થિતિનો વિચાર કરીએ.

આકૃતિમાં AB (=OP) ડિમત આપેલી છે. તેમાં કેરકાર કરી શકાતો નથી. કાર્ટલમાં સી. આ. SB જેટલી છે. હવે દરેક પેઢી એટલા પ્રમાણમાં ઉત્પાદન કરશે કે જેથી તેનું સી. બ. અને સી. આ. SB જેટલું થઈ રહે. આ સ્થિતિમાં પેઢી-1 OD, પેઢી 2 OD, અને પેઢી-3 OD, જેટલું ઉત્પાદન કરશે, કારણ કે આટલા-આટલા ઉત્પાદને દરેક પેઢીનું સી. બ. કાર્ટલની સી. આ. SB જેટલું થઈ રહેશે. અહીં જોઈ શકાશે કે દરેક પેઢીનું ઉત્પાદન તો સંપૂર્ણ કાર્ટલ હતું તેટલું જ રહે છે. તથાવત માત્ર એટલો રહે છે કે દરેક પેઢી પોતાનું ઉત્પાદન સ્વતંત્ર રીતે વેચે છે અને નથી મેળવે છે. આકૃતિમાં જોઈ શકાપ છે કે પેઢી-3 સૌથી વધુ નથી કમાશે, કારણ કે તે આપેલી ડિમતે (AB ડિમતે) સૌથી વધુ ઉત્પાદનું વેચાણ કરે છે. પેઢી-1 સૌથી ઓછું ઉત્પાદન અને વેચાણ કરે છે તેથી તેને સૌથી ઓછો નથી પ્રામ થશે.

## 6. ખાંચાવાળી માંગરેખાનો સિદ્ધાંત

પ્ર - ૧૧ અલ્પહસ્તક ઈજારામાં ખાંચાવાળી માંગ રેખા

(I) અર્થ :

આ સિદ્ધાંત એવું દર્શાવે છે કે પેડીઓ કિમતમાં વધારા અને કિમતમાં ઘટાડાના સંભવિત પ્રત્યાધાતો લક્ષમાં લેવા જ જોઈએ. અલ્પહસ્તક ઈજારામાં બિક્ટિગત પેડી એટલી જિનમહાવની નથી કે જેથી તેના કિમત અંગેના નિર્ણયોને અન્ય પેડીઓ લક્ષમાં જ ન હો. વાસ્તવમાં કોઈપણ બિક્ટિગત પેડીનો કિમત અંગેનો નિર્ણય અન્ય પેડીઓ પર અસર કરે જ છે અને આ પેડીઓ તેના પ્રત્યાધાત રૂપે પોતાના કિમત અંગેના નિર્ણયો હેતી હોય છે.

અલ્પહસ્તક ઈજારામાં બિક્ટિગત પેડીના કિમત-ઘટાડાના નિર્ણયને અન્ય પેડીઓ અનુસરે છે, પરંતુ કિમત-વધારાના નિર્ણયને અન્ય પેડીઓ અનુસરતી નથી. પરિણામે બિક્ટિગત પેડીની માંગરેખા ખાંચાવાળી (Kinked) બનતી હોય છે તેવું ખાંચાવાળી માંગરેખાનો સિદ્ધાંત જાણાએ છે.

(II) કિમત-જડતા (Price-rigidity) :

અલ્પહસ્તક ઈજારામાં અમૃક સમય માટે જ્યારે કિમતો સ્થિર રહે છે ત્યારે તે કિમતો જડ (rigid) કહેવાય છે. કિમત જડતાની સ્થિતિ એ એક એવા સ્થિતિ છે કે જેમાં માંગ અને પુરવઠાની પરિસ્થિત બદલવા છતાં પેડી કિમત બદલવાનું વલાક્ષ ધરાવતી હોતી નથી. કિમત-જડતા વ્યવહારમાં પણ જોવા મળે જ છે. મોટા ભાગની ટકાઉ વસ્તુઓની કિમત સમગ્ર વર્ષ દરમિયાન સ્થિર રહેતી જોવા મળે છે, જે કિમત-જડતાનું ઉદાહરણ કહી શકાય. આમ, અલ્પહસ્તક ઈજારામાં કિમત-જડતા એક સામાન્ય ઘટના છે તેમ કહી શકાય.

અલ્પહસ્તક ઈજારા ડેફન્સ પેડીમાં કિમત જડતા શા માટે જોવા મળે છે? આ માટે ઘણાં કારણો આપી શકાય; જે નોંધે પ્રમાણો છે : (1) અલ્પહસ્તક ઈજારામાં બિક્ટિગત પેડી પોતાના અનુભવ હાર્યા એવું શીખે છે કે કિમત-યુલો નિર્ધયક છે અને તેથી તે કિમત જડતા વધુ પસંદ કરે છે. (2) પેડીઓ ચાલુ કિમત, ઉત્પાદન અને નફાશી સંતુષ્ટ રહેતી હોય એ પણ શક્ય છે અને તેથી તેઓ બિનજરૂરી અનિશ્ચિતતા અને અસલામની વહોરવાનું ટાળે છે. (3) નવી પેડીઓને ઉદ્યોગમાં દાખલ થતી અટકાવવા માટે પણ તેઓ ચાલુ કિમતને વળગી રહેવાનું પસંદ કરે છે. (4) પેડી કિમત ઘટાડાને બદલે ચાલુ કિમતે વેચાક્ષ વધારવાના વનિક પ્રવાસો લાય પરી શકે છે. તેના મટે કિમત-ઝરીકાઈ કરતાં બિનકિમત ઝરીકાઈ વધુ યોગ્ય જશાય છે. (5) પેડી પોતાની વસ્તુની જ્ઞાનેરાત માટે પુરુષ નાણાં ખર્ચા પછી કિમત વધારીને પોતાને મળનાર લાભ જતો કરવા માગતી હોતી નથી. આથી સ્વામ્ભાવિક રીતે જ ચાલુ કિમતને વળગી રહેવાનું વધુ યોગ્ય ગણે છે. (6) જો કરાર કે જોગાણ દ્વાર સોઈ એક સ્થિર કિમત નક્કી કરવામાં આવી શોધ તો કોઈ પેડી કિમત-યુલ વહોરીને અને પોતાની જ્ઞાતને અનિશ્ચિતતા અને અસલામનિમાં પડેલી દઈને સ્થિર કિમતમાં દખલગીરી કરવાનું યોગ્ય ગણતી નથી. (7) ખાંચાવાળી માંગરેખાને કારણે કિમત જડતાની સ્થિતિ સર્જીય છે.


### (III) ધારણાઓ:

અલ્પહસ્તક ઈજારામાં કિમત જડતા અંગેના ખાંચાવાળી માંગરેખાના વિશ્વેષણમાં નીચે મુજબની ધારણાઓ રહેલી છે.

- (1) અલ્પહસ્તક ઈજારામાં ઉદ્યોગમાં વસ્તુની એક એવી કિમત સ્થાપિત થયેલી છે કે જેનાથી બધી પેઢીઓને સંતોષ થાય.
- (2) દોએક પેઢીનું વલણ પોતાની હરીક પેઢીના વલણ પર આધાર રાખે છે.
- (3) જો કોઈપણ પેઢી પોતાની વસ્તુની કિમત પટાડિને વેચાણ વધારવાનો મ્યાલ કરે તો તેની આ હિલચાલને અન્ય પેઢીઓ પણ અનુસરે છે અને એ રીતે કિમત ભટાડાનો પ્રતિકાર કરે છે.
- (4) જો કોઈ પણ પેઢી પોતાની વસ્તુની કિમત વધારે તો અન્ય પેઢીઓ તેને અનુસરતી નથી, તેઓ ચાલુ કિમતને વળગી રહે છે અને જેણે કિમત વધારી હોય તે પેઢીના આહદેને પણ ચાલુ કિમતે વસ્તુ પૂરી પડે છે.
- (5) સીમાંત બર્થના રેખા સીમાંત આવકની રેખાના બે ભાગો વચ્ચેથી પસાર થાય છે. પરિણામે સીમાંત બર્થમાં થતો ફેરફાર, ઉત્પાદન અને કિમતને અસર કરતો નથી.

### (IV) કિમત નિર્ધારણની પ્રક્રિયા:

અલ્પહસ્તક ઈજારા હેઠળ ખાંચાવાળી માંગ રેખાના સિદ્ધાંત અનુસાર પેઢીમાં કિમત અને ઉત્પાદન નિર્ધારણ વિષેની સમજૂતી માટે પાના નં. 137 પર આપેલી આકૃતિ જુઓ.



સમજૂતી : (1) આકૃતિમાં DAD, ખાંચાવાળી માંગરેખા છે. (2) પેઢીમાં OP જેટલી કિમત નક્કી થાય છે. (A બિંદુ કિમતનું બિંદુ છે.) (3) પેઢીમાં ON જેટલું ઉત્પાદન નક્કી થાય છે, કારણ કે ON ઉત્પાદને સી.આ. રેખા અને સી.એ., રેખા એકબીજાને E બિંદુએ છેટ છે.

A બિંદુથી ઊંચી કિમત નક્કી કરવામાં આવે એટલે કે OP કરતાં ઊંચી કિમત નક્કી કરવામાં આવે, તો પેઢીના વેચાણમાં (માંગમાં) વાણનાપાત્ર વટાડો થશે, કારણ કે તેના બરીકી તેના કિમત-વધારાને અનુસરતા નથી. આનું કારણ એ છે કે ખાંચાવાળી માંગરેખાનો DA ભાગ વધુ મૂલ્યસાપેક્ષ છે. આથી પેઢીનો કિમત-વધારો માત્ર તેનું કુલ વેગાજ જ નહિ વટાડે પરંતુ તેની કુલ આવક અને નક્કામાં પણ વટાડો લાવશે.

બીજુ બાજુએ પેઢી જો કિમતમાં ઘટાડો કરશે, એટલે કે કિમત A નિંદુથી નીચી નક્કી કરવામાં આવે અથવા OP કરતાં નીચી કિમત નક્કી કરવામાં આવે તો તેના હરીફી કિમત-ઘટાડાને અનુસરશે. હરીફી પણ કિમતમાં ઘટાડો કરશે. આ સંજોગોમાં જો કે પેઢીનું વેચાણ (માંગ) વધશે. પરંતુ તેનો નફો પહેલા કરતાં ઓછો થશે. આનું કારણ એ છે કે ખાંચાવાળી માંગરેખાનો AD, ભાગ ઓછો મૂલ્ય સાપેક્ષ છે. વળી તેને મળતો સી.આ. રેખાનો ભાગ N નિંદુ પછી ઝંખ છે.

આમ કિમત-વધારા અને કિમત-ઘટાડાની બંને સ્થિતિમાં પેઢીને નુકસાન થાય છે. આથી પેઢી OP કે જે ચાલુ કિમત છે તેને વળગી રહેશે. તે A નિંદુથી ઊંચી કે નીચી કિમત રાખવાનું ચોગ્ય ગણશે નહિ. પરિણામે પેઢીની કિમત જડ કે અપરિવર્તનશીલ (rigid) જ રહે છે.

માંગરેખા DAD, માં A નિંદુએ ખાંચો (Kink) છે, જેને લીધે સીમાંત આવકની રેખામાં R થી N સુધીના ભાગમાં gap અથવા Discontinuity ઊંચી થાય છે. સી.આ.ની રેખામાં કેટલો gap ઊંચો થશે તેનો આધાર ખાંચાવાળી માંગરેખાની મૂલ્યસાપેક્ષતા પર રહેલો છે. A નિંદુના જાણી બાજુનો માંગરેખાનો ભાગ જેમ વધુ મૂલ્યસાપેક્ષ અને A નિંદુથી જમણી બાજુનો માંગરેખાનો ભાગ જેમ ઓછો મૂલ્યસાપેક્ષ તેમ સી.આ. રેખાના R અને સંપ્રેણો gap મોટો થતો જાય છે.

જો DAD, માંગરેખા કાટખૂણા આકારની થઈ જાય તો R અને N વચ્ચેનો gap સૌથી મોટો થશે.

(V) ખર્ચ અને માંગમાં કેરકારની કિમત જડતા પર અસર :

અલ્પહસ્તક ઈજારામાં પેઢીની ખર્ચ અને માંગની પરિસ્થિતિમાં કેરકાર થાય તો તેની કિમત પર કેવી અસર થાય છે તે તપાસીએ.

(અ) ખર્ચની પરિસ્થિતિમાં કેરકાર : અલ્પહસ્તક ઈજારામાં ખાંચાવાળી માંગરેખાના લિશ્યેપણામાં અમુક હદ સુધી ખર્ચમાં કેરકાર થાય તો તેની પેઢીની ચાલુ કિમત પર કોઈ અસર થતી નથી.

ધારો કે સી.ખ.માં ઘટાડો થાય અને તેથી સી.ખ., ને બદલે સી.ખ., રેખા અસ્તિત્વમાં આવે છે. તો તે સી.આ. રેખાને E, નિંદુએ RN ગેપમાં જ છે દે છે. પરિણામે કિમત અને ઉત્પાદન યથાવતું જ રહે છે.

ધારો કે સી.ખ.માં ઘધારો થાય અને તેથી સી.ખ., ને બદલે સી.ખ., રેખા અસ્તિત્વમાં આવે છે. તો તે સી.આ. રેખાના AR ભાગને S નિંદુએ છેદ છે. પરિણામે હવે ઉત્પાદન OC જેટલું થશે અને કિમત CB જેટલી નક્કી થશે. આમ ઉત્પાદન પહેલાં કરતાં થએ છે, જ્યારે કિમતમાં વધારો થાય છે.

આ પરથી એમ કાઢી શકાય કે જ્યાં સુધી સી.ખ. રેખા, સી.આ. રેખાને RN ગેપમાં જ છેદ તાં સુધી કિમત જડતા ટકી રહે છે, પરંતુ જ્યારે સી.ખ. રેખા, સી.આ. રેખાને RN ગેપના ઉપરના ભાગમાં છેદ તારે કિમતમાં વધારો થાય છે.

(બ) માંગની પરિસ્થિતમાં કેરકાર : જ્યારે પેડીની માંગ ઘટે છે ત્યારે ડિમતમાં ઘટાડો થાય છે. આ ડિમત-ઘટાડાને હરીકે પેડીઓ અનુસરે છે. આ સંજીગ્દામાં સી.આ. રેખાનો ગુઠક ભાગ મોટો થાય છે. સી.ખ.ની રેખા સી.આ.ની રેખાને આ ગુઠક ભાગમાં એટલે કે gapમાં છેદ છે, પરિણામે ડિમત જડતા ટકી રહે છે.

જ્યારે પેડીની માંગ વધે છે ત્યારે તે ડિમત વધારવાનું પસંદ કરે છે. હરીકો તેને અનુસરે તેવું ધારવામાં આવે છે. આથી ખાંચવાળી માંગરેખાના A જિંદુ ઉપરનો ભાગ ઓછો મૂલ્યસાપેક બને છે. સી.આ. રેખાનો gap નાનો થાય છે. આમ છતાં જે સી.ખ. રેખા, સી.આ. રેખાના આ gapવાળા ભાગમાં જ છેદ તો ડિમત જડતા ટકી રહે છે.

(વી) ખાંચવાળી માંગરેખાના સિદ્ધાંત ડેટા ડિમત-નિર્ધરણની મર્યાદાઓ :

અલ્પહસ્તક ઈજારામાં ખાંચવાળી માંગરેખાના વિશ્વેષણમાં ડિમત કેવી રીતે નક્કી થાય છે તે આપણે જોયું. ડિમત-નિર્ધરણના આ પ્રકારના વિશ્વેષણની કેટલીક ખામીઓ કે મર્યાદાઓ છે, જે નીચે આપેલ છે :

(૧) ખાંચવાળી માંગરેખાના વિશ્વેષણમાં ડિમત-નિર્ધરણ માટે કરવામાં આવેલી પારણાઓ સ્વીકારીએ તો પણ સી.આ. રેખાનો ગુઠક ભાગ (gap) સી.ખ. રેખા તેમણી પસાર વઈ જાય તેટલો મોટો ન હોય તે સંભવિત છે, જ્યારે માંગ અથવા ખર્ચમાં ઘટાડો થાય ત્યારે પણ આ ગાળો નાનો રહે રહેણું બને અને તેથી ડિમત જડ રહેવાને બદલે અસ્થિર બને તે શક્ય છે.

(૨) સ્વીગલર આ સિદ્ધાંતની ટીકા કરતાં જણાવે છે કે એકવાર ડિમતમાં કેરકાર થયા પણી કરીથી તે શા માટે જડ કે સ્થિર બની જાય છે અને માંગમાં નવો ખાંગો ઊભો કરે છે તેની સમજૂતી આ સિદ્ધાંતમાં મળતી નથી.

(૩) સિદ્ધાંતમાં જણાવેલી ડિમત જડતા આમક પણ હોઈ શકે છે, કારણ કે તે ખરેખરા બજારના વર્તન પર આધારિત હોતી નથી. અલ્પહસ્તક ઈજારામાં પેડી ઉપરછલ્લી રીતે ડિમત સ્થિર રાખે છે, પરંતુ તે વસ્તુનું કદ કે તેની ગુણવત્તા ઘટાડી નાખે તેવું બને અને તેવાં સંજોગોમાં ડિમત જડતા માત્ર એક અમ જ નીવકે છે.

(૪) ખાંચવાળી માંગરેખાનું વિશ્વેષણ એંબું ધારી લે છે કે એક તો પેડીઓ ડિમત ઘટાડાને અનુસરે છે અને બીજું, પેડીઓ ડિમત-વધારાને અનુસરતી નથી. આ સંદર્ભમાં સ્વીગલર જણાવે છે કે આ પ્રકારના વલખાને કોઈ ઐતિહાસિક સમર્થન પ્રાપ્ત થતું નથી. કુગાવામાં પેડીઓ ડિમત-વધારાને અનુસરતી હોય તેવું જોવા મળે છે.

(૫) અલ્પહસ્તક ઈજારામાં ઉદ્ઘોગમાં જો પેડીઓની સંખ્યા પછી વધુ હોય અથવા તો બહુ ઓછી હોય તો ત્યાં પેડીમાં ખાંચવાળી માંગરેખા ન હોય તે સંભવિત છે એવી રજૂઆત પણ સ્વીગલરે કરેલી છે જેથી આ વિશ્વેષણ મર્યાદિત બની રહે છે.

(૬) ખાંચવાળી માંગરેખાનો સિદ્ધાંત ડિમત-નેતૃત્વ અને જોડાજી કે કાર્ટેલના સંજોગોમાં લાગુ પડતો નથી. આ સંજોગોમાં માંગરેખામાં ખાંગો ઊભો થતો નથી.